

श्री वर्धमान-सत्य-नीति-हर्षसुरि जैन अध्यमाला : पुण्य-१६

॥३८० अद्दम् ॥  
वेष्टनाशवल्लभार्थाक परमणु आचार्यांश्रो  
विजयनालस्त्रीयस्त्रुत्यो नमः

सहस्रारवानी शक्तिसरस्वतीष्ठरद्वारक युगप्रवान  
आचार्यांश्रो मुनिसुनदस्त्रीयविद्यित

## अध्यात्म-कुण्डलिम

भृत्य] मूर्व-पघानुवाह सार्थ

असुन्नामः :

अविद्याभृत वज्राभवं ह अद्वेष्टा-वृद्धिभीपुर (सौराष्ट्र)



अकाराः :

श्री वर्धमान सत्य-नीति-हर्षसुरि अध्यमाला कार्यालय  
शेष चित्प्राप्तार्थ निकटस्त्रीयस्त्रुत्यो नमः

ॐ

अभित : ये सूहय

अनन्त-वांचन-निकटियासन-सुदृग्येऽग

શ્રી વર્ધમાન-સત્ય-નીતિ-હર્ષસૂરિ જૈન અંથમાલા : પૃષ્ઠ-૧૧

॥ ઓ રહ્મ ॥

એવતાચલતીયોદ્ધારક પરમગુરુ આચાર્યશ્રી વિજયનીતિ-  
સૂરીશરસદૃશુરુષ્યે । નમઃ

સહસ્રાવંત્રાની કલિસરસ્વતીભિરસ્ત્વારક યુગપ્રકાન  
આચાર્યશ્રી મુનિસુન્દરસૂરીધરવિરચિત

## અધ્યાત્મ-કદુમુક્તિ

[ ભેટ ] મૂલ-પદ્માનુવાદ સાર્થ [ ભેટ ]

અતુવાચક :

કબિ દુર્લભા યુદ્ધાયથં મહેતા-વદ્ધલીપુર ( સૌરાષ્ટ્ર )

ફ

દૃવ્યસદાયક :

મુનિરાજશ્રી શ્રીકાન્તવિજયલુના સહપદેશથી કપડવંજ-  
નિવાસી સ્વર્ગસ્� શેઠ ચિમનલાલ ડાઢાલાઈ પરીખના  
સ્વરણાર્થી તેમના વર્માપણી ગંગાસ્વરૂપ-માયાળ્હેનની  
અધ્યાત્મિક સહાયથી

પ્રકાશક :

શ્રી વર્ધમાન સત્ય-નીતિ-હર્ષસૂરિ અંથમાલાના કાર્યવાહક  
શેઠ ચિતુલાઈ ત્રિકમલાલ સરાઝ-અમદાવાદ

૪

કીઅત : અમૂલ્ય  
મનન-વાંચન-નિહિયાસન-સહુપથેણ

वीर संवत् २४७६  
वि० सं. २००८]

प्रथमावृत्ति. ७००

[सत्य सं. २५३  
ध. स. १८५३]

अद्यात्म-कुरुपदुम आ, मनन-वाचन-निहित्यासन करता;  
'हुल्लभ' भवसायर आ, ए ज्ञाने भविजन रहेजे तरता।



मुद्रकः

शाह गिरधरदात फूलचांद : साधना मुद्रणालय, दाण्डापीठ-भावनगर

स भर्तु

નિઃસ્પૃહી, ખાળખુલ્લાચારી, શાંતમૂર્તિ, અધ્યાત્મજ્ઞાનના અપી શ્રીમદ્વિજયમહુન્ડસ્ક્રિપ્તાજ નેમની ખાસ પ્રેરણાથી મેં આ અધ્યાત્મ-કદ્વપ્તુમ શ્લોક ૨૭૮ નો શુર્જર ગિરામય પદ્યાનુવાદ મારી ઉપ વર્ણની જરૂરી ઉમરે શક્તિઅણારની વાત હોવા છતાં પણ બનાવ્યો એ તેમના અનુષ્ઠાનિક અને કૃપાદિષ્ટિનું જ ખાસ ફૂળ છે. તેમજ તે પ્રકારીત કરાવવામાં તેમનો તેમજ તેમના વિક્રાન્તિય શ્રીકાન્તવિજયમહુરાજનો પ્રયાસ અત્યંત આભારી છે; કેથી આ અધ્યાત્મ-કદ્વપ્તુમ, મૂળ શ્લોક, પદ્યાનુવાદ અર્થ સાથે પ્રકાશિત થતાં તે આપના પવિત્ર કરકુમળમાં

संभर्पण

કરી અવયાંશે કૃતાર્થ થાઉં છું. આ મારું પુસ્તક દે મું  
મારી કૃતિનો નવનો આંક ન ફરે તેમ પ્રકાશિત થતાં  
અપૂર્વ આદિષ થાય છે.

५.

આપનો ચરણો પાસક આવક,  
કવિ હુલ્લાભણ ગુલાખચંદ મહેતા  
વદ્ધલીપુર (સૌરાષ્ટ્ર)

ચાન્દ્રકુલ-તપાગચ્છ-સંવિગનશાખાગ્રહી-આચાર્ય  
શ્રી વિજયહર્ષસૂરિ

## ગુરુગુણુસૃપ્તપદી

### લિઙીત

સત્ય સાત્ત્વિક સહગુણોએ, શોભતા અવનીમહો,  
વિનય વિમળતા વિપુલ વાણી, હર્ષ ઉપજલી રહી;  
નભ્રતા સમતા દ્યા, હૃદ્ય હૃદ્યોનાં કાપતા,  
યમ દમ શરે તપવૃત્તિએ, સહજાન જાને આપતા. ૧

વંદ્યાય વિશ્વે જ્ઞાનીએ, શ્રી હર્ષસૂરિને વાંદીએ,  
દર્શાન કરી ગુરુરાજનાં, શ્રી વીરને આરાધીએ;  
નથન તલસત હૃદ્ય વિકસત, સેવતાં ગુરુગરણુને,  
હો જીવન અમ સાંક્ષેપે એવું, ઈચ્છાએ ગુરુશરણુને. ૨

શ્રીમહ વિજયનીતિસૂરિના, શિષ્ય પદ્મ સોહામણ્ણા,  
મન મોહથી કીધાં અધૂરાં, કાર્ય પૂરણ ગુરુતણું;  
દ્યાતાણી સાક્ષાત્ મૂર્તિ, હૃદ્ય અમૃતથી ભર્યું,  
ગુણવંત શ્રી ગુરુરાજનું, શુભ નામ જગ અમર કર્યું. ૩

રૂચિ સહા ધર્મેપદેશે, જગત જીવ ઉદ્ઘારવા,  
મહેનત કરો છો નિશ્ચાહિન, મહાપાતકીને તારવા;  
હાજરજવાખી છો ગુરુ, વિક્રાન વ્યાખ્યાતા મહા,  
રાજનગર બિરાજતા, જયાં શામળાની પોળ હા.. ૪

જયકાર કીધો જીવનો, સંપૂર્ણ સૂરિપદ દીપ્યંદુ,  
શ્રી શાંત ફાંત ક્ષમા ભૂષણુથી, માન અધિકું મેળ્યું;


[ ५ ]

विरताक्षर्यां उपधान विधिए, उज्जमण्डं णहु णहु कर्यां,  
जप तप करावी सेवकोनां, पातडो सधणां हर्यां. ५

यथा प्राप्त कीधी श्रेष्ठ गिरि, गिरनार पर करी नामना,  
हरणे भरी अंजनशताङ्का, पूर्ण कीधी मनःकामना;  
रगे रगे व्यापी रही, शासनताणी शुल लावना,  
खटराग छाडी विश्वना, धरी आत्मवत् संभावना. ६

सूरि शिष्य सूरि भण्डन्दने, कल्याणुस्त्रि सोहावता,  
रीछे गण्डु भंगणविजय, भंगण प्रभा प्रसरावता;  
जीत्या ज्वन आनंद, पूर्णिनंद मुनिपद साधता,  
चरणमां सुलक्षित गिरवर, पूर्ण प्रेमे लाधता. ७

संवत् २००७ अषाढ	}	लि० शाहु गिरवरलाल उभेद्यांहनी
शुक्ल पंचमी चंद्रवार		१००८ वार वंहना



## શ્રીમહા વિજયમહેત્રસૂરીક્ષરજી

### ગુરુગુણ પચ્ચીશી

( હસ્તિત છંદ )

મનોહર માળવ દેશના, રતદામ નામે શહેરમાં,  
રનકુક્ષી દ્વાલિબાઈ, માતાના મનોહર ધામમાં;  
\*ગુણ પંચ થેડ શરીવર્ષ, તૃતીયા કૃષ્ણ કર્તિક માસમાં,  
જનમ્યા શુરૂ જગજંતુ, ૨મીશ્રીમલજી આ સ્થાનમાં. ૧

શુરૂતાત ચેતાળુને હર્ષ, ભરાય આ શુલ્ષ અવસરે,  
કૃણી આચ્રવૃક્ષ લચી રહે, તિમ નારતા સુતમાં ઠરે;  
માત્ર ચાર વર્ષની ઉમરરે, વિશેષ પિતાનો થયો,  
માતુ વિશેષ અગિયાર વર્ષ, અશ્વિશુવયે આવી ગયો. ૨


કાલુરામજી લોલીરામજી, ૪પંચા પિતરાઈ ધરે,  
૦૪વહારિક હિન્દી ચાર ઝુક, અલ્યાસ આ સ્થળમાં કરે;  
ધર્મ અલ્યાસ પંચ પ્રતિક્રિમણ, કરી મહેસાળે ગયા,  
અલ્યાસ નિમિત્ત ચારમાસ, એ પાઠશાળામાં થયા. ૩

પંન્યાસ સિદ્ધિવિજય ગળિ, પરિચય ચોસડમાં થતાં,  
આ મહાન પુરુષ સમાગમે, વૈરાગ્ય દ્વિલમાં જમતાં;  
ઓગણીસ સડસરે ભરુય ગામે, ઉપધાન તપ વહન કરી,  
૫પંન્યાસ સિદ્ધિ પસાય પહેરી, માળ શુલ્ષ ભાવે ભરી. ૪


\* ૧૬૫૩ની સાલમાં. ૧ દ્વાલિબાઈ-માતાજીનું નામ. ૨ મીશ્રીમલજી  
સંસારી નામ. ૩ નાની વધ્યમાં માતાપિતાનો વિશેષ થયો. ૪ પંચા  
(શાખ) છે, કાકાના હિકરા ભાઈ થાય. ૫ આ પંન્યાસ વર્તમાન સમયમાં  
એ અટક આચાર્યશ્રી વિજયસિદ્ધસૂરીક્ષરજીના નામથી વિદમાન છે.



निःस्तूर्ही, बालब्रह्मचारी, शांतमृति अध्यात्मवर्णी सूरिराज;  
प्रणिपाए पदपंकज तस, “ दुर्दम ” भवजलधि तरचा जहाज.



अनुनादां चेताकृचर्वानय ॥३॥ विलयभैन्दस्त्री श्वरूप मुनि श्री श्रीकालतवि १९५७



[ ૭ ]

એગાણ્ણિસ સડસઠ સાલમાં, પંન્યાસ નીતિવિજ્યળ મળે,  
વીશનગર શ્રી કલ્યાણુપાર્થી, નાથના તીરથ સ્થળે;  
એગાણ્ણિસ એગાણ્ણોતેર વિકાસ, રાજનગર ગામે ગયા,  
પંન્યાસ નીતિવિજ્ય શિષ્ય, (મુનિ) હર્ષ કરે દીક્ષિત થયા. ૫

કર્તિક કૃષ્ણચતુર્થ તીથીએ, જેલ તળ સંસારની,  
મહેન્દ્રવિજ્ય નામે થયા, ર્ઘ્યાછા મહદી અણુગારની;  
વડી દીક્ષા વીરમગામ પંન્યાસ, ભાવવિજ્યળ કને,  
અભ્યાસમાં વૃદ્ધિ થતી, વૈરાગ્ય વસતા શુલ મને. ૬

વર્ષ તેર રહી શુરુસાથમાં, દીક્ષા લઈ સેવા કરી,  
ન્યાય શાણ વ્યાકરણ આદિ, અભ્યાસ ખાંતે આદરી;  
ઉત્તરાધ્યયન આચારાંગના, ચોગ વહન કિયા કરી,  
શુરુસાથમાં સ્તુત વાંચનાએ, ધારતા ભાવે ભરી. ૭

કલ્પસૂત્રના ચોગની કિયા, કરી સીતેરમાં,  
આગમ વાંચના કુપડવંજ, ગયા એકોતેરમાં;  
કઠીન કાંય અંથ વાંચન કરે, ઉઝા રહી ત્રોતેરમાં,  
સમવાયાંગ શુરુ જન્મભૂમિએ, વાંચન ચુમોતેરમાં. ૮

દીક્ષા લહી રાજનગર, ચાતુર્મસ રાધણુપુર ગયા,  
સીતેર એકોતેર ચાતુર્મસ, રાજનગર થયા;  
ઓંતેર પેથાપુર ત્રોતેર ઉઝા, ચુમોતેર થાંવલા,  
પણી અમહાવાહ રાધનપુર, છેંતેર ચોમાસું ભલા. ૯

૧ તેઓશ્રી આચાર્યપદ્ધથી વિભૂષિત થઈ સ્વર્ગવાસી થયા છે. તેમના  
શિષ્ય મહારાજ શ્રી હર્ષવિજ્યળના હાથે સંયમ અહણુ કર્યું. તેઓશ્રી  
પણ ૫. શ્રી આચાર્યપદ્ધથી વિભૂષિત થઈ વિચરી રહ્યા છે. ૨ દીક્ષા  
લેવાની ઉત્કટ ધર્યા જોઈ મહેન્દ્રવિજ્ય નામ શુરૂણે સ્થાપન કર્યું.

[ &lt; ]

सिद्धक्षेत्र सतोतर, भगवतीनी वांचना पूरणु करी,  
अहोतेर राजनगर आळया, शुरु साथे विच्चरी;  
ॐ एगाणुतेर, एंशीचे राजनगर गया,  
एकाशीचे तप्तगढ, उपधान तप अङ्गि थया. १०

केशरीआल्लना जै, रत्नाम गामे गया,  
भ्यासी ईदीर त्यासी, सीपोर चोमासा थया;  
चोरासी पंच्यासी, अमदावाह चोमासे रह्या,  
छ्यासीमां सीपोर लुणुवा, सत्याशीचे गया. ११

पञ्चवण्णा भगवतीसूत्रना, शुरु पासे वांचन करे,  
योगे वडन करी सूत्रना, तपस्याथी कर्मी निर्जदे;  
मृगशर शुक्ल पंचमी दिन, एगाणुषीशी विक्कमे,  
पामेल नीतिसूरि करे, गणिपद अमदावादमे. १२

एगाणु सत्याशी विक्कमे, कर्तिक वदनी आठमे,  
पन्यासपद शुरुहाथथी, पामेल गाम सीपोरमे;  
यात्रा करी अर्णुदगिरिनी, देश मरुधरमां गया,  
आगम अस्यासी थता, उपकार बहु कर्ता रह्या. १३

शुडाभावेतरा शिवगंज, ए ऐ गाममां २ वर्षी रह्या,  
नेवुंमां अंधेरी शुरु साथ, पुना चोमासे गया;  
वैतालपेंड चोमासुं करे, उपधान तप अङ्गि थया,  
अंतरिक्षल यात्रा निभिते, लघु संघ साथे गया. १४

णालापुर लरुच चोमासे, उपधान तप अङ्गि थया,  
चोराणुं सात राजनगर, वीरविजय उपाश्रये रह्या;  
पंचाणुं राधणुपूरमां, शुरु साथ चोमासुं करे,  
छन्नुमां शुरु-आज्ञा थतां, जयं श्री सिद्धगिरिवरे. १५

१ यत्रितनायकती ४-ममूमितुं गाम-रत्नाम. २ चोमासुं.

[ ६ ]

दीक्षा देई ए बायोने, सिद्धगिरिथी विचरता,  
तीर्थ श्री गिरनार जઈ, पौरण्डर गामे आवता;  
आ गाममां प्रतिभेदधारा, उज्जमण्डु शुभ त्यां थता,  
ज्ञानगर सताणु चोमासे, १०-११ वांचता. १६

१० उपधान करावी ज्ञानगर, अहुणु न गेडे रथा,  
चातुर्मास ए पूरुं करी, अमहावाह नवाणुं गया;  
११ इश्वरगुन कुण्ठु छहु दिवसे, आचार्यपद्धवी पामता,  
डेलो उपाश्रय लुवारपोण, गुरु संघ (मणी) सहु आपता. १७

१२ नवाणुं रही सीपोर, गुरु साथमां मरुधर गया,  
उपधान थाय गोहालीमां, ए हुलर पाड़ीव रथा;  
उपधान पाडिवमां थया, तपतगढ गया एकमां,  
अहुए भेडेच्छव ए थया, दीक्षा गोहाली रेंकमां. १८

१३ ए त्रय अमहावाह रही, पाणि मरुधरमां गया,  
पादरलीमां रथा चारमां, उज्जवाणु अहि ए थया;  
अहुए भेडेच्छव पांच अहि, पठी शिवगंजमां गया,  
ए हुलर पांचमां अहि, गुरु साथ चोमासे रथा. १९

१४ पछी अंजनशलाका कराववा, रैवतगिरिए गया,  
छ साले अमहावाहमां, सातमां सिद्धाचण रथा;  
अहुए भेडेच्छव अक्षयनिधि तप, एक जणु दीक्षा थहे,  
अंभात ए हुलर आठमां, चातुर्मास गुरुश्री रहे. २०

१५ १८८८ ना हाथणु वटी ६ ना रोज डेलानो उपाश्रय तथा लुवारन्ती  
पेक्षना उपाश्रय तरक्षी गुरुमहाराजे श्री संघने एकन करी आचार्य  
पद्धवी आपि. २ टेंकमां-धर्मशाणा गोहाली गाममा.

[ ૧૦ ]

પ્રતિષ્ઠા નાવી ગામમાં, હોઠ લાખ ઉપજના થયા,  
શ્રી કાન્તવિજય દીક્ષા અહીં, સેવા નિમિત સાથે રયા;  
નિસ્ત્રણ આલાચન્દ્રનારી, આલસ નહિ અંગે જરી,  
મારવાડ ગુર્જર ભૂમિમાં, ઉપકાર બહુ કીધા કરી. ૨૧

ગુરુ શિખ સંખ્યા સાત, વિદ્યમાન પાંચ જણાય છે,  
મણ્ણુવિજય શ્રીકાન્તવિજય, રાજહંસવિજય ગણાય છે;  
સુદર્શનવિજય સુરીલવિજય, એ પાંચ સંખ્યા જાહુંને,  
દર્શનવિજય વિનોદવિજય એ, સ્વર્ગવાસી પિછાહુંને. ૨૨

નિરાલિમાની શાંતમૂર્તિ, અધ્યાત્મ વાણી તરવરે,  
એ મહાનુ પુરુષ સમાગમે, ભવિ જીવ સમતા આદરે;  
ગુરુ વિનય પ્રભુતા સરલતા, આણુ પ્રભુની શિર ધરે,  
પુરુષાલાલાણી ભમતા તણ, નિજ આત્મગુણ રમણુ કરે. ૨૩

ઓગતું જીવન પ્રતિકૂળ જ્ઞાની, આત્મખણ્ઠી કેળવે,  
એ મહાનુ પુરુષ ચરિત્રથી, ભવિ આત્મગુણુ મેળવે;  
માટે આવા મહાનુ પુરુષના, ચરિત્ર શાસ્ત્ર લખાય છે,  
વાંચી અમલમાં મૂકૃતા, ભવિ આત્મ સન્મુખ થાય છે. ૨૪

આંહિ આગમ-તીર્થભૂમિમાં, સમાગમ ગુરુજીનો થતા,  
અધ્યાત્મ-કલ્પકુમ અનુવાદ, માટે ગુરુ ક્રમાવતા;  
હું અદ્યપભિ પણ ગુરુ કૃપા, એ વાત હુદ્ધે લાવતા,  
“હુલ્લાલ” કરે ગુરુ પુણ્યથી, ભવિ આત્મ સન્મુખરમણુતા. ૨૫

( ગુરુગુણ પદ્ધ્યીશી સમાપ્ત )

સં. ૨૦૦૬ ખીણ વૈશાક શુક્ર ૩ અક્ષયતૃતીયા : શતનિવાર વદ્ધલીપુર	લેખક : કવિ હુલ્લાલજ ગુલાખચંદ ભહેતા અનુવાદક-અધ્યાત્મકલ્પકુમ
---	--



स्व. हानवीर शोङ्कश्री चीमनलाल डायालाई परीभ  
(१८८९-७)

साधना मुद्रणालय-भावनगर

## સ્વ૦ શેડ ચીમનલાલ ડાલ્ખાભાઈ પરીખનો દુંક જીવનપરિચય

ગુજરાત દેશના ઐડા જીવામાં કપડવંજ નામનું શહેર છે. આ સ્થળમાં સ્વ. શેડ ચીમનલાલભાઈ બુદ્ધિશાળી, મહેનતુ અને પરગળુ હતા. શરૂઆતમાં તેઓએ નોકરી કર્યા પછી ધંધામાં આગળ વધતા જ્યંત મેટલ રીકાર્ડનરી વિગેરે કંપનીએ ઐલી લાણો રૂપીયા કમાયા હતા અને સ્વ. આગમોન્ડારક આચાર્ય-દેવ સાગરાનંદસૂરીધરજી મહારાજશ્રીએ આ સ્થળમાં આગમાની વાંચના કરેલ તેમની સાનિધ્યતામાં, કપડવંજની અંદર આંણીલની એળી અને દેશવિરતિ સંમેલન વગેરેમાં પોણો લાખ રૂપીયા ખરચ્યા હતા. કપડવંજ આજે પણ તેમની ઉદારતાને જણાવતું, તેમના હાથે સ્થપાનેલ જ્યંત સાર્વજનિક હોસ્પિટલ ચાલે છે જેમાં તેમણે રૂપીયા લાખ કરતાં વધુ સખાવત કરી છે. આ ઉપરાંત મહાવીર વિદ્યાલય, ભારતીય વિદ્યાભૂવન, કપડવંજ પાંજરા-પોળ, જૈન આત્માનંદ સભા વિગેરે અનેક ઠેકણે તેમણે તેમના ધનનો સારો સહૃદ્ય કર્યો છે.

સ્વ૦ શેડ ચીમનલાલભાઈ ઉદાર મિત્રનસાર અને નાગ્રજીના હુણુવાળા હતા. તેમણે પોતાના હાથે ગુપ્ત ફાન પણ સારું કર્યું છે. શાસનનાં દરેક શુશ્રાવ કામમાં પોતાનો ફાળો સારો આપતા હતા.

સ્વ૦ શેડ ચીમનલાલભાઈ વર્તમાન સમયે નથી પણ તેમની પાછળ તેમની જીવનપરાગ, કુટુંબ અને મિત્રોનો બહોળો સમૃદ્ધાય છે.

સ્વ૦ શેડ ચીમનલાલભાઈએ પંન્યાસળ મહારાજશ્રી કૈલાસ-સાગરજી (બુદ્ધિસાગરસૂરિના)એ બહાર પાઢેલી કથાસાગર ભાગ-૨ ની છપામણીમાં ઝ. ૪૦૦) ચારસોની મદદ કરેલ. એટલે તેમને સાહિત્ય પરત્યે પણ સારો પ્રેમ હતો. તેમના ધર્મપત્ની માયાખેને આ અધ્યાત્મકવર્તુમની બુક પ્રસિદ્ધ કરવા માટે બુક ૭૦૦) સાતસોનો

ખર્ચ તેમના સ્વરૂપ પતિહેવના સ્મરણાર્થે મુસુકુણું જીવોને લેટ આપવા શ્રીમહ આચાર્યશ્રી વિજયમહેન્દ્રસૂરીશ્વરજીના શિષ્ય મુનિરાજશ્રી શ્રીકાન્તવિજયજીના પ્રતિભોગથી સહકાર આપેલ છે. આ બુક આત્મહિતશિક્ષાથી ભરપૂર હેવાથી ધ્યાનાં ભવિક જીવો આત્મહિત સાધશે તેનો લાલ માયાભેનના ક્રાણે જાય છે, તેમાં જરાય અતિ-શાળેચિત નથી. તેમણે તેમના પતિહેવના પગલે ચાલી આ જીન-સાહિત્ય પ્રકાશ થવામાં જે લક્ષમીનો સફ્ફૂલ્ય કર્યો છે તે અમૂલ્ય છે અને તે માટે અમે તેમનો હાર્દિક આભાર માનીએ છીએ. તેઓ હીર્ઘાયુષ્ય રહી આવા શાસનના શુલ્ક કામ કરે એવી પ્રાર્થના છે.

\*કરણુ કરાવણુ ને અનુમોદન, સરખા ઇણ નિપણવે; રથકાર અણહેવ મુનિ હરિણુ એ ભાવે, ચોથા સ્વર્ગે સિધાવે.

શ્રીમહ વિજયમહેન્દ્રસૂરીશ્વરજીની પ્રેરણું તથા તેમની આજ્ઞા થતાં અદ્યમતિએ અમે અનુવાદ તૈયાર કર્યો અને ભાવનાપૂર્વક માયા ભેને તેમાં સારો સહકાર આપ્યો એટલે જેટલા અંશે આ બુક વાંચ્યો મનન કરી અભ્ય આત્માએ આત્મહિતમાં વૃદ્ધિ કરશે એટલો અમારા નણેનો પ્રયાસ સફળ થયો ગણીશું. સુરેષુ-કિં બહુના ? છું શાંતિ શાંતિ શાંતિ.

સં. ૨૦૦૬ ના વૈશાખ શુદ્ધ ૩  
શનિવાર ના. ૧૬-૫-૫૩  
વદ્ધલીપુર (સૌરાષ્ટ્ર)

અનુવાદક-આર્થ્યાત્મકલપદુમ

\* રથકારને જંગલમાં જમવા વખતે સુપાત્ર પ્રાપ્ત થવાની ભાવના હતી, અણહેવ મુનિ વિચારતા હતા કે આવા શ્રીમના તડકામાં પરસેવાથી રેખનેથ થઈ દાનના ભાવ કેવા રાખે છે, હરિણ તે જાડની ડાળ નીચે રથકારના દાનની ભાવના કરતું હતું. ડાળ પવનથી તૂરી પડતાં હુરત જ નણે જણું કણધર્મ પામી તે ભાવનાથી ચોથે સ્વર્ગે ગયા છે.

## આ સુખ

**આ** અનાહિ સંસારમાં મુખ્યતાએ દરેક પ્રાણીને ક્રમિક વિકાસ થયેલો હોય છે. સુદ્ધમ નિગોદથી માંડીને બાદર નિગોદ-પૃથ્વી-અપુ-તેજસ્-વાયુ અને વનરપતિકાયાહિ અનેક પરિસ્થિતિઓ(stages)માંથી પસાર થઈને વિકલોદ્વિદ્ય અને તિર્યંચ પંચેદ્વિદ્યાહિ અવસ્થાએ ઉદ્ઘાટણી હુલ્લાભ માનવજીવન પર્યાત આપણે આવ્યા છીએ. આ માનવજીવનમાં પણ આર્થિક, પંચેદ્વિદ્ય-સંપૂર્ણતા, સહગુરુયોગ અને વરતુધર્મની એણખાણ વિગેરે પ્રામ્ય થવું અયંત હુલ્લાભ છે. આવો માનવજીનું પ્રામ્ય થયા પછી સ્વર્ગોચર પ્રશ્ન(intuition)થાય છે કે મારું કર્તાં શું છે? શાસ્ત્રો તેને ઉત્તર આપે છે કે જે પરિસ્થિતિ તેને વ્યાવહારિક રીતે પૂર્વ સંયોગાનુસાર પ્રામ્ય થઈ છે તેને નીભાવી લઈને અહિગતમભાવ (Physical expression) તળુ અંતરતમભાવમાં સ્થિર થઈ સર્વ સંનેગોનો તઠરથ દિશા બની જા ! અને દર્શાન, શાન, ચારિત્રના અધ્યાત્મમાર્ગમાં વૈરાગ્યપૂર્વક પ્રગતિ હર ! એ પ્રગતિ એ જ માનવજીવનની સાર્થકતા છે, કેમકે સહજાન અને સહિક્યાના સુંદર નિભિતો મેળવવાથી ઇણ પણ અવશ્યંસુંદર મળે જ. તત્ત્વાર્થસૂદ્રતમાં કહેલા સમ્યગ્રૂહશાનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગઃ—એ સૂત્રાનુસાર વ્યવહાર અને નિશ્ચય-દિષ્ટિબિદ્ધુથી સમ્યકૃતવની પ્રાપ્તિ થયા પછીનું શાન મુક્તિની પ્રાપ્તિ માટે ગણત્રીવાળું બને છે અને તે શાન વિરતિગુણું ઉત્પન્ન કરવી આધ્યાત્મિક જીવનનો આનંદ ઉત્પન્ન કરી મુક્તિના સીધા માર્ગ ઉપર પ્રાણીને મૂકે છે.

વરતુસ્થિતિ આમ હોઈ અધ્યાત્મની વ્યાખ્યા કરતાં શાસ્ત્રકાર મહારાજાએ કહ્યું છે કે આત્માનું અધિકૃત્ય પંચાચારચારિમા—આત્માને ઉદેશીને પાંચ આચારો( શાનાચારાહિ )ની સાધના કરવી તેનું નામ અધ્યાત્મ કહેવાય છે. આ અધ્યાત્મસ્વરૂપની પ્રાપ્તિથી આત્મામાં પ્રકટ શાંતિ અનુભવાય છે. જે શાસ્ત્રો એકાંત આત્મહિત

[ १२ ]

માટે જ પ્રવર્તે છે, જે શાસ્ત્રવચનો વિકારવર્ણિત શ્રી વીતરાગહેવની વાણીના અનુવાદક હોય છે, જે સ્લેડે જ્ઞાન કે કિયાનો એકાંત પક્ષ એંચતા નથી, જે કાંયોવડે સંસારની અસારતા સમજવી આત્મામાં વૈરાગ્ય ઉત્પત્ત થાય છે અને સોળ ભાવનાનું સ્વરૂપ જેમાં આત્મા સાથે વિચારાય છે, તે અધ્યાત્મશાસ્ત્ર કહેવાય છે.

જેમ પંખી એ પાંખવડે જ ઊરી શકે છે, રથ એ ચક્કવડે જ ચાલી શકે છે તેમ અધ્યાત્મ પણ શુદ્ધ જ્ઞાન અને કિયાના સંમેલનથી જ પ્રવર્તે છે; તે વિના અધ્યાત્મ કંઈ શકાય જ નહિં; વસ્તુતત્ત્વની સમજ મેળવી, હિતાહિતનો યચાર્ય વિવેક કરી જે સ્વહિતસાધનમાં પ્રવર્ત થાય છે અને અહિત કાર્યથી નિવૃત થઈ વૈરાગ્યતત્પર અને છે તેજ અંતે સ્વ છિદ્જસિદ્ધ કરી શકે છે; આ રીતે અધ્યાત્મ આત્મકલ્યાણનો અમોદ ઉપાય છે; જેથી જે કાંઈ શુલ કર્તાબ્ય કરવામાં આવે છે તે લોકદેખાવ માટે નહિં પણ કેવળ પોતાના જ આત્માને લક્ષીને, તેની શુદ્ધ અને ઉત્તુતિ અર્થે કરવામાં આવે છે; આવી અંતરદૃષ્ટિ જેમને જાગી છે તે અધ્યાત્મદૃષ્ટિ કહેવાય છે; તેઓ આવા અધ્યાત્મકલ્પદ્રૂમ જેવા ઉચ્ચ શાસ્ત્રના વાચનના અધિકારી અને છે. શુદ્ધ અધ્યાત્મીઓ આ અંથના અધિકારી નથી.

અધ્યાત્મશાસ્ત્રનું અધિકારીપણું ચતુર્થ ગુણુસ્થાનકથી શરૂ થાય છે. આ વખતે વિકાસગામી આત્મા સ્વરૂપર્વાન કરી શકે છે; અર્થાત આજ સુધી આત્માની જે છીપમાં ઇપાની ભાતિતની જેમ, પરિપમાં સ્વરૂપની ભાતિ હતી-તે દૂર થઈ જાય છે: એથા તેના પ્રયત્ન અને પુરુષાર્થની ગતિ ઉલટી નહિં થતાં સીધી બની રહે છે; અર્થાત્ તે વિવેકી બનીને કર્તાબ્ય-અકર્તાબ્નો વિભાગ કરી લે છે. આ પરિસ્થિતિને જૈન દર્શનમાં અંતરાત્મભાવ કહે છે; ચતુર્થ ગુણુસ્થાનકથી અધ્યાત્મદૃષ્ટિની શરૂઆત થતી હોવાથી જિનપૂજન, સામાયિક, પ્રતિકમણું, પૌષ્ઠ, પ્રલાઘ્યાન, તપ વિગેરેની આવશ્યકતા બબી થાય છે અને તેનો અભ્યાસ વધારતાં

[ १३ ]

आत्मामां विरतिनुं बल प्रकटेछे. ए बल पुण्यातुभंधीपुण्य उपार्जन करावे छे, जे वडे आत्मानां अशुभ संस्कारो डे जे अनादिकालना पडेला होता ते हूर थर्ड शुभ संस्कारेनुं सिंचन थतां ए पुण्यातुभंधी पुण्य आत्माने अविष्यक्ताणमां अध्यात्मदृष्टिनो विशेष विकास करी मुक्ति तरह शीघ्र लाई ज्वामां सहायक नीवडे छे; आ स्थितिने प्राप्त करीने विकास-गाभी आत्मा पौतानी अंदर वर्तमान सूक्ष्म अने सहज ऐवा शुद्ध परमात्मभावने हेखवा लागे छे अर्थात् अंतरात्मस्वलाप ए आत्म-भंहिरनुं गर्भद्वार छे, जेमां प्रवेश करीने ते भंहिरमां वर्तमान परमात्मभावइप निक्षयहेवनुं हर्शन करी शके छे.

आ स्थिति विकासकमनी चोथा भूमिका छे, अथवा चोयुं गुणुस्थान छे; जे पाभीने आत्मा अथवावार ज आध्यात्मिक शांतिनो अनुभव करे छे. आ भूमिकामां आध्यात्मिकदृष्टि यथार्थ ( आत्मस्वइपोन्मुख ) हेवाना कारणे विपर्यास रहित होय छे जेने ज्ञेन हर्शनमां सम्यग्दर्शन कर्हेवामां आवे छे. आ भूमिका प्राप्त थया पठी ज आत्मस्वइपनी प्राप्तिनी शङ्कातानी गणुनी देखाय छे; भीजना चंद्रनुं हर्शन अहिं गणुय छे, अने ते तेमे गुणुस्थानके पूर्ण चंद्रइपे अनी नय छे. उत्कांतिकम( Theory of evolution )मां प्रगति करतां पंथम आहि गुणुस्थानकेनी प्राप्ति थतां-देशविरति अने सर्वविरतिपण्यातुं-विरति बल प्राप्त थतां उत्तरोत्तर अध्यात्मदृष्टिनी शुद्धता अधिकालिक थती नय छे, अने विकासकममां आगण वधतां आध्यात्मिक शांतिना अनुभवथी चारित्रमोहने नष्ट करो छेवटे अवाति कर्मनो नाश करी पूर्ण-स्थिरताइप छेही चरम अवस्था अर्थात् चौहमा गुणुस्थानने पाभी पूर्ण शुद्ध स्वइपी परमात्म अवस्थाने प्राप्त करी कृतकृत्य अनेहांतवाहनो

अध्यात्मगेण धरम गंभीर अने सूक्ष्म छे; निर्यात्य प्रवयननुं रहस्य छे, तेमज धर्मध्यान अने शुक्लध्याननुं कारण्य छे; उपादान कारण्य आत्मामां अध्यात्मभाव प्रकट थाय तो मुक्तिनी नजुक लाई ज्वानी निमित्तो स्वयमेव आवी भगे छे. मुख्य अने गौण्य दृष्टिमय अनेहांतवाहनो

[ १४ ]

રસીકાર કરતાં નિમિત્તો પણ ઉપાદાનની પરિપક્વતાતું કારણ બને છે. દર્શાન-મેહુને અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષયો પ્રતિ ઉદ્દાસીનતાથી, મહાપુરુષના ચરણુકુમળની ઉપાસનાના બળથી અને વિરતિ તરફના પુરુષાર્થથી અધ્યાત્મહષિ યથાર્થ પરિણમે છે; જગત એકનાટક જેવું લાગે છે; ઉપમિતિભવપ્રપંચાકારે સોળ હજર શ્લોડેવાળા અંથમાં નિવેદન કરેલું કર્મપરિણામ રાજી અને કાલપરિણાત્મિ મહારાણી તરફથી લોકાકાશોહરા નામની રંગભૂમિ ઉપર જીવ-પાત્રો તરફથી બજવાતું નાટક જુને છે. પોતે સાક્ષી બને છે અને કથારે આ વિષમ સંસારના સર્જક કર્મપાશથકી છૂટું તેવી ભાવનાથી અધ્યાત્મ-હષિતું બળ પ્રકટ થાય છે.

આધ્યાત્મિક વિકાસનો ક્રમ આશ્રવ નિરોધ અથવા સંવરના ક્રમ ઉપર અવલંબિત હોય છે; આ આધ્યાત્મિક વિકાસ આત્માને પરમ શાંતિમય લાગે છે; પ્રશામ, સંવેગ, નિર્વિદ અનુકંપા અને આદિતકય ગુણો પ્રકટે છે; અનાદિકાળથી ઉપમિતિભવપ્રપંચાકથામાં નિવેદન કરેલા ઉત્ત્રાવચેષુ ગેહેષુ ભ્રાંત્વા ભ્રાંત્વા નિષીદત્ત:-અર્થાત ઉચ્ચનીય ગતિઓમાં અટકી અટકીને થાક ખાતા આત્માને સ્વસ્વરૂપમાં શાંતિ પ્રકટ થાય છે લારે સાચો વિસામો મળે છે. બાલ્યદષ્ટિએ જેમ રોગ શાંત થતાં ‘હાશ’નો ઉચ્ચાર થાય છે તેમ કર્મરેગની શાંતિ પ્રદાન વૈગણ્યમય જીવન જીવતાં સાચો કર્મયોગી બને છે અને આત્માનંદ અનુભવે છે; તેથી જ યોગશાખમાં શ્રામદ્ હેમચંદ્રાચાર્યજીએ કહ્યું છે કે-

**મોક્ષોઽસ્તુ વા માઽસ્તુ પરમાનંદસ્તુ વેવ્યતે સ ખલુ ।**

**યस્મિન્નિખિલસુખાનિ પ્રતિભાસંતે ન કિંચિદિવ ॥**

“ મોક્ષ ગમે ત્યારે હો ! પરંતુ આધ્યાત્મિક સુખની વાનકી જે અહિં અનુભવાય છે તેની આગળ પૌર્ણગલિક સુખો કશી વાસાતમાં નથી.”

શ્રીમહ આત્મદ્વિનાન્દુએ કહ્યું છે કે-નામ અધ્યાત્મ, સ્થાપના અધ્યાત્મ, અને દ્રવ્ય અધ્યાત્મની એકાંત અપેક્ષા નહિં રાખીને ભાવ અધ્યાત્મ

[ १५ ]

તરફ પ્રગતિ કરો ! ભાવ અધ્યાત્મ આત્મા સાથે વણું જય છે અને તે જ મોક્ષસાધક શીધ નોવડે છે. ઉપાધ્યાયજી શ્રીમહ્યયોવિજ્યજીએ પણ સવાસો ગાથાના સ્તવનમાં કહેલું છે કે ‘ અધ્યાત્મ વિષ ને કિયા તે તનુમલ તોલે ’ અર્થાત् ભાવ અધ્યાત્મ વળગતી કિયા શરીરના મેલ તુલ્ય છે એટલે કે નિરર્થક છે. શ્રી વિજ્યલક્ષ્મીસુરિએ પણ જીન-પૂજનમાં કહું છે કે “ અધ્યાત્મજીને કરી વિધે લવભ્રમલિતિ. ”

અધ્યાત્મજીન ખાસ કરીને વૈરાગ્યથી પ્રકટે છે. વચ્ચના નાશથી જેમ તંતુનો નાશ થતો નથી, તેમ આ દેખાતા પ્રત્યક્ષ શરીરના નાશથી આત્માનો નાશ થતો નથી; દશ પ્રાણુના નાશથી આ શરીરથી આત્મા છૂટે છે અને અપરગતિમાં જય છે પણ આત્મા તેનો તે જ છે; આત્મામાં શુણું પર્યાય રહે છે; સહભાવી શુણું અને કુમલાવી પર્યાય; આ પ્રત્યક્ષ દેખાતું શરીર, વાણી, મન-તે હું નથી; એ નણુથી જોગવાતા વિષયો મારા નથી; શરીરગાહથી જિન આત્મસ્વરૂપ ચિંતવવાથી અધ્યાત્મદિષ્ટ પ્રકટ થવાનું કરણું ‘વૈરાગ્ય’ અને છે. અનિલાહિ બાર ભાવના અને મૈન્યાહિ ચાર ભાવના ભાવવાથી વૈરાગ્યજીન પ્રકટ થતાં અધ્યાત્મદિષ્ટને પુષ્ટિ મળે છે; તે વખતે અંતરાત્મા વિચારે છે કે—અરે ! આ સંસારમાં મારું શું છે ? કંઈ નથી ! આજે ને દેખાય છે તે મારા આત્માથી જૂદું છે; મારાથી જે વસ્તુ જૂદી છે તે સ્ત્રી, અપત્ય, ધન, દેહ, બંધુઓ, વિષયો, ધ્યાયો વિગેરે મારાં નથી; આત્મા જીનવડે દેખી શકે છે પણ આત્મા વિના પાંચ દ્વયોમાં એવા શક્તિ નથી, કે ને આત્માને દેખી શકે. હું જીન, દર્શન, ચારિત્રસ્વરૂપ આત્મા ઈદ્રિયોને અગોચર હું; મારે અધ્યાત્મમની અલિલાધા કરવી જેથી આત્મા પોતાના શુણેનો વિકાસ કરતાં શીધ પરમાત્મા બની રાંશે.

અધ્યાત્મજીન માટે શ્રી આનંદધન પદ સંખ ભાવાર્થમાં સ્વ. આ. શ્રી બુદ્ધિસાગરજી કહે છે કે “ અધ્યાત્મજીની થનારતે ધર્મકિયાઓ અને પારમાર્થિક કાર્યો કરવાનાં નથી એમ કદી ડાઢ્યે માત્રી લેવું નહિ,

[ ૧૬ ]

અર્થात् અધ્યાત્મરાનીઓને પોતાના અધિકાર પ્રમાણે સર્વ કરવાનું છે; ગૃહરથે ગૃહરથના અધિકાર પ્રમાણે ધર્મચારો અને પરૈપક્તારિક કૃત્યો કરવાં જોઈએ; અને સાધુઓએ પોતાના અધિકાર પ્રમાણે ધર્મચારો, ઉપહેશ, પડન, પાઠન આદિ કૃત્યો કરવાં જોઈએ. આત્મામાં ઉત્પન્ન થયેલો અધ્યાત્મરાનનો પરિણામ ખરેખર મન, વચન અને કાયાના યોગાને તાથે કરીને, ભાવનાનું સ્વરૂપ, ભવની પીડા, પૌરણલિક પદ્ધારોની અસ્થિરતા, રાગદેષનું વિચિત્રપણું અને આત્માનું સાધ્ય શું છે? તે કેમ અને કયારે ગ્રાપી થાય? વિગેર વિચારો આ અધ્યાત્મ કદ્યપ્રકૃતભાસ્ત્ર વર્ચે છે. રાગને ઉપમિતિકાવપ્રપંચાંથકાર કેસરીની ઉપમા અને દ્વેષને ગજેંદ્રની ઉપમા આપે છે; વૈરાગ્યના નિષયનો મુખ્ય જીવેશ સ્વરસ્તુ ઓળાખાવવાનો, અને તેના ઉપર પ્રેમ ઉત્પન્ન કરવવાનો છે. પર વસ્તુ કઈ છે તેને શાધી તેની સાથેનો સંબંધ ઓછા કરાવો, ધીમે ધીમે તે તોડી નાખવવાનો છે; પરમભિય ભિત્રો, પ્રાણાધિક પત્ની, જીવથી વહ્નાલો પુત્ર, પુત્રપ્રેਮી પિતા અને વાત્સલ્યભરપૂર માતા જ્યારે છોડા છાડીને ચાલ્યા જાય છે ત્યારે ગયા પછી તેઓ ભિત્ર, પતિ, પિતા કે પુત્રનું શું થયું તેની સંલાણ લેવા પણ આવતાનથી; આ હકીકત પ્રસ્તુત અંથમાં જીવોના સ્નેહસંબંધની વિચિત્રતા અને અસ્થિરતા બતાવે છે, અને આત્મરસ્વરૂપ તરફ વાળે છે.”

પ્રસંગોપાત્ર અધ્યાત્મ સંબંધમાં આટલું નિવેદન કર્યો પછી જાણુાવવાની આવશ્યકતા છે કે-પ્રસ્તુત અધ્યાત્મકલપકુમ અંથના કર્તા સહસ્રાવધાની પૂ. મુનિસુંદર મહારાજ છે. એમનો જન્મ સ. ૧૪૩૬માં થયો હતો. સાત વર્ષની નાની વયમાં દીક્ષા લીધી. શ્રી વજ્રસ્વામી, શ્રી સિદ્ધસેન હિવાકર, શ્રી હેમચંદ્રચાર્ય, શ્રી સોમસુંદરસુરિ અને ઉ. શ્રી યશોવિજયજી લગભગ સાત વર્ષની ઉમરે દીક્ષિત હતા. પૂ. મુનિસુંદર મહારાજના દીક્ષાગુરુ શ્રી હેવસુંદરસુરિ સંભવે છે. સ. ૧૪૭૮માં આચાર્યપદવી મળી હતી. શ્રી સુંબર્મસ્વામીથી ઓકાવનમી પાટે ગચ્છાધિપતિ શ્રી મુનિસુંદરસુરિ હતા. હેવકુલપદ્મભાઈ મહામારીના ઉપરનવખતે સંતિકર રતોન

[ ૧૭ ]

તेमણે અનાવ્યું હતું. એમના બીજા અંથે ત્રિદશતરંગિણી, ઉપદેશરત્નાકર, સ્તોત્રરત્નકાશ, ભિત્રચતુર્ષ્ટ્યકથા, તપાગચ્છપહાવળી અને શાંતરસ રાસ, ત્રિવિદ્ગેષિ, જ્યાનંદ ચરિત, ચતુર્વિંશતિજિનરતોત્ર તથા સીમાધરસ્તુતિ વિગેરે અંથે છે. એમને સુજીરખાન બાદશાહ તરફથી 'વાહીગોકુલબંદ'નું બિરુદ્ધ મળ્યું હતું. 'જ્યાંશી' એ શબ્દ દરેક અંથની આદમાં તેમની ઝૂટિની નિશાની છે.

પ્રસ્તુત અંથને કલપવૃક્ષની ઉપમા આપી છે. તેની સોણ શાખાઓએ સોણ અધિકારો છે. સમતા, સ્વીમભત્વમોચન, અપત્યમભત્વમોચન, ધ્વનમભત્વમોચન, દેહમભત્વમોચન, વિષયપ્રમાદલાગ, કૃષાયત્યાગ, શાંક્રાંત્યાસ, ચતુર્ણતિદુઃખવર્ણનાધિકાર, અતોનિયંત્ર, વૈરાગ્યોપદેશ, ધર્મશુદ્ધ, ગુરુશુદ્ધ, અતિશિક્ષા, ભિદ્યાત્વાદિનિરોધ, શુભવૃત્તિ અને સામ્યસર્વસ્વ.

આ સોણ અધિકારોની શાંક્રાંતમાં અદ્યાત્મમશાલને શાંત રૂપાધિરાજની ઉપમા આપી છે. હાસ્ય, શૂંગાર, બિલત્સ, રૌદ્ર, કુરણું વિગેરે આડ રૂસો છે પણ તે કરતાં આત્માને મુક્તિ લણી લઈ જનાર નવમો શાંતરસ છે. આ અદ્યાત્મકલપદુમમાં ૨૭૮ શ્લોકા છે. તેનું ભાષાંતર સ્વ. મોતીચંદ્ર ગિરધરલાલ કાપડીઆંગે લગભગ સં. ૧૬૬૫ માં વિવરણ સાથે પ્રકાશિત કરેલું છે. શ્રી જિનન્દ્રસરિના શિષ્ય રંગવિલાસે ભૂળ શ્લોકા ઉપરથી ગુર્જર ભાષામાં ચોપાધ બનાવેલ છે. પ્રસ્તુત અંથની સંસ્કૃતમાં એ ટીકાઓ છે; એક શ્રી ધર્મવિજ્ય ગણિની તથા બીજી શ્રી રનચંદ્ર ગણિની.

પિંગળશાલના અભ્યાસપૂર્વેક ધણું વષેં થયાં કંબિ તરીકે ઘ્યાતિ પામેલા શ્રીયુત દુર્લભજી ગુલાભચંદ્ર મહેતા (વલભીપુરનિવાસી) કે નેમની ઉમ્મર હાલમાં ૭૫ વર્ષની છે અને નેરો અમારા લધુ બ્યાંધુ લાધ જાદુજીના ક્ષમુર થાય છે તેમણે પ્રસ્તુત અદ્યાત્મકલપદુમના સંસ્કૃત શ્લોકા ઉપરથી હરિગીત છેદી બનાવેલા છે. તેમણે મને દુર્લભ

[ १८ ]

કાવ્યક્ષોલ ભાગ બીજાનું આમુખ લખવા કેમ પ્રથમ ગ્રેરણું કરી હતી તેમ આ વખતે પણ એમણે પુનઃ ગ્રેરણું કરી જેથી તેમની વિનાંતિને માન આપી પ્રસ્તુત આમુખ યથામતિ લખેલ છે. શ્રી દુર્લભજ મહેતાના કાવ્યોનો વિકાસ પ્રાચીન વક્ષભીપુર શહેર કે જ્યાં હુરિણુગમૈષી દેવના માનવભવમાં શ્રી દુર્લભિંગણું ક્ષમાત્રમણે શ્રી જિનાગમને પુસ્તકાંદ કર્યા હતા તે હાલના વળાના આમ્યરથાનમાં થયો. હતો અને પૂઠ મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજ મહારાજના કૃપાંદ્ર નિમિત ક્ષરણું અને શ્રી દુર્લભજ મહેતાને આત્મિક-નૈસર્ગિક કાવ્ય શક્તિંદ્ર ઉપાદાનકારણુદ્ધારા નવ રમરણુ, વૈરાગ્યશાંતિક, સમરાદિલ ડેવલી વિગેરે બાર વિભાગેના કાવ્યમય અનુવાદના રચયિતા વિશિષ્ટ કવિ તરફ અભિનંદન આપી, હજુ તેઓ પ્રસ્તુત અધ્યાત્મકલ્પદુમના કાવ્યાનુવાદને તેમની આ વૃદ્ધ ઉમ્મરમાં પણ છેલ્લો નહિ ગણ્યતાં વિશેષપણે કાવ્યાનુવાદ કરવા માટે દીર્ઘાયુથ થાય તેમ ધર્છણી, નીચેનો અધ્યાત્મ સંબંધમાં અધ્યાત્મસાર અથમાં પૂઠ ઉ. શ્રી યશોવિજયજ મહારાજે નિવેદન કરેલો મંગલમય શ્લોક સાદર કરી વિરસું છું.

યેષામધ્યાત્મશાસ્ત્રાર્થતત્ત્વં પરિણતં હૃદિ ।  
કષાયવિષયાવેશકલેશસ્તેષાં ન કર્હિચિત् ॥

“ ને પ્રાણીઓના હુદયમાં અધ્યાત્મશાસ્ત્રના અર્થનું તરતઃ શાન થયું છે તેને કષાયંદ વિષયના આવેગનો કલેશ કદાપિ થતો નથો.”

મુંબઈ.  
સં. ૨૦૦૬ ફાલગુન  
શુક્રવાર્ષિક  
શ્રી ભાડવા તીર્થયાત્રા  
મંગલમય તિથિ.

દેશભૂષણ અવેરકાઈ

## નિવેદન

સહસ્રાવધાની કાલી સરસ્વતિ બિકુદ્ધારક યુગપ્રધાન આચાર્ય  
મહારાજ શ્રી મુનિસુનન્દરસ્રીખરવિરચિત અંદ્યાતમ કલ્પદ્રમનો અંથ પોડશૈ  
દારમાં સંસ્કૃત અસેહ અડોતેર શ્લોકથી ભગ્નપૂર આત્મહિતશિક્ષા જિને દ્વારા  
ભાષીત તત્ત્વના આગમોથી ઉધ્ઘરિને અનાદિ કાળથી ભવભ્રમણું કરતા  
અનિ જીવોના ઉદ્ધાર માટે અનૂપમ અનાવેલ ને તેમનો અમાપ ઉપગાર છે  
અને તેથી તે મહાપવિત્ર મહાત્માના ચરણુકમળમાં ડાડી ડેઢી વંદના છે.

આ અંથ માત્ર સંસ્કૃતના અભ્યાસી જ નાણી શરૂ પરંતુ તેનો  
લાભ ધણા જીવોને પ્રાપ થાય એ હેતુથી સ્વ. સોલીસીટર શાહ મોતી-  
ચંદ્રભાઈ ગ્રન્થલાલે ધણા સમય અગાઉ તેની એ આવૃત્તિ બહાર પાંદેલ  
તેનો સંશેષ ઉપરોગી હોવાથી થઈ જતાં સં. ૧૯૮૮ ની સાલમાં વલાદ-  
વાળા શાહ ખીમચંદ ડેશવલાલે મૂળ અને અર્થ સાથે નાની ઝુકો  
(૧૦૦૦) આર્થિક સહાય મળતા પ્રસિદ્ધ કગવી લેટ આપે.

સદરહુ અંથ અનાદિ કાળનાં ભવભ્રમણ મટાડી આત્મ સન્મુખ  
થવા ખાસ ઉપરોગી નાણી શ્રીમહુ વિજયમહેન્દ્રસ્રોધરજીનો વિચાર થયો  
કે આ ૨૭૮ શ્લોકનો ગુર્જર પદ્યાનુવાદ અનાવી આપનાર મળે તો મૂળ  
ગુર્જર પદ્યાનુવાદ તથા અર્થ સાથે છપાવી તેનો પ્રચાર કરતા ધર્ણો  
લાભ થશે તેથી તેણો સાહેબે મળે ગુર્જર પદ્યાનુવાદ કરી આપવા  
સૂચના કરતાં, મારી ઉમ્મર ૭૫ વર્ષની શરીરસ્થિતિ ધર્ણી જ નથળી  
હોવાથી શરૂઆતે તો હું તો સમજ ગયો કે આ કામ મારી શક્તિ  
બહારનું છે. વળી વખત પણ ફરી ગયેલ હોવાથી મારી મહેનત  
નકામી જય તેમ છે. તેથી તેણોએ ઝુક (૧૦૦૦) માટે સહાયક  
મેળવા આપવા ને ઝુક મેળવવા પ્રયત્ન કરતા મેં અહિં પંન્યાસજ  
મહારાજશ્રી ધર્મસાગરજી તથા અભ્યસાગરજી મહારાજ પદ્યારતા તેણોની  
પાસે વલાદવાળાની નાની ઝુક મેં નેંધ અને તેનો અનુવાદ કરવા જણ્ણાવતા  
કહે કે-આ ઝુક સાંધુ-સાંનીએ માટે નિર્મણ ચાર્નિ પાળવા પળવા  
કાયમ વાંચન કરવાની છે. અમો હાલ વિહારમાં છીએ માટે એ માસમાં  
અનુવાદ અમો કણ્ણાથી મગાવીએ ત્યાં ર્તકાળ પહોંચાડો તો

[ २० ]

આપીએ. મને પણ ભાવના સ્કુરી અને એ માસમાં ૪ સં. ૨૦૦૮ના મહા વદી ૧૩ અનુવાદ તૈયાર કર્યો. આચાર્ય મહારાજશ્રી વિજયમહેન્દ્રસૂરીજ અહિં પદ્ધાર્યો. સાધના સુદર્શાલયવાળાને જોલાની છાપવા પણ આપ્યો. પરંતુ તેજ સાલના ફાગણ વદીમાં બજારમાં ૪૪૫૨૨૦૮ત મંદી આવવાથી રહાયક નિષ્ટળ ગયા અને ત્યારપછી આચાર્ય મહારાજશ્રી અનુવાદ તૈયાર કરાવેલ હોનાથી સં. ૨૦૦૮ની સાલમાં તેઓશ્રીએ ખંભાત રા. રા. શ્રીયુત નીકમલાલ પોપટલાલ અમહાવાદવાળા વાંદવા આવેલા તેમને પ્રેરણા કરી યુક (૩૦૦) નાણસે ખરીદી લેટ આપવા સ્વીકારતા પ્રયાસ વધારે શરૂ ગયતા કપડવંજવાળા સ્વી. શ્રી ચીમનલાલ ડાલ્ખાભાઈ પરીખના ધર્મપત્ની ગંગારવર્ષ્ય માયાએને આચાર્ય મહારાજશ્રીના શિષ્યરલન શ્રીકાન્તવિજયજીએ પ્રતિબોધ કરતા યુક (૭૦૦) સાતસો ખરીદ કરી લેટ આપવાની તેમણે પોતાના સ્વ. પતિના રમરણાર્થે ભાવના જીતાવતા આ યુકની નકલ (૧૦૦૦) પ્રકાશિત થઈ તે આતર તે અને સહાયકોનો હાર્દિક આભાર માનું છું.

આ યુક પ્રથમ સાધના સુદર્શાલયવાળા રા. રા. શાહ ગિરધરલાલ કુલયંદને ઠરાવ કરી આચાર્ય મહારાજશ્રીએ આપેલ તે તેમના મારફત જ મારી દેખરેખ નીચે કામ કરવા સ્વચના કરી અને તેમણે પણ ધર્યી જ કાળજીપૂર્વક બાહેશ પૂર્ણ જોનાર પાસે શોધાની પૂર્ણી મને અહીં વહૃભીપુર મોકલી એર્ડર મળે છાપતા તેમાં શુદ્ધિપત્રક પણ ન મૂકેલું પડે તેટલી કાળજીથી સારા ટાઈપથી ડાંસણીથી તૈયાર કરી તે આતર તેમનો આભાર વ્યક્તા કરું છું. આ પ્રેસના માલીક કાળજીપૂર્વક સારું સરસું કામ પોતાનું ગણીને જ કરે છે એ વાતનો મને અનુભવ હતો જ; વળી વિરોધ થયો; જેથી જેને છપાવવાનું કામ આપવાનું હોય તેમણે તેના સાથે એક વખત કામ પાડવાથી આત્મી થાય તેવો મારો અભિપ્રાય છે.

સદગુ યુકને છપાવવામાં વિલંબ સાંપણો તે પણ સારા માટે જ કારણ તેમાં આચાર્ય મહારાજશ્રીની ગર્ભઅહોતેરીની સંજાય જે અર્થે સાથે છપાણી તે ઉપકારક અની છે. તેમજ દસ દ્રષ્ટાત, નમિગાજ અરીન પણ જોધાયક છે.

આ યુક સાધુ-સાધી જ્યાં મુનિવિહાર કમી હોય તેવા ગામડામાં લેટ મોકલવાથી ધર્યો જ લાભ થવા સંભવ છે.

દિવિ દુર્લ્લભજી ગુલાખ્યંદ મહેતા-વલલીપુર



જન્મ સંવત ૧૯૩૪ ના કાર્તિક શુદ્ધ અગિયારસ (હેવદીવાળી)  
નવરમરણો, શ્રી રત્નાકર પચ્ચિશી, દુમપત્ર, સાર્થ ભવવૈરાગ્યશાતક,  
સમરાદિત્ય ચરિત્ર, આધ્યાત્મકલપદુમના અતુવાદક તેમજ મુનિ-  
મહારાજ શ્રી વૃદ્ધિયંદળ રાસ, ચતુર્વિંશતિ જિન આરતિ મંગળ દીપક,  
દુર્લ્લભ કાવ્ય ફલોલ ભાગ ૧-૨ આદિ ૬ પુસ્તકોના પદ્ધાતમક લેખક.

[ २१ ]

આ બુકમાં સમતા, પંચેદ્રિય ઉપર કાખુ કૃપાયોથી વિરક્ત રહેવા, મન અશ્વપર આત્માનો કાખુ, અંતરશત્રુ આત્મધન લુંટતા તેને ઓળખી નિમિત્ત ચનારાપર રાગ-દ્રોષ ન કરવા અને વિષય-પ્રમાણી હડવા ઉપરેશ આપેલ છે તે ગુજરત કાયમાં હોવાથી તે મોઢે કરનાર આત્માને પણ કાયમ દ્વારાનામાં રહે ઓવે અનુવાહનો આમાં સમાસ હોવાથી તે વાંચનાર મનત વાચન અને નિહિદ્ધાસન કરી આત્મહિતમાં જેટલા આગળ વધે તેટલો અમારો પરિશ્રમ આચાર્ય મહારાજશ્રીની પ્રેરણા અને આર્થિક સહાય કરનાર એઉ સદગૃહસ્થનો પ્રયાસ સર્કણ થયો ગણીશું.

આ બુક તપાસી શાખો આપી રા. રા. શ્રીયુત શાહ ઇતેચંદ જવેરભાઈએ વગોવૃદ્ધ ઉમરે પ્રસ્તાવના (આમુખ) લખી આપેલ છે તે આતર તેમનો અભિનંદન આપવા સાથે આલાર માનીએ છીએ.

વર્તમાન સમયે સાહિત્યને મહદ કરનાર બહુ કમી છે; નહિ તો આવું સાહિત્ય સર્તા ભાવે કે બેટ આપવા પ્રકાશિત કરાવતા જ્ઞાનદાન કરનાર મહાન ઇણ ઉપાર્જન કરે તેમ છે.

હવે આ બુક બેટ મગાવનાર આત્મારી ભવિજીવોએ પુનઃ પુનઃ વાંચી જઈ હિતશિક્ષાએ અમલવમાં સુક્વાવ વિરસિ કરું છું. અનાદિકાળના જરૂર-મરણ જગના દુઃખોથી નિવૃત થવા આ ગ્રંથ ધનવંતરી વૈદ્યના જેવું કામ કરે તેવો છે તે ધ્યાનમાં લઈ અમલવમાં મૂકીશું.

આ ગ્રંથમાં કયાંય સુધારો મૂકવાનું વાંચનારને જરૂરાય તો અમેને સુચના કરતા બીજી આવૃત્તિ વખતે સુધારો મૂકીશું.

વાત દોષ ચિત્તવ્યગતાજી રે, અળ્ણુ લોહી વિકાર;

જીર્ણ શરીર જરા કરે જરે, રહી અગાઉ તૈયાર

સમયમે રે જોયમ મ કર પ્રમાણ.

આ શ્રી મહાવાર જિનનો દુમ્પત્ર અધ્યયનનો બોધ યાદ રાખી શરીરશક્તિમાં આત્મસાધન મેળવવા ખાસ વિરસિત કરી વિરમું છું.

સં. ૨૦૦૯  
બાદપદ પૂર્ણિમા  
વલલલલલલલ

સદગૃહાનુરાગી,  
ફર્જભજ શુક્લાખચંદ મહેતા  
અનુવાદક

## પ્રકાશકનું નિવેદન

આત્મારે જડવાહના જમાનાની અસરને કારણે અધ્યાત્મમની ભૂખ ઉધરતી આવે છે. લોકોમાં આધ્યાત્મિક સાહિલ્ય સારી રીતે વંચાતું જાય છે અને અધ્યાત્મ-સાહિલ્યને સારો આવકાર પણ મળી રહ્યો છે.

પૂજય આચાર્ય મહારાજશ્રી વિજયમહેન્દ્રસૂરીજી મહારાજ આ યુગના શાંતમૂર્તિ અને આધ્યાત્મિક બોધના સારા ઉપદેશક છે. ભાલ્ય આડંબર કે હોડધામ વગર સંયમી જીવન જીવી સાચા ઉપદેશક તરીકે તેઓશ્રીની સુખ્યાતિ છે. સાહિત્યોપાસના તેમનો પ્રિય વિષય છે અને જ્યારે જ્યારે અથું અનુભૂતિ ઉપસ્થિત થાય છે ત્યારે ત્યારે તેઓશ્રી “આધ્યાત્મિક સાહિલ્ય”નું જ પ્રકાશન કરે છે.

થોડા સમય પૂર્વે તેઓશ્રીએ “અધ્યાત્મકદ્વારા”નો હિંદી અનુવાદ પ્રકટ કરાવેલો. ત્યારબાદ ભાલજીનોની સમજણું માટે મૂળ અને તેનો ગુજરાતી અર્થ પ્રકટ કરાવેલો. બાદ તેઓશ્રીને વળાનિવાસી દુલ્હ કવિવર્ણ દુર્લભજીભાઈ ગુલાબચંદ મહેતાનો પરિચય થયો. અને તેના પરિણામે દુર્લભજીભાઈએ એ સંસ્કૃત લોકાનો સમર્પલોકી અનુવાદ કરવાનું સ્વીકાર્યું અને તેના ફલસ્વરૂપ આ પુરતક પ્રકાશમાં આવે છે.

વલલભીપુરનિવાસી શ્રી દુર્લભજીભાઈ મહેતા ભાગવયથી જ કાવ્ય-રસના ગ્રેમી રહ્યા છે, અને આને પોણી સહી વીતાવવા છતાં તેમની કલમ કાવ્યમાં સચોટ રીતે જ ચાલી રહી છે, તે આ અનુવાદ જોવાથી અરિતાર્થ નીવડશે.

[ २३ ]

હુલ્લબળજીએ “હુલ્લબ કાવ્ય કલ્પિત” નામના પુરુષના બે ભાગો પ્રકટ કર્યાં છે તેમજ “નવરમરણ”નો ગુજરાતી પદ્માનુવાદ કરી પ્રચિન્ધ કરેલ છે. તેઓ સંરક્ષારી અને સાહિત્યોપાસક છે. ઉપરાંત નતધારી છે અને સ્ત્રોમાંના જીવનનો વ્યવસાય છે. ટૂંકામાં કહેવું હોય તો કલી શક્તાય ડે-નેવું તેમનું કથન છે તેવુંજ તેમનું જીવન છે.

કાઈપણ કાર્ય આર્થિક સહાયક સિવાય સફળ નીવડતું નથી. આ પુરુષના સહાયકની સહગૃહસથનો આભાર માનવામાં આવે છે.

પ્રાંતે એઠલું જ ધર્મજીએ ડે-મનોવાંચિત પૂર્ણાર કદમ્પવૃક્ષની જેમ આ “અધ્યાત્મમકલ્પદ્રુમ”-કદમ્પવૃક્ષનું પુરુષ વાંચનારને શીતળ છાય આપી સંસારના ત્રિવિધ તાપથી મુક્તા બનાવે.

—પ્રકારાંક



## પ્રકાશકનું નિવેદન

અત્યારે જડવાદના જમાનાની અસરને કાગળે આધ્યાત્મની ભૂજ ઉઘડતી આવે છે. લોકોમાં આધ્યાત્મિક સાહિલ્ય સારી રીતે વચ્ચાતું જય છે અને આધ્યાત્મ-સાહિલને સારી આવકાર પણ મળી રહો છે.

પૂજય આચાર્ય મહારાજાશ્રી વિજયમહેન્દ્રમુણ્ડિ મહારાજ આ યુગના શાંતમૂર્તિ અને આધ્યાત્મિક બોધના સારા ઉપદેશાં છે. આથ આઠંખર કે દોડધામ વગર સંયમી જીવન જીવા સાચા ઉપદેશાં તરીકે તેઓશાની સુખ્યાતિ છે. સાહિત્યોપાસના તેમનો પ્રિય વિષય છે અને જ્યારે જ્યારે પણ પ્રસંગ ઉપસ્થિત ચાય છે ત્યારે ત્યારે તેઓએ “આધ્યાત્મિક સાહિલ્ય”નું જે પ્રકાશન કરે છે.

થોડા સમય પૂર્વે તેઓએ “આધ્યાત્મકદયુગ”નો દિદ્દી અનુવાદ પ્રકટ કરાવેલો. ત્યારણાથ ખાલજીવોની સમજણું માટે સૂચા અને તેનો શુદ્ધજગતી અથૈ પ્રકટ કરાવેલો. યાદ તેઓએને વળાનિવાસી રૂઢ કવિવર્ય હુર્વાલજીભાઈ ગુલાબચંદ મહેતાના પરિચય થયો અને તેના પરિચ્યું હુર્વાલજીભાઈએ એ સંસ્કૃત લોકોનો સમર્થોકી અનુવાદ કરવાનું સ્વીકાર્યું અને તેના ફલસ્વરૂપ આ પુસ્તક પ્રકાશમાં આવે છે.

વલલભીપુરનિવાસી શ્રી હુર્વાલજીભાઈ મહેતા બાળવયથી જ કાવ્ય-રસના પ્રેમી રહ્યા છે, અને આજે પોણી સહી વીતાવવા છતાં તેમની કલમ કાવ્યમાં સચોટ રીતે જ ચાલી રહી છે, તે આ અનુવાદ જોવાથી ચરિતાથી નીવડશે.

[ २३ ]

हुल्लूभज्जभाईजे “हुल्लूभ काव्य कल्पोल” नामना पुस्तकना ऐ आगो प्रकट कर्यां छे तेमજ “नवरमरण” नो गुर्जर पद्धानुवाद करी प्रसिद्ध हरेल छे. तेझो संस्कारी अने साहित्योपासक छे. उपरांत श्रत-धारी छे अने शान-द्वान एवं तेमनो व्यवसाय छे. टूंकामां क्षेत्रुं छाय तो कर्णी शक्तय के-जेतुं तेमनुं कथन छे तेतुं ज तेमनुं अवन छे.

કाम्पिणी कार्य आर्थिक सदायक सिवाय सझण नीवडतुं नथी. आ पुस्तकमां सदायक्तां सद्गुह्यस्थनो आलार मानवामां आवे छे.

ग्रांते ऐटलुं व धर्मजाग्रे के-मनोवाचित पूरनार क्षेत्रक्षेत्री जेम आ “मन्यात्मक्षेत्रम्”—क्षेत्रक्षेत्रनुं पुस्तक वाचनारने शीतण छाय आप्ति संसारना विविध ताप्ति भुक्त बनावे.

—प्रकाशक



# આ.....નુ.....કુ.....મ

વિપય							પૂછ
૧ સમર્પણુ	....	....	....	....	....	....	૩
૨ આ. શ્રી. વિજયહર્ષસૂર્જિલ-ગુરગુણ સેતપદી	....	....	....	....	....	....	૪
૩ આ. શ્રી. વિજયમહેંદ્રસૂર્જિલ-ગુરગુણ પંચવિશ્વતિકા.	....	....	....	....	....	....	૬
૪ આમુખ	....	....	....	....	....	....	૧૧
૫ નિવેદન	....	....	....	....	....	....	૨૦
૬ ગ્રંથાશક્તનું નિવેદન	....	....	....	....	....	....	૨૩
૭ પ્રથમ અધિકાર સમતા	....	....	....	....	....	....	૩
૮ દ્વારીય અધિકાર-ખી મમતવમોચન	....	....	....	....	....	....	૧૮
૯ તૃતીય અધિકાર-અપત્યમમતવમોચન	....	....	....	....	....	....	૨૨
૧૦ ચતુર્થ અધિકાર-ધનમમતવમોચન	....	....	....	....	....	....	૨૪
૧૧ પંચમ અધિકાર-દેહમમતવ મોચન	....	....	....	....	....	....	૨૭
૧૨ ષષ્ઠ અધિકાર-વિષયપ્રમાણ ત્યાગ	....	....	....	....	....	....	૩૨
૧૩ સેતમ અધિકાર-ક્ષયાય ત્યાગ	....	....	....	....	....	....	૩૬
૧૪ અષ્ટમ અધિકાર-શાસ્વામ્યાસ	....	....	....	....	....	....	૪૭
૧૫ નવમ અધિકાર-ચિત્તદમન	....	....	....	....	....	....	૫૫
૧૬ દશમ અધિકાર-વૈરાગ્યોપદેશ	....	....	....	....	....	....	૬૩
૧૭ એકાદશ અધિકાર-ધર્મશુદ્ધિ ઉપદેશ	....	....	....	....	....	....	૭૬
૧૮ દ્વાદશ અધિકાર-દેવ ગુરુ ધર્મશુદ્ધિ	....	....	....	....	....	....	૮૩
૧૯ ત્રૈદશ અધિકાર-યતિ શિક્ષોપદેશ	....	....	....	....	....	....	૮૨
૨૦ ચતુર્દશ અધિકાર-મિથ્યાત્વાદિનિરોધ	....	....	....	....	....	....	૧૨૨
૨૧ પંચદશ અધિકાર-શુભવૃત્તિ શિક્ષોપદેશ	....	....	....	....	....	....	૧૩૨
૨૨ ષોડશ અધિકાર-સામ્ય સર્વર્સ્વ	....	....	....	....	....	....	૧૩૬
૨૩ ગર્ભઅહેંતેરીની સન્જાય	....	....	....	....	....	....	૧૪૧
૨૪ " " નો રૂપધાર્થ	....	....	....	....	....	....	૧૪૫
૨૫ માનવભવતી દુર્લભતાના દ્વારા દર્શાત	....	....	....	....	....	....	૧૫૫
૨૬ નમિરાજવિર્ભિતું સંક્ષિપ્ત વૃત્તાત	....	....	....	....	....	....	૧૫૬

**“ श्री वर्धमान-सत्य-नीति-हर्षसूरि जैन अर्थभासा ” नं. १४**

**अहंम्**

याद्गुल-तपागच्छ-संविभशाखाशृणी-सुविहिताचार्य-श्रीमह-  
विजयहर्षसूरीश्वरसङ्गुरुभ्या नमः

सहस्रावधानी “काली सरस्वति” विश्वदधारक-युगप्रधान  
आचार्य श्री मुनिसुन्दरसूरीश्वरविरचित

## **अध्यात्म-कुण्डलिम्**

**भूग-पद्मानुवाद तथा अर्थ**

**शांतरस-शाइयात-मांगलिक.**

जयश्रीरांतरारीणां, लेभे येन प्रशांतितः ।

तं श्रीवीरजिनं नत्वा, रसः शांतो विभाव्यते ॥ १ ॥

अनुवाद-( हरीगित ७६ )

जेऽये गृत्या अंतरं रिपु, शान्ति पूरणु हित धारता,  
पात्या उत्कृष्ट शास्त्रत लक्षिम, चित्तवृत्ति कण्ठे थता;  
ऐवा प्रखु वीतराणि श्री, महावीरने करी वंहना,  
वृद्धिचंद्र गुडे नभी उशारदा, कहु शान्त रसनी भावना. १

“ ने श्री वार्लगवाने अंतरंग शत्रुओंनी जय लक्ष्मी उत्कृष्ट  
शांतिथी भेणवा छे, ते परमात्माने नमस्कार करीने शान्त रसनी भावना  
करवामां आवे छे. ”

अनुष्टुप्

अनुपम सुभ्यना कारणुभूत शान्त रसनो उपदेश.

सर्वमंगलनिधौ हृदि यस्मिन्, संगते निरूपमं सुखमेति ।

मुक्तिशर्म च वशीभवति द्राक्, तं बुधा भजत शांतरसेद्रम् ॥२॥

१ रीपु-शत्रु. २ वृद्धिचंद्र भगवान्नश्री. ३ शारदा-सम्प्रवति.

: २ :

આધ્યાત્મ-

સર્વ ભાગલિકનો નિધાન, એવો શાન્ત રસ હૃદયે ઠરે,  
તેઓ અનૂપમ સુખ આ, સંસારમાં સહેજે વરે;  
વળીં શાશ્વતા સુખ મોક્ષના, તેઓ તુરત કથને કરે,  
હે પંડિતો ! એ શાંત રસ, સેવો બન્ને લાવે ખરે. ૨

“ સર્વ ભાગલિકનો નિધાન એવો શાંતરસ જેના હૃદયમાં પ્રાસ થાય  
તે અનૂપમ સુખ પામે છે અને મોક્ષનું સુખ એકદમ તેના કથળમાં  
આવી જાય છે. હે પંડિતો ! એવા શાન્ત રસને તમે બન્ને સેવો—  
ભાવો ”. ૨

આ અંથના સોળ દ્વારે.

સ્વાગતાવૃત્તમ

સમતૈકલીનચિત્તો, લલનાપત્યસ્વદેહમમતામુક् ।

વિષયકષાયાદ્વશઃ, શાસ્ત્રગુરૌર્દમિતચેતસ્કઃ ॥ ૩ ॥

વૈરાગ્યશુદ્ધધર્મા, દેવાદિસતત્ત્વવિદ્વિરતિધારી ।

સંવરવાનું શુભમૃત્તિઃ સામ્યરહસ્યં ભજ શિવાર્થિન् ॥૪॥ યુગ્મમુ

મોક્ષાર્થી પ્રાણી લિન ચિત્ત, સમતા હૃદયમાં ધારને,

ખ્રી-પુત્ર, લક્ષ્મી-શરીરની, ભમતા સહ્ય નિવારને;

વર્ષું, ગંધ, રસ, સ્પર્શ પંચાદ્રિય, વિષયથી વિરામને,

કોધ-માન-માયા લોભવશ, પડતા ન આતમરામને.

ધરી શાસ્ત્રરૂપ લગામ ૧૫૨, મન રેચ્ય કથને રાખને,

સર્વ વિરતિ ડે દેશ વિરતિમાં રહી, આત્મહિત વધારને;

શુદ્ધ હેવ ગુરુ ધર્મ સ્વરૂપ જાણી, વિરતિ દ્વિતિમાં લાવને,

શુદ્ધ વૃત્તિ સંવર ભાવ ધરી, સમતા હૃદયમાં ભાવને. (૩-૪)

“ હે મોક્ષાર્થી પ્રાણી ! તું સમતા ઉપર લીન ચિત્તવાળો થા;  
ખ્રી, પુત્ર, ચૈસા અને શરીર ઉપરથી ભમતા છોડી હે; વર્ષું, ગંધ,  
રસ, સ્પર્શ વિગેર ધરીયોના વિષયો અને કોધ, માન, માયા અને લોભ

૧ કરું-હાથ. ૨ અશ્વ-દ્વારાને.

-५६५-

: ३ :

ऐ धर्मोने वक्ष था नहि; शास्त्रेऽप लगाम वडे तारा भनइप अस्ते  
तुं कायुमां राख. वैश्ये करीने शुद्ध निष्कलंक धर्मवान् था ( साहुना  
क्षय अतिधर्म अने श्रावकनां आर व्रत तेमज्ज आत्मगुणोभां चमणुता  
करवाइप शुद्ध धर्मवाणो था.) हेव युद्ध धर्मतुं शुद्ध स्वदृप जाणुनारो  
था; सर्व प्रकारना सावध योग्यी निष्पत्तिःप विरति धारणु कर,  
( सतावन प्रकारना ) संवेदवाणो था; तारी वृत्तिओने शुद्ध राख अने  
समताना रुद्धस्यते तुं जज्ज. ” ३-४ आर्यवित्त

प्रथम अधिकार समतालावना आवना भाटे भनने उपहरा.

**चित्तबालक ! मा त्याक्षीरजस्तं भावनौषधीः ।**

**यत्त्वां दुर्ध्यानिभूता, न छलयन्ति छलान्विषः ॥ ५ ॥**

हे चित्तइप आणक ! सदा शुल, भावना हिल राखने,  
अे भावनाइप औषधे, समता तणुं करा आणने;  
दुर्ध्यानिइप भूत पिशाचो, करीने छेतरे,  
सावध रही दूर काढता, ज्ञाताय नहिं तेथी अने. ५

“ हे चित्तइप आणक ! तुं भावनाइप औषधिओने हमेशां दूर  
कराश नहिं; जेथी करीने कराने शोधनारा दुर्ध्यानिइप भूत पिशाचो तने  
छेतरी शक्षे नहिं.” ५ अनु॒द्गुप्त

ईदियोनां सुभ-समतानां सुभ.

**यदिंद्रियार्थैः सकैः सुखं स्यान्नरेद्वचक्रित्रिदशाधिपानाम् ।**

**तद्विंदवत्त्वेव पुरो हि साम्यसुधांबुधेस्तेन तमाद्रियस्त्व ॥६॥**

य कवती ते भूयती, हेवेना स्वामी ईन्द्रने,  
सर्व धन्दियना अर्थार्थी, सुभ सांपडे जेवु भने;  
१ जलधिमां जिन्हु तुव्य ए, समता तणुं सुभ आणणे,  
भाटे ज समता सुभनो, आहर करो सहु २पणे पणे. ६

१ जलधि-समुद्र. २ पणे पणे-घडीओ घडीओ, समय-समय.

i x i

અદ્યાત્મ-

“રાજ ચક્રવર્તી અને દેવોના સ્વામી ઈશ્વરને સર્વ ઈદ્રિયના અથેથી જે સુખ થાય છે તે સમતાના સુખસમુદ્ર પાસે ખરેખર એક વિષુદ્ધ તુલ્ય છે, માટે સમતાના સુખને આદર.” ૬ ઉપેક્ષાવણાવતા

संसारिक ज्ञनां सुख-यतिनां सुख.

अदृष्टवैचित्र्यवशाज्जगज्जने, विचित्रकर्माशयवाग्विसंस्थुले ।  
उदासवृत्तिस्थितचित्तवृत्तयः, सुखं श्रयंते यतयः क्षतार्तयः ॥७॥

પુષ્ય પાપના વિચિત્રપણુંને, જગત જીવ આધીન છે,  
મન વચ્ચેન કાય વ્યાપારમાં, અસ્થિર મન અતિ લીન છે;  
ચિત્ત દૃષ્ટિ માધ્યમથી લાવથોડી, મનની પીડાઓ ને તજે,  
તેવા યતિઓ આ સુસ્થિત્વમાં, ખરેખરા ઝુખને લઙ્જે. ૭

સમતા સુખ અનુભવવાનો ઉપદેશ.

विश्वजंतुषु यदि क्षणमेकं, साम्यतो भजसि मानस मैत्रीम् ।  
 तत्सुखं परममत्र परत्राप्यश्वेषे न यदभूत्वं जातु ॥८॥  
 हे भन ! तुं सहु प्राणी पर, क्षणवार समता लावशे,  
 परहित चिन्ताइप मैत्री, लावना दिल लावशे;  
 तो आ लवे ने परस्वे तुं, सुख अनूपम पामशे,  
 ए सुख पामशे अेहुं, जे कहि नहि अनुभूयुं हुशे. ८

“હે મન ! તું સર્વ પ્રાણી ઉપર સમતાપૂર્વક એક કણું વાર પણ પરહિતચિત્તાદ્ય મૈત્રીભાવ લાગિશ તો તને આ લવ અને પર-

१ सुष्टि-जगत्,

-ક ૬૫ દુઃમ

: ૫ :

ભવમાં એવું સુખ મળશે કે જેવું તેં કદિ પણ અતુલભ્યું હશે  
નહિ." ૮

સ્વાગતાવૃત્તા

## સમતાની ભાવના તેનું દર્શિન.

ન યસ્ય મિત્ર ન ચ કોડપિ શત્રુર્નિજઃ પરો વાપિ ન કથનાસ્તે ।

ન ચેંદ્રિયાર્થેષુ રમેત ચેતઃ, કષાયમુક્ત પરમઃ સ યોગી ॥૧॥

જેને નહિ ડોઈ મિત્ર કે, નહિ શત્રુ દ્વિલમાં ખટકતા,

તેમ જ પોતાના કે પરાયા, ડોઈને નથી માનતા;

વિરક્ત જેહ કષાયથી, નહિ રક્ત પંચેન્દ્રિય વિષયમાં,

તેવા જનોને મહાનું યોગી, જાણવા આ જગતમાં. ૬

"જેને ડોઈ પણ મિત્ર નથી અને ડોઈ પણ શત્રુ નથી; જેને ડોઈ  
પોતાનો નથી અને ડોઈ પાંડો નથી; જેનું મન કષાયરહિત હોઈને  
ઇદ્વિયાના વિષયમાં રમણું કરતું નથી, તેવો પુરુષ મહા યોગી છે." ૮

ઉપેક્ષવળા

## સમતાના અંગો-ચાર ભાવના.

મજસ્વ મैત્રી જગદંગીરાશીષુ, પ્રમોદમાત્મન ગુणિષુ ત્વશોષતઃ ।

મવાર્તિદીનેષુ કૃપારસં સદાપ્યુદાસવૃત્તિ ખલુ નિર્ગુણેષ્વપિ ॥૧૦॥

હે આત્મનુ! જગતનું સહુ પર, રાખ મैત્રી ભાવના,

સંતોષ વૃત્તિથી નિરખજો, સર્વ શુણો ગુણુવાનના;

અથ ભ્રમણુમાં પિડાયલા, જીવો પર કરણું લાવુણો,

માધ્યસ્થ ભાવ નિહાળતા, નિર્ણાણી પણ નિભાવજો. ૧૦

"હે આત્મનુ! જગતના સર્વ જીવો ઉપર મैત્રીભાવ ધારણું કર;  
સર્વ ગુણુવાન પુરુષો તરફ સંતોષદિશી જો. ભાવ(સંસાર)ની પીડાથી  
દુઃખી થતાં પ્રાણીઓ ઉપર કૃપા રાખ અને નિર્ણાણી પ્રાણીઓ ઉપર  
ઉદ્ઘાસવૃત્તિ-માધ્યસ્થભાવ રાખ." ૧૦.

વંશસ્થવૃત્તાં.

: ૬ :

અધ્યાત્મ-

ચાર ભાવનાનું સંક્ષિપ્ત સ્વરૂપ.

મैત्रી પરस્મિન् હિતથિઃ સમગ્રે, ભવેત્પ્રમોદો ગુણપ્રશ્પાતઃ ।  
કૃપા ભવાર્તે પ્રતિકર્તુમીહોપેક્ષાવ માધ્યસ્થ્યમવાર્યદોષે ॥૧૧॥

હિત ખુદ્ધિ થીજા સહુ જીવો પર, એ જ મैત્રી ભાવના,  
રહે ગુણનો પક્ષપાત, પ્રમોદ ભાવ ચિત ભાવતા;  
ભાવ ઔષધે કર્ણણાવડે, હેરાન જીવ ણાવતા,  
ઉદાસીનતા નિર્ગુણી પર, માધ્યસ્થ્ય ચોથી ભાવના. ૧૧

“થીજાં સર્વ પ્રાણીઓએ ઉપર હિત કરવાની ખુદ્ધિ તે (પ્રથમ)  
મैત્રી ભાવના; ગુણનો પક્ષપાત તે (થીજી) પ્રમોદ ભાવના; અવરૂપ  
વ્યાધિથી હેરાન થતાં પ્રાણીઓને ભાવઅ૔ષધથી સારુ કરવાની છંચા!  
તે (થીજી) કૃપા ભાવના; ન ટળી શકે તેવા દોષવાળા પ્રાણી ઉપર  
ઉદાસીનભાવ તે (ચોથી) માધ્યસ્થ્ય ભાવના.” ૧૧.      ઉપજાતિ.

ઉક્ત ચાર ભાવનાન્યોનું હુરિઅદસ્તુરિકૃત તૂર્યાધિકારાનુસાર સ્વરૂપ.

પરહિતચિત્ત મैત્રી, પરદુઃखવિનાશિની તથા કરુણા ।  
પરસુખતુષ્ટિમુદિતા, પરદોષોપેક્ષણમુપેક્ષા ॥ ૧૨ ॥

હિત ચિન્તવે થીજા જીવોનું, એ જ મैત્રી ભાવના,  
ચિન્તા પરાયું હુઃખ હરવા, કર્ણણ હૃદયમાં આવતા;  
આનંદ પરાયા સુખમાં, થીજી પ્રમોદ એ ભાવના,  
ઉપેક્ષા પરાયા દોષની, માધ્યસ્થ્યભાવ નિલાવતા. ૧૨

“(આત્મવિનિરીક્તા) થીજાં પ્રાણીઓનું હિત ચિંતવું તે મૈત્રી  
ભાવના; પારકાં હુઃખોનો નાશ કરવાની છંચા અથવા ચિતા તે કર્ણણ  
ભાવના; થીજાઓનાં સુખને લોઈ આનંદ પામવો તે પ્રમોદ ભાવના  
અને થીજાઓનાં દોષાની ઉપેક્ષા કરવી તે ઉપેક્ષા ભાવના.” ૧૨  
આર્થિકા

-કુ ૬૫ કુ ૮

: ૭ :

પ્રથમ મૈત્રીભાવનાનું સ્વરૂપ.

મા કાર્યોલ્કોપિ પાપાનિ, મા ચાભૂત્કોપિ દુઃખિતઃ ।  
મુચ્યતા જગદ્ધ્યેષા, મતિર્મત્રી નિગદ્યતે ॥૧૩॥

કોઈ પ્રાણીં પાપ કરે નહિ, નહિ દુઃખ પામે કોઈએ,  
આ જગતના પ્રાણી સહુ, કર્મથી મુક્તા જોઈએ;  
હિત બુદ્ધિ આવી હૃદય ઉપર, આવતા પિછાનીએ,  
એ પ્રથમ મૈત્રી ભાવના, સંસારમાંછે જાણીએ. ૧૩

“કોઈ પણ પ્રાણી પાપ કરે નહિ, કોઈ પણ જીવ દુઃખી થાએ  
નહિ, આ જગત કર્મથી મુક્તાએ-આવી બુદ્ધિને મૈત્રી કહે છે.” ૧૩  
અનુષ્ટુક્તિવિના

દ્વિતીય પ્રમોદ ભાવનાનું સ્વરૂપ.

અપાસ્તાશોષદોષાણાં, વસ્તુતત્ત્વાવલોકિનામ् ।

ગુણેષુ પક્ષપાતો યઃ, સ પ્રમોદઃ પ્રકીર્તિતઃ ॥૧૪॥

હોષે સકળ નિવારી, વસ્તુ તત્ત્વને જે જાણુતા,  
ઉદ્દ્વાસ પ્રગટે હૃદય પર, એવા જીવો પીછાણુતા;  
પક્ષપાત પણ તેનો કરે, ચેખી ગુણો ગુણવાનના,  
તો જાણું ૧જચી હૃદયમાં, ઐજુ પ્રમોદ એ ભાવના. ૧૪

“જેમણે સર્વ હોષે દૂર કર્યો છે અને વસ્તુતત્ત્વને જેણો જોઈ રહ્યા  
છે તેણોના ગુણ ઉપર પક્ષપાત તે પ્રમોદ ભાવના કહેવાય છે.” ૧૪  
અનુષ્ટુક્તિવિના

તૃતીય કર્દણા ભાવનાનું સ્વરૂપ.

દીનેષ્વાર્તેષુ ભીતેષુ, યાચમાનેષુ જીવિતમ् ।

પ્રતિકારપરા બુદ્ધિઃ, કારુણ્યમભિધીયતે ॥ ૧૫ ॥

૧ જચી-રચી-દિલમાં ઉતરી.

10

અધ્યાત્મ-

અશક્ત હુઃખીયા ભયવડે, વ્યાકુળ જીવો નીહાળતા,  
જીવિતંધને યાચનાર જીવો, દૃષ્ટિ સંમુખ ભાળતા;  
તેવા જનોના હુઃખ દળવા, બુદ્ધિ ને દ્વિલ થાય છે,  
જાણો! કર્દણ્ણા ભાવના, ત્રીજ એ રીત ગણ્ણાય છે. ૧૫

“ અશક્ત, દુઃખી, અથથી વ્યાકુળ થગેલા અને જીવિતબ્યને યાચનાર પ્રાણીઓ ઉપર તેઓનું દુઃખ ટાળવાની જે ઝુક્કિ તે કઢ્યા ભાવના કહેંચાય છે.” ૧૫

અનુભૂતિ

ચૈથી માધ્યરથ લાવનાનુ' સ્વરૂપ.

क्रूरकर्मसु निःशंकं, देवतागुरुनिर्दिष्टु ।

आत्मशंसिषु योपेक्षा, तन्माध्यस्थ्यमुदीरितं ॥ १६ ॥

નિન્હા કરે ગુડ હેવની, નિજ આત્મ શ્રલાધા જે કરે,  
જરા અંચુકો ખાધા વગર, જે કુરુ કામો આહદે;  
કર્મ આધીન જાણ્યો ઉપેક્ષા, તેહની દિલ આણુવી,  
માધ્યસ્થ લાવે ચિત રહે, અતુર્થ લાવના જાણુવી. ૧૬

“કોઈ પણું પ્રકારના આંચદા વગર કૂરું કર્મ કરનારા, હવે અને ગુરુની નિંદા કરનારા અને આત્મહીલાધા કરનારા પ્રાણુંઓ તરફ ઉપેક્ષા તે માધ્યરથ(અથવા ઉદ્ઘાસીનતા)લાવના કહેવાય છે.” ૧૬ અનુષ્ટુલ

सभतानुं थीजुं साधन-ईद्रियना विषये। पर सभता.  
चेतनेतरगतेष्वसिलेषु, स्पर्शरूपरवगंधरसेषु ।

साम्यमेष्यति यदा तत्र चेतः,

पाणिं शिवसुखं हि तदात्मन् ॥ १७ ॥

ਫੇ ਚੇਤਨ ! ਸਾਰੀ ਚੇਤਨ, ਅਚੇਤਨ ਪਹਾੰਥਿਨੇ ਭਾਗਤਾ, ਸਪਈ-ਦ੍ਰਿਪ-ਦਵਰ-ਗਾਂਧੀ-ਰਸਮਾਂ, ਚਿਤ ਤੁੰ ਜ ਲਿਖਵੀਨ ਥਤਾ;

ପ୍ରକାଶକ

一〇

તત્ત્વ જ્ઞાનથી જ્ઞાણી અનિયત, પદ્ધતિ સમતા લાવશે,  
ત્યારે જ તારા હાથમાં, શ્રીવસુભ સહેલે આવશે. ૧૭

“હે ચેતન ! સર્વ ચેતન અને અચેતન પદાર્થમાં રહેલાં સ્પર્શ,  
ઝ્ય, ઝવ (શબ્દ), ગંધ અને રૂસમાં તાડ ચિત્ત સમતા આણશે ત્યારે  
મોક્ષનું સુખ તારા હાથમાં આવી જશે.” ૧૭ સ્વાગતાવત.

આત્મરિક્ષા-વિચાર કરવાની જરૂરિયાત.

समताप्राप्तिवृं श्रीगुं सावन.

के गुणास्तव यतः स्तुतिमिच्छ-स्यद्भुतं किमकृथा मदवान् यत् ।  
कैर्गता नरकभीः सुकृतैस्ते, किं जितः पितृपर्तिर्यदचिन्तः ॥१८॥

તારામાં શુણો કયા એહવા, સ્તુતિની આશા રાખતો,  
કર્યું કામ આશ્વર્યકારી શું? માન મનમાં લાવતો;  
ભીતિ મટી ગઈ નારકીની, સુકૃત શું? એવો થયો,  
જીત્યો શું? તે યમરાજને, ચિન્તા વગરનો થઈ ગયો. ૧૮

“તારામાં કયા ગુણો છે કે તું સુતિની છંદળ રાખે છે? તેં શું આશર્વદારી મોટું કાર્ય કર્યું છે કે તું અહંકાર કરે છે? (તારા) કયા સુકૃત્યોથી તારી નરકની બીજી મટી ગાઈ છે? તેં શું વમને જીત્યો છે કે નેથી તું ચિત્તા વગરનો થઈ ગયો છે?” ૧૮ સ્વાગતાવત.

ଶାନ୍ତିନୁ ଲକ୍ଷ୍ମୀ.

गुणस्त्रैयो गुणिनां परेषा-माक्रोशनिदादिभिरात्मनश्च ।

**मनः समं शीलति मोदते वा, खिद्येत च व्यत्ययतः स वेत्ता ॥१९॥**

જ્યારે થીજી ચુણવાનના, ચુણુંની કોઈ સ્તુતિ કરે, અન્ય માણુસો આકોશથી, નિંદા પોતાની ઉચ્ચરે;

## ૧ શાંતિસુખ-મોક્ષના સુખ.

: १० :

अर्थात्-

स्थितिस्थापक भन राखता, राज रहे ए अवसरे,  
स्वस्तुति निन्दा पारडी, सुणी ऐह सहजानी करे. १६

“भीज गुणवान् प्राणीओना गुणुती रहति करे त्यारे अने अन्य  
आणुसो पोता पर आकेश उरे अथवा पोतानी निंदा करे ते वर्खते जे  
पोताना भनने स्थितिस्थापक राखे छे अथवा ते वर्खते जे आनंद  
पामे छे; अने तेथी उलटी वात भनतां (अटले परगुणुनिंदा अथवा  
आभप्रशंसा थतां) जे ऐह पामे छे ते प्राणी जानी-गुणकार  
करेवाय छे.” १६

उपनिषद्.

पोताना शत्रु भिन्न-स्वपर ओणभवाने। उपदेश.

न वेत्सि शत्रून् सुहृदश्च नैव, हिताहिते स्वं न परं च जंतोः ।  
दुःखं द्विषन् वांछसि शर्म चैत-निदानमृदः कथमाप्स्यसीष्टम्॥२०॥

हे आत्मन्! तारा शत्रू के, भिन्नने नहि जाणुतो,  
तारुं हित के अहित करनारुं, शुं छे! ते नहि रपिषाणुतो;  
पोताना के परथी अज्ञान, हुःभ पर द्वेषे अणे,  
धृच्छ! धरे सुख भाभवा, धृच्छत वस्तु केम भणे? २०

“हे आत्मन्! तुं तारा शत्रु अने भिन्नने ओणभतो नथी. तारुं  
हित करनारुं अने अहित करनारुं शुं छे ते जाणुतो नथी, अने तारुं  
पोतानुं अने पारकुं शुं छे? ते जाणुतो नथी. (वणी) तुं हुःभ पर  
द्वेष करे छे अने सुख भेणववाने धृच्छे छे, पणु तेनां कारणो नहि  
जाणुतो डोवाथी तुं ते धृच्छत वस्तु केवा रीते भेणवाश? ” २०  
उपेंद्रवणावता.

वस्तु अहं उरथा पहेलां विचार करवानी ४३२.  
कृती हि सर्वं परिणामरम्यं, विचार्य गृह्णाति चिरस्थितीह ।  
भवान्तरेऽनन्तसुखासये त-दात्मन्! किमाचारमिमं जहासि? ।२१।

१ स्व-पोतानी डोध रहति करे. २ रपिषाणुतो-ओणभतो.

-કુદ્યુ મ

: ૧૧ :

ડાદ્યાજનો આ જગતમાં, વિચાર પુષ્ટળ ડેળવે,  
સુન્દર બસ્તુ દીર્ઘકાળ ચાલે, એહવીં એ મેળવે;  
હે ચેતન ! ત્યારે પછી અનંત, સુખ પરસ્પરે થવા,  
ધાર્મિક આચારે વિશેષે, કેમ લાગ્યો ત્યાગવા ? ૨૧

“આ લોકમાં જે ડાદ્યા માણુસ હોય છે તે વિચાર કરીને એવા  
બસ્તુ અદ્યા કરે છે કે જે લાંબો વખત સુખી ચાલે તેવી અને પરિણામે  
સુંદર હોય. ત્યારે હે ચેતન ! આ ભન પછી અનંત સુખ મેળવવા  
માટે આ ધાર્મિક આચારને તું કેમ તળ હે છે ? ” ૨૧ ઉપનાતિ.

રાગદ્રોષના કરેલા વિલાગ પર વિચારણા.

નિજઃ પરો વેતિ કૃતો વિભાગો, રાગાદિભિસ્તે ત્વરયસ્તવાત્મન ! ।  
ચર્તુર્ગતિક્લેશવિધાનતસ્તત, પ્રમાણયબ્રસ્યરિનિર્મિતં કિમ્ ? ॥૨૨॥

હે ચેતન ! રાગદ્રોષના, ૧વિલાગ થા તું પિછાનતો,  
આ તારું પોતાનું આ પરાયું, દ્વિધો કરીં દ્વિલ માનતો;  
ચારે ગતિ અનેક પ્રકારે, કલેષ ક્રેષ કરાવતો,  
શત્રુ ભરા એ એળાખી કરે, કણુલ કેમ રઠરાવતો. ૨૨

“હે ચેતન ! તારું પોતાનું અને પાગકું એવો વિલાગ રાગદ્રોષે  
કરેલો છે; ચારે ગતિમાં તને અનેક પ્રકારનો કલેશ કરાવતા હોવાચી  
રાગદ્રોષ તો તારા શત્રુએ છે—ત્યારે શત્રુઓએ કરેલો વિલાગ તું કેમ  
કણુલ કરે છે ? ” ૨૨ ઉપનાતિ.

૧ એ લાગ પાડેલા રાગદ્રોષના તને એળાખવા. ૨ પછી તેના  
કરેલ ઠરાવને શા માટે મંજૂર રાખે છે ?

: १२ :

अध्यात्म-

आत्मा अने वीज वस्तुओंना संभव पर विचारणा।  
 अनादिरात्मा न निजः परो वा, कस्यापि कथित रिषुः सुहद्वा ।  
 स्थिरा न देहाकृतयोऽणवश्च, तथापि साम्यं किमुपैषि नैषु? ॥२३॥

आत्मा अनादि शाश्वतो, पर के पेतानुं न तेष्वने,  
 तेभ्य शत्रु के भित्र पशु, जगमां न कोई ज्वेष्वने;  
 अंग आकृतिमां रहेला, परमाणुं अस्थिर जाणुता,  
 तो पशु समता तेष्वमां, केम राखवा न पिछाणुता? २३

“आत्मा अनादि छे, कोई ज्वेतानुं नथी अने कोई पार्दुं  
 नथी; कोई शत्रु नथी अने कोई भित्र नथी; हेष्वनी आकृति अने (तेभां  
 रहेला) परमाणुओं रिथर नथी तो पशु तेमां तुं समता केम राखतो  
 नथी?” २३

उपज्ञानिति.

हुवे भातापिता वजेदेनो संभवं डेवो छ ते क्षेत्रे छे.

यथा विदां लेघ्यमया न तच्चात्, सुखाय मातापितृपुत्रदाराः ।  
 तथा परेऽपीह विशीर्णतत्त्व- दाकारमेतद्वि समं समग्रम् ॥२४॥  
 चित्रे दल्ला भाता पिता पुत्र, स्त्री सुख आपे नहीं,  
 प्रत्यक्ष भात पिताहिंडे पशु, एते रीते जाणु सही;  
 आकार नाश थता बेउनो, वास्तविक सुख कुण्ठु करे?  
 भाटेज समक्तिं लुवो, दृढ़भुद्धि धर्म विषे धरे. २४

“जेवा रीते चित्रमां आलेखेलां भाता, पिता, पुत्र अने स्त्री  
 वास्तविक रीते समजु प्राणीने सुख आपतां नथी तेवाज रीते आ  
 संसारमां रहेलां अलक्ष भातापिताहिंडे पशु सुख आपतां नथी. ते  
 अन्नेनो आकार नाश पामतां ते अने सरभांज छे.” २४ उपज्ञानिति.

-५६५ दु भ

: १३ :

सभताने शोणभनारानी संघ्या.

जानन्ति कामान्निखलाः संसङ्गाः, अर्थं नराः केऽपि च केऽपि धर्मम्।  
जैनं च केचिद् गुरुदेवशुद्धं, केचित् शिवं केऽपि च केऽपि साम्यम्॥

सर्वं संज्ञी काम जाणु, केऽपि अर्थने पथु जाणुता,  
धर्म जाणुता तेथी कभी, जैन धर्म कभी पिछाणुता;  
शुद्ध देव शुद्धयुक्त धर्म, कभी भोक्षसुखने जाणुता,  
तेथी कभी अहु १ अल्प प्राणी, सभतानुं सुख पिछाणुता. २५

“सर्वं संसावाणा आणीयो ‘काम’ने जाणु छे, तेमांथी डेटलाक अर्थ—  
(धनग्राहित)ने जाणु छे, अने तेमां पथु डेटलाक ज धर्मने जाणु छे;  
तेमांथी डेटलाक ज जैन धर्मने जाणु छे; अने तेमांथी अहु थोडा  
शुद्धदेवयुक्त जैन धर्मने जाणु छे; तेमां पथु अहु थोडा प्राणी  
भोक्षने शोणभे छे अने तेथी पथु अहु थोडा प्राणीयो सभताने  
शोणभे छे.” २५

धृश्वणा.

सगासंभंधीयोनो स्नेह स्वार्थी छे; तेथी पोताना स्वार्थी—  
साधनमां रक्त रहेवुं ए सभतानुं चोथुं साधन.

स्त्रियन्ति तावद्दि निजा निजेषु, पश्यन्ति यावन्निजमर्थमेभ्यः ।  
इमां भवेऽत्रापि समीक्ष्य रीतिं, स्वार्थे न कः प्रेत्यहिते यतेत ॥२६॥

सगां संभंधीयो पोतानो, स्वार्थं ज्यां सुधी सरे,  
ज्यां सुधी ए स्नेहने, तेयोना उपर शयम करे;  
आ भवमां आवी रीतरसमो, दृष्टिमां ज्यारे तरे,  
परभव हितकारी स्वार्थनो, उप्रयत्न डेणु न आहरे? २६

१ अल्प-थोडा. २ रसम-चालवापथु. ३ परभवमां थता पोताना  
हितने डाणु न आहरे?

198

અધ્યાત્મ-

“સગાસંખ્યાઓ જ્યાં સુધી પોતાના સગાઓમાં કાઈ પણું પોતાનો સ્વાર્થ જુઓ છે લાં સુધીજ તેના પર રનેહ રાએ છે; આ ભવતમાં પણ આવા પ્રકારની રીત જોઈને પદ્ભવમાં હિતકારી પોતાના સ્વાર્થ માટે ઝાણ થતન ન હરે ? ” ૨૬ ઉપનિષિત.

પૌર્ણાલિક પદાર્થની અસ્તિથરતા-સ્વમ ફર્હિન.

स्वमेद्रजालादिषु यद्वदासै-रोषश्च तोषश्च मुधा पदार्थः ।  
तथा भवेऽस्मिन् विषयैः समस्तै-रेवं विभाव्यात्मलयेऽवधेहि ॥२७॥

સ્વમ કે ઈન્ડબાળ પ્રાસ થયેત, પદાર્થજવ્હી વિષુસે, આ લવ પદાર્થ મળેલ નહિ, પરલોક સાથે આવશે; તો પછી એતો રેખ મળતા, વિષુસત્તા નકારું હિલ ચણે, વિચારપૂર્વક જાણી તત્પર, આત્મ-સમાધિમાં રહે. ૨૭

“જેવી રીતે સ્વમ અથવા ઈર્દગળ વિગેરેમાં પ્રાપ્ત થયેલા પદાર્થી પર રોષ કરવો કે તોષ કરવો તે તહીન નક્કમો છે તેવી રીતે આ ભવમાં પ્રાપ્ત થયેલા પદાર્થી ઉપર પણ (રોષ કરવો કે તોષ કરવો તે નક્કમો છે). આવી રીતે વિચાર કરીને આત્મસમાધિમાં તત્પર થા.” ૨૭ ઉપનિષાટ.

मरणे पर विचारः भमत्वनुं वास्तविक स्वदृपे.

एष मे जनयिता जननीयं, बंधवः पुनरिमे स्वजनाश्च ।

द्रव्यमेतदिति जातममत्वो, नैव पश्यसि कृतांतवशत्वम् ॥२८॥

માતા પિતા આ માહરા, આ બન્ધુ મારા થાય છે,  
સગા સંખ્યા આ માહરા, આ ધન મારું રહાય છે;  
મમત્વ એ રીત રાખતો, તેમાંજ નિત્ય હરખાય છે,  
પણ યમને આધીન રહેલો, વિચાર એ ન જણાય છે. ૨૮

१ तोष-भुश थवुं. २ रोष-नाराज थवुं.

-६५ दुर्भ

: १५ :

“આ મારા પિતા છે, આ મારી માતા છે, આ મારા બાઈઓ છે,  
વળી આ મારા સગા રનેકીએ છે, આ મારું ધન છે, એ પ્રમાણે તને  
મમતન થયો છે અને તેથી તારું યમને વશપણું છે, તે તો તું જેતો જ  
નથી.” ૨૮

સ્વાગતા!.

વિષય ૫૨ મોહુ-તેનું ખરું સ્વરૂપ-સમતા આદરવાને ઉપદેશા.

નો ધનૈ: પરિજનૈ: સ્વજનેર્વા, દેવતઃ પરિચિતૈરપિ મંત્રૈ: ।  
રક્ષયતેત્ત્ર ખલુ કોડપિ કતાંતા-નો વિભાવયસિ મૂઢ! કિમેવ? ૨૯  
તૈર્ભવેઽપિ યદહો સુખમિચ્છં-સ્તસ્ય સાધનતયા પ્રતિભાતૈ: ।  
મુદ્દસિ પ્રતિકલં વિષયેષુ, પ્રીતિમેષી ન તુ સામ્યસતત્ત્વે ॥૩૦॥

સગાં ઠંડાલાંએ અને, નોકર ચાકર ધન આદિમાં,  
રક્તા દેવતાએ તેમ જ, પરિચિત થતા મંત્રાદિમાં;  
હે અદ્યપજ્ઞ પ્રાણી! મરણુસમયે, એ નહિ જ ઉગારતા,  
આવો વિચાર હૃદ્ય વિષે, તમે કેમ નથી વિચારતા?

એ સંબંધી નોકર ચાકર ધન, મોહને આધીન થતા,  
સંસારમાં સુખ પામવા, એહિ જ સાધન જાણુતાં;  
પ્રત્યેક ક્ષણે વિષયમાં, સુંઝાઈ દિલ નહિ આણુતા,  
સમતા રૂપ ખરા રહસ્યને, નહિ પ્રેમથી પિણાણુતા. ૨૯-૩૦

“ધન, સગાંઠાલાંએ, નોકરચાકરો, દેવતાએ અથવા પરિચિત  
મંત્રો, ડેર્ઘ પણ યમ(મરણ)થી અહીં રક્ષણું કરતું નથી. હે અદ્યપજ્ઞ  
પ્રાણી! તું આ પ્રમાણે વિચાર કેમ નથી કરતો? સુખ મેળવવાનાં  
સાધન તરીકે હેખાતા તેએ (ધન, સગા, નોકર વિગેર) વડે સંસારમાં  
સુખ મેળવવા છચ્છતા હે ભાઈ! તું પ્રત્યેક ક્ષણે વિષયોમાં સુંઝાઈ  
નથી છે, પણ સમતારૂપ ખરા રહસ્યમાં પ્રીતિ પામતો નથી.”

સ્વાગતાવૃત્તા.

: १६ :

અધ્યાત્મ-

કૃપાયનું ખર્દું સ્વરૂપ-તેના ત્યાગનો ઉપદેશ.  
કિં કષાયકલુણ કુરુષે સ્વં, કેષુ ચિન્નનુ મનોરિધિયાત્મન् !  
તેજપિ તે હિ જનકાદિકરૂપૈ-રિષ્ટતાં દધુરનંતમબેષુ ॥૩૧॥

હે આત્મન ! તું કેષ્ક લુલ પર, શનુષુદ્ધિ શીદ ધરે ?  
આ રીતનો કૃપાય રાખી, ભલિન તું મનને કરે;  
માતા પિતા વિવિધ રૂપે, પ્રીતિ અનંતી એ પામતા,  
અનંત ભવ સંબંધ જાણી, રાખવી ચિત્તપ્રસન્નતા. ૩૧

“હે આત્મન ! કેટલાક આણુઓ ઉપર શનુષુદ્ધિ રાખીને તું તારાં  
મનને શા સારું કૃપાયથી ભલિન કરે છે ? (કારણ કે) તેઓ ભાતપિતા  
વિગેર રૂપોમાં તારી પ્રીતિ અનંતા ભવોમાં પામ્યા છે.” ૩૧ સ્વાગતાવૃત્તા.

શોકનું ખર્દું સ્વરૂપ-તે ત્યાગ કરવાનો ઉપદેશ.  
યાશ્ચ શોચસિ ગતાઃ કિમિમે મે, સ્નેહલા ઇતિ ધિયા વિધુરાત્મા ।  
તैર્ભવેષુ નિહતસ્ત્વમનંતે-ષ્વેત તેજપિ નિહતા ભવતા ચ ॥૩૨॥

મરી જતા નિજ સ્નેહીઓ, વ્યાકુળ થઈને શીદ કરે ?,  
મહામોહથી તસ વિરહને, તું શોક અંતરમાં ધરે;  
હણાયદો તેના વડે તું, અનંત ભવમાં રખડોતો,  
તારા વડે પણ એ હણાયેલ, શનુભાવે ભાળો. ૩૨

“શું આ મારા સ્નેહીઓ (મરી) ગયા !” આ પ્રમાણે બુદ્ધિથો  
વ્યાકુળ થઈને જેઓને મારે તું શોક કરે છે તેઓ વડેજ તું અનંત  
ભવોમાં હણાયેલો છે અને તેઓ પણ તારા વડે હણાયા છે. ૩૨  
સ્વાગતાવૃત્તા.

મોહ ત્યાગ-સભતામાં પ્રવેશ.

ત્રાતું ન શક્યા ભવદુઃખતો યે, ત્વયા ન યે ત્વામએ પાતુમીશાઃ ।  
મમત્વમેતેષુ દધન્યુધાત્મન !, પદે પદે કિં શુચમેષિ મૂढ ! ॥૩૩॥

-ક ૬૫ કુ મ

: ૧૭ :

સ્નેહિજનો ભવથી બચાવા, શક્તિ નહિ તુજમાં જરી,  
તેમ જ તને ભવભ્રમણુથી, નહિ તારતા તેઓ ધરી;  
હે મૂઢ આતમન! મમત્વ, રાખી તેઓની ઉપરે,  
પગલે પગલે તું શોક રાખી, મોહમાં ફરતો ફરે. ૩૩

“જે સ્નેહીઓને ભવદુઃખથી બચાવવાને હું શક્તિવાનું નથો અને  
જેઓ તને બચાવવાને શક્તિવાળા નથી તેઓ ઉપર ખોટા મમત્વ  
રાખીને હે મૂઢ આતમન! હું પગલે પગલે શા સારું શોક પામે છે?” ૩૩.  
ઉપનાતિ.

સમતાદ્વારનો ઉપસંહાર :: રાગ-દ્રેષ્ટયાગનો ઉપદેશ.

સચેતનાઃ પુદ્રલપિંડજીવા, અર્થાઃ પરે ચાણુમયા દ્વયેડપિ ।  
દ્રેષ્ટયનંતાનું પરિણામભાવાસ્તવેષુ કસ્તવ્રહૃતિ રાગરોષૌ ॥૩૪॥

પુદ્રાલ પિંડ અધિકિત જીવો, સચેતન ગણ્યાય છે,  
પરમાણુમય અર્થ વિગેરે, અચેતન જણ્યાય છે;  
એ બેઉં જાત પદાર્થી, અનેક પર્યાય-પલટન કરે,  
લાયક કોણ ગણ્યાય? કરવા રાગ-દ્રેષ્ટ તે ઉપરે. ૩૪

“પુદ્રાલ પિંડને અધિકિત જીવો સચેતન પદાર્થી છે અને પરમાણુ-  
મય અર્થ(ચૈસા) વિગેરે અચેતન પદાર્થી છે; આ બન્તે જાતિના પદાર્થી  
અનેક પ્રકારના પર્યાયભાવ-પલટનભાવ પામ્યા કરે છે, તેથી તેના  
ઉપર રાગદ્રેષ્ટ કરવાને કોણ લાયક ગણ્યાય?” ૩૪.                   ઉપનાતિ.

પ્રથમ અધિકાર સમાપ્ત.

: १८ :

अध्यात्म-

## अथ द्वितीय स्त्रीभमत्वमेऽनाधिकार.

पुरुषने गणे भांधेली शिला.

**मुह्यसि प्रणयचारुगिरासु, प्रीतिः प्रणयिनीषु कृतिस्त्वम् ।  
किं न वेत्सि पततां भववाद्दों, ता नृणां खलु शिला गलबद्धाः ॥१॥**

“हे विद्वन् ! स्नेहवश स्त्री, वाणीमां मधुरता लागती,  
प्रीति थता तेना उपर, ते भोगवृद्धि पमाइती;  
पणु भवसमुद्रमां बूडता, प्राणी रडे पिछाणुतो,  
स्त्री गणे भांधेली पथ्थर, समान शुं नथी जाणुतो ?” १

“हे विद्वन् ! ने स्त्रीओनी वाणी स्नेहथा तते मधुर लागे छे  
तेना उपर प्रीतिथा तुं भोग पाने छे, पणु भवसमुद्रमां पडतां  
प्राणीओने तेओ। गणे भांधेला पथ्थर (जेवा) छे गेम शुं जाणुतो  
नथी ?” २

स्वागतावृत्त.

## स्त्रीओमां रहेली अरभणुप्रियता.

**चर्मास्थिमज्जात्रवसास्तमासा—मेध्याद्यशुच्यस्थिरपुद्रलानाम् ।  
स्त्रीदेहपिंडाकृतिसंस्थितेषु, स्कंधेषु किं पश्यसि रम्यमात्मन् ! ॥२॥**

स्त्री अंगपिंडनी आकृतिमां, रहेला पेझे चामडी,  
पणु हाडका चरणी आंतरडा, मेहथी लरी जडी;  
रुधिर विष्टा भांस अपवित्र, अस्थिर पुहङ्गले,  
हे आत्मन् ! ए समूहमांडे, शुं सुन्दरता जुञ्चे ?” २

“स्त्रीना शरीरपिंडनी आकृतिमां रहेला चामडी, हाडका, चरणी,  
आंतरडा, मेह, लोही (रुधिर), भांस, विष्टा विगेरे अपवित्र अने  
अस्थिर पुहङ्गलेना समूहमां हे आत्मन् ! तुं सुन्दर शुं जुञ्चे छे ?” २  
ईश्वरज्ञा.

-५६५ कु भ

: १६ :

अपवित्र पदार्थीनी हुर्गधी. स्त्रीशरीरने। संभव.  
विलोक्य दूरस्थमेध्यमल्पं, जुगुप्ससे मोटितनासिकस्त्वं ।  
भृतेषु तेनैव विमूढ योषा-वपुःषु तत्कि कूरुषेऽभिलाषम् ? ॥३॥

हे भूर्भु ! दूर रहेल जरा, हुर्गध तुज्जने आवता.  
हुर्गंछा करे ए वस्तुनी, पैण्डी नाक भयेडता;  
तेवी ज हुर्गधे भरेली, स्त्रीओना अंगमां,  
अभिलाषा करे शा डारणे ? नेह उपरना रंगमां. ३

विशेष विवेचन भीज अने त्रीज भाथानुं साथे छे.

“हे भूर्भु ! दूर रहेली जरा पण हुर्गधी वस्तु नेह तु नाक  
मरडीने हुर्गंछा करे छे; त्यारे तेवी ज हुर्गधीथी भरेलां स्त्रीओनां  
शरीरनी तु डेम अभिलाषा करे छे ? ३ धृष्टिवज्ञा.

स्त्रीभेषाहुथी आ भवमां परभवमां थतां इणोनुं दर्शन.  
अमेध्यमांसास्ववसात्मकानि, नारीशरीराणि निषेवमाणाः ।  
इहाप्यपत्यद्रविणादिर्चितातापान् परत्र प्रति दुर्गतीश्च ॥४॥

विष्णा भांस ने अरण्डी, विगेरे भरेला अंगथी,  
अवी स्त्री प्राणी सेवता, संसारमां ने रंगथी;  
ते पुत्र लक्ष्मीनी चिन्ताना, तापथी ज तवाय छे,  
वणी परभव स्त्रीभेष वधता, हुर्गति लध जाय छे. ४

“विष्णा, भांस, रुधिर अने अरण्डी विगेरथा भरेलां स्त्रीओनां  
शरीरने सेवनारा प्राणीओ। आ भवमां पण पुत्र अने पैसा विगेरती  
चितानो ताप पामे छे अने परभवे हुर्गतिमां जाय छे.” ४ उपज्ञाति.

स्त्री शरीरमां शुं छे ? ते विचारवानी ज़र.

अंगेषु येषु परिषुहसि कामिनीनां,  
चेतः प्रसीद विश च क्षणमंतरेषां ।

: २० :

अध्यात्म-

## सम्यक् समीक्ष्य विरमाशुचिपिंडकेभ्य-

### स्तेभ्यश्च शुच्यशुचिवस्तुविचारमिच्छत् ॥५॥

हे चित ! स्त्रीओना अंग पर, भोष्टु तु जे आणुतु, पणु प्रसन्न थै अपेक्षा करौ, था अंग एह पिण्डाणुतु; पवित्र अपवित्र वस्तु विवेक, पूर्वक थातु जाणुतु, तो तो अशुचि ठगलाथी, नक्की थाय तु विरामतुः । ५

“ हे चित ! तुं स्त्रीओनां शरीर उपर भोष्टु पामे छे; पणु तुं ( अस्वस्थता भूझाने ) प्रसन्न था, अने जे अंगो उपर भोष्टु पामे छे ते अंगोमां प्रवेश कर. तुं पवित्र अने अपवित्र वस्तुना विचार- ( विवेक)ती धृष्टा राखे छे तेथी अग्राह यारी राते विचार कराने ते अशुचिना ठगलाथी विराम पाम.” ५ वसंततिलक्षा.

**क्षविष्यनी पीडाओ** विचारीने भोष्टु एछो करवो.

**चिमुद्द्वसि स्मेरहशः सुमुख्या, मुखेक्षणादीन्यभिवीक्षमाणः ।**  
**समीक्षसे नो नरकेषु तेषु, मोहोद्भवा भाविकदर्थनास्ताः ॥६॥**

वौक्सित योवन वय सुन्दर, अंग नेत्र मुख ज्ञेयने, थाने आधौन थाय प्राणी, स्त्री उपर भडु भोडीने ? लविष्यमां उत्पन्न थनारी, पौडाने नहि जाणुतो, स्त्रीना अतिशय भोष्टमां, था, नरक पौडा पिण्डाणुतो. ६

“ विक्सित नयनवाणी अने सुंदर मुखवाणी स्त्रीओनां नेत्र, मुख विगेर ज्ञेय तुं भोष्टु पामे छे, पणु तेना भोष्टने लाघे लविष्यमां उत्पन्न थनारी नरकनी पीडाओने डेम जेतो नथो ? ” ६ उपनाति.

**स्त्रीशरीर, स्वल्पात्म अने लोगङ्कणातुं २४३५.**

**अमेध्यमस्ता बहुरंगनिर्यन्मलाविलोघत्वकुमिजालकीर्णा ।**  
**चापल्यमायानृतवंचिका स्त्री, संस्कारमोहान्नरकाय भुक्ता ॥७॥**

-६५ हु भ

: २१ :

विष्टा लरेली चामडानी, क्लेथणी स्त्री ज्ञाणुवी,  
ज्ञु छिद्रोथाँ निकणता भणवडे, भलिन एहु पिछाणुवी;  
उत्पन्न कीडावडे व्याप्त, मायामृषावाहे भरी,  
पूर्व संस्कार-भोडे लोगवे, नरक गति जवा ठरी. ७

“विष्टाथी लरेली चामडानी क्लेथणी, ज्ञु छिद्रोभांथी नीकणता भण-  
(मुन्र-विष्ट)था भलिन (गोनिमां) उत्पन्न थता कीडाओथी व्याप्त,  
चपणता, माया अने असत्य (अथवा मायामृषावाह)थी ठगनारी  
ओवी स्त्रीओ पूर्व संस्कारना भोडथी नरकमां जवा सारु ज भोग-  
वाय छे.” ७

ललनाभभत्वभोग्यनद्वारने। उपसंहार अने स्त्रीनी हीन उपभेद्यता।  
निर्भूमिर्विषकंदली गतदरी व्याधि निराहो महाव्याधि-  
मृत्युरकारणश्च ललनाऽनभ्रा च वज्राशनिः ।

वंधुस्नेहविघातसाहसमृषावादादिसंतापभूः,  
प्रत्यक्षापि च राक्षसीती बिरुदैः ख्याताऽऽगमे त्यजयताम् ॥८॥

भूमि वगर विष वेळडी, स्त्री, वाधणु शुक्रा वगरनी,  
आकाशविषु स्त्री विज्ञणी, व्याधि ननाभी लगरनी;  
माया मृषा साहसभरी, करावे क्लेश अन्धु स्नेहमे,  
प्रत्यक्ष राक्षसी स्त्री तजे, उपनाम रेखाभ्या आगमे. ८

“(स्त्री) भूमि वगरनी (उत्पन्न थेक्की) विषनी वेळडी छे, शुक्रा  
वगरनी वाधणु छे, नाम वगरनो भेटो व्याधि छे, क्लारणु विनानुं  
भृत्यु छे, आकाश वगरनी विज्ञणी छे, सगां अथवा लाईओना स्नेहनो  
नाश, साहस, मृषावाह विजेरे संतापेनुं उत्पत्तिस्थान छे अने प्रत्यक्ष  
राक्षसी छे,—आवां आवां उपनामे स्त्रीओ माटे आगमभां आपवाभां  
आव्यां छे, माटे तेने तजु हो.”

शार्दुलविक्षिडित.

द्वितीयव्याध्याय समाप्ते.

---

१ नाम वगर भेटी व्याधि. २ शास्त्रमां उपनामा उपनामे वर्णवी छे.

: २२ :

અધ્યાત્મ-

अथ तृतीयोऽपत्यममत्वमोचनाधिकारः

पुत्रपुत्री षष्ठ्यन् छे तेतुं दर्शन्.

मा भूरपत्यान्यवलोकमानो, मुदाकुलो मोहनपारिणा यत् ।  
चिकिप्सया नास्कचारकेऽसि, दृढं निबद्धो निगडैरमीभिः ॥१॥

तुं पुत्र पुत्री ऐખીने અતિ, હર्षધેલો થાય છે ?  
કારણું અનાદિકાળથી, એહ મોહશનુ ઠગાય છે;  
પુત્ર પુત્રીઝ્ય લોઢાની થેડી, મજબૂત ણાંધતા,  
ઇચ્છા ધરાવો મોહ નરકઝ્ય, બંદિખાને નાખતા. १

“તું પુત્ર પુત્રીને જોઈનિ હર્ષધેલો થા મા, કારણ કે મોહરાજ  
નામના તારા શત્રુઓ તને નરકઝ્ય બંદિખાને નાખવાની ઇચ્છાથી આ  
( પુત્રપુત્રીઝ્ય ) લોઢાની એડોડે તને મજબૂત ણાંધો છે.” १ ઉપમાતિ.

पुत્રપુત્રી શલ્યઝ્ય છે તેતુं દર्शન.

આજીવિતं જીવ ભવાન્તરે�પિ વા,

શલ્યાન્યપત્યાનિ ન વેત્સિ કિં હૃદિ  
ચલાચલૈયે વિવિધાર્તિ દાનતો-

અનિશં નિહન્યેત સમાધિરાત્મનઃ ॥ २ ॥

હે ચેતન ! પુત્ર પુત્રી આ ભવ, પરભવે પણ શલ્ય છે,  
નથી જાણુતો તું કેમ ! તારા મનવડે ૧અદ્યપજ છે;  
થોડી અગર વધુ ઉમ્મર સુધી, જીવી એ પૌડા કરે,  
અનેક પ્રકારે એ રીતે, તું જ આત્મસમાધિને હુરે. २

“હે ચેતન ! આ ભવમાં અને પરભવમાં પુત્રપુત્રી શલ્ય છે, એમ  
તું તારા મનમાં તેમ નથી જાણુતો ? તેણો થોડી અથવા વિશેષ ઉમ્મર

૧ અદ્યપજ-થોડા શાનદારો.

-६५ दु भ

: २३ :

सुधी ज्ञाने तते अनेक प्रकारनी भीड़ करी तारी आत्मसमाधिनो  
नाश करे छे।”

**आक्षेपद्धारा पुनरभवत्य त्यागनो उपदेश।**

**कुक्षो युवत्याः कृमयो विचित्रा, अप्यस्तशुक्रप्रभवा भवन्ति ।**  
**न तेषु तस्या न हि तत्पतेश, रागस्ततोऽयं किमपत्यकेषु ? ॥३॥**

पुरुषनुं वीर्यं स्त्री रक्तनो, संणांधं बेहुनो थता,  
स्त्रीयोनिमां विचित्रं प्रकारना, कीडाओ उपज्ञता;  
तेना उपर ए उलयनो, थतो राग नहि ज्ञाय छे,  
त्यारे पछी पुत्रो उपर शा सारु राग णांधाय छे? ३

“पुरुषनुं वीर्यं अने स्त्रीनुं रक्त-ते अननेना संयोगथी स्त्रीनी  
योनिमां विचित्रं प्रकारना कीडाओ उपज्ञ थाय छे; तेना उपर स्त्रीनो  
उ तेना पतिनो राग थतो नथी, त्यारे पुत्रो उपर शा सारु राग  
थाय छे?” ३

**अपत्य पर स्नेहुभूंधन थवानां त्रषु कारण्या।**

**त्राणाशक्तेरापदि संबंधानंत्यतो मिथोऽगवताम् ।**

**संदेहाच्चोपकृतेर्मापत्येषु स्निहो जीव ॥ ४ ॥**

आपत्तिमां पालन करवा, ज्यारे अशक्ति ज्ञायाय छे,  
हौर्धकाण ज्ञवनो परस्पर, संणांधं पणु हेखाय छे;  
अहलो उपकारनो वाणवा, संहेड उपज्ञतो भने,  
हे ज्ञव! तुं पुत्र पुत्री परनो, स्नेह तज कहिये तने. ४

“आपत्तिमां पालन करवानी अशक्ति होवाथी, प्राणीओनो दरेक  
प्रकारनो परस्पर संणांधं अनंत वअत थयेलो होवाथी अने उपकारनो  
अहलो वाणवानो संहेड होवाथी हे ज्ञव! तुं पुत्र पुत्राहि पर स्नेहवालो  
था भा.” ४

आर्या.

**तृतीय अधिकार समाप्त.**

• 28 •

અદ્યાત્મ-

अथ चतुर्थो धनममत्वमोचनाधिकारः

पैसा पापना हेतुभूत छ.

याः सुखोपकृतिकृत्यधिया त्वं, मेलयन्नसि रमा ममताभाक् ।  
पाप्मनोऽधिकरणत्वत एता, हेतवो ददति संसृतिपातम् ॥१॥

ભરણુપોવણુ નિજ સુખ માટે, ધનની લાતચ થાય છે,  
શક્તિ એ વૃદ્ધિ પામતા, ઉપકાર બૃદ્ધિ રખાય છે;  
લક્ષ્મી અધિકરણ હોવાથી, પાપ હેતુભૂત ગણ્યાય છે,  
સંસાર-ભ્રમણ કરાવનારી, મોહ આર્ધીન થાય છે. ૧

“ લક્ષ્મીની લાકયમાં લેવાગેલો હું (સ્વ) સુખ અને ઉપકારની બુદ્ધિથી જે લક્ષ્મી મેળવે છે તે અધિકરણું હોવાથી પાપની જ હેતુભૂત છે અને સંસારભમણને આપનારી છે.” ૧ સ્વાગતાવત.

થન એહિક અને આમણિક દ્વારા કરેતાર છે.

यानि द्विषामप्युपकारकाणि, सपौन्दुरादिष्वपि वैर्गतिश्च ।  
शक्या च नापन्मरणामयाद्या, हन्तुं धनेष्वेषु क एव मोहः ॥२॥

શત્રુને પણ ઉપકાર કરનારું, દ્રવ્ય ને થઈ પડે,  
સર્વ ઉદ્દર તિર્યાં આહિ, ગતિ થાય છે જેના વડે;  
મૃત્યુ રોગ આદિ આપત્તિ ડોય, ટાળવા શક્તિ નથી,  
‘સયું’ જગતમાં ઓહવા, પૈસા ઉપરના મોહથી. ૨

“જે ચૈસા શત્રુને પણ ઉપકાર કરનારા થઈ પડે છે, જે પૈસાથી સર્વ, ઉદ્દ્ર. વિગેરેમાં ગતિ થાય છે, જે ચૈસા મરણ રોગ વિગેરે ક્રાઇધ પણ આપત્તિએ હુર કરવાને શક્તિવાન નથી તેવા ચૈસા ઉપર મોહ શો ? ” ૨

## १ संयुक्त शब्द का मत।

-કે ૬૫ હું અ

: ૨૫ :

ધનથી સુખ કરતાં દુઃખ વચ્ચારે છે.

મમત્વમાત્રેણ મન:પ્રસાદ-સુખં ધનૈરલ્પકમલ્પકાલમ् ।

આરંભપાપૈઃ સુચિરં તુ દુઃખં, સ્યારુગતૌ દારુણમિત્યવેહિ ॥૩॥

આ મારું દ્વય વિચારતા, પ્રકુલ્પિત મનમાં થાય છે,  
વળી દ્વયથી થોડા વખતના, સુખને ય પમાય છે;  
આરંભ પાપના કાર્યથી તે, દુર્ગતિ લઈ જાય છે,  
અને જાણું લાંબો વખત, દુઃખ જાયંકરાય છે. ૩

“ આ પૈસા મારા છે એવા વિચારથી મન પ્રસાદઃપ થોડું અને  
થોડા વખતનું સુખ પૈસાથી થાય છે, પણ આરંભના પાપથી દુર્ગતિમાં  
લાંબા વખત સુધી જાયંકર દુઃખ થાય છે; આ અમાણે તું જાણું. ” ૩  
ઉપજાતિ.

ધર્મ નિભિતે ધન મેળવવું યુક્ત છે ?

દ્રવ્યસ્તવાત્મા ધનસાધનો ન,

ધર્મોऽપि સારંભતયાતિશુદ્ધઃ ।

નિ:સંગતાત્મા ત્વતિશુદ્ધયોગાત्,

મુક્તિશ્રિયં યच્છતિ તद્ભવેઽપि ॥૪॥

દ્વય સ્તવ સ્વરૂપવાળો, ધનથી ધર્મ સધાય છે,  
આરંભ યુક્ત હોવાથી તે પણ, શુદ્ધ અતિ ન મનાય છે;  
નિ:સંગતા સ્વરૂપવાળો, અતિ શુદ્ધ ધર્મ ગણ્યાય છે,  
તેનાવડે વળી તે જ જ જવમાં, મોક્ષલક્ષમો પમાય છે. ૪

“ ધનના સાધનથી દ્વયસ્તવ સ્વરૂપવાળો ધર્મ સાધી શક્યા છે, પણ  
તે આરંભયુક્ત હોવાથી અતિ શુદ્ધ નથી; જ્યારે નિસંગતા સ્વરૂપવાળો  
ધર્મ અતિશુદ્ધ છે અને તેથી તે જ જવમાં પણ મોક્ષલક્ષમી આપે છે.” ૪  
ધીર્દ્વજા.

આ શ્રીકૈતલાસરમાગરજરાજિ

: २६ :

અધ્યાત્મ-

મળેલ ધનનો વ્યય ક્યાં કરવો ?

ક્ષેત્રવાસ્તુધનધાન્યગવાશૈ-મેલિતૈઃ સનિધિમિસ્તનુભાજામ् ।  
ક્ષેત્રપાપનરકાભ્યધિકઃ સ્યાત્કો ગુણો ન યદિ ધર્મનિયોગઃ ॥૫॥

મળેલ કે મેળેલ વસ્તુ, ધન ધાન્ય ગાય ૧૦થ ધરે,  
બાંડાર આહિ વસ્તુઓ, જે ધર્મ કાને ન વાપરે;  
તે પણી કલેશ હુઃખ અને, પાપ એથી પમાય છે,  
અને નરક ગતિથી વધારે, ગુણ અવર શું થાય છે ? ૫

“ મળેલાં અથવા મેળેલાં ક્ષેત્ર, વરતુઓ (ધર. વિગેર) ધન, ધાન્ય,  
ગાય, દોડા અને બાંડારનો ઉપયોગ જે ધર્મ નિમિત્તે ન થાય તો તેથી  
કલેશ (હુઃખ), પાપ અને નરકથી બીજે શો વધારે ગુણ થાય ? ” ૫  
સ્વાગતાકૃતઃ.

ધનથી થતી અતેક પ્રકારની હુનિ, તેને તજી દેવાનો ઉપહેશ.  
આરંભૈર્મરિતો નિમજ્જતિ યતઃ પ્રાણી ભવાંભોનિધા-  
વીહંતે કુનૃપાદયશ્ પુરુષા યેન ચ્છલાદ્વાધિતુમ् ।  
ચિંતાવ્યાકુલતાકૃતેશ્ હરતે યો ધર્મકર્મસ્મૃતિં,  
વિજ્ઞા ! ભૂરિપરિગ્રહ ત્યજત તં ભોગ્યં પરૈઃ પ્રાયશઃ ॥૬॥

આરંભ પાપના ભારથી, ભવસમુદ્ર પાણી બૂડતા,  
ધન પરિથિતે નૃપતિ આહિ, છિદ્ર જેઠ હુઃખ આપતા;  
આકુળાયાકુળ કાર્યવૃદ્ધિએ, ધર્મકાર્ય નહિ અને,  
અવર ઉપયોગી દ્રોઘ એ, તજવા કહું પંડિતને. ૬

“ આરંભના પાપથી ભારે થયેલો ગ્રાણી જે ધનને લાઘે સાર-  
સમુદ્રમાં ઝૂપે છે, જે ધનના પરિગ્રહથી રાજ વિગેર પુરષો છિદ્ર જેઠને

૧ ગય-હાથી.

—કુદ્યુ કુભ

: ૨૭ :

હુઃખ હેવાને છચ્છે છે, અનેક ચિત્તામાં આકુળબ્યાકુળ રાખીને જે પૈસા ધર્મજ્ઞાર્થ કરવાતું તો યાદ આવવા હેતા જ નથી, અને ધર્ષે ભાગે જે ખારડાના જ ઉપલોધમાં આવે તેવા એ પૈસાના મોટા સંગ્રહને પંડિતો !  
તમે તળ હો. ” ૬ શાર્દૂલવિકીડિત.

સાત ક્ષેત્રમાં ધન વાપરવાનો ઉપહેશ.

ક્ષેત્રેષુ નો વપસિ યત્સરદાપિ સ્વમેત

દ્યાતાસિ તત્પરભવે કિમિદં ગૃહીત્વા ।

તસ્યાર્જનાદિજનિતાઘચયાર્જિતાતે,

માવી કર્થ નરકદુઃखભરાચ મોક્ષઃ ॥ ૭ ॥

સાત ક્ષેત્રમાં વપરાય નહિં, દ્રોધ એ શા કામતું ?  
નથી સાથ પરખવ આવતું, વિચાર કર તમામ તું;  
મેળવેલ આરંસે દ્રોધના, પાપ જ્યારે જાગશો,  
નારકી ગતિ હુઃખે પોડાતો, મોક્ષ ક્યારે પામશો ? ૭

તારી પાસે દ્રોધ છે છતાં પણ તું (સાત) ક્ષેત્રમાં વાપરતો નથી,  
ત્યારે શું પરખને ધનને તારી સાથે લઈ જવાનો છે ? વિચાર કર કે  
પૈસા મેળવવા વિગેરથી થયેલા પાપસમૂહથી મેળવેલાં નારકીનાં  
દુઃખોથી તારો મોક્ષ (શુટકારો) કેમ થશો ? ૭ વસંતતિલકા

ચાયો અધિકાર સમાપ્ત.

અથ પંચમો દેહમમલમોચનાધિકારઃ ।

શરીરને પાપથી પોષતું નહિં.

પુણાસિ ય દેહમધાન્યર્ચિતયં-

સ્તવોપકારં કમય વિધાસ્યતિ ।

: २८ :

अध्यात्म-

**कार्मणि कुर्वन्निति चितयायति,**

**जगत्ययं वंचयते हि धूर्त्तराद् ॥ १ ॥**

निज अंग पेषण्यु कास्ये, विचारते। नथी पापने,  
ऐ शरीर तारा उपर, करनारुं शुं उपकारने ?  
ऐ शरीरनी रक्षा निभिते, कर्म डिसाहिक उरे,  
भाविकाण विचार कर प्राणी ! अंग धूतारु १छतरे. १

“ पापने अणुविचारते जे शरीरने तुं गोषे छे ते शरीर तारा  
उपर शुं उपकार करते ? (तथी ते शरीर भाटे डिसाहिक) कर्मो करतां  
आवता काणनो विचार कर. आ शरीरइप धूतारो प्राणीने हुनियामां  
छतरे छे. ” १

**शरीर-कारागृहमांथी धूतवानो उपहेश.**

**कारागृहाद्विधाशुचितादिदुःखा-**

**निर्गंतुमिच्छति जडेऽपि हि तद्विभिष ।**

**क्षिप्तस्तोऽधिकतरे वपुषि स्वकर्म-**

**व्रातेन तद्रददयितुं यतसे किमात्मन् ! ॥ २ ॥**

अशुचि आहि हुःअ भरेलुं, अंहिखानुं भूरभा तजे,  
आकरुं मणेल निज कर्मथी, अंहिखानुं शीढ अन्जे ?  
मज्जूत विशेषे अेह करवा, प्रयत्नो शाने करे ?  
ऐ अंहिखानुं त्रुटी जता, आत्म सुख शाखत वरे. २

“ भूर्भ प्राणी हेय छे ते पण्यु अनेक अशुचि विग्रे हुःभाथी  
भरेलां अंदीभानाने भांगीने अहार नीकणी जवा छच्छा शाखे छे. तारां  
पेतानां कर्मो वडे ज तेथी पण्यु वधारे आकरा शरीर-अंदीभानामां तुं  
नंभायो छे छतां ते अंदीभानाने वधारे मज्जूत करवा शा सारु धत्न  
करे छे ? ” २

**वसंततिलका.**

१ छतरे-ठगे.

-५६५-

: २४ :

शरीर साधनथी करवा योग्य कर्त्तव्य प्रेरणा।  
 चेद्वांछसीदमवितुं परलोकदुःख-  
 भीत्या ततो न कुरुषे किमु पुण्यमेव ।  
 शक्यं न रक्षितुमिदं हि न दुःखभीतिः ।  
 पुण्यं चिना क्षयमुपैति च वज्रिणोऽपि ॥ ३ ॥

परब्रह्म थनारा हुःभक्तयर्थी, अन्याववा निज अंगने,  
 विचार आवतो होय तो, आहर पुण्यप्रसंगने;  
 आ शरीर केाधि वडे, पोषी शक्तय तेवुं नथी,  
 पुण्य विनानी हुःअ भीक, अणगी न जाणु। ईन्द्रथी. ३

“जे तु तारा शरीरने परब्रह्मां थनारा हुःअना लयथी  
 अन्याववा ईच्छतो होय तो पुण्य शा भाटे करतो नथी? आ शरीर  
 (केाधि वडे पणु) पोषी शक्तय तेवुं नथी; ईद जेवाने पणु पुण्य वगर  
 हुःअनी भीक नाश पाभती नथी.” ३ वसंततिक्षा.

देहाश्रितपञ्चाथी हुःअ, निरालंभनत्वमां सुअ.  
 देहे विमुद्य कुरुषे किमधं न वेत्सि,  
 देहस्थ एव भजसे भवदुःखजालम् ।  
 लोहाश्रितो हि सहते घनघातमग्नि-

वाधा न तेऽस्य च नभोवदनाश्रयत्वे ॥ ४ ॥  
 आ अंग उपर भोड धरीने, पाप तुं शाने करे?  
 तेमां रह्या संसारना हुःओ, उपज्ञता जे अरे;  
 अभि क्षेत्रामां होय तो, धरणुना प्रहारे खाय छे,  
 आकाश सम आश्रयरहित, तेनी पीडा सुकाय छे. ४

“शरीर उपर भोड करीने तुं पाप करे छे, पणु तने अपर नथी  
 ते संसारसमुद्रमां हुःओ अभवां पडे छे, ते शरीरमां रह्यो छे तेथी ४

: ३० :

अध्यात्म-

पामे छे. अभि लोढामां रखो होय छे त्वां सुधीज उथेऽना (व्युत्तुना) प्रहारा (धा) खमे छे. तेथो ज्यारे तुं आकाशना पेठे आश्रयरहितपण्यु अंगीकार करीश त्यारे तने अने अभिने कांध पशु भीडा नहि थाय." ४  
वसंततिवक्ता.

७७ अने चूरि वच्चे थयेदी वातयीत.

दुष्टः कर्मविपाकभूपतिवशः कायाह्वयः कर्मकृत्,  
बद्धवा कर्मणैर्हृषिकचषकैः पीतप्रमादासवम् ।  
कृत्वा नारकचारकापदुचितं त्वां प्राप्य चाशु च्छलं,  
गन्तेति स्वहिताय संयमभरं तं वाहयालयं ददत् ॥ ५ ॥

कर्मविपाक नुपने दुष्ट नोकर, शरीर पिण्डाणुतो,  
भांधी कर्म॒३५ १२४४४ दारु पाई, अमादमां आणुतो;  
नारकी हुःअ अभवा येऽय, करी तुज नासी जतो,  
तो हित माटे अंग चोपी, था २संयम आराधतो। ५

"शरीर नाभनो नोकर कर्मविपाक राजनो दुष्ट सेवक छे, ते तने कर्म॒३५पी दोरडाए भांधीने ईदियोळपी दारु पावानां पात्रोवडे तने प्रमाद॒५ भविरा पाशे. आवी रीते तने नारकीनां हुःअ अभवाने येऽय करीने पशी कांध ब्लानुं लधने ते सेवक नासी जशे; माटे तारां चोताना हितने माटे ते शरीरने जरा जरा आपीने संयमना भारते तुं सहन ४२." ५  
शार्दूलविक्षिप्ति.

शरीरनी अशुचि, स्वहितअहुणु.

यतः शुचीन्यप्यशुचीभवन्ति ।

कृम्याकुलात्काकशुनादिभक्ष्यात् ।

१ दोरडाथी. २ चारित्र.

-ੴ ਦਾ ਗੁਰ ਮ

- 39 -

द्राग्भाविनो भस्मतया ततोऽगात् ,  
मांसादिपिंडात् स्वहितं गृहाण ॥ ६ ॥

શરીર સંગથી પવિત્ર વસ્તુ, અપવિત્ર થઈ જાય છે,  
કૃમિ ભારેલ કાગ શ્વાન અક્ષણુ, ચોડ્ય અંગ જણ્ણાય છે,  
જે માંસનો જ પિડ અવધ સમય, ટકી વાની થાય છે!  
એ શરીરથી તુજ હિત કરવા, કેમ તં થોભાય છે? ૬

“જે શરીરના સંખ્યથી પવિત્ર વર્ણાઓ પણ અપવિત્ર થઈ જય છે, જે કુમિથી ભારેલું છે, જે ધાર્ગડા હૃતરાને અક્ષણુ ફરવાને યોગ્ય છે, જે થોડા વખતમાં રાખ થઈ જવાનું છે અને જે માંસનો જ પિંડ છે તે શરીરથી તું તો તારું પોતાનું હિંત કર.” ૬ ઉપયત્તિ.

શરીર-ધરને ભાડું અને તેનો ઉપયોગ.

परोपकारोऽस्ति तपो जपो वा, विनश्वराद्यस्य फलं न देहात् ।  
सभाटकादल्पदिनासगेरु-मृत्पिंडमूढः फलमश्नुते किम् ? ॥ ७ ॥

પરોપકાર તપ જ્યુદ્ધે કુળ, નાશવંત શરીરથી,  
જો ન ઘને તો અદ્ય સમય, મારે રહે શા મોહથી ?  
ભાડે રાખેલ ધર માટીના, પિંડને પિછાણીએ,  
એ અંગના મહામોહથી, કુળ આવનારું જાણીએ. ૭

“ ને નાશવંત શરીરથી પરોપકાર, તપ, જ્યુર્ય કુળ થતાં નથી તે શરીરવાળો પ્રાણી થોડા દ્વિવસને માટે ભાડે રાખેલા વર્ગું માટીના પિડ પર મોહ પામીને શું કુળ પામે ? ” ૭ ઉપનાતિ.

શરીરથી કરી શકતું આમહિત.

मृत्तिंडरुपेण विनश्वरेण, जुगुप्सनीयेन गदालयेन ।

देहेन चेदात्महितं सुसाधं, धर्मान् कि तद्यतसेऽत्र मृढ ! ॥८॥

१ वानी-ग्रन्थ.

i 32 i

અધ્યાત્મ-

નાશવંત હુર્ગધીવાળું, રોગે ભરેલું અંગ છે,  
અંગ માર્ગેદ્વિપ પિંડ પણ, ધર્મ સાધવા પ્રસંગ છે;  
તુજ આત્મહિત સધાય, જ્યારે એક શરીર-પ્રસંગથી,  
હે મૃદુ ! પછી શા કારણે, એ યત્ન તું કરતો નથી? ૮

“ મારીના પિંડરૂપ, નાશવંત, દુર્ગાધી અને રોગના ધર એવા આ શરીરવડે જ્યારે ધર્મ કરીને તારું ખોતાનું હિત સારી રીતે સાધી શકાય તેમ છે ત્યારે હે મુઠ ! તેમાં થતું કેમ કર્યો નથી ? ” ૮

## પાંચમો અધિકાર સમાચેત.

अथ षष्ठो विषयप्रमादत्यागाधिकारः

વિષયસેવનથી થતાં હુઅ-સુઅન્ની સરખામળી.

अत्यल्पकलिपतसुखाय किमिद्रियार्थे-

स्त्वं मुहसि प्रतिपदं प्रचुरप्रमादः ।

एते क्षिपन्ति गहने भवभीमक्षे,

जंतुन् यत्र सुलभा शिवमार्गदृष्टिः ॥ १ ॥

માની લીધેલ અદ્વય સુખકાજ, પ્રમાણી શાને ણને ?  
વારંવાર ધન્દ્રિય વિષયમાં, મોહ આવે છે ૧મને;  
એ વિષય સુખ સંસારમાં, હેંકે ભયંકર રેગણ વને,  
ત્યાંથી ન જાણવું સુલભ જીવને, સુધીત મારગ ખંથને. ૧

“ ધાર્યા જ થોડા અને તે પણ માની લાઘેલાં (કલિપત) સુખ માટે તું પ્રમાદવાન થઈને વાગ્વાર ધંદ્રિયોના વિષયમાં શા માટે મોહ પામે છે? એ વિષયો પ્રાણીને સંસારદ્વિપ ભયંકર ગણનવનમાં ફેંકી હે છે, જ્યાંથી મોક્ષમાર્ગતું દર્શાન પણ આ જીવને સુદ્ધાર નથી.” ૧ વસંતતિલકા.

१ भने-हिलमां. २ भोटा जंगलमां.

-५६५ हु भ

: 33 :

परिणामे हुनिकारक विषये।

आपातरम्ये परिणामदुःखे, सुखे कथं वैषयिके रतोऽसि ? ।  
जडोऽपि कार्यं रचयन् हितार्थी, करोति विद्वन् ! यदुदर्कतर्कम् ॥२॥

सुन्हर लागता विषयसुभ्ये, लोगवती वर्खते तने,  
परिणाम हुःअ हेनार, आसक्ता तेमां शीह णने ?  
भूरभ प्राकृतज्ञन आहारे, जेझ कार्यना परिणामने,  
हे निपुण ! तो तुझ डित भाटे, विचार करी कर कमने. २

“लोगवती वर्खते भाव सुन्हर लागता पाणु परिणामे हुःअ हेनार  
विषयसुभमां तुँ डेम आसक्ता थये छे ? हे निपुण ! खेतानुं डित  
धर्यनार भूर्भू प्राकृत भाषुस पाणु कार्यना परिणामतो तो विचार  
करे छे.” २

भोक्षयुभ अने संसारसुभ.

यदिद्रियार्थेरिह शर्म विदव-

धदर्णवत्स्वःशिवगं परत्र च ।

तयोर्मिथोऽस्ति प्रतिपक्षता कृतिन् !,

विशेषदृष्ट्यान्यतरद् गृहाण तत् ॥ ३ ॥

धन्दियोथौ आ संसारमां, जे सुभ ज्ञवने थाय छे,  
स्वर्गं भोक्ष सुभ समुद्र आगण, जिन्हु भाव गण्याय छे;  
बन्ने प्रकारना आ सुभने, शत्रुता कायम रहे,  
भाटे विचारपूर्वक सारु, जण्याय ते सुभने लहे. ३

“धन्दियोथौ आ संसारमां जे सुभ थाय छे ते जिन्हु जेट्युं छे  
अने परलोकमां (तेना त्यागथी) स्वर्गं अने भोक्षनुं सुभ थाय छे ते  
समुद्र जेट्युं छे; आ बन्ने अक्षरनां सुभेने परस्पर शत्रुता छे. तेला  
भाटे हे भाघ ! विचार क्षीने ते ऐमांधी झेझने आस अहणु छर.” ३  
वंशस्थ.

: ३४ :

અધ્યાત્મ-

હુઃખ થવાનાં કારણોનો નિશ્ચય કર.

સુંકો કર્થ નારકતર્યગાદિ—હુઃખાનિ દેહીત્યવધેહિ શાસ્ત્રૈઃ ।  
નિવર્તતે તે વિષયેષુ તૃષ્ણા, બિભેષિ પાપપ્રવયાચ યેન ॥૪॥

નારકી તિર્યંચ ગતિના, જીવ હુઃખો કેમ પામતા ?  
ભાવાર્થ તસ્ સફજાન પામી, શાસ્ત્રથી વિચારતા;  
એ જાણ્યા પછી જ આ જીવની, વિષય તૃષ્ણા કર્મો થશે,  
અને પાપ એકહું કરવાના, હોષથી વિરામશે. ૪

“ આ જીવ નારકી તિર્યંચ વિગેરનાં હુઃખો શા માટે પામે છે તે શાસ્ત્રનડે જાણુ, તેથી ક્રીને વિષય ઉપર તૃષ્ણા એઠી થશે અને પાપ એકહું થવાની ખીંક લાગશે.” ૪ ઉપનાતિ.

સદરહુ નિશ્ચય પર વિચારણા.

ગર્ભવાસનરકાદિવેદનાઃ, પદ્યતોऽનવરતં શ્રુતેક્ષણૈઃ ।  
નો કષાયવિષયેષુ માનસં, શ્લિષ્યતે બુધ ! વિર્ચિતયેતિ તાઃ ॥૫॥

ગર્ભવાસ નારકીં હુઃખને, જે જ્ઞાન ચક્ષુએ જુએ,  
વારંવાર થાતી વેહના, જોઈ શાસ્ત્રતાણી રૂએ;  
વિષય કષાય મન તેણતું, નહિ ચોટતા પાછું કરે,  
હે પંડીંત ! માટે બરાબર, વિચાર કર તેનો ખરે. ૫

“ જ્ઞાનચક્ષુથી ગર્ભવાસ, નારકી વિગેરની વેહનાઓ વારંવાર જેવા  
પછી તારું મન વિષયક્ષાય ઉપર ચોટશે નહિ; માટે હે પંડિત ! તેનો  
હું બરાબર વિચાર કર.” ૫ રથોદ્ધતા.

મરણ ભય પ્રમાદ ત્યાગ.

વધ્યસ્ય ચૌરસ્ય યથા પશોર્વા, સંપાદ્યમાણસ્ય પદં વધ્યસ્ય |  
શનૈઃ શનૈરેતિ મૃતિઃ સમીપં, તથાસ્વિલસ્યેતિ કર્થ પ્રમાદઃ ? ॥૬॥

-કદ્વારામ

: ૩૫ :

કાંસી સજ થયેલ ચોરને, સુદૃત એઠી આવતા,  
વધ થવાના સ્થાનકે એ રીત, પશુઓ લહી જતા;  
મૃત્યુ નળુક સહુ પ્રાણીનું, એ રીત આવતું જય છે,  
તો પછી આ સંસારમાં, પ્રમાદ શીદ સેવાય છે? ૬

“ કાંસીની સજ થયેલ ચોરને અથવા વધ કરવાને સ્થાનકે લઈ  
જવાતા પશુને મૃત્યુ ધીમે ધીમે નળુક આવતું જય છે, તેવી જ રીતે  
સર્વને મૃત્યુ નળુક આવતું જય છે, ત્યારે પછી પ્રમાદ ડેવી રીતે  
થાય? ” ૬

સુખ માટે સેવાતા વિષયોમાં હુંઘો.

વિભેષિ જંતો! યદિ દુઃखરાશેસ્તદિન્દ્રિયાર્થેષુ રતિં કૃથા મા।  
તદુદ્ભવં નશ્યતિ શર્મ યદ્યાકુ, નાશો ચ તસ્ય ધ્રુવમેવ દુઃખમુ ॥૭॥

હે પ્રાણી! ને તું હુંઘોની, બીક હોયે રાખતો,  
તો ઈન્દ્રિય આસક્તિ સુખથી, સદાય થા વિરામતો;  
એથી થયેલું સુખ તો, અવપ્કાળમાં વિષુસી જશે,  
અને પછી લાંઘા કાળ સુધી ના, હુંઘને પામશે. ૭

“ હે પ્રાણી! ને તું હુંઘોથી જીવ રાખતો હોય તો ઈન્દ્રિયોના  
વિષયોમાં આસક્તિ કર નહિ. ‘તે(વિષયા)થી ઉપજ થયેલું સુખ તો  
હુરત નાશ પામે છે અને તે નાશ પામે ત્યારે તો પછી લાંઘા વખતનું  
હુંઘ જ છે.’ ” ૭

તું શા ઉપરથી વિષયોમાં રાચે છે?

મૃતઃ કિસુ પ્રેતપતિર્દુરામયા, ગતાઃ ક્ષયં કિં નરકાશ મુદ્રિતાઃ ।  
ધ્રુવાઃ કિમાયુર્ધનદેહબંધવઃ, સકૌતુકો યદ્વિષયैર्वિમુદ્રાસિ ॥૮॥

‘થમની નથી તું જ ણિક કે, શું બ્યાધિઓ નાશી ગયા,  
પેસા શરીર સંગાસથાંખી, કાથમી ડેના રથા? ’

: 35 :

અધ્યાત્મ-

શું નરકદ્વારે બંધ થયા, નહિ વિષયથોડી વિરામતો,  
આજ્ઞાખ્રી હું સહિત વિષયમાં, મોહ વૃદ્ધિ પૂમતો. ૮

“ શું જમ (યમ) મરી અયો? શું હુનિયામાંથી બધા વ્યાધિઓ નાશ પામી ગયા? શું નારકીનાં બારણાં બંધ થયાં? શું આયુષ્ય, ચૈસા, શરીર અને સગાં સંબંધીઓ હમેશાં એસી રહેવા હ્યો? કે તું આશ્ર્ય-હર્ષ સહિત વિષયોમાં વિશેર્પે મોહ પામે છો?” ८

ଓপসংহৃত

## વિષય પ્રમાણ ત્યાગ કરવાથી સુખ.

विमोह्यसे किं विषयप्रमादैभ्रैमात्सुखस्यायतिदुःखराशेः ।

तद्रूपमुक्तस्य हि यत्सुखं ते, गतोपमं चायतिमुक्तिं तत् ॥१॥  
 विषय प्रभाद जन्म भुद्धिथी, केम पामतो माहने ?  
 अविष्यमां अनेक दुःखना, राशी ज्ञे समारोहने;  
 तेमां ज सुखना अभवडे, जे अलिलाखा थाय छे,  
 ए छोडता निरूपम अविष्यमां, माक्षसुख पभाय छे. ६

“ લવિષ્યમાં જે અનેક હુઃખોનો રાશિ છે તેઓમાં સુખના ભરમથી  
તું વિષયપ્રમાણન્ય બુદ્ધિથી કેમ મોહ પામી જાય છે? તે સુખોની  
અભિવાધારી ભૂકાયલા પ્રાણીને જે સુખ થાય છે તે નિરૂપણ છે અને  
વળી લવિષ્યમાં તે મોક્ષ આપનારું છે.” ૬ ઉપજનતિ.

## ધ્રતિ પષ્ઠ અધિકાર સમાચેત.

अथ सप्तमः कषायत्यागधिकारः

કોથનું પરિણામ-તેનો નિયંત્રણ કરવાની આવશ્યકતા.

रे जीव ! सेहिथ सहिष्यसि च व्यथास्ता-

स्त्वं नारकादिषु पराभवभूः कषायैः ।

**मुग्धोदितैः कुवचनादिभिरप्यतः किं ?**

क्रोधान्निहंसि निजपुण्यधनं दुरापम् ॥ १ ॥

-કે દ્વારા મ

: ૩૭ :

હે જીવ ! કૃપાયવડે પરાભવ, સ્થાન પામી જગતમાં,  
અનેક પીડા થઈ નારકીમાં, રાખતા એ ધ્યાનમાં;  
મૂર્ખ મનુષ્યની ગાળ કે, બૂર્ઝ વચન કોધે ચડે,  
મુસીણતે પામેલ પુણ્ય ધન, નાશ કરતો તે વડે. ૧

“હે જીવ ! કૃપાયવડે પરાભવનું સ્થાન થઈને નારકીમાં તેં અનેક  
પીડાઓ સહન કરી અને હજુ સહન કરીશ; તેથી મૂર્ખ મનુષ્યોએ  
દીધેલ ગાળ વગેરે ખરાખ વચનથી કોધ પામી જઈને મહા મુશ્કેલીથી  
મળી શકે એવું પુણ્ય ધન પું ડેમ નાશ પમાડે છે ? ” ૧ વસંતતિવદ્ધા.

માન-અહુંકાર ત્યાગ.

પરામિભૂતૌ યદિ માનમુક્તિસ્તતસ્તપોऽખંડમતઃ શિવં વા ।  
માનાદતિર્દુર્વચનાદિભિશ્રેત્તપઃક્ષયસ્તબ્રકાદિ દુઃખમ् ॥૨॥  
વૈરાદિ ચાત્રેતિ વિચાર્ય લાભાલાભૌ કૃ બ્રાભવસંમવિન્યામ્ ।  
તપોઽથવા માનમવામિભૂતાવિહાસ્તિ નૂં હિ ગતિદ્વિધૈવ ॥૩॥

(યુગમ)

પરાભવ ધીજથી પામતા, માનને જે ત્યાગશે,  
અખંડ તપ તેથી થતા વળી, મુદ્ધિત સુણ પણુ પામશે;  
હુર્વચન અવર ના સુણુતાં, આહર માનનો થાય છે,  
તપ ક્ષય થતા તેના વડે, નારકી હુઃખ પમાય છે.  
હે પંડીંત ! આ લવ વિષે, વૈર-વિરોધ વૃદ્ધ થાય છે,  
લાલ હાનિ વિચારતાં મન, કોધ માન મુક્ષય છે;  
તપ અગર માન એમાંથી, રક્ષણુ એકનું થાય છે,  
માટે જ તપ રક્ષણુ કાઢે, કૃપાય એહ તન્નય છે. ૨-૩  
(યુગમ)

“ધીજ તરફથી પરાભવ થાય લારે જે માનનો લાગ થાય તો  
તેથી અખંડ તપ થાય છે અને તેથી મોક્ષ થાય છે. ધીજ તરફથી  
હુર્વચન સાંભળતાં જો માનનો આહર થાય તો તપનો ક્ષય થાય છે

: ३८ :

अर्थात्-

अने नारकी विग्रेनां हुःभो थाय छे. आ अवमां पणु भानथी वै॒  
विशेष थाय छे; तेटला भाटे हे पंडित! लाल अने तुक्षशानने। विचार  
हरीने आ संसारमां ज्यारे ज्यारे तारे। परालव थाय त्यारे त्यारे तप  
आथवा भान(भेमाथी एक)नुं रक्षणु कर. आ संसारमां आ ऐ ४  
सता छे (भान करतुं अथवा तप हरवे.)” २-३ उपनिषदि.

डेव त्याग करनार योगीने भाक्षप्राप्ति.

अत्वाक्रोशान् यो मुदा पूरितः स्यात्,

लोष्टार्द्यैर्यथाहतो रोमहर्षी ।

यः प्राणान्तेऽप्यन्यदोषं न पश्य

त्येष श्रेयो द्राग् लभेतैव योगी ॥ ४ ॥

आङ्कोश आटकणी थतां ने, हृषीयी उलराय छे,  
थतां प्रहारे पथरना, चैभराय विक्ष्वर थाय छे;  
प्राणुंत कष्ट पणु अवरना, अवगुणु ने नहि देखता,  
ते महान् योगी जाणुवा, तत्काळ शीवपुर पेखता. ४

“ ने आङ्कोश (परालव वयन; आटकणी) सांभणीने उलटो आनंद्यी  
उलराध जाय छे, केने पथर विग्रे वडे भारी होय तो पणु जेनां  
चैभराय उलटा विक्ष्वर थाय छे, ने प्राणुन्ते पणु पारका अवगुणुने  
देखतो ४ नथी, ते योगी छे, अने ते तुरत ४ भेक्ष मेलवे छे.” ४ शालिनी.

कृषायनियहु.

को गुणस्तव कदा च कषायैर्निर्ममे भजसि नित्यमिमान् यत् ।  
किं न पश्यसि दोषममीषां, तापमत्र नरकं च परत्र ॥ ५ ॥

कथो गुणु थथो कृषायथी, कृयारे कर्यो ए जाणुता,  
कृयम कृयायो सेवता, रहो होष गुणु पिण्ठाणुता;  
संतापे आ अव विषे, परालव नरक हुःभ पामता,  
बेड होष एह कृषायना, पेखी रहो विरामता. ५

-ક ૬૫ કુ મ

: ૩૬ :

“તને ક્ષાયોએ કરો ગુણ કરો? તે ગુણ કયારે કરો? કે તું તેઓને હંમેશાં સેવે છે? આ અવમાં સંતાપ અને પરલવમાં નરક આપવાથી તેઓના દોષો છે તે શું હેઠળો નથી?” ૫ સ્વાગતા.

ક્ષાય સેવન-અસેવનના ઇણ પર વિચારણા.

યત્ક્ષાયજનિતં તત્ત્વ સૌરૂહ્યં, યત્ક્ષાયપરિહાનિમત્ત્વં ચ ।  
તદ્વિશોषમથવૈતદુર્દર્કે, સંવિભાવ્ય ભજ ધીર વિશિષ્ટમ् ॥૬॥

ક્ષાયના સેવન વડે, શું સુખ તુજને થાય છે?  
નિવૃત્ત થતા એ ક્ષાયથી, શું ક્ષાયદો હેખાય છે?  
વિચારી એ બેછ જાણુને, જે સુખમાં વૃદ્ધિ કરે,  
ક્ષાયલ્યાગ પરિણામ સારું, વિખુદ વિચારી આઢરે. ૬

“ક્ષાયસેવનથી તને જે સુખ થાય અને ક્ષાયના ક્ષયથી તને જે સુખ થાય તેમાં વધારે સુખ કયું છે, અથવા તો ક્ષાયનું ને તેના ત્યાગનું પરિણામ ડેનું આવે છે તેનો વિચાર કરીને તે ઐમાથી જારું હોય તે હે પંડિત! આદરી લે.” ૬ સ્વાગતાવૃત્તા.

ક્ષાય ત્યાગ-માનનિઅહુ-ભાહુભલી.

સુખેન સાધ્યા તપસાં પ્રવૃત્તિર્થાતથાનૈવ તુ માનષુક્તિઃ ।  
આદ્યા ન દત્તેઽપિ શિવં પરા તુ, નિર્દર્શનાદ્રાહુબલેઃ પ્રદત્તે ॥૭॥

પ્રવૃત્તિ તપસ્યામાં કર્વી, એ તો હળુએ રહેલ છે,  
પણ માનનો જે ત્યાગ કરવો, તે અત્િ સુષ્કેલ છે;  
કેવળ તપસ્યા મોક્ષના, સુષ્પો ઉપાર્જન ના કરે,  
બાહુણદી દધાંત માન, મૂક્યા પણી શીંવસુખ વરે. ૭

“જેવી રોતે તપસ્યામાં પ્રવૃત્તિ કર્વી તે સુષ્પે થઈ શકે તેમ છે  
તેવી રોતે માનનો ત્યાગ કરવો તે સુષ્પે થઈ શકે તેમ નથીજ. કેવળ

૧ વિખુદ-પંડિત.

: ४० :

अद्यात्म-

तपस्यामां प्रवृत्ति भोक्षने आपी शक्ती नथी, पण मानने त्याग तो  
आहुअलिना दृष्टांतनी जेम भोक्ष जडू आपे छे.” ७ उपनिषत्.

मान त्याग-अपमान सहन.

सम्यग्विचार्येति विहाय मानं, रक्षन् दुरापाणि तपांसि यत्नात् ।  
मुदा मनीषी सहतेऽभिभूतीः, शरः क्षमायामपि नीचजाताः ॥८॥

रक्षण् करी तपनुं सहा, क्षमा हृदयमां धारता,  
विचार करी सारी रीते, मानने ने त्यागता;  
शूरवीर पंडित साधु नीच, अपमानथी न जरी डरे,  
पण राजु राखी दिलने, अपमान तेह सहन करे. ८

“ आ प्रमाणे सारी रीते विचार करी मानने त्याग करीने अने  
दुःखे भणी शके तेवां तपोनुं यत्नथी रक्षण् करीने क्षमा करवामां शूरवीर  
अवो पंडित साधु नीच पुरुषोंने करेलां अपमाने पण युशाथी सहन  
करे छे.” ९ उपनिषत्.

संक्षेपथी कोवनिश्चल.

पराभिभूत्यालिपक्यापि कुप्यस्यघैरपी मां प्रतिकर्तुमिच्छन् ।  
न वेत्सि तिर्यङ्गनस्कादिकेषु, तास्तैरनन्तास्त्वतुला भवित्रीः ॥९॥

करे पराभव सहज कोई पण, कोध दिलमां लावतो,  
महापाप कृताथीं वैर लेवा, भावना भन भावतो;  
नारक तिर्यंच गतिना झाँज, भविष्य भाटे वावतो,  
अतुल पौडा पारवगरनी, थाय रहे दिल लावतो,

“ सहज पराभवथी पण तुं कोप करे छे अने गमे तेवां पापी  
कृत्येथी तेतुं वैर वाणवाने छच्छे छे, पण नारकी तिर्यंच वर्गेरे  
अतिग्रोमां पारवगरनी अतुल परकृत पीडाओ थवानी छे तेने तो तुं  
नाणुतो के विचारतो पण नथी.” १० उपनिषत्.

-કે ૬૫ હુ અ

: ૪૧ :

પદ્મરિપુ પર કોથ-ઉપસર્ગ કરનાર સાથે મૈત્રી.

ધત્તે કૃતિન ! યદ્વપકારકેષુ, ક્રોધં તતો ધેશરિષ્ટક એવ ।  
અથોપકારિષ્વપિ તજ્જવાર્તિકૃત્કર્મહૃનિત્રબહિર્દ્વિષત્સુ ॥ ૧૦ ॥

હે પંડિત ! અહિત કરનાર, ઉપર કોથ ન આવતો,  
કામ કોથ લોભ માન મદ હર્ષ, વિષદ્વરિપુ નિભાવતો;  
અહિત કરનાર એળાખતા, તુજ કર્મ રીપુ નાસશે,  
પરિસંહેદ્રા હિતેચુના થતા, તો જ દિવમાં લાસશે. ૧૦

“ હે પંડિત ! જે તારું અહિત કરનાર ઉપર તું કોથ કરતો હો  
તો પદ્મરિપુ ( છ શત્રુ-કામ, કોથ, લોભ, માન, મદ અને હર્ષ ) ઉપર  
કોથ કર, અને જે તારા હિત કરનાર ઉપર પણ કોથ કરતો હોય  
તો સંસારમાં થતી સર્વ પોડા કરનારાં જે ધર્મો છે તેઓને હરી જનાર  
(ઉપસર્ગો કરનારા વિગેર) ને ઘરેખરા તારા હિતેમણું છે અને બાલ દશ્યથી  
જે તારા શત્રુ જેવા લાગે છે તેના ઉપર કોથ કર.” ૧૦ ઉપાતિ.

### માયાનિઅહુ ઉપદેશઃ

અધીત્યનુષ્ઠાનતપઃશમાદ્યાન्, ધર્માન् વિચિત્રાન् વિદ્ધત્તસમાયાન् ।  
ન લપ્સ્યસે તત્ફલમાત્મદેહલેશાધિકં તાંશ્ ભવાંતરેષુ ॥ ૧૧ ॥

શાસ્ત્રાભ્યાસ ધર્માનુષ્ઠાન, તપસ્યા આહિ જે કરે,  
શબ્દ આહિ ણહું ધર્મકાર્યો, માયા સહિત તે આદરે;  
એ તારા શરીરને કલેશ, ઉપરાંત બીજું શું કરે ?  
બીજું ભવાંતરે ઝળ નહિં, પણ એજ ધર્મ વિમુખ ઠરે. ૧૧

“ શાસ્ત્રાભ્યાસ, ધર્માનુષ્ઠાન, તપસ્યા, શબ્દ વિગેર વિગેર અનેક ધર્મો  
અથવા ધર્મકાર્યો માયા સાથે આચરે છે, તેથી તારા શરીરને કલેશ  
થવા ઉપરાંત ભવાંતરને વિષે બીજું કાંઈ પણ ઝળ મેળવવાનો નથી,  
અને તે ધર્મો પણ ભવાંતરમાં ભળવાના નથી.” ૧૧ ઉપાતિ.

૧ પદ્મરિપુ-૪ આંતરશત્રુઓ.

: ४२ :

अध्यात्म-

### लोक निश्चहु उपहेश।

सुखाय धत्से यदि लोभमात्मनो, ज्ञानादिरत्नत्रितये विधेहि तत् ।  
दुःखाय चेदत्र परत्र वा कृतिन् !, परिग्रहे तद्विरांतरेऽपि च ॥१२॥

तारा पोताना सुख माटे, लोक आवे ज्ञे तने,  
तो ज्ञान दर्शन चारित्र, त्रण रत्न भेणववा भने;  
कर लोक ए ज्ञे तु एहुवो, परब्रह्म तेथी सुधरे,  
परिश्चहु निभिते लोक कर्ता, हुःभद्रायक ते ४२. १२

“ हे पंडित ! ज्ञे तु तारा पोताना सुख माटे लोक राखतो हो  
तो ज्ञान, दर्शन, चारित्रिय त्रण रत्नो भेणववा माटे लोक राख,  
अने ज्ञे आ भव अने परब्रह्मां हुःभ भेणववा माटे लोक राखतो  
होय तो आंतर अने अहिं धरियु भाटे लोक राख.” १२. उपज्ञाति.

### मह-मत्सरनिश्चहु उपहेश।

करोषि यत्प्रेत्यहिताय किंचित्, कदाचिदिल्यं सुकृतं कथंचित् ।  
मा जीहरस्तन्मदमत्सराघैर्विना च तन्मा नरकातिथिर्भुः ॥ १३ ॥

महामुसीधते सुकृत करवा, भावना हिल आवता,  
करी मह मत्सर तेहनो, हारी जशो हिल लावता;  
सुकृत करण्यी वगर ज्ञवो, नरक परोणा थाय छे,  
मह मत्सर विषु शुभ कार्य ए, अवांतरे सुखदाय छे. १३

“ कोध वभत महामुश्केलीए आवता अव भाटे जरा कांध सारु  
क्षम (सुकृत्य) करवातु तारे अनी आवे तो पछी वणा तेने मह-मत्सर  
करीने हारी जधश भा, अने सुकृत वगर तु नरकनो परोणो थधश भा.” १३  
उपज्ञाति.

### विशेष करीने धर्या न करवी.

पुरापि पापैः पतितोऽसि संसृतौ,  
दधासि रे किं गुणिमत्सरं पुनः ।

-५६५ दु अ

: ४३ :

न वेत्सि किं घोरजले निपात्यसे,  
नियंत्र्यसे शृंखलया च सर्वतः ॥ १४ ॥

थयेल अगाउना पापथी, संसारमां आ०ये। अरे,  
शुणुवानना गुणु पेखता, धृष्टी पछी शानी करे ?  
आवा करैला पापथी, ऊडा पाणीमां उतरे,  
अंधाय मज्जूत सांक्ळे, नहि जाणुतो हिकमां भरे. १४

“ अरे ! पहेलां पथु तुं पापथी संसारमां पञ्चो छे, त्यारे वणी  
करीथी पथु शुणुवान उपर धृष्टी केम करे छे ? आ पापथी तुं ऊडा  
पाणीमां उतरे छे अने तारे आऐ शरीरे सांक्ळे। अंधाय छे ते शुं  
तुं जाणुतो नथी ? ” १४ वंशस्थव्रता.

कृपायथी सुहृत्यनो नाश.

कष्टेन धर्मो लब्धो मिलत्ययं, क्षयं कषायैर्युगपत्रप्रयाति च ।  
अतिप्रयत्नार्जितमर्जुनं ततः, किमङ्ग ! ही हारयसे नभस्वता ॥ १५ ॥

महाकृष्णे जरा जरा कांઈ, धर्मकार्य सधाय छे,  
कृपाय करतां नाश तेहुनो, एक सपाटे थाय छे;  
हे भूर्भु ! महाकृष्णे भयेलुं, ठेम चाल्युं जाय छे,  
कृपायइप एक कुंकमां, सहंतर नाश जाण्याय छे. १५

“ महाकृष्णथी जरा जरा करीने “धर्म” प्राप्त थाय छे ते कृपाय  
कृपायथी एक सपाटामां एकहम नाश पामे छे. हे भूर्भु ! महाकृपायथी  
भेणवेलुं सोनुं एक कुंकमारीने केम ऊडावी हे छे ? ” १५ वंशस्थ.

कृपायथी थती हुनिनी परंपरा.

शत्रूभवन्ति सुहदः कलुषीभवन्ति,  
धर्मा यशांसि निचितायशसीभवन्ति ।

: 88 :

અધ્યાત્મ-

स्त्रियंति नैव पितरोऽपि च बांधवाश,  
लोकद्वयेऽपि विपदो भविनां कषायैः ॥ १६ ॥

મિત્ર શરૂ થાય કષાયથી, ધર્મ ભવિનતા થાય છે,  
આખરું સજજડ હોય પણ, અપયશ થતાં બહલાય છે;  
માણાપ બન્ધુ રનેહિઓનો, પ્રેમ અગ્રો જાય છે,  
આ લોક કે પરલોકમાં પણ, વિપત્તિઓ બહુ થાય છે. ૧૬

મહનિયણ-ખાસ ઉપહેરા.

रूपलाभकुलविक्रमविद्याश्रीतपोवितरणप्रभुताद्यः

किं मदं वहसि वेत्सिन, मूढाऽनंतशः स्वभृशलाघवदुःखम् ॥१७॥

તૃપ બળ લાલ વિદ્યા લક્ષ્મી, તપ દાન ઐશ્વર્ય આહિનો,  
મહ આઠ એ તું શું કરે, ભવભ્રમણુ કરત અનાહિને;  
હે મૂર્ખ ! અનંત વખત તું, રલધુતાધ હુઃખ વહુન કરે,  
શું જાણુતો નથો મદવડે, સંસારમાં ફરતો કરે. ૧૭

“ ઇપ, લાભ, બજ, વિદ્યા, લક્ષમી, તપ, હાન, ઔષ્ણ્ય વગેરોનો મહત્વ શું જેઠને કરે છે? હે મૂર્ખ! અનંત વખત ને લધુતાઈનું હુઃખ વહન કરવું પડ્યું છે તે શું તું જાણુંતો નથી?” ૧૭ સ્વાગતાવૃત્તિ.

## સંસારવૃક્ષનું મુળી-કષાયો।

विना कषायान्न भवार्त्तिराशिर्भवद्भवेदेव च तेषु सत्सु ।

**मूलं हि संसारतरोः कषायास्तच्चान् विहायैव सुखी भवात्मन् ॥१८॥**

१ हेम-सोनुः २ लघुताठ-नाना पञ्चः

-੫੪੬-

: ४३ :

કથાય વિષુ પિડા અનેક, સંસારમાં નવ સાંપડે,  
થાતા કથાય જરૂર જગમાં, અનેક પીડાઓ નહે;  
હે ચેતન ! સંસાર-વૃક્ષનું, મૂળ એજ કથાય છે,  
એ મહાનું દોષ કથાય તરતા, જીવન સુખી થાય છે. ૧૮

“ કષાય વગર સંસારની અનેક પીડાઓ થાય નહિ અને કષાયો હોય ત્યારે પીડાયો જરૂર થાય છે. સંસારવૃક્ષનું મૂળ જ કષાયો છે, તો હે ચેતન ! તેને તળું સુખી થા.” ૧૮ ઉપનિષત્ત.

કષાયના સહચારી વિષયનો ત્યાગ.

समीक्ष्य तिर्यङ्गनरकादिवेदनाः, श्रुतेक्षणैर्धर्मदुरापतां तथा ।

प्रमोदसे यद्विषयैः सकोतुकैस्ततस्तवात्मन् ! विफलैव चेतना । १९।

તિર્યંચ નારકીની વેહના, શાસ્વત્રદ્વારા-નેત્રોવડે,  
તેમજ મુશ્કેલી ધર્મપ્રાપ્તિ, દૃષ્ટિએ આવી ચડે;  
છતાં કુતુહળવાળા વિષયમાં, દિલ આનંદ આવતા,  
હે ચેતન ! તેથી જાણવું, જીવન નકારું વિતાવતા. ૧૬

“ શારીર આંખોથી તિર્યંચ, નારકી વિગેરતી વેદનાને જણી,  
તેમજ ધર્મ ભળવાની સુષેકેલી પણ જણી, તેમ છતાં પણ કુતુહલવાળા  
વિષયોમાં તું આતંક માનશે તો હે ચેતન! તારું ચેતન પણ તદ્વાન  
નકારું છે.” ૧૬

કખાયના સહયારી પ્રમાણનો ત્યાગ.

चौरै स्तथा कर्मकर्गहीते, दुष्टः स्वमात्रेऽप्युपतप्यसे त्वम् ।

पुष्टैः प्रमादैस्तनुभिश्च पुण्यधनं न किं वेत्स्यपि लुट्ठयमानम् ॥२०॥

તસ્કર અગર તુંજ નોકરો, કંદિ ધન ચોરી જાય છે,  
તપતો જરા એ ધન લુંટતા, હિલ અતિ હુંખાય છે;  
પુષ્ટ અગર પાતળા અમાદે, પુષ્ટ ધનને લુંટતા ?  
એ જાણુતો જરીયે નથી, શું પુષ્ટ થાશે ખૂટતા. ૨૦

: ४६ :

अध्यात्म-

“ चोर अथवा कामकाज इनागा ( नोठरचाठरो ) तारुं जरा पछु  
धन उपाडी जय छे तो पछु हुं तपी जय छे; जयारे पुष्ट अथवा  
पातणा अमादो तारुं पुष्टधन लूंडी ले छे ते हुं जाणुतो पछु नथी.” २०  
उपज्ञाति.

जरा नीचुं लोहने चाल-उपसंहार-अौदृश्य त्याग.

मृत्योः कोऽपि न रक्षितो न जगतो दारिद्र्यमुत्रासितं,  
रोगस्तेन वृपादिजा न च भियो निर्णाशिताः घोडश ।  
विध्वस्ता नरका न नापि सुखिता धर्मैखिलोकी सदा,  
तत्को नामगुणो मदश्च विभुता का ते स्तुतीच्छा च का? ॥२१॥

रक्षणु भृत्युथी न कोयनुं, दाणहर श्रीटाङ्गुं न ते,  
रोण चोर नृपतिथी थता, सोण भयो लही ध्यानमे;  
नथी नाश कीधो तेहनो, नारक गति टाणी नथी,  
सुभी न कीँधा प्रणु लोइ धरमे, स्तुति धर्मिषा शा गुणुथी? २१

“ हे भाई! ते उजु सुधी कोई पछु प्राणीनुं भरण्यथो रक्षणु क्युं”  
नथी, ते कोई जगतनुं दाणहर श्रीटाङ्गुं नथी, ते रोण चोर चाल  
विगरेए करेला भोटा सोण भयोनो नाश कीर्णी नथी, ते कोई नरकगतिनो  
नाश कीर्णी नथी अने धर्मवडे ते कांध प्रणु लोइने सुभी कीर्णी नथी,  
त्यारे तारामां गुणु शा छे के तेनो भद्र करे छे? अने वणी ओवुं कांध  
प्रणु कीर्णी विना हुं रहुतिनी धर्मिषा प्रणु शेनी राखे छे? (अथवा  
शुं तारा गुणु अने शो तारा भद्र! तेमन् शा तारी भोटाई अने शो  
तारो भुशामतनो भ्रेम!!) ” २१

शार्दूलविक्षिप्ति.

सप्तम अधिकार समाप्त.

-ક ૬૫ કુ મ

: ૪૭ :

## अथाष्टमः शास्त्रगुणाधिकार

उपरच्चाईओ २॥

शिलातलाभे हृदि ते वहंति, विशंति सिद्धान्तरसा न चान्तः।  
यदत्र नो जीवदयार्द्रता ते, न भावनांकुरततिश्च लभ्या ॥१॥

शिलानी सपाठी जेवा तारा, हृदय उपर थर्ध अने,  
सिद्धान्तशृण चाल्युं जाय पथु, प्रवेश करतुं नहि १तने;  
ज्ञवद्याइप लीनाश नथी, ए कारणे तारा भने,  
वर्णां भावनाइप अंकुराओ, ऐणु न भणे हृदयमें. १

“ सिद्धान्तशृण शिलानी सपाठी जेवा तारा हृदय पर थर्धने चाल्युं  
जाय छे पथु तेनी अंदर प्रवेश करतुं नथी; कारण, के तेमां (तारा  
हृदयमां) ज्ञवद्याइप लीनाश नथी अने भावनाइप अंकुराओनी ऐणु  
पथु नथी.” १

ઉपेंद्रवज्ञ।

## शास्त्र भषेला प्रभादीने उपदेश।

यस्यागमांभोदरसैने धौतः, प्रमादपंकः स कथं शिवेच्छुः।  
रसायनैर्यस्य गदाः क्षता नो, सुदुर्लभं जीवितमस्य नूनम् ॥२॥

सिद्धान्तइप वरसाह जपे, प्रमाद काहव ना धुवे,  
ऐवा मुमुक्षु प्राणीओ जग, मुक्तिसुख क्यांथी जुवे?  
भरेभरा रसायणे पथु, जे व्याधि नाश नहि करै,  
तो जाणुवुं ए प्राणीनुं, हवे शुवन् आ०युं रआभरे. २

“ जे प्राणीनो प्रभादिप काहव सिद्धान्तइप वरसाहनां जगप्रवाहयो  
पथु धीवातो नथी, ते तेवा नीते मुमुक्षु (भोक्ष भेणवानी धर्मवालो)  
डोळ शके? भरेभग, रसायणयुथी पथु जे कोळ प्राणीना व्याधिओ नाश  
पामे नहि तो पक्षी तेनुं ज्वन रहेवानुं ज नहि ऐम जाणुवुं.” २ उपनिति.

१ तने—शरीर. २ छेवट.

: ४८ :

अध्यात्म-

स्वपूजा भाटे शास्त्रालयास करनाराए। प्रत्ये.  
 अधीतिनोऽर्चादिकृते जिनागमः,  
 प्रमादिनो दुर्गतिपापतेर्मुद्धा ।  
 ज्योतिर्विमूढस्य हि दीपपातिनो,  
 गुणाय कस्मै शलभस्य चक्षुषी ? ॥ ३ ॥

जैन शास्त्रालयास प्राणी, निज पूजा भाटे करे,  
 निष्ठूण प्रभादी प्राणीए, दुर्गति ज्ञातां आखरे;  
 अभि भिच पतंगीया, चक्षु इन्द्रियश अपवावता,  
 शु लाल थाये तेहने, आवना जूठी आवता. ३

“ दुर्गतिमां पडनार प्रभादी प्राणी पोतानी पूजा भाटे जैनशास्त्रेनो  
 अभ्यास करे छे ते निष्ठूण छे, दीवानी ज्ञेतिमां इसाएला दीवामां  
 पडनार पतंगीआनी आंभ्या तेने शा लाल करनारी छे ? ” ३ वंशस्थ.

परदोऽहितयुद्धि वगरना अल्यास करनाराएने.  
 मोदन्ते बहुतकर्त्तर्णचणाः केचिज्जयाद्वादिनां,  
 काव्यैः केचन कलिपतार्थघटनैस्तुष्टाः कविख्यातितः ।  
 ज्योतिर्नाटकनीतिलक्षणधनुर्वेदादिशास्त्रैः परे,  
 ब्रूमः प्रेत्यहिते तु कर्मणि जडान् कुशिभरीनेव तान् ॥४॥

भडु तर्क डे विर्कमां, प्रसिद्ध थाता वाहीए,  
 ज्ञेति, नाथ्य, नीति, सामुद्रिक, आहिना अल्यासीए;  
 काव्यशक्ति धनुर्वेद आहि, प्रसिद्ध थावा भेणवे,  
 पेटबरा ए जाणुवा ले, परदोऽहित न केणवे. ४

“ डेटलाक अल्यासीए। भडु प्रकारना तर्कविर्केना विचारमां प्रसिद्ध  
 होई वाहीएने अतीने आनंद पाने छे, डेटलाक ४८५ना उडावीने काव्ये।

-૬૫ કુમ

: ૪૯ :

રચીને કણી તરીકે ખ્યાતિ મેળવી આનંદ માને છે અને ડેટલાક જ્યોતિષ-  
શાસ્ત્ર, નાયશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, ધરુર્વેદ વિગેરે શાસ્ત્રોના  
અભ્યાસવડે ખુશી થાય છે; પરંતુ આવતા ભવમાં હિતકારી કાર્ય  
તરફ જે તેઓ અરા (અથવા એદ્રક્તા) હોય તો અમે તો તેઓને  
પેટભરા જ કહીએ છીએ. ૪

શાર્દુલવિકૃતિ

શાસ્ત્ર લાણીને શું કરવું ?

કિ મોદસે પંડિતનામમાત્રાત्, શાસ્ત્રેષ્વરીતી જનરંજકેષુ ।  
તત્કિચનાધીષ્વ કુરુષ્વ ચાશુ, ન તે ભવેદ્યેન ભવાબ્ધિપાતઃ ॥૫॥

કરે શાસ્ત્ર અભ્યાસ કોઈ જન, લોક રંજન કારણે,  
પંડિત ! નામ એ માત્ર પામી, રાજ થાતા તે ક્ષણે;  
અભ્યાસ કરવો એહુવો, અનુષ્ઠાન પણ એવું કરે,  
સંસાર હથિ નિસ્તાર થાતા, પાર પાડે આખરે. ૫

“ લોક રંજન કરનારાં શાસ્ત્રોનો અભ્યાસી થઈને તું પંડિત નામ  
માત્રથી કેમ રાજ થઈ જય છે ? તું કોઈ એવો અભ્યાસ કર અને  
પણી કાંઈ એવું અનુષ્ઠાન કર કે નેથી તારે સંસારસમુક્તમાં પડવું  
પડે નહીં. ” ૫

ઉપલતિ.

શાસ્ત્રાભ્યાસ કરીને સંયમ રાખવો.

ધિગાગમૈમાધસિ રંજયન જનાન, નોદ્યચ્છસિ પ્રેત્યહિતાય સંયમે ।  
દધાસિ કુર્ક્ષિમરિમાત્રતાં મુને !, ક તે ક તત્કૈષ ચ તે ભવાંતરે ॥૬॥

હે મુનિ ! સિદ્ધાંતવડે મન, રંજન કરે લોકો તણું,  
નિજ આત્મ આસુભિક હિત માટે, યતન નહિ વિચારણા;  
ધીઃકર તુ એ જ કારણે, માત્ર પેટ ભરવાને કરે,  
શું મનરંજન આગમથી, ચારિત્ર વિષુસે આખરે. ૬

૧ હથિ-સમુદ્ર.

: ૫૦ :

અધ્યાત્મ-

“હે મુનિ ! સિદ્ધાંતવડે તું લોકાને રંજન કરતો ખુશી થાય છે અને તારાં પોતાનાં આમુષિક હિત માટે યત્ન કરતો નથી તેથી તતે વિક્રાર છે, તું માત્ર પેટલરાપણું જ ધારણું કરે છે પણ હે મુનિ ! ભવાંતરમાં તે તારાં આગમે કયાં જશે ? તે તારું જનરંજન કયાં જશે અને આ તારો સંયમ કયાં જશે ? ” ૬

ઉપજતિ.

કેવળ અભ્યાસ કરનારે અને અદ્યાભ્યાસી સાધકમાં શ્રેષ્ઠ કોણ ?

ધન્યા કેઽપ્યનધીતિનો�પિ સદનુષ્ટાનેષુ બદ્ધાદરા,

દુઃસાધ્યેષુ પરોપદેશેલવતઃ શ્રદ્ધાનશુદ્ધાશયાઃ ।

કેચિચ્ચાગમપાઠિનો�પિ દધતસ્તત્પુસ્તકાન् યેઽલસાઃ

अત્રામુત્ત્રહિતેષુ કર્મસુ કથં તે ભાવિનઃ પ્રેત્યહાઃ ॥ ૭ ॥

થયો ન શાખાભ્યાસ શુલ, અનુષ્ઠાન પ્રતિભોધી કરે,

શ્રદ્ધાપૂર્વક શુદ્ધ આશયે, ધન્ય ને નજરે તરે;

કેર્દી આગમ અભ્યાસી થઈ, પુસ્તકો પણ રાખશે,

નિજ આત્મહિત કામે પ્રમાદિ, જવોખવે તસ શું થશે ? ૭

“કેટલાક ગ્રાહીઓએ શાખનો અભ્યાસ કર્યો ન હોય તો પણ બીજાના જરા ઉપહેશથી મુશ્કેલીથી સાધી શકાય તેવાં શુલ અનુષ્ઠાનો તરફ આદ્યવાળા થઈ જાય છે અને શ્રદ્ધાપૂર્વક શુદ્ધ આશયવાળા થઈ જાય છે તેઓને ધન્ય છે ! કેટલાક તો આગમના અભ્યાસી હોય અને તેનાં પુસ્તકો પાસે રાખતાં હોય છતાં પણ આ ભવ પરભવનાં હિતકારી કાર્યોમાં પ્રમાદી થઈ જાય છે અને પરલોકને હણી નાખે છે તેઓનું શું થશે ? ” ૭

શાર્દૂલવિક્રીડિત.

મુખ્યભુદ્ધિ વિ. પંડિત.

ધન્યઃ સ મુખ્યમતિરપ્યુદિતાર્હદાજ્ઞા-

રાગેણ યઃ સુજતિ પુણ્યમદુર્વિકલ્પઃ ।

—૯૬૫ હુ મ

: ૫૧ :

**પોઠન કિં વ્યસનતોડસ્ય તુ દુર્વિકલ્પૈ-  
યોં દુસ્થિતોડત્ર સદનુષ્ટિતિષુ પ્રમાદી ॥૮॥**

શુભ કિયા પ્રખુ આશા, કૃત્તાવેલ રાગ વડે કરે,  
અભ્યાસમાં સુગ્રંથ બુદ્ધિવાળો, ભાગ્યશાળી પણ ખરે;  
શુભ કિયા પ્રમાદી વળી, માડા વિચાર કર્યા કરે,  
અભ્યાસ કે એ ટેવથી, શોલાલ તેને આખરે ? ૮

“ માડા સંકદ્ય નહીં કરનારો અને તીર્થાંકર મહારાજે કૃત્તાવેલી  
આશાઓના રાગથી શુભ કિયા કરનારો પ્રાણી અભ્યાસ કરવામાં સુગ્રંથ  
બુદ્ધિવાળો હોય તો પણ ભાગ્યશાળી છે. જે પ્રાણી માડા વિચાર કર્યા  
કરે છે અને જે શુભકિયામાં પ્રમાદી હોય છે તેવા પ્રાણીને અભ્યાસથી  
અને તેની ટેવથી પણ શોલાલ છે ? ” ૯ વસંતતિલકા.

### શાસ્વાદ્યાસ-ઉપસંહાર.

અધીતીમાત્રેણ ફલંતિ નાગમાઃ, સમીહિતૈજોવિ સુર્વૈર્ભવાન્તરે ।  
ખનુષ્ટિતૈઃ કિંતુ તદીરિતૈઃ ખરો, ન યત્સિતાયા વહનશ્રમાત્સુર્ખી ॥૯॥

ભવાંતરે દ્યાચિત સુખ દઈ, આગમો ઝણતા નથી,  
ઝેણે ન માત્ર અભ્યાસથી, પણ ઝેણે શુભ અનુધાનથી;  
ગર્ભાં વહન કરી જારને, સાકર જેમ ઉપાડતા,  
એ સ્વાદથી વિમુખ રહે, દૃઢાંત એહ ઘટાવતા. ૯

“ માત્ર અભ્યાસથી જ ભવાંતરમાં દ્યાચિત સુખ આપીને આગમો  
ઝણતાં નથી, પરંતુ તેમાં બતાવેલ શુભ અનુધાનો કરવાથી આગમો  
ઝેણે છે. જેવી રીતે સાકરનો બોને ઉપાડવાના શ્રમથી ગઢેડો કાંઈ  
સુખી નથી.” ૯ વંશરથ

૧ ગર્ભાં-ગઢેડા.

: ५२ :

अध्यात्म-

नरकातिनां हुःभो।

दुर्गंधतो यदणुतोऽपि पुरस्य मृत्यु-

रायूषि सागरमितान्यनुपक्रमाणि ।

स्पर्शः खरः क्रकचतोऽतितमामितश्च,

दुःखावनंतगुणितौ भृशशैत्यतापौ ॥१०॥

तीव्राव्यथाः सुरकृता विविधाश्च यत्रा-

क्रंदारवैः सततमध्रभृतोऽप्यमुष्मात् ।

किं भाविनो न नरकात्कुमते विभेषि,

यन्मोदसे क्षणसुखैर्विषयैः कषायी ॥११॥ युग्मम्

भाव्र सूक्ष्म आगवडे, नरक हुर्गंधी मृत्यु करे,

ज्यां सागरोपमथी भपातु, आयुष्य निरुपक्षम घरे;

स्पर्श कर्कश भङ्ग टाठ ताप, अनंतग्रन्थुं जे स्थले,

वेहना तीव्र २३६० आकंद, आकाशे भणे;

हे कुमति! आवा नरक हुःभो, भवीसँमां भणशे तने,

थेडा वधतना सूख विषय, कषायना लावी भने;

उरतो नथी आनन्दधी, थेडा वधत सुख पामशे,

परभव अगाडी नाखता, लांबो समय हुःभमां जशे. १०-११

युग्मम्

“ जे नारकीनी हुर्गंधीनां एक सूक्ष्मलाग भावथी (आ भनुष्य लेआकना) नगरतुं (एट्ले नगरवासी जनोनुं) मृत्यु थाय छे, ज्यां सागरोपमथी भपातुं आयुष्य निरुपक्षम होय छे, ज्यो स्पर्श करवतथी पर्णु भङ्ग कर्कश छे, ज्यां टाठ तडकानुं हुःभ अही करतां (भनुष्यलेआक करतां) अनंतग्रन्थुं वधारे छे, ज्यां देवताओनी करेली अनेक प्रकारनी वेहनाओ। थाय छे अने तेथी २३६० अने आकंदवडे आकाश भगाई जाय छे—आवा प्रकारनी नारकी तने भविष्यमां भणशे ए विचारथी

—५८५ कु भ

: ५३ :

हे कुभिति ! तुं भीता नथी के धाय करने अने थोड़ा वर्खत सुख  
आपनारा विषये सेवीने आनंद माने छ ” १०-११ वसंततिलक्षण।

तिर्यंचगतिना हुःओ।

बंधोऽनिशं वाहनताडनानि, क्षुत्तृङ्गदुरामातपशीतवाताः ।

निजान्यजातीयभयापमृत्युदुःखानि तिर्यक्षिति दुस्सहानि ॥१२॥

निरंतर अंधन मारने, भार वडन करवे पडे,  
भूख तरस हुष्ट रोगो, ताप वृषा टाढ पवनवडे;  
पर पोतानी जलिनो भय, कुमरणु पथु आवी नडे,  
तिर्यंचगतिमां ओहवा, असद्य हुःओ सांपडे. १२

“ निरंतर अंधन, भारतुं वडन, भार, भूख, तरस, हुष्ट रोगो,  
तडो, ठंडी, पवन, पोतानी अने पारझी जलिनो भय अने कुमरणु-  
तिर्यंचगतिमां आ असद्य हुःओ छे. ” १२ उपज्ञाति.

देवगतिनां हुःओ।

मुधान्यदास्याभिभवाभ्यसूया, भियोऽन्तर्गर्भस्थितिदुर्गतीनाम् ।

एवं सुरेष्वप्यसुखानि नित्यं, किं तत्सुखैर्वा परिणामदुःखैः ॥१३॥

निष्कारणु सेवा इन्द्रनी, पराभव भत्सर सांख्यवा,  
अंतकाण गर्भस्थित अने, हुर्गतिना भय राखवा;  
निरंतर हुःओ देवगतिमां, हुःअ परिणुमे थता,  
ऐ हीर्घकाण देवगति सुख, अनित्य ते शुं पामता ? १३

“ धृशटिक्नी निष्कारणु सेवा करवा, पराभव, भत्सर, अंतकाण,  
गर्भस्थिति अने हुर्गतिनो भय-आवी रीते देवगतिमां पथु निरंतर  
हुःओ छे. वणी ऐने परिणुमे हुःअ छे तेवा सुखथी शुं ? ” उपज्ञाति.

अनुष्यगतिनां हुःओ।

सप्तभीत्यभिभवेष्टविप्लवानिष्टयोगगददुःखतादिभिः ।

स्याच्चिरं विरसता नृजन्मनः, पुण्यतः सरसतां तदानय ॥१४॥

18

અધ્યાત્મ-

સાત લય પરાલવ અપમાન, વિદેશ ઠડાલાનો ખને,  
અપ્રિય સંચેદા પ્રતિકુળ પ્રજા, વ્યાધિઓ આવે તને;  
દીર્ઘ સમય મનુષ્ય જન્મ પણ, વિરસ એમ જણાય છે,  
માત્ર પુણ્યવડે જ મધુરપણે, માનવજન્મ ગણાય છે. ૧૪

“ સાત લય, પરાબવ (અપમાન), વહુવાનો વિશેષ, અપ્રિયનો સંચેષ, વ્યાધિઓ, માંડી વાળેલ છોકરા વિગેરે વડે મનુષ્યજન્મ પણ લાંબા વખત સુધી વિરસ (આરોધુદ્વા) થઈ જાય છે, તેથી માટે પુણ્ય વડે મનુષ્ય જન્મનું મધુરપણું પ્રાપ્ત કર.” ૧૪ સ્વાગતા

## ઉક્તસ્થિતિદર્શનનું પરિણામ.

इति चतुर्गतिदुःखततीः कृति-

न तिभयास्त्वमनंतमनेहसम् ।

हृदि विभाव्य जिनोक्तक्रतांतरः,

कुरु तथा न यथा स्युरिमास्तव ॥ १५ ॥

हेव नारकी तिर्यंच मनुष्य, स्वदृपवान् ज्ञव थये,  
आरे गति लवभ्रमणु करता, काण अनंतो गये;  
ऐ चार गति हुःअ डेवणीये, जिन आगममां कह्यो,  
हे हुःअ झरी नव सांपडे, विचार ने इहये रयो. १५

એ પ્રમાણે અનંતકાળ પર્યાત (સહન કરેલી) અતિશય ભય આપનાર  
ચાર અતિના હુઃખોની રાશિઓને ડેવળા ભગવંતે છ્લેલાં સિદ્ધાતથી  
હુદ્ધયમાં વિચારીને હે વિદ્ધન ! એવું કર કે જેથી તને તે પીડાઓ ફરી  
થાય નહિ. ૧૫ દ્રત્વિલંબિત

## અધ્યાત્મા દ્વારનો ઉપસંહાર.

आत्मन् ! परस्त्वमसि साहसिकः श्रुताक्षै-

र्यद्वाविनं चिरचतुर्गतिदुःखराशिम् ।

१ तने-शरीर.

-५६५ दु भ

: ५५ :

पश्यन्नपीह न विभेषि ततो न तस्य,  
विच्छित्तये च यतसे विपरीतकारी ॥ १६ ॥

હे आत्मन् ! साहसिक ज्ञाने, यारे गतिनां हुःअने,  
लांभेा वर्खत शान यक्षुथी, जेतां नहि डरतो मने;  
उलटुं विपरीत आचरणु तारु, करे प्रथास न टाणवा,  
अचे अविष्यना हुःअथी, विचार लाव ए खाणवा. १६

“ हे आत्मन् ! पुं तो ज्ञाने साहसिक छे, कारणु के अविष्यक्तमां  
लांआ वर्खतसुधी थनार यार गतिअनां हुःभोने पुं शानयक्षुथी जुअे छे  
तो पछु तेओथी थीतो नथी अने वणा उलटो विपरीत आचरणु करी  
ते हुःभोना नाश साढ जगा पछु प्रथास करतो नथी.” १६ वसांततिलका.

अधिकार अष्टम सभापत.

अथ नवमश्चित्तदमनाधिकारः  
भनधीवरनो विश्वास न कर्वो.  
कुकर्मजालैः कुविकल्पसूत्रजै-  
निवध्य गाढं नरकाग्निभिश्चिरम् ।  
विसारवत् पक्ष्यति जीव ! हे मनः-

कैवर्तकस्त्वामिति मास्य विश्वसीः ॥ १ ॥

હे येतन ! भनधीवर, कुविकल्प द्वारीनी ज्ञानमां,  
पाथरी कुकर्म धाणेा वर्खत, इसावशे जंज्ञानमां;  
लांभेा वर्खत नरकाग्निमां, भच्छी भाङ्क कुंजशे,  
माटे ज तस विश्वास पर, भरुसो जरी नहि राखशे. १

“ हे येतन ! भनधीवर (भच्छीमार) कुविकल्प द्वारीनी ज्ञानवेली  
कुकर्मजाल पाथरीने तेमां तेने भजभूत शीते शुंथी लांआ वर्खत सुधी

: ५६ :

अद्यात्म-

माछलानी पेडे नरकभिमां लुंगशे, तेटला माटे तेना पर विश्वास  
शभीश नहीं” १

मनभित्रने अनुकूल थवा प्रार्थना.

चेतोर्थये मयि चिरत्नसख ! प्रसीद,

किं दुर्विकल्पनिकरैः क्षिपसे भवे माम् ।

बद्धोजलिः कुरु कृपां भज सद्विकल्पान्,

मैत्रीं कृतार्थय यतो नरकाद्विभेमि ॥ २ ॥

लांआ वधतना भित्र हे भन ! प्रार्थना करुं छुं तने,  
कृपा करी खराण संकल्प, विकल्प ना आवे भने;  
संसारमां हीर्दाणथी, राख्यो रभडतो मुजने,  
नरकगति भीति विनुं, सहविचार हेवा तुजने. २

“ हे भन ! भाग लांआ वधतना भित्र ! हुं प्रार्थना करुं छुं के  
भाग उपर कृपा कर ! खराण संकल्पो करीने शा माटे भने संसारमां  
नांगे छे ! (तारी पासे) हुं हाथ ज्ञेडीने जिलो २ हुं छुं, भाग पर कृपा  
कर; सागा विचारो कर, अने आपणी लांआ वधतनी होस्ती सहण कर,  
कारणु के हुं नरकथी भीहुं छुं.” २

वसंततिलका.

भन पर अंकुशनो सीधो उपहेश.

स्वर्गापवगों नरकं तथान्तर्मुहूर्तमात्रेण वशावशं यत् ।

ददाति जंतोः सततं प्रयत्नात्, वशं तदंतःकरणं कुरुष्व ॥ ३ ॥

वश अने अवश भन क्षणु, क्षणुवारमां अहलाय छे,

स्वर्गभोक्ष नारकी गति, अनुकूमे एहुथी थाय छे;

भाटे प्रथत्नपूर्वक चेतन, आधीन मन सधाय छे,

त्यारे ज वा संसारना, अवशमणु हुःय टणाय छे. ३

“ वश अने अवश भन क्षणुवारमां स्वर्गभोक्ष अथवा नरक अनुकूमे  
ग्राण्हीने आपे छे भाटे प्रथत्न करीने ते भनने जलदी वश कर.” ३  
उपजाति.

-५६५ छु अ

: ५७ :

संसारभ्रमण्णनो हेतु-भन.

सुखाय दुःखाय च नैव देवा, न चापि कालः सुहृदोऽरयो वा ।  
भवेत्परं मानसमेव जंतोः, संसारचक्रभ्रमणैकहेतुः ॥ ४ ॥

आ श्रवने सुख अगर हुःअ, पशु देवताओ ना करे,  
शत्रु भिन्न सुख हुःअ ना करे, काण नहि तेमां करे;  
मनुष्यने संसारचक्रमां, लभाइनाकुं भन भरे,  
भनमेक्ष णांध करावनाकुं, साधतां तेओ तरे. ४

“देवताओ आ श्रवने सुख के हुःअ आपता नथी, तेमज काण  
पशु नहि, तेमज भिन्नो नहि अने शत्रु पशु नहि, मनुष्यने संसार-  
चक्रमां भभवानो भान एक हेतु भनज छे.” ४      उपज्ञाति.

भनेनिश्चह अने यमनियम.

बशं मनो यस्य समाहितं स्यात्,  
किं तस्य कार्यं नियमैर्यमैश्च ? ।

हतं मनो यस्य च दुर्विकल्पैः,  
किं तस्य कार्यं नियमैर्यमैश्च ? ॥ ५ ॥

समाधिवंतं भन होय वश, तो यमनियम करवाथी शुं ?  
दुर्विकल्पैथी हथायेत, भन पामवाथी लाल शुं ?  
तेवा जनोनां यमनियम, ते पशु कहो शुं कामना ?  
भनेनिश्चह कर्या पछी, इण पामीचे यमनियमना. ५

“ने प्राणीतुं भन समाधिवंतं होधने पोताने वश होय छे तेने  
पछी यमनियमथी शुं ? अने नेतुं भन दुर्विकल्पैथी हथायुं छे तेने  
पशु यमनियमथी शुं !” ५      उपज्ञाति.

भनेनिश्चह विनाना दानादि धर्मेतुं व्यर्थपशुं.  
दानश्रुतध्यानतपोऽर्चनादि, वृथा मनोनिग्रहमंतरेण ।  
कषायचिंताकुलतोजिज्ञतस्य, परो हि योगो मनसो वशत्वम् ॥ ६ ॥

: ४८ :

અધ્યાત્મ-

દાન જ્ઞાન ધ્યાન તપ પૂજા, સત્કર્તાવ્યો ને કરે,  
મનોનિયંહ કર્યા વિનાના, એ નકામા આખરે;  
કૃષાયથી થતી ચિન્તા, આકુળાંયાકુળ રહી તને,  
એવા જનો મન સાધતા, સાધ્યો સકળ મહાયોગને. ૬

“ દાન, જ્ઞાન, ધ્યાન, તપ, પૂજા વિગેરે સર્વે મનોનિયંહ વગર  
નકામાં છે. કૃષાયથી થતી ચિન્તા અને આકુળાંયાકુળતાથા રહિત એવા  
પ્રાણીને મન વશ કરું એ મહાયોગ છે.” ૬ ઉપલતિ.

મન સાંધું તેણું સધળું સાંધું.

જપો ન મુક્તયૈ ન તપો દ્વિભેદં, ન સંયમો નાપિ દમો ન મૌનમ્ય.  
ન સાધનાદ્વારં પવનાદિકસ્ય, કિંત્વેકમંતઃકરણ સુદાન્તમ્ય ॥૭॥

એ પ્રકારે તપ જ્ઞાપ કરવાથી, હુઃખ સંસારના,  
સંયમ દમ મૌનધારણું, પવનાદિકની પણ સાધતા;  
એ મોક્ષકુળ આપે ન પણું, મન અશ્વ કણને આવતા,  
સારી રીતે મન વશ થતા, તત્કાળ શિવસુખ પામતા. ૭

“ જ્ઞાપ કરવાથી મોક્ષ મળતું નથી, તેમ જ નથી મળતું એ પ્રકારનાં  
તપ કરવાથી; તેવા જ રીતે સંયમ, દમ, મૌન ધારણું અથવા પવનાદિકની  
સાધતા વિગેરે પણ મોક્ષ આપી શકતાં નથી; પરંતુ સારી રીતે વશ  
કરેલું એકલું મન જ મોક્ષ આપે છે.” ૭ ઉપલતિ.

મનને વશ થયો તે રખખ્યો.

લભ્યાપિ ધર્મ સકલં જિનોદિતં, સુદુર્લભં પોતનિમં વિહાય ચ ।  
મનઃપિશાચગ્રહિલીકૃતઃ પતન, ભવાંબુધીનાયતિહગ્ જડોજનઃ ॥૮॥

સંસાર-સમુદ્રમાં લટકતાં, મનુષ્ય જન્મ પુષ્યે મળે,  
તીર્થંકરાદિક ધર્મ ભાષિત, જહાજ મળતાં તે પળે;  
મન પિશાચને તાબે થઈ, ને પ્રાણીં તજતા તેહને,  
લાંઘી નજર વિષુ મૂર્ખ, જન સંસાર વાધે એહને. ૮

-૬૫ હુ મ

: ૫૬ :

“સંસાર—સમુદ્રમાં ભટકતાં મહામુશકેલીએ પ્રાત થકે તેવું, વહાણું જેવું, તીર્થાંકરભાવિત ધર્મજલાજ પ્રાપ્ત કર્યા પછી જે પ્રાણી મનપિશાચને તાએ થઈ તે જહાજને તળ હે છે અને સંસાર—સમુદ્રમાં પડે છે તે મૂર્ખ માણસ લાંખી નજર પહોંચાડનાર નથી.” ૮ ઉપજાતિ.

પરવચન અનવાળાને વણું શત્રુથી લય.

સુદુર્જયં હી રિપવત્યદો ભનો, રિપૂકરોત્યેવ ચ વાકૃતનૂ અપિ ।  
ત્રિભિર્હતસ્તદ્રિપુમિઃ કરોતુ કિં, પદીમબ્રન દુર્વિષદાં પદે પદે ॥૧॥

મહામુસીખને જીતાય એ મન, કાર્ય વૈરાનું કરે,  
વચન અને કાયાને પણ, દુઃમન જનાવે આપ્યદે;  
ત્રણું શત્રુથી હણ્યાયલો તું, વિપત્તિનું ભાજન થશે,  
શું આત્મહિત સાધી શકે, જે મનને આધીન હશે? ૯

“મહા મુશકેલીથી જીતી શકાય એવું એ મન શત્રુના જેવું આચરણ  
કરે છે, કારણું કે તે વચન અને કાયાને પણ દુઃમન જનાવે છે. આવા  
ત્રણું શત્રુઓથી હણ્યાયલો તું સ્થાને સ્થાને વિપત્તિઓનું ભાજન થઈને  
શું કરી શકીશ? ” ૧૦ વંશસ્થ

મન તરફ ઉક્તિ.

રે ચિત્ત ! વૈરિ ! તવ કિં નુ મયાપરાદ્ધં,  
યદુર્ગતૌ ક્ષિપસિ માં કુવિકલ્પજાલૈઃ ।  
જાનાસિ મામયમપાસ્ય શિવેઽસ્તિ ગંતા,  
તર્કિં ન સંતિ તવ વાસપદં હ્યસંહ્યાઃ ॥૧૦॥

હે ચિત્તવैરી ! મેં અપરાધ, શું કરેલ છે તાહરો ?  
કુવિકલ્પ જણે ણાંધી કરે, વાસ દુર્ગતિ માહરો;  
તેં ધાર્યું હશે મૂકી મને, એ મોક્ષમાં ચાલ્યો જશે,  
અસંહ્ય સ્થાનકો છો ધીજા, તારું નહિ વિષુસી જશે. ૧૦

: ६० :

अध्यात्म-

“हे चितवैरी ! मैं ते तारो शो अपराध क्यों छे के तुं कुविक्लप नणवडे भने वांधीने हुर्गतिमां इंका हे छे ? शुं तारो भनमां एम आने छे के आ ज्व भने तज्जने भोक्षमां चालयो ज्वानो छे. (अने तेथी भने पकडी राखे छे) ? पण तारे रहेवानां शुं जीझ असंख्य स्थानको नथी ? ” १०

वसंततिलक्ष.

परवश भनवाणानुं अविष्य.

पूतिश्रुतिः श्वेव रतेविदूरे, कुष्टीव संपत्सुदृशामनहः ।  
श्वपाकवत्सद्वितिमंदिरेषु, नार्हेत्प्रवेशं कुमनोहतोंगी ॥ ११ ॥

भराण स्थितिमां जेनुं भन, संताप पमाञ्चा करे,  
ते प्राणी कुभि भरपूर काने, एहवा श्वानो परे;  
रहे भोजभज्जी हूर, लक्ष्मौ सुन्दरी पण नो वरे,  
डोढी जिम अयोग्य, यंडाण जिम शुभ गति नहि आभरे. ११

“जे प्राणीनुं भन भराण स्थितिमां हेवाथी संताप पमाञ्चा करे  
छे ते प्राणी कुभिथी भरपूर धानवाणा झूतरानी पेठे भोजभज्जी अहु  
हूर रहे छे, डोढीआना पेठे लक्ष्मी सुन्दरीने वरवाने अयोग्य थै ज्य छे  
अने यंडाणनी पेठे शुभगति-मंदिरमां प्रवेश करवाने लायक रहेतो  
नथी.” ११

धृदवज्जा.

भनेनिअह वगरना तप ज्य विग्रहे धर्मी.

तपोजपाद्याः स्वफलाय धर्मा,

न दुर्विकल्पैर्हतचेतसः स्युः ।

तत्काव्यपेयैः सुभृतेऽपि गेहे,

क्षुधातृष्णाभ्यां म्रियते स्वदोषात् ॥ १२ ॥

दुर्विकल्पथी हुख्यायलुं भन, जेह प्राणीनुं अहे,  
तप ज्य धर्म पैतपोतानुं, नहि इण देनारा ठरे;

-ક ૬૫ દુઃમ

: ૬૧ :

ખાનપાનથી ભરેલા ધરમાં, નિજ દોષવડે અને,  
ભૂખ તૃપત્યો વેઠી પ્રાણી, અકાળ લેટે મરણુને. ૧૨

“ને પ્રાણીનું ચિન દુર્વિકલ્પોથી હણાગેલું છે તેને તપ, જપ વિગેરે  
ધર્મો પોતપોતાનું” (આત્મિક) ઇણ આપનારા થતા નથી; આવા પ્રકારનો  
પ્રાણી ખાનપાનથી ભરેલા ધરમાં પણ પોતાના દોષથી ભૂખ અને તરસ-  
વડે મરણ પામે છે.” ૧૨  
ઉપજાતિ.

મન સાથે પુણ્ય પાપના સંખ્યા.

અકૃચ્છાસાધ્યં મનસો વશીકૃતાત्,

પરં ચ પુણ્યં ન તુ યસ્ય તદ્વશમ् ।

સ વંચિતઃ પુણ્યચૈસ્તદુદ્ભવૈઃ,

ફલैથી હી ! હી ! હતકઃ કરોતુ કિમ् ? ॥ ૧૩ ॥

ઉત્તમ પ્રકારે પુણ્યવશ, કૃધેલ મનથી થાય છે,  
ભીલકુલ કષ્ટ રહિત ધાર્યાં, કાર્ય સાધી શકાય છે;  
પુણ્યરાશિ તસ ઇળથી પણ, મન આધીન સુંઝાય છે,  
અહો અહો ! આવા હતભાગી, જીવોથી શું થાય છે ? ૧૩

“વશ કરેલા મનથી મહાઉત્તમ પ્રકારનું પુણ્ય ભીલકુલ કષ્ટ વગર  
સાધી શકાય છે. નેને મન વશ નથી તે પ્રાણી પુણ્યની રાશિથી  
છેતરાય છે અને તેથી થનારાં ઇળવડે પણ છેતરાય છે. (એટલે  
પુણ્યઅંધ થતો નથી અને તેથી થનારાં સારાં ઇણ પણ પ્રાપ્ત થતાં નથી.)  
અહો અહો !! આવો આવો હતભાગી જીવ બિચારો શું કરે ? (શું  
કરી શકે ? ) ” ૧૩  
વંશસ્થવૃત્તાં.

વિદ્વાન પણ મનોનિષ્ઠહ વિના નરકગામી થાય છે.

અકારણ યસ્ય ચ દુર્વિકલ્પૈહૃતં મનઃ શાસ્ત્રવિદોऽપि નિત્યમ् ।  
ઘોરૈરઘૈર્નિશ્ચિતનારકાયુર્મૃત્યૌ પ્રયાતા નરકે સ નૂનમ् ॥ ૧૪ ॥

: ३२ :

અધ્યાત્મ-

માણા સંકલપોથી નિરર્થક, પ્રાણી ને મુંજાય છે,  
નિકાચિત આયુ નારકીનું, એ વડેજ ણંધાય છે;  
ગમે તેવો વિદ્ધાન પણ, એ ભયંકર પાપોવડે,  
મરણુસમય જરૂર એ જીવ, નારકી ગતિમાણે પડે. ૧૪

“ને પ્રાણીનું મન નિરર્થક માણા સંકલપોથી નિરંતર પરાલવ  
પામે છે તે પ્રાણી ગમે તેવો વિદ્ધાન હોય તો પણ ભયંકર પાપોવડે  
નારકીનું નિકાચિત આયુષ્ય બાંધે છે અને મરણ પામે છે ત્યારે જરૂર  
નરકમાં જનારો થાય છે.” ૧૪ ઉપનાતિ.

### મનોનિયાત્મકી મોક્ષ

યોગસ્ય હેતુર્મનસઃ સમાધિઃ, પરં નિદાનं તપસશ્ યોગઃ ।  
તપશ્ મૂલं શિવશર્મવળુચા, મનઃસમાધિં ભજ તત્કર્થંચિત् ॥૧૫॥

મનની સમાધિ એકાયતા, એ યોગનું સાધન અને,  
યોગ ઉત્કૃષ્ટ સાધન તપતણું, વિચારતાં આવે મને;  
તપ શિવસુખ વેલડીનું મૂળ, જ્ઞાણી ને આદરે,  
એ સાધવા માટેજ જીવ, મનની સમાધિ તરવરે. ૧૫

“મનની સમાધિ (એકાયતા-રાગદેષરહિતપણું) યોગનું કારણ છે,  
યોગ એ તપનું ઉત્કૃષ્ટ સાધન છે અને તપ શિવસુખઇપ વેલડીનું મૂળ છે,  
તેટલા માટે ડોધ પણ રીતે મનની સમાધિ રાખ ” ૧૫ ઉપનાતિ.

### મનોનિયાત્મકા ચાર ઉપાય.

સ્વાધ્યાયયોગૈશ્વરણક્રિયાસુ, વ્યાપારણૈર્દ્વાદશભાવનામિઃ ।  
સુધીસ્ત્રિયોગીસદસત્પ્રવૃત્તિફલોપયોગૈશ્ મનો નિરુધ્યાત્ ॥૧૬॥

સ્વાધ્યાય યોગવહન ચારિત્ર, ડિયાના વ્યાપારમાં,  
ચાર ભાવના મન શુભ અશુભ, પ્રવૃત્તિના વિચારમાં;  
ચિંતવન થતાં સુરૂ પ્રાણીઓ, મનનિરોધ સદ્ગ કરે,  
મનોનિયાત્ માટેજ ચાર એ, ખાસ ઉપાયો ઠરે. ૧૬

—कृष्ण कुम

: ६३ :

“स्वाध्याय (शास्त्रो अन्यास), योगवर्णन, यानि छियामां व्यापारं, आर भावना अने भनवयनकायाना शुभ अशुभ प्रवृत्तिनां इणनां चिंतवनथी सुर प्राणी भननो निरोध करे.” १६ उपज्ञाति.

भनेनिथहुमां भावनातुं भाष्टात्मेय.

भावनापरिणामेषु, सिंहेष्विव मनोवने ।

सदा जाग्रत्सु दुर्धर्यानसूकरा न विशंत्यपि ॥१७॥

भनइप भडावन गडनभां, ज्यां भावना शुद्धि ठें,  
शुद्ध अध्यवसायइप ज्यां, जगता सिंहो इरे;  
दुर्धर्यानइपी सूखरो, ए वनप्रवेश न करी शक्ते,  
उगो न जरा भनेनिथहु प्राणी, आवती सामी तके. १७

“भनइप वनभां भावना अध्यवसायइप सिंहो सदा जगत होय  
त्यारे-दुर्धर्यानइप सुखरो ते वनभां प्रवेश पछु करी शक्ता नथी.” १७

अनुष्टुप्.

अध्याय नवम संपूर्णम्

अथ दशमो वैराग्योपदेशाधिकारः

मृत्युनो दोर, तेनो ज्य अने ते पर विचार.

किं जीव माद्यसि हसस्ययमीहसेऽर्थान्,

कामांश्च खेलसि तथा कुतुकैरशंकः ।

चिकिष्प्तु घोरनरकावटकोटरे त्वा-

मभ्यापतल्लघु विभावय मृत्युरक्षः ॥ १ ॥

आलंबनं तव ल्वादिकुठारघाताः,

छिंदति जीवितरहं न हि यावदात्मन ! ।

: ६४ :

અધ્યાતમ-

તાવદ્યતસ્વ પરિણામહિતાય તસ્મન्,

છિંગે હિ કઃ ક ચ કથં ભવિતા સ્વતંત્રઃ ? ॥૨॥

હે જીવ ! તું શું જોઈને ગર્વ, કામભોગ ઈચ્છા ધરે ?  
 લક્ષ્મી જોઈ હસતો નિઃશંક, કુતૂહળથી એલો કરે;  
 મૃત્યુ રાક્ષસ તારી સન્મુખ, ઉતાવળેથી આવતો,  
 નરક ખાડે ઝેંકી દેવા, વિપર્યૈત કાર્ય કરાવતો.  
 જીવ આદિ દુઠાર પ્રહારો, છેદવા જીવન-વૃક્ષને,  
 હે આત્મન ! એ જ્યાં સુધી, આવ્યો નથી સન્મુખ તને;  
 જ્યાં સુધી નિજ હિત માટે, યત્ન કર પણું છેદ થયા પછી,  
 પરતંત્ર થઈ કયાં જાઈશ, એહ વિચાર રાખ અગાઉથી. ૧-૨

“અરે જીવ ! તું શું જોઈને અહંકાર કરે છે ? કેમ દસે છે ? પૈસા  
 અને કામભોગાને શા માટે ધર્યે છે ? અને શા ઉપર નિઃશંક થઈને  
 કુતૂહળથી ઘેલ કરે છે ? કારણું કે નરકના ઊંડા ખાડામાં ઝેંકી દેવાની  
 ઈચ્છાથી મૃત્યુરાક્ષસ તારી નજીક ઉતાવળો આવતો જય છે તેનો તું  
 વિચાર કર.” ૧.

“જ્યાં સુધીમાં જીવ વિગેરે દુઢાડાના પ્રહારો તારા આધારઃપ જીવન-  
 વૃક્ષનો છેદ કરે નહીં ત્યાં સુધીમાં હે આત્મન ! પરિણામે હિતને માટે  
 યત્ન કર; તેનો છેદ થયા પછી તું પરતંત્ર થધશ એટલે પછી ડાણ  
 જાણે ડાણ (શુ) થધશ અને કયાં થધશ અને કેવા શીતે થધશ.” ૨  
 વસંતતિલકા.

આત્માની પુસ્થાર્થથી સિદ્ધિ.

ત્વમેવ મોખધા મતિમાન ત્વમાત્મન !,

નેષ્ટાપ્યનેષ્ટા સુખદુઃખયોસ્ત્વમ् ।

દાતા ચ ભોક્તા ચ તયોસ્ત્વમેવ,

તच્ચેષ્ટસે કિ ? ન યથા હિતાસિઃ ॥ ૩ ॥

—૬૫ કુ મ

: ૬૫ :

હે આતમન ! તું સુખને, જાણુકાર તુજ્જને જાણુતા,  
સુખ ઈચ્છા દુઃખ દ્રેષ્ણનો, કરનાર તુજ પિછાણુતા;  
સુખ દુઃખ હેઠાર ભોગવનાર, પણ તુજ જાણુતા,  
તો પછી નિજ હિત સારુ, નથી યતન હિત કેમ આણુતા ? ૩

“હે આતમન ! તું જ સુખને (અસ્તાની) છે અને તું જ જાણુકાર છે.  
સુખની વાંચા કરનાર અને દુઃખનો દ્રેષ્ણ કરનાર પણ તું જ છે. અને  
સુખ દુઃખને હેઠાર અને ભોગવનાર પણ તું જ છે; ત્યારે તને પોતાને  
હિતની ગ્રાપિત થાય તેવો પ્રયાસ શા માટે કરતો નથી ? ” ૩ ઉપજાતિ.

લેઝરંજન અને આત્મરંજન.

કસ્તે નિરંજન ! ચિરં જનરંજનેન,  
ધીમન ! ગુણોઽસ્તિ પરમાર્થદશેતિ પદ્ય |  
તં રંજયાશુચરિતૈવિશદૈર્ભવાબ્ધો,  
યસ્ત્વાં પતંતમબલં પરિપાતુમીષે ॥ ૪ ॥

હે નિર્લેખ ! હે બુદ્ધિમાન ! કયો ગુણ થાશે તુજને ?  
હૌર્ધ સમય જનરંજન સારુ, આપતા પ્રતિષ્ઠાધને;  
વિશુદ્ધ આચરણ પરમાર્થ બુદ્ધિ, ધર્મરંજન ઓધથી,  
તો અળરહિત તુજ આત્મનું, રક્ષણ થશે સંસારથી. ૪

“હે નિર્લેખ ! હે બુદ્ધિમાન ! લાંઘા વખત સુધી જનરંજન કરવાથી  
તને કયો ગુણ થશે તે પરમાર્થદશીથી નો; અને વિશુદ્ધ આચરણું  
તું તો તેનું (ધર્મનું) રંજન કર કે જે બળ વગરના તારા આત્માનું  
સંસારસમુદ્રમાં પડતાં રક્ષણ કરવાને શક્તિમાન હોય.” ૪ વસંતતિલકા.

મદ્યાગ અને શુદ્ધ વાસના.

વિદ્વાનહં સકલલબ્ધિરહં નૃપોઽહં,  
દાતાહમદ્ભુતગુણોઽહમહં ગરીયાન ।

三

અદ્યાત્મ-

इत्याद्यहंकृतिवशात्परितोषमेषि,

नो वेत्सि किं परभवे लघुतां भवित्रीम् ? ॥५॥

હું વિદ્ધાન, હું સર્વ લભિધવાળો, હું દાનેશ્વરી,  
હું ભૂપતિ અહસુત શુણવાળો, વડોલ અહંકારે કરી;  
આવા અહંકારે કરી, સંતોષ દિલમાં આણુતો,  
એ મદ્દ લઘુતા પરભવે, કરનાર તે નથી જણુતો. ૫

“હું વિદ્યાન છું, હું સર્વ લગ્નિધિવાળો છું, હું રાજ છું, હું દાનેશ્વરી છું, હું અદ્ભુત ગુણવાળો છું, હું મેટ્રો છું—આવા આવા અહુંકારને વશ થઈતે તું સંતોષ પામે છે; પણ પરલક્ષમાં થનારી લખૃતા શું તું જાણુતો નથી ? ” ૫ વસંતતિલકા.

તને મળેલી જોગવાઈ.

वेत्सि स्वरूपफलसाधनबाधनानि,

धर्मस्य तं प्रभवसि स्ववश्व कर्तुम् ।

तस्मिन् यतस्व मतिमन्त्रधुनेत्यमुत्र,

किंचित्वया हि नहि सेत्स्यति भोत्स्यते ॥ ६ ॥

તું ધર્મનું સ્વરૂપ કોણ સાધન, અને બાધક પિછાણુંતો,  
ધર્મ કરવાને સમર્થ, સ્વતંત્ર છે રહે જાણુંતો;  
માટે જ હુમણાં યત્ન કર, ભાવી ઉપર નહિ રાખતા,  
તારથી સિદ્ધ થઈ શકે નહિ, પરબરે ન પિછાણુંતા. ૬

“તું ધર્મનું સ્વરૂપ, ફળ, સાધન અને બાધક જાણે છે અને તું સ્વતંત્ર હોઈને ધર્મ કરવાને સમર્થ છે, તે માટે તું હમણાંજ (આ ભવમાંજ) તે કરવા યત્ન કર; કારણું કે આવતા ભવમાં તારાથી આઈ પણ સિદ્ધ થઈ શકશે નહિ અથવા જાણી શકશે નહિ.” ૬ વસ્તંતિલકા.

—क ६५ हु भ

: ६७ :

धर्म करवानी आवश्यकता, तेथी थते। हुःख्षय.  
 धर्मस्याऽवसरोऽस्ति पुद्गलपरावर्तैरनंतैस्तवाऽऽ-  
 यातः संप्रति जीव हे प्रसहतो दुःखान्यनंतान्ययम् ।  
 स्वल्पाहः पुनरेष दुर्लभतमश्चास्मिन् यतस्वार्हतो,  
 धर्म कर्तुमिमं विना हि नहि ते दुःखक्षयः कर्हिचित् ॥७॥  
 हे चेतन ! अहु प्रकार हुःख, सहन करतां थका तने,  
 अनंत पुद्गलपरावर्तने, मनुष्यजन्म पाभी अने;  
 थेडा वधत ए चालशे, इरी पामवो मुश्केल छे,  
 आर्हत धर्म आराधतां, भवभ्रभणु जावुं स्खेल छे. ७

“ हे चेतन ! अहु प्रकारे अनेक हुःखो सहन करतां करतां अनंता  
 पुद्गलपरावर्तने कर्त्ता पालमां तने आ धर्म करवानो अवसर  
 प्राप्त थगो छे; ते पाण थेडा हिस चालशे, अने इरी इरीने तेवो  
 अवसर भणवो महामुश्केल छे; भाटे अर्हत धर्म करवामां उद्यम कर.  
 आ वगर तारां हुःखनो कठी पाण अंत थगो नहि.” ७ शाहौलविक्षिप्ति.

अविकारी थवा यत्न कर.

गुणस्तुतीर्वाञ्छसि निर्गुणोऽपि, सुखप्रतिष्ठादि विनापि गुण्यम् ।  
 अष्टांगयोगं च विनापि सिद्धीर्वातूलता कापि नवा तवात्मन् ॥८॥

विना गुणे गुणुनी प्रशंसा, पामवा भन आवतुं,  
 पुण्य विषु सुख आणरु, सिद्धियोनी वांछा राखतुं;  
 अष्टांगयोग विना न सिद्धि, वांछ ना शानी करे ?  
 विचित्र वायडापाणुं केवुं, आ रीते तारुं ठरे ? ८

“ तारामां गुण नथी तो पाण पुं गुणुनी प्रशंसा थती सांबणवा  
 छूच्छे छे. पुण्य वगर सुख अने आणरु छूच्छे छे. तेमन अष्टांग योग  
 वगर सिद्धियोनी वांछा राखे छे. तारुं वायडापाणुं तो क्राई विचित्र  
 लागे छे ! ” ८

: ६८ :

अध्यात्म-

पुण्यासावे पराभव अने पुण्यसाधनतुं करण्यियपछुः।  
पदे पदे जीव ! पराभिभूतीः, पश्यन् किमीर्ष्यस्यधमः परेभ्यः ।  
अपुण्यमात्मानमैषि किं न, तनोषि किं वा नहि पुण्यमेव? ॥९॥

पराभव थता जन अवरथी, ईर्षी अधमपछे करे,  
निष्पुण्यक निझ आत्मा प्रति, ज्ञाणुतो था अवसरे;  
पुण्य करवा उद्घम करे न, पराभवे मुंजाय छे,  
निभित्तलूत थता भीज, ईर्षी अज्ञाने थाय छे. ६

“ हे श्रव ! पारकांगे करेल चेतानो पराभव ज्ञेधने तुं अधमपछे  
भीजांगो तरइ शा भाटे ईर्षी करे छे ? तारा चेताना आत्माने  
निष्पुण्यक (अपुण्यांगो) केम समज्ञतो नयो ? अथवा पुण्य केम करतो  
नयो ? ” ६ उपनिषत्.

पापथी हुःभ अने तेनुं त्याज्यपछुः.

किर्दयन्निर्दयमंगिनो लघून्, विचेष्टसे कर्मसु ही प्रमादतः ।  
यदेकशोऽप्यन्यकृतार्दनः सहत्यनंतशोऽप्यग्ययमर्दनं भवे ॥१०॥

निर्दयपछे नाना ज्ञवोने, प्रभाद्यथी पीडा करे,  
ओकवार ए रीत पीडता, कर्म धांधी आभरे;  
तेज पिडा अनंतवार, लवांतरे तुं पामतो,  
भाटे ज आवा कर्मथी, सहाय रहे विरामतो. १०

“ तुं प्रभाद्यथी नाना ज्ञवोने पीडा आपवाना कर्ममां निर्दयपछे  
शुं काम प्रवृत्ति करे छे ? प्राणी भीजने जे पीडा ओक वार पछु नीपञ्जवे  
छे तेज पीडा लवांतरमां ते अनंतवार खमे छे.” १० वंशस्थवतः.

प्राणी पीडा-तेनुं निवारणु करवानी जड़र.

यथा सर्पमुखस्थोऽपि, भेको जंतुनि भक्षयेत् ।  
तथा मृत्युमुखस्थोऽपि, किमात्मन्नर्दसेऽगिनः ॥ ११ ॥

-૬૬૫ કુભ

: ૬૬ :

સર્વ મુખે રહ્યો દેડકે, અન્ય જંતુઓ ભક્ષણ કરે,  
નહિ જાણુતો એ કાળના, મુખમાં રહેલો હું ખરે;  
હે આત્મન! એહિજ રીતે, તું ભૃત્યુના મુખમાં રહે,  
તો અન્ય પ્રાણીઓને કરવા, પીડા શાને ચહે? ૧૧

“જેમ સર્વના મુખમાં રહ્યા છતાં પણ દેડકા અન્ય જંતુઓનું  
ભક્ષણ કરે છે તેમ હે આત્મન! તું ભૃત્યુના મુખમાં રહ્યો થડો  
પ્રાણીઓને ડેમ પીડા આપે છો?” ૧૧  
અનુષ્ટુપ્

માની લીધેલું સુખ-તેનું પરિણામ.

આત્માનમલ્પૈરિહ વંચયિત્વા, પ્રકલ્પિતૈર્વા તત્ત્વચિત્તસૌર્ખ્યૈ: ।  
મચાધમે કિં જન! સાગરાણ, સોઢાસિ હી નારકદુઃખરાશીન ॥૧૨॥

હે મનુષ્ય! થોડા અને, માની લીધેલા સુખને,  
એ શરીર મનના સુખને વશ, કાર્ય કરી વિસુખને;  
છેતરી રહ્યો નિજ આત્મને, પરભવે પછીં શું થશે?  
અધોગતિ સાગરાપમ હુઃખ, નારક ગતિમાં પામશે. ૧૨

હે મનુષ્ય! થોડાં અને તે પણ માની લીધેલાં શરીરનાં અને  
મનનાં સુખવડે આ ભવમાં તારા આત્માને છેતરાને અધમ ભવેમાં  
સાગરાપમ સુધીં નારકીનાં હુઃખો સહન કરીશ. ૧૨  
ઉપનિતિ.

પ્રમાદથી હુઃખ-શાસ્ત્રગત દસ્તાંતો.

ઉરભ્રકાકિણુદર્બિદુકાભ્રવણિકૃત્રયોશાકટભિષ્ઠુકાદૈ: ।  
નિર્દ્દશનૈર્હરિતમર્ત્યજન્મા, દુઃખો પ્રમાદર્બહુ શોચિતાસિ ॥૧૩॥

પ્રમાદ કરી હે જીવ! તું, મનુષ્યભવ ડારી જય છે,  
છોડકો કાકિણી જળખિન્હ, ત્રિવણિક આભ્ર જાણુથ છે;

: ७० :

अध्यात्म-

गाङुं हांकनार लिक्षुक, दृष्टांत शास्त्रथी ज्ञानुता,  
ऐ रौत हुःअ अहु परब्रह्मे, छोडो प्रभाद पित्राणुता. १३

“प्रभादे करने हे श्रव ! तुं मनुष्यब्रह्म द्वारी जय छे अने तेथी  
हुःअी थैठने ऐकडो, काळिणी, जगाभिहु, डेरी, त्रण वाणीआ, गाङुं  
हांकनार, भीभारी विग्रेनां दृष्टांतोनी पेठे तुं अहु हुःअ पामीश.” १३  
उपज्ञाति.

प्रत्येक धन्दियथी हुःअ पर स्पष्ट दृष्टांत.

पतंगभृंगैणखगाहिमिनद्विपद्विप्रमुखाः प्रमादिः ।

शोच्या यथा स्युर्भूतिबंधदुःखैश्चिराय भावी त्वमपीति जंतो ! १४।

गज पतंग अलि भाष्टलांओ, हरिण्य हुःअी थाय छे,  
सर्प सिंह पक्षी एक धन्दिय आधीन ज्ञानाय छे;  
एक धन्दिय प्रभादवश ए, मरणुनां हुःअ पामता,  
तो पांचे धन्दियवश हे श्रव ! शोच मनथी वामवा. १४

“पतंगीयुं, अमरो, हरण्य, पक्षी, सर्प, भाष्टलुं, हाथा, सिंह  
वगेरे प्रभादवी एक एक धन्दियना विषयइप प्रभादने वश थैज्ञवाथा  
नेम मरण्य बंधन वगेरे हुःओथा पोडा पामे छे, तेम हे श्रव ! तुं  
पण्य धन्दियोने वश पडीने लांगा वर्खत सुधी शोच पामीश.” १४  
उपज्ञाति.

प्रभादनुं त्याज्यपञ्चः.

पुरापि पापैः पतितोऽसि दुःखराशौ पुनर्मूढ ! करोपि तानि ।  
मज्जन्महापंकिलवारिपूरे, शिला निजे मूर्ध्नि गले च धत्से । १५।

हे भूढ ! पूर्वना पापथी, हुःअना ढगले पड्यो,  
हञ्जु पण्य ते ज पापोवडे, निश्चि हिवस रहे अड्यो;  
महाकाढवे पूर पाणीमां, पडतां पडतां अरे,  
तारा गणे ने भस्तडे, पथथर भोटो धारणु करे. १५

-५६५ कु भ

: ७१ :

“ हे भूढ ! पूर्व पथु पापवडे तुं दुःखना दगमां पञ्चो छे अने  
वणी हज्जु पथु ते ज इरे छे, महाकाश्ववाणा पाणीना पूरमां पडतां  
पडतां खरेखर तुं तो तारे गणे अने भस्तडे मोटो पथ्थर धारणु  
करे छे ! ” १५

उपलिति.

मुखप्राप्ति अने हुःखनाशना उपाय.  
एनः पुनर्जीव ! तवोपदिश्यते,

बिभेषि दुःखात्मुखमीहसे चेत् ।  
कुरुष्व तत्किञ्चन येन वांछितं,

भवेत्तवास्तेऽवसरोऽयमेव यत् ॥ १६ ॥

हे भाई ! अमे तो वारंवार कहीओ तुझने,  
सुखनी इच्छा राखतो तुं, हुःखीँ णीतो होयने;  
वांछित आपे ओहुं, कांधिक कार्य धरे १५  
कारणु के आ प्राप्त थयेल, अवसर ओणभता खरे. १६

“ हे भाई ! अमे तो तने वारंवार कहीओ छीओ के ने तुं  
दुःखी भीतो होय अने सुखनी इच्छा राखतो होय तो तुं कांधिक  
ओहुं कर के जेथो वांछित थध ज्ञय, कारणु के आ तने प्राप्त थयेलो  
अवसर छे. ( आ तारे वर्णत छे. ) ” १६

वंशरथ.

मुखप्राप्तिना उपाय-धर्मसर्वस्व.

धनांगसौख्यस्वजनानमूनपि, त्यज त्यजैकं न च धर्ममार्हतम् ।  
भवन्ति धर्माद्वि भवे भवेऽर्थितान्यमून्यमीभिः पुनरेष दुर्लभः । १७ ।

लक्ष्मीं शरीर सुख सगांसंगंधी, छेवट तलु प्राणुने,  
अर्हत परमात्माए अतावेल, तलुश नहि धर्मने;  
धर्मी अवेक्षवमां, आवा पहार्या तुं पामशो,  
वौतरागभाषित धर्म रहुर्लभ, पामवो ने उवामशो. १७

१ उत्तमां. २ कठिन. ३ छाडी ढेश तो.

: ૭૨ :

અધ્યાત્મ-

“ પૈસો, શરીર, સુખ, સગાસંખ્યાએ અને છેવટ પ્રાણુ પણ તજુ હે, પણ એક વીતરાગ અર્દતપરમાત્માએ જીતાવેલો ધર્મ તજુશ નહિ; ધર્મથી જીવાભવમાં આ પદથોરી (પૈસો, સુખ વિગેર) મળશે, પણ એથી (પૈસા વિગેરથી) તે (ધર્મ) મળવે હુર્દાભ છે.” ૧૭ વંશરસ્થ.

સકામ દુઃખસહન-તેનાથી લાભ.

દુઃખં યથા બહુવિધિં સહસેડ્યકામઃ,

કામં તથા સહસ્રિ ચેત્કરુણાદિમાવૈઃ ।

અલ્પીયસાપિ તવ તેન ભવાંતરે સ્યા-

દાત્યંતિકી સકલદુઃખનિવૃત્તિરેવ ॥ ૧૮ ॥

હુઃઝો બહુ પ્રકારના, ઈચ્છા વિના તું સહન કરે,  
થોડાં દુઃઝો કરેણું બાવથી, વેઠવા ઈચ્છા ધરે;  
ઈચ્છા સહિત દુઃખ વેઠતાં એ, પરબ્રહ્મ સુખ પામશે,  
બાવાંતરે અહનિશ્ચ એ સર્વ, દુઃખથી નિવૃત્ત થશે ૧૮

“ વગર ઈચ્છાએ જેમ તું બહુ પ્રકારનાં દુઃઝો સહન કરે છે  
તેમ જ જો તું કરણાદિક ભાવનાથી ઈચ્છાપૂર્વક થોડાં પણ દુઃઝો સહન  
કરીશ તો ભવાંતરે હુમેશને માટે સર્વ દુઃઝોની નિવૃત્તિ થશેજ.” ૧૮  
વસંતતિવક્તા.

પાપકર્મેભાં ઉહાપણુ ભાનનાર પ્રત્યે.

પ્રગલભસે કર્મસુ પાપકેષ્વરે, યદાશયા શર્મ ન તદ્વિનાનિતમ્ય,  
વિભાવયંસ્તત્વ વિનશ્વર દ્વારા, વિભેષિ કિં દુર્ગતિદુઃખતો નહિ? ૧૯

તું પાપકર્મી મુખ્યાઈથી, તલાલીન થતાં કરે,  
જે સુખની ઈચ્છાવડે, જીવિતન્ય વિષુ શું આખરે?  
શીશ્વ નાશવંત છે જિદ્ધારી, એમ તું સમજેલ છે,  
તો દુર્ગતિના દુઃખથી તું, કેમ નહિ ધીરેલ છે? ૧૯

-੫੬੫ ਦੂਜਾ

: 93 :

“ જે સુખની ઈચ્�ાચી તું પાપકરોમાં મૂર્ખાંધી તલાવીન થાય છે તે સુઝો તો જીવિતબ્ય વગર કાંઈ કામના નથી; અને જિન્દગી તો શાંખ નાશવાંત છે એમ જયારે તું સમજે છે લારે બરે ભાઈ ! તું હુર્ગતિનાં હુઃખ્યો કેમ બીતો નથી ? ” ૧૬ વંશસ્થ.

તારાં કૃત્યો અને ભવિષ્યનો વિચાર.

कर्माणि रे जीव ! करोषि तानि,

यैस्ते भविष्यो विपदो ह्यनंताः ।

ताभ्यो भिया तद्धसेऽधुना किं ?

संभाविताभ्योऽपि भृशाकुलत्वम् ॥ २० ॥

ભવિષ્યમાં અનંત આપત્તિઓ, થાય તે કર્મો કરે,  
હે જીવ ! સંભવિત વિષિત્તિઓથી અત્યારે શીછ ડરે ?  
અત્યંત આકુળંયાકુળ, તું વિષિત્ત પડતાં થાય છે,  
તો ભવિશની અનંત આપત્તિનો, ડર કેમ ન રખાય છે ? ૨૦

“હે જીવ ! તું કર્મા એવાં કરે છે કે જેના વડે તતે ભવિષ્યમાં અન્તં આપત્તિઓ થાય, લારે સંભવિત એવી વિપત્તિઓના લયથી અલ્યારે અત્યંત આદૃગબ્યાદૃગ શા માટે થાય છે ? ” ૨૦ ઈદ્રાજા.

## સહયારીના મૂલ્યથી એવ.

ये पालिता वृद्धिमिताः सहैव, स्निग्धा भृशस्नेहपदं च ये ते ।  
यमेन तानप्यदयं गृहीतान्, ज्ञात्वापि किंन त्वरसे हिताय? ।२१।

પળાયા પોખાયા તારી, સાથે પણુ મોટા થયા,  
અત્યંત સ્નેહી પ્રેમપાત્ર પણુ, યમરાજે ન કરી દ્યા;  
નિર્દ્યપણુ શહેર કરેલા, જોઈ રહેતા તુજથી,  
એમ જોઈ સ્વહિત કરવા, માટે ઉતાવળ કિમ નથી? ૨૧

۸۹:

અધ્યાત્મ-

“જે તારી સાથે પળાયા, પોષાયા અને મોટા પણું સાથે થયા, વળી જેણો અત્યંત રનેહી હતા અને જે તારા પ્રેમપાત્ર હતા તેઓને ધરમરાજે નિર્દ્યાપણે અહણું કર્યા છે એમ જણીને પણ તું સ્વહિત ફરવા માટે કેમ ઉતાવળ કરતો નથી ? ” ૩૧ ઉપલબ્ધિ

ਪੁਤ੍ਰ, ਮੈਡੀ ਕੇ ਸਗਾਂ ਆਤਰ ਪਾਪ ਕੁਰਨਾਰਾਓਨੇ ਉਪਦੇਸ਼.

यैः क्लिश्यसे त्वं धनवंधपत्ययशः प्रभृत्वादिभिरात्रयस्थैः ।

**कियानिह प्रेत्य च तैर्गुणस्ते, साध्यः किमायुश्च विचारयैवम् ।२२।**

કદ્વિપનામાં રહેલાં ધન સગા, યશ પ્રલુદ્વ આદિથી,  
તં કદ્વેશ ગાંઠે તે તે લિખાન હતે હોય એવી?

તુ કલશ પામ છે તા, વિચાર કરતા કુમ નથી ?  
તો આ લવ પરબર ગુણુ, તેથી શું સાધી શકાય છે ?

આયુષ્ય છે હવે કેટલું, એથી અનાણ જણાય છે. ૨૨

“કુલપતનામાં રહેલાં એવાં ધન, સગા, પુત્ર, યથા, પ્રભુત્વ વગેરેથી (વિગેરે માટે) તું કલેશ પામે છે; પણ તું વિચાર કર કે આ અવમાં અને પરબ્રહ્મમાં તેણોથી કેટલો ગુણ સાધી શક્યાય તેમ છે અને તારું આયુષ્ય કેટલું છે ? ” ૨૨ ઉપાય.

परहेशी पंथीनो ऐम : हित विचारणा,

किमु मुहासि गत्वरैः पृथक्, क्रपणीर्वधुवपुः परियहैः ।

विमृशस्व हितोपयोगिनोऽवसरेऽस्मिन् परलोकपांथ ! रे ॥२३॥

હે પરલોક જનાર યંથી ! જુદા જુદા સહુ જાય છે,

તુચ્છ એવા ખંડું અંગ, પૈસાથી મોહ પમાય છે; આપણા લાદુન આપણા ગરાબાં વિના હોય કેની

આવા વખત સારી મુખમા, વૃદ્ધકાર કાળું જણાય છ ?  
તિથાર ૫૩ તિથારો ને રહેતેનું હેઠાં જાપાન ને ?

વિચાર કર ઉપાયા અને, ખરેખરા કાળું ગણ્યાય છે? ૨૩

“હું પરલોક જનારા પંથી ! જુદા જુદા ચાલ્યા જનારા અને  
તુચ્છ એવા બંધુ, શરીર અને પૈસાથી તું શું મોહ પામે છે ? આ  
વખતે તારાં સુખમાં વધારો કરે તેવા ઉપાયો ખરેખરા કયા છે તેજ  
વિચાર.” ૨૩

—ੴ ਦ੍ਰਿਸ਼ ਮ

١٩٤

અર્મજાગૃતિ.

सुखमास्से सुखं शेषे, भुक्षे पिवसि खेलसि ।  
न जाने त्वग्रतः पुण्यविना ते किं भविष्यति ? ॥२४॥

સુધે સુધે, સુધે બેસે, સુધે પીએ, ને ખાય છે,  
સુખ સુધિમાં ખેલી રહેલો, વખત ચાલ્યો જાય છે;  
આગળ પુષ્ટ વિના પઢી, શું હાલ પરલવમાં થશે ?  
જાણતો નથી અજ્ઞાનથી, એ રીત ભવ હારી જશે. ૨૪

“સુઅ એસે છે, સુઅ સુઅ છે; સુઅ ખાય છે, સુઅ પીએ છે અને સુઅ એલે છે; પણ પુરુષ વગર હવે પછી તારા શા હાલ થશે? તે જાણુતો નથી.” ૨૪ અનુભૂતિ.

શોરા કષ્ટથી પીડું છે અને બધું કષ્ટ થાય તેવું કરે છે.

शीतात्तापान्मक्षिकाकत्तुणादि,

स्पर्शाद्युत्थात्कष्टतोऽल्पाहृभेषि ।

तास्ताथैभिः कर्मभिः स्वीकरेषि,

श्वभ्रादीनां वेदना धिग् धियं ते ! ॥२५॥

ટાકે તડકો માખી ડાંસ, કર્કશ તૃણુહિસ્પર્શથી,  
ડરી જય કમિ અદ્વયસમય, ચાલતા એવા કષ્ટથી;  
તારા પોતાના કૃત્યથી, નરક નિગોદના હુઃખને,  
અંગીકાર કર મહાવેદના, રંગ તાર્દી અઝેલને. ? ૨૫

“ ટાં, તડકો, માખીના ડંસ અને કર્કશ તુણુછિના સ્પર્શથી થયેલાં બહુ થોડાં અને થોડા વખત સુધી ચાલે તેવાં કષ્ટથી હું હરી જાય છે અને તારું પોતાના કૃત્યેથી પ્રાપ્ત થનાગે નરક નિગેદની મહાવેદના-ઓનો અંગીકાર કરે છે. રંગ છે તારો અકુલને !! ” ૨૫ શાલિની.

: ۹۶ :

અધ્યાત્મ-

ਉਪਸੰਖਾਰ-ਪਾਪਨੇ। ੩੨.

कचित्किषायैः कचन प्रमादैः,  
कदाग्रहैः क्वाषि च मत्सरायैः ।  
आत्मानमात्मन् ! कलुषीकरोषि,  
विभेषि धिङ् नो नरकादधर्मा ॥२६॥

હે આત્મનું! કોઈ વખત કૃપાય, પ્રમાણ કોઈ વખત કરે,  
કદ્માશ્વર કોઈ વખત કરે, મતસર વિગેરે મન ધરે,  
એ રીતે આત્મ ભલિન કરે, ધિક્કાર છે તુજને,  
તું આવો અધમી રાખતો નહિં, નરકગતિની થીકને. ૨૬

“હે આત્મન! કોઈ વખત કથાય કરીને, કોઈ વખત પ્રમાણ કરીને,  
કોઈ વખત કદમ્બાં કરીને અને કોઈ વખત મત્સ્ય વિગેરે કરીને આત્માને  
મહિન કરે છે. અરે! તને ધિકાર છે! તું આવો અધર્મી કે નરકથી પણ  
ખીટો નથી ? ” ૨૬. ઉપલભિ.

## हसमे अधिकार सभापत.

अथैकादशो धर्मशुद्धयुपदेशाधिकारः

## વર्मशुद्धिनो। ઉપદેશ।

भवेद्भवापायविनाशनाय यः,

तमज्ज ! धर्म कल्पीकरोषि किम् ? ।

र्ने प्रमादमानोपधिमत्सरादिभि-

मिथ्रितं हौषधमामयापहम् ॥१॥

હુ મૂર્ખ ! ધર્મ તારી, સંસાર વિટંઘનાચ્છો હેણે,  
તે ધર્મને પ્રમાણ માયા, ભત્સર વડે ભળિન કરે;

-੫੯੪ ੬੦ ਮ

٩٥

ચોક્કસ સમજશે હિલમાં, ભિન્નિત ઓવધિયો વડે,  
જેમ નાશ થાય ન વ્યાધિનો, તેમ જ ધર્મ ન સાંપડે. ૧

“હે મુખ્ય ! જે ધર્મ તારી સંસાર સંબંધી વિટાંખણનો નાશ કરનાર છે તે જ ધર્મને પ્રમાદ, આન, ભાયા, અત્સર વિગેરે વડે શા માટે મહિન કરે છે ? ( તારા મનમાં ચોક્કસ સમજને કે ) મિશ્રિત અનૈવધ્ય વ્યાધિનો નાશ કરી શકતું નથી.” ૧

શુક્ર પુણ્યજલમાં મળના નામો.

शैथिल्यमात्सर्यकदाग्रहकुधोऽनुतापदंभाविधिगौरवाणि च ।  
प्रमादमानौ कुगुरुः कुसंगतिः, श्लाघार्थिता वा सुकृते मला इमे॥२॥

સુકૃત્યમાં આટલા પદાર્થી, મેલડ્રિપ તે જાણુવા,  
શિથિલતા મત્તુસર કદાચિંહ, કોધ અનુત્તાપ પિછાણુવા;  
હંલ અવિધિ પ્રમાદ ગૌરવ કુસંગત આદિ માન એ,  
કુણુર આત્મપ્રશંસાની ઈચ્છા, મેલ રૂપે જાણ એ. ૨

“ સુકૃત્યમાં આટલા પદાર્થી મેલિઝ્પ છે—શિથિલતા, મત્સર, કદ્દાગ્રા, કોધ, અનુતાપ, હંસ, અવિધિ, ગૌરવ, પ્રમાદ, માન, કુયુરુ, કુસંગ, આત્મપ્રશ્નં સાથેવણુંની છર્છા; આ સર્વે પુષ્પરાશિમાં મેલ ઝ્પ છે.” ૨. ઉપજાતિ.

परगुणप्रशंसा।

यथा तवेष्टा स्वगुणप्रशंसा, तथा परेषामिति मत्सरोजझी ।

तेषामिमां संतनु यद्ग्रभेथास्तां नेष्टदानादि विनेष्टलाभः ॥३॥

પ્રશંસા ઠાકી તુજને, તેમ અવરનેય જણાય છે,  
માટે અવરના ગુણુનો, પ્રશંસા ને હિલમાં રહાય છે;  
મત્તસર તળુ અવર ગુણવાનની, પ્રશંસાઓ ને કરે,  
કારણ કે ઠાકી વસ્તુ, આપ્યા નિષ્ણ ન મળે આપરે. ૩

: ૭૮ :

અધ્યાત્મ-

“ જેવી રીતે તને તારા પોતાના ગુણોની પ્રશંસા વહાલી છે તેવી જ રીતે ભીજાઓને પણ પોતાના ગુણુની પ્રશંસા વહાલી હોય છે; તેથી ભત્સરે તળ દઈને તેઓના ગુણુની પ્રશંસા સારી રીતે ઝરવા માંડ જેથી તને પણ તે મળે (એટલે તારા ગુણોની પણ પ્રશંસા થાય) કાગળું કે વહાલી વરતુ આપ્યા વગર વહાલી વરતુ મળતી નથી.” ૩ ઉપજાતિ.

પોતાની ગુણસ્તુતિ અને દ્વારાનિઃદામાં ભન ન રાખવું.

જનેષુ ગૃહસુ ગુણાન् પ્રમોદસે,  
તતો ભવિત્રી ગુણરિક્તતા તવ ।

ગૃહસુ દોષાન् પરિતપ્યસે ચ ચેદ्,  
ભવન્તુ દોષાસ્ત્વયિ સુસ્થિરાસ્તતઃ ॥૪॥

હર્ષ થાય જ્યારે તારા, ગુણુની સ્તુતિ ધીજા કરે,  
તો જાણું પામેલ શુણુની, શૂન્યતા તેથી ઠરે;  
દ્વાર તમારા બોલતાં કોઈ, એદ દ્વિલમાં આવશે,  
તો દ્વાર નિશ્ચય જાણુંબા, એ તમારામાં દઢ થશે. ૪

“ ભીજ માણુસો તારા ગુણુની સ્તુતિ કરે ત્યારે તું હર્ષ પામીશ તો તારામાં ગુણુની શૂન્યતા થશે, અને લેંડા તારા દ્વારે ગ્રહણ કરે ત્યારે એદ પામીશ તો તે દ્વારે તારામાં નિશ્ચળ-દઢ થશે.” ૪. વંશસ્થ,

શત્રુગુણુપ્રશંસા.

પ્રમોદસે સ્વસ્ય યથાન્યનિર્મિતૈઃ,  
સ્તવૈસ્તથા ચેત્પતિપંથિનામપિ ।

વિગર્હણૈઃ સ્વસ્ય યથોપતપ્યસે,

તથા રિપૂણામપિ ચેત્તતોડસિ વિત ॥૫॥

તુજ શત્રુગુણુની પ્રશંસા, જ્યારે અવસ્થી સાંકણે,  
તારી પ્રશંસા મુજબ તેમાં, હર્ષ આવે તે પણે;

-કે ૯૫ કુ મ

: ૭૬ :

નિન્હા પોતાની સાંભળી, એદ જે રીત થાય છે,  
શત્રુ નિન્હાએ એદ થાતાં, જાણુકાર ગણ્યાય છે. ૫

“ બીજ માણુસોએ કરેલી તારી પ્રશંસા સાંભળાને જેમ તું ઝુશી  
થાય છે તેવી જ શીતે શત્રુની પ્રશંસા સાંભળાને પણ તને પ્રમોદ થાય,  
અને જેવી શીતે તારી પોતાની નિન્હા સાંભળાને એદ પામે છે; તેવી જ  
શીતે શત્રુની નિન્હા સાંભળાને એદ પામે ત્યારે તું ખરેખરો જાણુકાર  
છો એમ સમજવું.” ૫

પરણુણુપ્રશંસા.

સ્તવૈર્યથા સ્વસ્ય વિગર્હણૈશ, પ્રમોદતાપૌ ભજસે તથા ચેત્ ।  
ઝીમો પરેષામપિ તૈશ્રતુર્બ્રષ્યુદાસતાં વાસિ તતોર્થવેદી ॥ ૬ ॥

પોતાની પ્રશંસા નિન્હાથી, હર્ષ એદ જાણ્યાય છે,  
બીજાની પ્રશંસા નિન્હાથી, એ રીતે મન થાય છે;  
અથવા ઉદાસીનવૃત્તિ, એ ચારે ઉપર સેવાય છે,  
તો જાણુવું ખરા અર્થનો, તું જાણુકાર જાણ્યાય છે. ૬

“ જેવી શીતે પોતાની પ્રશંસા અને નિન્હાથી અતુક્ષમે આનંદ અને  
એદ પામે છે તેવી જ શીતે પરતી પ્રશંસા અને નિન્હાથી આનંદ અને  
એદ થતો હોય અથવા તે ચારે ઉપર ઉદાસીનવૃત્તિ રાખતો હોય તો  
તું ખરા અર્થનો જાણુકાર છે.” ૬

ઉપેંદ્રવજ્ઞા.

શુણ સ્તુતિની અપેક્ષા તુકરાનકારક છે.

મવેન્ન કોડપિ સ્તુતિમાત્રતો ગુણી,

રૂધ્યાત્યા ન બહ્વ્યાપિ હિતં પરત્ર ચ ।

તદિચ્છુરીષ્યાદિમિરાયર્તિ તતો,

મુધાભિમાનગ્રહિલો નિહંસિ કિમ્ ? ॥ ૭ ॥

કરતા પ્રશંસા શુણુની, તેથી ન શુણ્ણી થવાય છે,  
ખ્યાતિથી આ ભવે કે પરખવે, નહિ હિત સધાય છે;

: ८० :

અધ્યાત્મ-

નકામો અભિમાન વશ થઈ, ધર્મ વિગેર શીદ કરે?  
આવતો ભવ અગાડવાને, વાત શીદ હિલમાં ધરે? ૭

“લોક વખાણુ કરે તેથો ડોઢ ગુણી થતો નથી, વળી ઘ્યાતિથી  
પણ આવતા ભવમાં ( પરલોકમાં ) હિત થવાનું નથી, તારેને આવતા  
ભવમાં તારું સારું કરવાની ધર્યા છે તો નકામો અભિમાનને વશ થઈને  
ધર્મ વિગેર કરી આવતો ભવ પણ શા માટે અગાડે છે ? ” ૭ ઉપજાતિ.

શુદ્ધ ધર્મ કરવાની જરૂર. કરનારાએની સ્વદ્ધપતા.

સુજન્તિ કે કે ન બહિરૂસ્વા જનાઃ,

પ્રમાદમાત્સર્યકુબોધવિપ્લતાઃ ।

દાનાદિધર્માणિ મલીમસાન્યમૂ-

ન્યુપેક્ષ્ય શુદ્ધ સુકૃતં ચરાણવપિ ॥ ૮ ॥

પ્રમાદ મત્તસર ભિથ્યાત્વવડે, કે જનો ધેરાય છે,  
સાધારણુ એહવા જનોથી, દાન ધર્મ કરાય છે;  
મલિન જાણી એહ ધર્મો, તેઓની ઉપેક્ષા કરે,  
શુદ્ધ સુકૃત જરા એક આણું, ઝાયદો તેથી ઠરે. ૮

“પ્રમાદ, મત્તસર અને ભિથ્યાત્વથી ધેરાયેલા ડેટલાએક સામાન્ય  
માણુસો દાન વિગેર ધર્મો કરે છે, પણ આ ધર્મો મલિન છે; તો  
તેઓની ઉપેક્ષા કરી શુદ્ધ સુકૃત જરા એક એક આણું જેટલુંજ કર.” ૮  
વંશરથવતઃ.

પ્રશાંસા વગરના સુકૃતયનું વિશિષ્ટપણું:

આચ્છાદિતાનિ સુકૃતાનિ યથા દર્ઘંતે,

સૌભાગ્યમત્ત્ર ન તથા પ્રકટીકૃતાનિ ।

વ્રીડાનતાનનસરોજસરોજનેત્રા-

વક્ષઃસ્થલાનિ કલિતાનિ યથા દુકૂલૈઃ ॥ ૯ ॥

—ੴ ਦੇਵ ਕੌਰ

151

ગુણ પુણ્યકર્મ સુકૃત્યો, સૌભાગ્ય આપે કેટલું,  
પ્રસિદ્ધ પુણ્ય સુકૃત્યતું, ઇણ પામતા નહિં તેટલું;  
વખ્યથી આચારિત સ્તરનમંડળ, કર્મજનયના સ્ત્રીતથું,  
નમાવેલ મુખકર્મણ લનજાથી, શોભતા જેથી ધણાં. ૬

સ્વગુજુપ્રશાસાથી લાભ જરા પણ નથી.

स्तुतैः श्रुतैर्वाप्यपरैर्निरीक्षितैर्गुणस्तवात्मन् ! सुकृतैर्न कथन ।  
फलन्ति नैव प्रकटीकृतैर्भुवो, द्रुमा हि मूलैर्निपतंत्यपि त्वधः ॥१०॥

હે ચેતન ! તારા સુકૃત્ય શુણુની, જોઈને સ્તુતિ કરે,  
અગર કરેલ સારા કાર્યની, પ્રશંસા જો આપદે;  
નથી લાભ તેથી કાર્ય તને, વૃક્ષ દંકાયલ કરો,  
એ મૂળ ઉધાડા થતાં, જેવી રીતે ધૂડમાં મળો. ૧૦

તારા ગુણો અથવા સુકૃત્યોની બીજા રહુતિ કરે અથવા સાંભળે અથવા તારાં સારાં કામો બીજા બુઝો, તેથી હે ચેતન ! તને કાંઈ પણ લાભ નથો. જેમ કે આડાં મૂળ ઉધાડાં કરી નાખ્યાં હોય તો તેથી કાડ ફુલતાં નથો, પણ ઉલટાં ઉખડી જઈને ભોંય પર પડે છે તેમજ સારાં કામો પણ ઉધાડાં પડવાથી ભોંયે પડે છે. ૧૦ વંશસ્થવૃત્ત.

ગુણું ઉપર મતસર કરેનાર-તેની ગતિ.

तपःक्रियावश्यकदानपूजनः, शिवं न गंता गुणमत्सरी जनः ।  
अपथ्यभोजी न निरामयो भवेदसायनैरप्यतुल्यर्थदातुरः ॥११॥

: ८२ :

अध्यात्म-

शुणु उपर भत्सर करनार, दान पूजा तपस्या करे,  
आवश्यक डियाथकी पण, नहि भोक्ष लक्ष्मीने वरे;  
मांडा रसायण आय अहु, पण कुपथ्य जे लोक्जन करे,  
साजे न थाये ऐहुथी, दृष्टांत ए नजरे तरे. ११

शुणु उपर भत्सर करनार प्राणी तपश्चर्या, आवश्यक डिया, दान अने  
पूजाथी भोक्षे जरो नथी. जेमके मांडा माणुस जे अपथ्य लोक्जन  
करतो होय तो पछी ते अमे तेटलुँ रसायण आय तो पण ते साजे  
न थाय. ११

वंशस्थवृत्तं.

शुद्ध पुण्य अद्य लोय तो पण सासं.

मंत्रप्रभारत्नरसायनादिनिर्दर्शनादल्पमपीह शुद्धम् ।

दानार्चनावश्यकपौषधादि, महाफलं पुण्यमितोऽन्यथान्यत् ॥१२॥

मंत्र प्रभा रत्नरसायण, दृष्टांतथी ज जण्णाय छे,  
दान पूजा आवश्यक पौषध, धर्म कमती थाय छे;  
अहु थाडा पण शुद्ध थाता, महाकृष्णने आपता,  
विशेष पण अशुद्ध थाता, भोक्षकृष्ण नहि पामता. १२

मंत्र, प्रभा, रत्न, रसायण विग्रेमां दृष्टांतथी (जण्णाय छे के)  
दान, पूजा, आवश्यक, पौषध विग्रे (धर्मडिया) अहु थाडा लोय  
तो पण जे शुद्ध लोय तो ते महाकृष्णने आपे छे, अने अहु लोय छतां  
अशुद्ध लोय तो भोक्षकृष्ण इण आपतां नथी. १२

उपलिति.

उक्त अर्थ दृष्टांतथी ज्ञातावे छे.

दीपो यथालयोऽपि तमांसि हन्ति,

लबोऽपि रोगान् हरते सुधायाः ।

तृण्यां दहत्याशु कणोऽपि चाग्ने-

र्धर्मस्य लेशोऽप्यमलस्तथांहः ॥ १३ ॥

—ક દ્વારા મ

: ૧૩ :

નાનો હીવો એક હોથ પણ, અંધકાર નિવારતો,  
માત્ર એક અમૃત દીપાંથી, મહાન् રોગ હડી જતો;  
ચીણુગારી અભિનતણો, ખડના જથ્થાને બાળતો,  
ધર્મ અંશ નિર્મણ થતાં પણ, મહાન् પાપને ટાળતો. ૧૩

“ એક નાનો હીવો પણ અંધકારને હણી નાખે છે, અમૃતતું એક  
કીપું પણ અનેક રોગોનો નાશ કરે છે અને અમિતી એક ચીણુગારી  
ખડના મોટા દગ્લાને બાળી મૂકે છે; તેવાજ રીતે જે ધર્મનો અંશ  
પણ નિર્મણ હોય તો તે પાપને હણી નાખે છે.” ૧૩ ઉપનાતિ.

ભાવ અને ઉપયોગ વગરની કિયાથી કાયકલેશ-ઉપસંહાર.

ભાવોપયોગશુન્યાઃ, કુર્વન્નાવશ્યકીઃ ક્રિયાઃ સર્વાઃ ।  
દેહક્ષેણ લભસે, ફલમાપ્યસિ નૈવ પુનરાસામ્ર ॥ ૧૪ ॥

ભાવ અને ઉપયોગ વિષુ, આવશ્યક કિયા શુશ્રેષ્ઠા,  
કરતા થકા કાયકલેશ પામે, માત્ર જાણો તેટલી;  
માટે શુદ્ધ ભાવ ઉપયોગથી, વિધિ સહિત કિયા કરે,  
તે અદ્ય પણ થયેલ કિયાઓ, આત્મહિત માટે ઠરે. ૧૪

“ ભાવ અને ઉપયોગ વગર સર્વ આવશ્યક કિયા કરતાં તને માત્ર  
કાયકલેશ (શરીરની મજૂરી) થશે, પણ હું તેઓનું કણ મેળવી શકીય  
નહીં જ.” ૧૪

અગિયારમો અધિકાર સમાપ્ત.

अथ द्वादशः देवगुरुधर्मभृद्धयधिकारः ॥

“ ગુરૂતત્ત્વની ભુખ્યતા ॥”

તત્ત્વેषુ સર્વેષુ ગુરુઃ પ્રધાનं, હિતાર્થધર્મા હિ તદુક્તિસાધ્યાઃ ।  
શ્રયંસ્તમેવેત્યપરીક્ષ્ય મૂઢ !, ધર્મપ્રયાસાન् કુરુષે વૃથૈવ ॥ ૧ ॥

: ८४ :

અધ્યાત્મ-

સર્વ તત્ત્વોમાંદે જાણુવા, મુખ્યશ્રી ગુરુરાય છે,  
આત્મહિત માટે ધર્મકાર્યો, એ વડેજ સધાય છે;  
હે મૂર્ખ ! પરીક્ષા વિષુ ને તું, તેહનો આશ્રય કરે,  
તો તારા ધર્મ સંબંધી, પ્રયાસ સહુ નિષ્ઠળ ઠરે. ૧

સર્વ તત્ત્વોમાં ગુરુ મુખ્ય છે, આત્મહિત માટે જે ધર્મો  
કરવાના છે તે તે તેઓના કહેવાથી સાધી શકાય છે. હે મૂર્ખ ! તેઓની  
પરીક્ષા કર્યા વગર જે તું તેઓનો આશ્રય કરીશ તો તારા ધર્મ  
સંબંધી કરાતા પ્રયાસો ( ધર્મના કામમાં કરવામાં આવતી ભહેનત )  
નકોમા થશે. ૧

ઉપલાટિ.

“ સહૈષુધ ગુરુના જતાવેલા ધર્મ પણ સહૈષુ. ”

ભવી ન ધર્મેરવિધિપ્રયુક્તેર્ગમી શિવ યેષુ ગુરુન શુદ્ધઃ ।  
રોગી હિ કલ્યો ન રસાયનેસ્તર્યેષાં પ્રયોક્તા ભિષગેવ મૂર્ખઃ ॥૨॥

ગુરુ શુદ્ધ નથી જતાવનારા, ધર્મ અવિધિએ થશે,  
અવિધિએ કરેલ ધર્મથી, નહિ મોક્ષ પ્રાણી પામશે;  
મૂર્ખ વૈદ રસાયણ આપતા, વ્યાધિ નહિ એ ટાળશે,  
એ રીત શુદ્ધ ગુરુ જાણુતા, જે ધર્મ શુદ્ધ જતાવશે. ૨

“ જ્યાં ધર્મના જતાવનાર ગુરુ શુદ્ધ નથી ત્યાં અવિધિએ ધર્મો  
કરવાથી પ્રાણી મોક્ષ જઈ શકતો નથી; જે રસાયણ અવરાવનાર વૈદ  
મૂર્ખ હોય તે ખાવાથી વ્યાધિસ્ત પ્રાણી નિરોગી જઈ શકતો નથી.” ૨  
ઉપલાટિ.

“ પાતે દૂષે અને થીજાને દૂષાવે તેવા કુણુરુ ”

સમાધિતસ્તારકબુદ્ધિતો યો, યસ્યાસ્ત્યહો મજ્જયિતા સ એવ ।  
ઓઘં તરીતા વિષમં કથં સ, તથૈવ જંતુઃ કુગુરોર્મબાબ્ધિમૃ ॥૩॥

સમર્થ આ પુરુષ તારવા, એ બુદ્ધિએ આશ્રય કરે,  
એ આશ્રય દૂષાડનારો, થાય ત્યાં પણી શું ઠરે ?

-ક ૬૫ કુભ

: ૮૫ :

આ આકરો પ્રવાહ જગનો, પ્રાણી કર્દી રીતે તરે ?

કુશુરુ નહીં સમરથ તરવા, તેથી અવર શું હિંગરે ? ૩

“આ પુરુષ તારવાને સમર્થ છે, એવી ખુદ્ધિથી જેનો આશ્રય કરવામાં આવે તે આશ્રય કરનારનો જ્યારે આશ્રય આપનાર જ દૂસાવનાર થાય ત્યારે પછી આ આકરો (અથવા ચપળ) પ્રવાહ તે પ્રાણી કેવી રીતે તરી શકશો ? તેવી જ રીતે કુશુરુ આ પ્રાણીને સંસારસમુદ્ધી કેવી રીતે તારશો ?” ૩

ઉપજાતિ.

“શુદ્ધ હેવ, ગુરુ અને ધર્મ લાજવાનો ઉપદેશ.”

ગજાશ્વપોતોક્ષરથાન् યથેષ્ટ-પદાસ્યે ભદ્ર ! નિજાન् પરાન् વા ।

મંજંતિ વિજ્ઞાઃ સુગુણાન् ભજૈવં, શિવાય શુદ્ધાન् ગુરુદેવધર્માન् ॥૪॥

હે ભદ્ર ! ડાઢા પ્રાણીઓ, ધૂચિષ્ઠત સ્થાને પોચવા,  
હાથી ઘોડા વહાણું અળદ રથ, આદિ વાહન જોડવા;  
પોતાના કે પારકા જોઈ, સરસ જેમ રાખતા,  
એ રીત શુદ્ધ હેવ, ગુરુ ધર્મ લાજતા, મોક્ષ ઝૂળને પામતા. ૪

“હે ભદ્ર ! જેવી રીતે ડાઢા પ્રાણીઓ ધૂચિષ્ઠત જગાએ પહેંચવા  
સારુ પોતાનાં અથવા ફારકાં હાથી, ઘોડા, વહાણું, અળદ અને રથો  
સરસ જોઈને રાખ્યો બે છે તેવી જ રીતે મોક્ષ મેળવવા માટે શુદ્ધહેવ,  
ગુરુ તથા ધર્મને ભજ.” ૪

ઉપેંદ્રનજા.

“કુશુરુના ઉપદેશથી કરેલો ધર્મ પણ નિષ્ઠળ છે.”

ફલાદ્વૃથાઃ સ્યુઃ કુગુરુપદેશતઃ, કૃતા હિ ધર્માર્થમપીહ સુદ્યમાઃ ।

તદ્વદ્વિષ્ટરાગં પરિસુચ્ય ભદ્ર ! હે, ગુરુ વિશુદ્ધ ભજ ચેદ્વિતાર્થ્યસિ ।૫।

સંસારમાં કુશુરુ ઉપદેશો, ધર્મકાર્યો જે કરે,  
મોટા પ્રયાસ કરે અલે પણ, કષ્ટ વૃથા તેમાં ઠરે;

૧ હિંગરે-અચ્ચી શકે તે તરે કણાં ?

: ८६ :

અધ્યાત્મ-

હે ભાઈ ! જો તુજ હિતની, ઈચ્છા હૃદયમાણે ધરે,  
દિલ્લિરાગ પડતો મૂક તું, જન શુદ્ધ શરૂ જેથી તરે. ૫

“ સંસારયાત્રામાં કુગુરુના ઉપદેશથી ધર્મને માટે કરેલા મોટા  
પ્રયાસ પણ ઇણની બાબતમાં નોદિયે તો વથા નીવડે છે, તેટલા માટે  
હે ભાઈ ! જો તું હિતની ઈચ્છા રાખતો હોય તો દિલ્લિરાગ પડતો  
મૂકીને અત્યંત શુદ્ધ ગુરુને જન. ” ૫                          વંશરસથવૃત્તાં.

“ વીરને વિનિતિ-શાસનમાં લૂંટારાતું જોર. ”

ન્યસ્તા મુક્તિપથસ્ય વાહકતયા શ્રીવીર ! યે પ્રાક્ ત્વયા,  
લુંટાકાસ્ત્વદ્વતેઽમબન् બહુતરાસ્ત્વચ્છાસને તે કલૌં ।  
વિભ્રાણા યતિનામ તત્ત્વનુધિયાં મુષ્ણંતિ પુણ્યશ્રિયઃ,  
પૂત્રુર્મઃ કિમરાજ્યકે હ્રાષ્પિ તલારક્ષા ન કિં દસ્યવઃ ? ॥૬॥

હે વીર ! ધર્મ સાર્થવાહ, પૂર્વે તમે મૂકૃતા ગયા,  
કળિકાળ તુમ વિરહ શાસને, એડા લૂંટારા થયા;  
ર્થતિ નામધારી ભતિહીણુ પ્રાણીની, પુણ્ય લક્ષમો હરે,  
અરાજ્યમાં પોકાર કયાં ? ચોરી ડોટવાળો કરે ? ૬

“ હે વીર પરમાત્મા ! મોક્ષમાર્ગના વહન કરનારા તરીક (સાર્થવાહ  
તરીક) જેને તે પૂર્વે મુક્યા હતાં, (સ્થાપિત કર્યા હતાં) તેઓ કળિકાળમાં  
તારી જેરહાજરીમાં તારા શાસનમાં મોટા લૂંટારા થઈ પડ્યા છે. તેઓ  
યતિનું નામ ધારણુ કરીને અદ્યપુષ્ટિવાળા પ્રાણીઓની પુણ્યલક્ષમી ચોરી  
લે છે, અમારે તે હવે શું પોકાર કરવો ? ધણી વગરનું રાજ્ય હોય  
ત્યાં ડોટવાળ પણ શું ચોર નથી થતા ? ” ૬                          શાર્દુલવિકોહિત.

૧ મોટા. ૨ પુષ્ટિ વિનાના માણુસ. ૩ રાજ્ય જ્યાં ધણી વગરનું  
હોય ત્યાં અરાજ્ય છે.

-५६५ दु अ

: ८७ :

“ अशुद्ध देवगुरुधर्म-भविष्यमां शाय. ”

मात्रस्यथृद्वयरुद्देवघर्मेद्धिग् दृष्टिरागेण गुणानपेक्षः ।

अमुत्र शोचिष्यसि तत्फले तु, कुपथ्यभोजीव महामयार्तः ॥७॥

अशुद्ध देवगुरुधर्म प्रत्ये, हर्ष तुं द्विलभां धरै,  
दृष्टिरागथी गुणुनी अपेक्षा, वगर तुं जे करै;  
धिङ्कार भाटे तुज्जने, कुपथ्य लोज्जन जेम नडे,  
हेरान थातां शोय ए, परलोक हुर्गिति सांपडे. ७

“ दृष्टिरागथी गुणुनी अपेक्षा वगर तुं अशुद्ध देवगुरुधर्म प्रत्ये  
हर्ष अतावे छे ते भाटे तने धिङ्कार छे ! जेवा रीते कुपथ्य भोज्जन  
करनार महापीडा पाभीने हेरान थाय छे तेवाज्ज रीते आवता भवमां  
तुं ते ( कुदेवगुरुधर्मसेवन )तुं क्षण पाभीने शोय करीश.” ७ उपनिति.

“ अशुद्ध गुरु भोक्ष आपे नहि-दृष्टिंत ”

नाम्रं सुसिक्तोऽपि ददाति निंबकः,

पुष्टा रसैर्वध्यगवी पयो न च ।

दुःस्थो नृपो नैव सुसेवितः श्रियं,

धर्मं शिवं वा कुगुरुने संश्रितः ॥ ८ ॥

केवी न आपे लिंबडे, २सायणु देता गायने,  
२वंध्या ते पय आपे नहि, भराण समये उरायने;  
सेव्याथी लक्खमौ न सांपडे, तेमज्ज कुशुरु आश्रय करे,  
शुद्ध धर्म भोक्ष न आपता, अपावनारानो ठरे. ८

“ सारी रीते साँचेलो १ पणु लींबडे केवी आपतो नथी; (शे२डी,  
धी, तेल, विगेर) २सो भवरावीने पुष्ट करैली वंध्या गाय दूध देती नथी;  
(राज्यअष्टता जेवा) ३सो भराण संज्ञेगोभां आवेला राजनी सारी रीते

१ विचार कर. २ वांछली गाय. ३ राजने.

: ८८ :

अध्यातम-

सेवा करी होय तो पथु ते लक्ष्मी आपी न्याल करते नथी; तेवा ज  
रीते, कुणुरने। आश्रय करवाची ते शुद्ध धर्म अने भोक्ष आपी अपावा  
शक्ता नथी.” ८

धृद्वजा.

“ तात्त्विक हित करनार वस्तु ॥”

कुलं न जातिः पितरौ गणो वा, विद्या च बंधुः स्वगुरुर्धनं वा ।  
हिताय जंतोर्न परं च किंचित्, किंत्वाद्वताः सद्गुरुदेवधर्माः ॥९॥

कुल ज्ञाति माणाप महाजन, विद्या सगासंभैर्धीयो,  
कुणुरु अगर पैसा के, भील कोई जगनी वस्तुयो;  
उरनार नहि कोई हित यो, सर्व जगतना प्राणीने,  
शुद्ध देव गुरु धर्म आराधी, हितकर्ता जाणीने. ९

“ कुल, ज्ञाति, माणाप, महाजन, विद्या, सगासंभैर्धीयो, कुणुरु  
अथवा पैसा के भील कोई पथु वस्तु आ प्राणीना हितने माटे थती  
नथी, परंतु आदरेला (आश्रयन करेला) शुद्ध देव, गुरु अने धर्म ज  
( हित करनारा याय छे.) ” ९

उपजाति.

“ धर्मामां ज्ञेऽ ते ज भरां माणाप ”

माता पिता स्वः सुगुरुश्च तत्त्वात्,  
प्रबोध्य यो योजति शुद्धधर्मे ।  
न तत्समोऽरिः क्षिपते भवाव्यौ,  
यो धर्मविग्नादिकृतेश्च जीवम् ॥ १० ॥

जे छोध आपी धर्मनी, शुद्ध धर्मामां ज्ञेऽ भरे,  
तत्त्वर्थी भरा माणाप, आ संसारमां तेयो। ठडे;  
पोताना भरा हितस्त्वी, अने तेज सुगुरु समजवा,  
सुकृत धर्म अंतरायकूत, वैरी जगमां जाणुवा. १०

—૬૫ કુ અ

: ૮૯ :

“ જે ધર્મના બોધ આપીને શુદ્ધ ધર્મમાં જોડે તે જ તત્ત્વથી ખરે-  
ખરાં માણાપ, તે જ ખરેખરાં પોતાના હિતસ્વી અને તે જ સુગુરુ સમ-  
જવા, જે આ જીવને સુકૃત્ય અથવા ધર્મના વિષયમાં અંતરાય છેને  
સંસારસમુદ્રમાં ફેંકી હે છે. તેના સરખે કોઈ દુઃખમન નથી. ” ૧૦ ઉપલતિ.

“ સંપત્તિનાં કારણો. ”

**દાક્ષિણ્યલજે ગુરુદેવપૂજા, પિત્રાદિમહત્ત્મિઃ સુકૃતામિલાષઃ ।**  
**પરોપકારચ્યવહારશુદ્ધી, વૃણામિહામુત્ર ચ સંપદે સ્યુઃ ॥૧૧॥**

દાક્ષિણ્યતા, લજ્જાળુપણું શુરુ દેવની પૂજા કરે,  
માણાપ કે વડિલો તરફ જે, ભક્તિલાલે આદરે;  
પરોપકાર વ્યવહારશુદ્ધિ, કાર્ય જે સારાં કરે,  
એવા મનુષ્ય આ ભવ પરલાલે, સંપત્તિ સારી વરે. ૧૧

“ દાક્ષિણ્યતા, લજ્જાળુપણું, શુરુ અને દેવની પૂજા, માણાપ વગેરે  
વડોલ તરફ ભક્તિ, સારાં કાર્યો કરવાની અભિલાષા, પરોપકાર અને  
વ્યવહારશુદ્ધિ મનુષ્યને આ ભવમાં અને પરભવમાં સંપત્તિ આપે છે. ” ૧૧  
ઉપલતિ.

“ વિપત્તિનાં કારણો. ”

**જિનેષ્વભક્તિર્ધમિનામવજ્ઞા, કર્મસ્વનૌચિત્યમધર્મસંગઃ ।**  
**પિત્રાદુપેક્ષા પરવંચનશ્ચ, સુજન્તિ પુંસાં વિપદઃ સમંતાત ॥૧૨॥**

અભક્તિ શ્રી જિનેદ્ર પર, અવગણુના સાધુઓની કરે,  
અનુચિત પ્રવૃત્તિ વ્યાપારમાં, અધર્મીની સોણત ઠરે;  
માણાપાદિ સેવાની, ઉપેક્ષા ઠગખાળ આદરે,  
આવા પ્રાણી ચોતરક્ષથી, નિજ આપદાને નોતરે. ૧૨

“ જિનેષ્વ અગવંત તરફ અભક્તિ ( આશાતના ) સાધુઓની  
અવગણુના, વ્યાપારસ્માં અનુચિત પ્રવૃત્તિ, અધર્મીની સંગ, માણાપ,

: ६० :

अर्ध्याम-

वज्रेनी सेवा करवामां उपेक्षा ( ऐदरकारी ) अने परवंचन ( भीजने छनु ते )-आ सर्व प्राणीने भाटे चोतश्चिंथो आपहाणो उत्पन्न करे छे.” १२

“ परब्रह्मां सुख मेणववा भाटे पुण्य धन ”

भक्त्यैव नार्चसि जिनं सुगुरोश्च धर्म,  
नाकर्णयस्यविरतं विरतीर्न धत्से ।  
सार्थं निरर्थमपि च प्रचिनोष्यधानि,  
मूल्येन केन तदमुत्र समीहसे शम् ? ॥१३॥

“ हे भाई ! तुं अक्षित सङ्खित, अरथा प्रभुनी ना करे,  
सेवा सुशुल्कराजनी नित्य, धर्मश्रवण न आहरे;  
अविरतिपाणुं विना प्रयोजने, पापनी पुष्टि करे,  
सुख छांचे परलोकमानुं, शुं किमते भण्डुं ठरे. १३

“ हे भाई ! तुं अक्षिताथी श्री क्लिनेश्वरभगवाननी पूजा करतो नथी;  
तेम ज सारा युरुमहाराजनी सेवा करतो नथी; निःंतर धर्म सांभ-  
गतो नथी, वज्ञा विरति( पापथी पाणा हड्डु-वत पञ्चपञ्चाणु  
करवां ते )ने तो धारणु पाणु करतो नथी; वज्ञा प्रयोजने के विना प्रयो-  
जने पापने पुष्टि आपे छे; त्यारे तुं शुं किमते आवता भवमां सुख  
मेणववानी छन्हिं गाए छे ? ” १३  
वसंततिलक.

“ सुयुक्तं सिंह, कुयुक्तं शिथाण ”

चतुष्पदैः सिंह इव स्वजात्यैर्मिलच्चिमांस्तारयतीह कश्चित् ।

सहैव तैर्मज्जति कोऽपि दुर्गे, शृगालवचेत्यमिलन् वरं सः ॥१४॥

जे रीते तार्या हता, सिंहे स्वज्ञति प्राणीने,  
अे रीत सुयुक्ते तारे, स्वज्ञति भाईओ जाणीने;  
जे भ शिथाण दूधी भूयो, स्वज्ञति प्राणी-साथमां,  
कुयुक्तं भज्या होय तो, अधीगति थाय चढता हाथमां. १४

-કદ્વા મ

: ૬૧ :

“જેવી શીતે પોતાની જાતિના પ્રાણીઓને મળીને સિંહે તાર્યા હતા, તેવી શીતે આધક (સુગુરુ) પોતાના જાતિબાઈ( ભવ્ય પંચાંગ્રિય )ને મળાને આ સંસાર-સમુદ્ધારી તારે છે; અને જેવી શીતે શિયાલ પોતાના જાતિબાઈઓની સાથે ઝૂશી મૂંઝો, તેવી શીતે આધક (કુગુરુ) પોતાની સાથે સર્વને નરકાદિ અનંત સંસારમાં ઝૂશાવે છે; માટે આના શિયાળ જેવા પુરુષ તો ન મળ્યા હોય તો જ સારું.” ૧૪ ઉપેક્ષનજ્ઞા

“ગુરુનો યોગ છતાં પ્રમાદ કરે તે નિભાઈ.”

પૂર્ણે તટાકે તૃષ્ણિતઃ સદૈવ, ભૃતેડપિ ગેહે ક્ષુધિતઃ સ મૂઢઃ ।  
કલપદુમે સત્યપિ હી દરિદ્રો, ગુર્વાદિયોગેડપિ હિ યઃ પ્રમાદી ॥૧૫॥

ઉત્તમ જેગ સુગુરુનો પામી, પ્રમાદ જે પ્રાણી કરે,  
પાણી અરેલ તળાવથી, તરસ્યો રહી પાછો કરે;  
ધનધાન્યથી ભરપૂર ધરમાં, મૂર્ખ તે ભૂખ્યો મરે,  
કદ્વાપુરુષ પાસે હોય તો પણ, દરિદ્રીને શું કરે? ૧૫

“ગુરુમહારાજ વિગેરની બરાબર જેગવાઈ છતાં પણ જે પ્રાણી  
પ્રમાદ કરે તે, તળાવ પાણીથી અરેલું છે છતાં પણ તરસ્યો છે,  
( ધનધાન્યથી ) ધર ભરપૂર છે છતાં પણ તે મૂર્ખ તો ભૂખ્યો છે અને  
પોતાની પાસે કદ્વાપુરુષ છે તો પણ તે તો દરિદ્રી જ છે.” ૧૫ ઉપજનિ..

“દેવ ગુરુ ધર્મ ઉપર અંતરંગ પ્રીતિ વિના જન્મ અસાર છે”  
ન ધર્મચિત્તા ગુરુદેવમહ્ક્કિર્યેષાં ન વૈરાગ્યલવોડપિ ચિત્તે ।  
તેષાં પ્રસૂક્લેશફલઃ પશૂનામિવોદ્ધવઃ સ્યાદુદરંમરીણામ् ॥૧૬॥

ધર્મ સંગંધી ચિન્તા નહિ, દેવગુરુભક્તિ નહિ દિલમાં,  
અંશ માત્ર ચિત્ત વૈરાગ્ય નહિ, પેટભરા તેહ અભિલમાં;  
તેવા પ્રાણીનો જન્મ પણ જેમ, નિર્થક જાય છે,  
એથી કલેશ માત્ર જણુનારી, રજનેતાને થાય છે. ૧૬

૧ જગતમાં. ૨ માતા.

卷之三

અધ્યાત્મ-

“જે પ્રાણીને ધર્મસંબંધી ચિંતા, ગુરુ અને દેવ તરફ ભક્તિ અને વૈરાગ્યનો અંશ માત્ર પણ ચિંતમાં છોય નહિ તેવા પેટકારાયોનો જરૂર પણું નથી એડે જણુનારીને કલેશ આપનારો જ છે.” ૧૬ ઉપનાતિ.

“ હેવસ ધારિ કાર્યોમાં દ્રોયુંયું ”

न देवकायेै न च संघकायेै, येषां धनं नश्वरमाशु तेषाम् ।  
तदर्जनाधैर्वज्ञैर्भवांधौ, पतिष्यतां किं त्ववलंबनं स्यात् ? ॥१७॥

નાશવંત છે એકદમ લક્ષ્મી, પ્રાઈત થાતા તેહને,  
દેવ શુરુ સંઘકાર્યમાં, વપરાય નહિં જો એહને;  
તો પ્રાઈત મેળવવા કરેલા, ભારત્ય એ પાપથી,  
આધાર કેનો તારવા, સંસાર્યદ્વિના તાપથી. ૧૭

“ધન-પૈસા એકદમ નાશવંત છે. આવા પૈસા જેનો પાસે હોય છે તેઓ જો તેને દેવકાર્યમાં અથવા સંભકાર્યમાં વાપરતા નથી તો તેઓને સદરહુ દ્વય મેળવવા માટે કરેલાં પાપોથી સંસારસમુદ્રમાં ફડતાં ફડતાં આધાર ડેને થશે ? ” ૧૭. ઉપલતિ

આંખકાર બાર સમાપ્ત.

अथ त्रयोदशो यतिशिक्षोपदेशाधिकारः

મુનિરાજનું ભાવનામય ૨૩૩૫.

ते तीर्णा भववारिधि मुनिवरास्तेभ्यो नमस्कुर्महे,  
 येषां नो विषयेषु गृध्यति मनो नो वा कषायैः प्लुतम् ।  
 रागद्वेषविमुक्तं प्रशांतकलुषं साम्याप्नशर्माद्वयं,  
 नित्यं खेलति चात्मसंयमगुणाक्रीडे<sup>२</sup> भजद्भावनाः ॥१॥

१ संसारसभूद्. २ उद्याने.

-કે ૬૫ કું મ

: ૬૩ :

ઇન્દ્રિય વિષય આસક્તા નહિ, સુક્ત રાગ દ્વેષથી,  
કર્યાં પાપકાર્યો શાન્ત, અદ્વૈત સમતા સુખથી;  
આત્મ સંયમ ગેલ્લી રહ્યા, એવા ભણાસુનિરાજના,  
તર્યા અને તારી હિયે, તસ ચરણમાંહે વંદના. ૧

“જે ભણાત્માઓનું મન ધીર્યોના વિષયમાં આસક્તા થતું નથી,  
ક્ષાયોથી બાપેત થતું નથી; જે (મન) રાગદ્વેષથી સુક્ત રહે છે, જેણે  
પાપકાર્યેને શાન્ત પમાખાં છે, જેણે સમતાવડે અદ્વૈત સુખ પ્રાપેત  
કર્યું છે અને જે ભાવના ભાવતું ભાવતું આત્મસંયમ ગુણોઽપી ઉદ્વાન-  
માં હમેશાં એદે છે—આવા પ્રકારનું જેમનું મન થયેલું છે તે ભણા-  
સુનીશરો આ સંસારસમુદ્ર તરી ગયા છે અને તેઓને અમે નમસ્કાર  
કરીએ છીએ.” ૧

શાર્દૂલવિકૃહિતમ्

સાધુના વેશ ભાવથી મોક્ષ મળતું નથી.

સ્વાધ્યાયમાધિત્સસિ નો પ્રમાદૈઃ,

શુદ્ધા ન ગુસીઃ સમિતીશ ધત્સે ।

તપો દ્વિધા નાર્જસિ દેહમોહા—

દલ્પેઽપિ હેતૌ દધસે કષાયાન् ॥ ૨ ॥

પરીષહાનો સહસે ન ચોપ—

સર્ગાન્ન શીલાંગધરોઽપિ ચાસિ ।

તન્મોક્ષ્યમાણોઽપિ ભવાબ્ધિપારં,

મુને ! કથં યાસ્યસિ વેષમાત્રાત् ॥ ૩ ॥ યુગમમ् ॥

હે મુનિ ! વિકથા પ્રમાદ કરતા, સ્વાધ્યાય ધૂચ્છા ના કરે,  
વિષયાદિ પ્રમાદથી સમિતિ, શુસ્ત પણ નહિ આદરે;  
અન્ને પ્રકાર તપસ્યા, શરીર ભમત્વથી ના કરે,  
કષાય નળ્યવા કારણે, પરિસહ ઉપસર્ગવડે ઢરે;

: ६४ :

અધ્યાતમ-

અઠાર હજાર શીલાંગ રથ, ધારણ કર્તી ના ઠરે,  
છતાં ચ તું મોક્ષસુખ મળવાની, ઈચ્છા ધારણ કરે;  
પણ હે મુનિ ! વેશમાત્રથી, એ શાશ્વત સુખ ન સાંપડે,  
સંસારદ્વિનિસ્તારમાં, આવા પ્રમાણો સહુ નાં. ૨-૩

“ હે મુનિ ! તું વિકથાદિ પ્રમાણ કરીને સ્વાધ્યાય (સજ્જાય ધ્યાન) કરવા ઈચ્છતો નથી, વિષયાદિ પ્રમાદથી સમિતિ અને શુપ્તિ પામતો નથી, શરીર પર ભમત્વથી બન્ને પ્રકારના તપ કરતો નથી, નજીવા કારણથી કથાય કરે છે, પરીષહ તથા ઉપસર્ગ સહન કરતો નથી. અઠાર હજાર શીલાંગ ધારણ કરતા નથી તે છતાં તું મોક્ષ મળવા ઈચ્છે છે, પણ હે મુનિ ! વેશ માત્રથી સંસારસુદ્રનો પાર ડેવી રીતે પામીશા ? ” ૨-૩

ઉપલાટિ.

વેશમાત્રથી કંધ વળતું નથી.

આજીવિકાર્થમિહ યદ્વતિવેષમેષ,

ધત્તસે ચરિત્રમમલં ન તુ કષ્ટભીરુઃ ।

તદ્વેતિસિ કિં ન ન વિભેતિ જગજ્જિવૃક્ષુ-

મૃત્યુઃ કુતોડપિ નરકશ ન વેષમાત્રાત् ॥ ૪ ॥

ભરણુપોષણુઃ આળુવિકા, નિભિત યતિપણું આદરે,  
પણ કષ્ટથી ડરી જઈ અને, ચારિત્રયાલન ના કરે;  
પણ તમામ જગતને અહણુ, કરવા ઈચ્છતું મૃત્યુ ઈરે,  
નરકાદિ ગતિ ડોધ પણ, પ્રાણી વેશમાત્રથી ના ડરે. ૪

“ તું આળુવિકા માટે જ સંસારમાં યતિનો વેશ ધારણ કરે છે પણ  
કષ્ટથી અહી જઈને શુદ્ધ ચારિત્ર પાળતો નથી. પણ તને ખખર નથી  
કે તમામ જગતસે અહણુ કરવાની ઈચ્છાવાળું મૃત્યુ અને નરક કોધ ડોધ  
પણ પ્રાણીના વેશ ઉપરથી ડરી જતાં નથી.” ૪.      વસંતતિલકા.

-ક ૬૫ કુ મ

: ૬૫ :

કેવળ વેશ ધારણુ કરનારને તો ઉલટો હોષ પ્રાપ્ત થાય છે.

વેષેણ માદ્યસિ યતેશ્વરણ વિનાત્મન !,

પૂજ ચ વાંછસિ જનાદ્વાર્થોપર્દીં ચ ।

મુખ્યપ્રતારણભવે નરકેડસિ ગંતા,

ન્યાય બિમર્દિ તદજાગલકર્તરીયમ્ ॥૫॥

હે આત્મન ! તું વર્તન વિના, યતિવેશથી મઝ્જમ રહે,  
વખ્યપાત્રાદિ મેળવતા, લોકોથી પુણવા ચહે;  
ભોગ વિશ્વાસુ છેતરતા, નરક ગતિને પામશે,  
અન્જલગતકર્તારી ન્યાય જેમ, અનુબન તુજ નિષ્ઠળ થશે. ૫

“હે આત્મન ! તું વર્તન (ચરિત્ર) વગર માત્ર યતિના વેશથી જ  
મઝ્જમ રહે છે (અદ્યાત્ર કરે છે) અને વળી લોકોની પુણતી અપેક્ષા  
રાખે છે અને અનેક પ્રકારે વખ્યપાત્રાદિ ઉપધિ મેળવવાની ધર્યા રાખે  
છે; તેથી ભોગ વિશ્વાસ રાખનારા લોકોને છેતરવાથી પ્રાપ્ત કરેલ નરક-  
માં તું જરૂર જવાતો છે એમ લાગે છે. ખરેખર તું ‘અન્જલગતકર્તા-  
રીન્યાય’ ધારણુ કરે છે.” ૫.

આદ્યવેશ ધરવાનું ઈણ.

જાનેડસ્તિ સંયમતપોમિરમીમિરાત્મ-

અસ્ય પ્રતિગ્રહભરસ્ય ન નિષ્ક્રયોડપિ ।

કિં દુર્ગતૌ નિપતતઃ શરણ તવાસ્તે ?,

સૌરૂધય ચ દાસ્યતિ પરત્ર કિમિત્યવેહિ ॥૬॥

જાણુવા પ્રમાણે હે આત્મન !, આવા સંયમ તપ વડે,  
ગૃહસ્થે દીધેલા પાત્ર ભોજનનું, ન ભાડું સાંપડે;  
લારે પછી હુર્ગતિમાં જતા, શરણુ ડોનું પામશે ?  
વિચાર કર પરલોકમાં, પછી સુખ ડોનાથી થશે ? ૬

: ६६ :

ગ્રંથાત્મ-

“ ભારા જાણવા પ્રમાણે હે આત્મન ! આવા પ્રકારના સંયમ અને તપથી તો (ગૃહરથ પાસેથી લિધેવાં પાત્ર, ભોજન વિગેર) વરુણાનું ભાડું પણ પૂરું થતું નથી. ત્યારે દુર્ગતિમાં પડતાં તને શરણ શું થશે ? અને પરલોકમાં સુખ ડેણું આપશે ? તેનો તું વિચાર કર.” ૬.  
વસંતતિલકા.

વર્તીન વિનાનું લોકરંજન, એધિવૃક્ષને કુહાડા,  
સંસારસમુદ્રમાં પાત.

કિં લોકસત્કૃતિનમસ્કરણાર્ચનાં  
રે મુખ્ય ! તુષ્યસિ વિનાપિ વિશુદ્ધયોગાન्।  
કૃતન ભવાંધુપતને તવ યત્પમાદો,  
બોધિદુમાશ્રયમિમાનિ કરોતિ ર્ઘ્રૂન् ॥૭॥

ત્રિકરણું યોગ વિશુદ્ધ નથીઁ, સત્કાર તો લોકો કરે,  
હે મૂઢ ! નમન સેવાપૂજથી, સંતોષ હિંલમાંહે ધરે;  
આધાર ઝક્કા એધિથાજનો, સંસાર ઉદ્ધરવા તને,  
નમન આદિ સંતોષ, કુહાડાડાંપ કાપવા તે બને. ૭

“ તારા ત્રિકરણું યોગ વિશુદ્ધ નથી છતાં પણ લેડો તારો આદર-  
સત્કાર કરે, તને નમસ્કાર કરે અથવા તારી પૂજાસેવા કરે ત્યારે હે  
મૂઢ ! તું શા માટે સંતોષ માને છે ? સંસારસમુદ્રમાં પડતાં તને  
આધાર ઝક્કા એધિવૃક્ષનો. ૮ છે. તે ઝડને કાપી નાખવામાં નમસ્કારા-  
હિથી થતો સંતોષાદિ પ્રમાદ આ(લોકસત્કાર વિગેર)ને કુહાડા બનાવે  
છે.” ૮.

લોકસત્કારનો હેતુ-શુણું વગરની ગતિ.

ગુણાંસ્તવાશ્રિત્ય નમંત્યમી જના, દદત્યપધ્યાલયમૈક્ષ્યશિષ્યકાન्।  
ચિના ગુણાન વેષમૃષ્ટેર્બિભર્ષિ ચેત, તતૃકાનાં તવ માવની ગતિઃ। ૯।

-કુદ્યુ મ

: ૬૭ :

આ લોક તારા શુણોને, આશ્રયી નમે છે તુજને,  
ઉપધિ ઉપાશ્રય આહાર શિષ્યો આપતા તેઓ અને;  
હવે જે શુણુ વિનાજ, તું ઋષિ વેશને ધરતો હશે,  
તો જાણું તારી ગતિજ, એ ઠગના જેવીજ થશે. ૮

“ આ લોક તારા શુણોને આશ્રયીને તને નમે છે અને ઉપધિ,  
ઉપાશ્રય, આહાર અને શિષ્યો તને આપે છે. હવે જે શુણુ વળર ઇથિ—  
( યતિ )નો વેશ તું ધારણુ કરતો હોધશ તો ઠગના જેવી તારી ગતિ  
થશે. ” ૮. વંશરથવૃત્તમ.

અતિપણાતું સુખ અને કરજ.

નાજીવિકાપ્રણયિનીતનયાદિચિન્તા,

નો રાજમીશ્વ ભગવત્તસમયં ચ વેતિસ ।

શુદ્ધે તથાપિ ચરણે યતસે ન મિક્ષો !,

તત્તે પરિગ્રહભરો નરકાર્થમેવ ॥ ૯ ॥

આજીવિકા સ્વી પુત્ર વિગેરે-ની તને ચિન્તા નથી,  
નથી થીક રાજ્ય તરફની, વાકેદ થધ સિદ્ધાંતથી;  
સિદ્ધાંત પુસ્તકો સાથમાં, ચારિત્ર ધતન કરીશ નહીં,  
તો એ વરતુઓનો પરિથિદ, નરક ગતિ માટે સહી. ૯

“ તારે આજીવિકા, સ્વી, પુત્ર વિગેરેની ચિંતા નથી, રાજ્ય તરફની  
ખીંક નથી, અને ભગવાનનાં સિદ્ધાંતો તું જાણે છે. અથવા સિદ્ધાંતનાં  
પુસ્તકો તારી પાસે છે, છતાં પણ હે યતિ ! જે તું શુદ્ધ ચારિત્ર માટે  
ધતન કરીશ નહીં તો પણ તારી પાસેની વરતુઓનો ભાર( પરિથિદ )  
નરક માટે જ છે. ૯.

જાની પણ પ્રમાણે વશ થાય-તેનાં એ કારણે.

શાસ્ત્રજ્ઞોऽપि ધૃતવ્રતોऽપि ગૃહિણીષુત્રાદિબંધોજ્જીતો-  
ધ્યંગી યદ્વત્તતે પ્રમાદવશગો ન પ્રેત્યસૌર્ઘ્યશ્રિયે ।

: ६८ :

અધ્યાતમ-

તન્મોહદ્વિપતસ્તિલોકજયિનઃ કાચિત્પરા દુષ્ટતા,  
બદ્ધાયુષ્કતયા સ વા નરપશુનૂં ગમી દુર્ગતૌ ॥૧૦॥

નાણનારો શાસ્ત્રનો, ત્રતો અહણુ કરેલા હોય ને,  
અંધનમુક્ત ખી પુત્રથી, છતાં પ્રમાદવશ થઈ અને;  
પારલૌકિક સુખદ્રષ્ટ લક્ષ્મી, માટે યત્ન ને નહિ કરે,  
તો મોહશત્રુથી ડગાળો, અગર દુર્ગતિ બંધન ઠરે. ૧૦

“ શાસ્ત્રનો નાણનારો હોય, નત અહણુ કરેલાં હોય તથા ખી પુત્ર  
વિગેરના બંધનથી મુક્ત હોય, છતાં પ્રમાદને વશ પડીને પારલૌકિક  
સુખદ્રષ્ટ લક્ષ્મી માટે આ પ્રાણી કાંઈ યત્ન કરતો નથી. તેમાં નણ  
લોકને જીતનાર મોઢ નામના શત્રુની કાંઈ અવાચ્ય દુષ્ટતા કારણદ્રષ્ટ  
હોવી જોઈએ અથવા તો તે નરપશુ અગાઉ આયુષ્ય બાંધેલ હોવાને  
લીધે જરૂર દુર્ગતિમાં જનાર હોનો જોઈએ.” ૧૦. શાર્દુલવિકોડિતમ.

યતિ સાવદ્ધ આચયરે તેમાં ભૂષેાઙ્કિતનો પણ હાપ.

ઉચ્ચારયસ્યનુદિનં ન કરોમિ સર્વ,  
સાવદ્ધમિત્યસકૃદેતદથો કરોષિ ।  
નિત્યં મૃષોક્તિજિનવંચનભારિતાત્ત્વ,  
સાવદ્ધતો નરકમેવ વિમાવયે તે ॥ ૧૧ ॥

રાત્રી દિવસ નવ વાર નિત્ય, કરેમિલાંતે ઉચ્ચારતો,  
સાવદ્ધ કામ નહિ કરું, વારંવાર કહી પ્રલુ છેતરતો;  
ઓદું ઓલો એ પાપથો, બારે થયેલા પ્રાણીને,  
હું ધારું થાય નરકગતિ, એ ટેવ તજવી નાણીને. ૧૧

“ તું હમેશાં દિવસ અને રાતમાં થઈ નવ વાર કરેમિલાંતેનો પાઠ  
ભણુતાં એલે છે તે-હું સાવદ્ધ કામ નહિ કરું અને પાછો વારંવાર  
તે જ કર્યા કરે છે. આ સાવદ્ધ કર્મો કરી તું ઓદું ઓલનાર થવાથી

-ક દ્વાપ કુ મ

: ૬૬ :

પ્રભુને પણ છેતરનાર છે. અને તે પાપના ભારથી જારે થયોલા તારે માટે  
તો નરક જ છે એમ હું ધારું છું.” ૧૧. વસંતતિલકા.

યતિ સાવધ આચરે તેમાં પરવચનનો દ્વાપ.

વેષોપદેશાગ્રુપધિપ્રતારિતા, દદત્યભીષાનૃજવોડ્ધુના જનાઃ ।  
બુંખે ચ શોષે ચ સુખં વિચેષુસે, ભવાંતરે જ્ઞાસ્યસિ તત્ફલં પુનઃ ॥૧૨॥

વેશ ઉપદેશ અને કપટથી, છેતરાયોલા જનો,  
અદ્રિક લોકો વાંછિત વસ્તુ આપે, વળી સહુ સાધનો;  
સુષે ખાય, સુષે સુઅ, સુષે ઇરી રહ્યો જગતમાં,  
આવતા લવે ઇણ એહના, જાણીશ રાખો હિવમાં. ૧૨

“ વેશ, ઉપદેશ અને કપટથી છેતરાયોલા અદ્રક લોકો તને હાલ  
વાંછિત વસ્તુઓ આપે છે, હું સુષે ખાય છે, સુષે છે અને ઇરતો ઇરે  
છે, પણ આવતા ભવે તેનાં ઇણ જાણીશ..” ૧૨. ઉપજાતિ.

સંયમમાં યતન ન કરનારને હિતષોધ.

આજીવિકાદિવિવિધાર્ત્ચભૂશાનિશાર્ત્તાઃ,  
કુચ્છેણ કેળપિ મહતૈવ સુજન્તિ ધર્માન् ।  
તેમ્યોડપિ નિર્દય ! જિવૃક્ષસિ સર્વમિષ્ટ,  
નો સંયમે ચ યતસે ભવિતા કથં હી ॥૧૩॥

આજીવિકા ચલાવવા આદ્ધિની અનેક પોડા વડે,  
રાતદિવસ હેરાન થાતા, ગૃહસ્થો મુસીખત પડે;  
ધર્મકાર્યો કરનાર પાસે, યતિ દ્યાહોન થમ અને,  
ઈષ વસ્તુ મેળવતા પણ, સંયમ વિષુ શું સારું ઘને ? ૧૩

“ આજીવિકા ચલાવવા વિગેરે અનેક પ્રકારની પોડાયોથી રાત-  
દિવસ અહુ હેરાન થતા કેટલાક ગૃહસ્થો મહામુશકેલીથી ધર્મકાર્યો કરતાં

: १०० :

અધ્યાત્મ-

હોય છે, તેઓ પાસેથી પણ હે દ્વારીન યતિ ! તું સારી સર્વ ધજ  
વસ્તુઓ મેળવવા ધંચા રાખે છે અને સંયમમાં યતન કરતો નથો;  
લારે તારું શું થશો ? ૧૩

નિર્ણય મુનિની અકિતથી તેને તથા ભક્તોને ક્ષલ થતું નથી.

आराधितो वा गुणवान् स्वयं तरन्,  
भवाब्धिमस्मानपि तारयिष्यति ।

श्रयन्ति ये त्वामिति भूरिभक्तिभिः,

फलं तवैषां च किमस्ति निर्गुण ! || १४ ||

આ ગુણવાન પુરુષ તરે, તેમજ ધીને તારતા,  
એ કારણે અહું અકિલથી, આશ્રય તમારો ધારતા;  
હે નિર્ભય ! તો ચારિત્રવિહોન, લાલ શું તું પામશે ?  
લોળે ભાવે આશ્રય, કરનારા જને ! દુષી જશે. ૧૪

“આ ગુણવાનું પુરુષની આગધના કરી હોય તો તે અવ સમુદ્ર તરે ત્યારે આપણુંને પણ તારશે એવા પ્રકારની બહુ અકિઠાથી ધણાં માણુસો તારો આશ્રય કરે છે, તેથી હે નિર્ણય ! તને અને તેઓને ચું લાભ છે ? ” ૧૪. ઉપજનતિ.

નિર્ગુણ મુનિને ઉલટો પાપથ્વ થાય છે.

स्वयं प्रमादैर्निपतन् भवांबुधौ,  
कथं स्वभक्तानपि तारयिष्यसि ? ।

प्रतारयन् स्वार्थभृजून् शिवार्थिनः;

स्वतोऽन्यतश्चैव विलुप्यसेऽहसा ॥ १५ ॥

તું પોતે તારા પ્રમાણથી, સંસાર પડતો અરે !  
તો પછી લકૃતજ્ઞનો તમારા, આશ્રયે શી રોત તરે ?

-५६५ दु अ

: १०१ :

जियारा भोक्षार्थी सरल ज्ञव, स्वार्थ भाटे छेतरे,  
पेताथी अन्यद्वारा, भरडाय पापेथी भरे. १५

“तुं पोते प्रभाद्वडे संसारसमुद्रमां पडोता जय छे त्यां पोताना  
भक्तोने तुं केवा रीते तारवानो होतो? जियारा भोक्षार्थी सरण ज्ञवोने  
पोताना स्वार्थ भाटे छेतरीने पेताथी अने अन्यद्वारा पापवडे तुं  
भरडाय छे.” १५  
वंशस्थवत्तम्.

निरुणुने थतुं नक्षु तेनुं परिणाम.

गृह्णासि शश्याहृतिपुस्तकोपधीन्, सदा परेभ्यस्तपसस्त्वयं स्थितिः।  
तत्ते प्रमादादूभरितात्प्रतिग्रहैर्कृष्णार्णमग्रस्य परत्र का गतिः? १६।

तुं उपाश्रय, आहार, पुस्तक, उपधि अवरथी भेणवे,  
अे स्थिति तपस्वी लोडेनी, चारित्र तप ने केणवे;  
तुं तो अेह स्वीकार करी, प्रभाद्वश पडी जय छे,  
विचार अे भोटुं हेवुं करता, परब्रह्म गति शुं थाय छे? १६

“तुं खीजओ पासेथी वसति (उपाश्रय), आहार, पुस्तक अने  
उपधि अदण्डु करे छे. अे रिथिति तो तपस्वी लोडेनी (शुद्ध चारित्र-  
वाणीओनी) छे (अट्टले अे लेवानो हो तो भान्त तपस्वी लोडेनो  
छे.) तुं तो तेअनो स्वीकार करीने पाछो प्रभाद्वश पडी जय छे,  
त्यारे भोटा हेवामां इमेला अवा तारी परब्रह्म शी गति थशे?” १६  
उपजाति.

तारा क्या गुणु भाटे तुं अ्यातिनी छच्छा राखे छे?

न कापि सिद्धिर्न च तेऽतिशायि,

मुने! क्रियायोगतपःश्रुतादि ।

तथाप्यहंकारकदर्थितस्त्वं,

ख्यातीच्छया ताम्यसि धिङ्मुधा किम्? ॥१७॥

: १०२ :

अध्यात्म-

हे मुनि ! तारामां नथी डेढ़ि, आस सिद्धि अेहवी,  
जीया प्रकारनी कियायेग, तपस्या नहि तेहवी;  
ज्ञान छतां अहंकार कहर्थना, थाय प्रसिद्धि थवा,  
हे अधम ! अहं कहर्थना, परिताप दिलमां लाववा. १७

“ हे मुनि ! तारामां नथी डेढ़ि आस सिद्धि के नथी जीया  
प्रकारनां किया, योग तपस्या के ज्ञान; छतां पण् अहंकारथी कहर्थना  
पामेलो असिद्धि पामवानी धन्याथी हे अधम ! तुं नकामो परिताप  
शा भाटे करे छे ? ” १७. उपज्ञाति.

**निर्गुण् हेऽय छतां स्तुतिनी धन्या राखे तेनुं झण.**  
हीनोऽप्यरे भाग्यगुणैर्मुद्धात्मन् !, बांछंस्तवाचार्यवान्वानुवंश ।  
ईर्ष्यन् परेभ्यो लभसेऽतिताप-मिहापि याता कुगतिं परत्र ॥१८॥

हे आत्मन् ! तुं निष्पुण्यक छतां, पूजा विजेते धन्यतो,  
नहिं आस थाता भीज घर, द्वेष भनमां धारतो;  
आ भव अणतरा नकामी, ए दीते वेत्तनार छे,  
परभवे पण् आवी धन्याच्यो, कुगति लध जनार छे. १८

“ हे आत्मन् ! तु निष्पुण्यक छे छतां पण् पूजा विजेता धन्या  
राखे छे अने ते भणतां नथी त्यारे भीज उपर द्वेष करे छे. ( पण्  
तेम करवाथी ) आ भवमां अणतरा वहोरी ले छे अने परभवे कुग-  
तिमां जवानो छे. ” १८. उपज्ञाति.

गुण् वगार स्तुतिनी धन्या करनारनुं झण.

**गुणैर्विहीनोऽपि जनानतिस्तुति-**

**प्रतिग्रहान् यन्मुदितः प्रतीच्छसि ।**

**लुलायगोऽश्वोष्ट्रवरादिजन्मभि-**

**र्विना, ततस्ते भविता न निष्क्रयः ॥ १९ ॥**

-६५ हु अ

: १०३ :

तुं शुणु रहित तो पण्, वंदन स्तुति थवा धृच्छा धरे,  
आहार पाणी विगेरे, अहंणु खुशी थधने करे;  
पण् परभवे पाडा, गाय, घोडा, उंट के अपर थशे,  
ओ रीत जन्म थथा वगर, हेवामांथी नहि धृष्टशे. १६

“तुं शुणु विनानो छे छतां पण् लोडा तगड़थी वंदन, स्तुति,  
आहार पाणीनुं अहंणु विगेरे खुशी थधने मेणववा धृच्छा राखे छे,  
पण् याद राखने के पाडा, गाय, घोडा, उंट के गवेडाना जन्म लीधा वगर  
तुं ते हेवामांथी शृटा थध शक्षीय नहीं.” १६. वंशस्थव्रतम्.

शुणु वगरना वंदन पूजन-इण.

गुणेषु नोद्यच्छसि चेन्मुने ! ततः;  
प्रगीयसे यैरपि वंद्यसेऽर्च्यसे ।

जुगुप्सितां प्रेत्यगर्ति गतोऽपि तै-  
र्हसिष्यसे चाभिभविष्यसेऽपि वा ॥ २० ॥

हे मुनि ! जे तुं शुणो, मेणववानी धृच्छा ना करे,  
तो पछी पूजे ने वांडे, शुणुस्तुति जेह आहारे;  
तेओएज परभव तुं कुगति जतां, तने ज हसशे खरे,  
अथवा तारोज परभव, परभव विषे तेओा करे. २०

“हे मुनि ! जे तुं शुणु मेणववा यत्न करतो नथी तो पछी जेओा  
तारी शुणु-स्तुति करे छे, तने वांडे छे अने पूजे छे तेओा ज ज्यारे  
तुं कुगतिमां जर्दिय लारे तने खरेअर छसशे अथवा तारो परभव  
करशे.” २०. वंशस्थव्रतम्.

शुणु वगरनां वंदन पूजन-हितनाश.

दानमाननुतिवंदनापरमोदसे निकृतिरंजितैर्जनैः ।  
न त्वचैषि सुकृतस्य चेलुवः, कोऽपि सोऽपि तव लुक्यते हि तैः ॥ २१ ॥

१. अर=गवेडा.

: १०४ :

अध्यात्म-

तारी कपट जगथी रंजन, थयेला लोडा तने,-  
दान मान आपे नमस्कार, वंदन करे तुजने;  
त्यारे तुं राज थाय छे, पणु जाणुतो नथी एज रे,  
ते तारी पासे एक लेश, सुकृत हुशे तेने हुरे. २१

“तारी कपट-जगथी रंजन पामेला लोडा तने दान आपे, मान  
आपे, नमस्कार करे के वंदन करैत्यारे तुं राज थाय छे, पणु तुं  
जाणुतो नथी के तारी पासे एक लेश सुकृत्य हुशे ते पणु तेअ। लूंगी  
जय छे.” २१.

स्तवननुँ रहस्य-गुणार्जन.

भवेद्गुणी मुग्धकृतैर्न हि स्तवै-  
न् रुयातिदानार्चनवंदनादिभिः ।

विना गुणान्बो भवदुःखसंक्षय-  
स्ततो गुणानर्जय किं स्तवादिभिः ॥ २२ ॥

लोणा ज्वोनी स्तुतिथी, गुणु के प्रभ्याति न पाभतो,  
दान अर्चन पूजन भेणवतां, गुणुवान नथी थतो;  
गुणु वगर आ संसारना, धूटी शडे नहिं हुःभथी,  
माटे हे भाई ! गुणु उपार्जन कर, शुं स्तुतिना लाभथी. २२

लोणा ज्वोने करेली स्तुतिथी केाध माणस गुणुवान थतो नथी,  
तेमज प्रभ्याति पाभवाथी अथवा दान अर्चन अने पूजन भेणवाथी  
पणु केाध गुणुवान थतो नथी. गुणु वगर संसारनां हुःभनो क्षय थतो  
नथी, तेटला माटे हे भाई ! गुणु उपार्जन कर. आ स्तुति विग्रेथी  
शुं लाभ ? ” २२.

अवांतरने। ज्याल-लोडरंजन पर असर.

अच्येषि शास्त्रं सदसद्विचालापादिभिस्ताम्यसि वा समायैः ।  
येषां जनानामिह रंजनाय, भवांतरे ते क मुने ! क च त्वम् । २३।

-ક ૬૫ કુભ

: ૧૦૫ :

મનુષ્ય મનરંજન નિમિત્ત, સારા ખરાખ શાસ્ત્રો ભણે,  
કંઠશોષાધિ કરે ભાયાપૂર્વક, વિચિત્ર ભાષણે;  
શાસ્ત્રો અનેક પ્રકારના, ભણી તું એહ સહન કરે,  
તેઓ અને તું પણી પણું, કહેા કયાં જશો ભવાંતરે ? ૨૩

“ ને મનુષ્યોનું મનરંજન કરવા માટે તું સારાં અને ખરાખ  
અનેક પ્રકારનાં શાસ્ત્રો ભણે છે અને ભાયાપૂર્વક વિચિત્ર પ્રકારનાં  
ભાષણોથી (કંઠશોષાધિ) એહ સહન કરે છે તેઓ ભવાંતરે કયાં જશે  
અને તું કયાં જઈશ ? ” ૨૩. ઉપનાતિ.

### પરિશ્રણત્યાગ

પરિગ્રહ ચેદ્ધયજહા ગૃહાદે—સ્તર્લિં નુ ધર્મોપકૃતિચ્છલાત્તમ્ ।  
કરોષિ શશ્યોપધિપુસ્તકાદે—ગરોડપિ નામાંતરતોડપિ હંતા ॥૨૪॥

ધર આદિ પરિથળે તન્યા, વૈરાગ્ય દિલમાં આવતા,  
ધર્મ ઉપકરણું શશ્યા ઉપધિ, પુસ્તક મેળવે ઝાપતા;  
એ પરિશ્રણના મોહવડે, નામાંતરે પણ જેર છે,  
જેર મારતું નામાંતરે, સંસાર કાળો ડેર છે. ૨૪

“ ધર વિગેરે પરિશ્રણને તેં તજી દીધા છે તો પણી ધર્મના ઉપ-  
કરણું અહાને શશ્યા, ઉપધિ, પુસ્તક વિગેરનો પરિશ્ર શા માટે કરે  
છે ? જેરને નામાંતર કર્યાથી પણ તે મારે છે, ” ૨૪. ઉપેંદ્રવણા.

### ધર્મના નિમિત્તથી રાખેલ પરિશ્ર.

પરિગ્રહાત્સ્વીકૃતધર્મસાધના-

ભિધાનમાત્રાત્કિષ્ણ મૂઢ ! તુષ્યસિ ? ।  
ન વેત્સિ હેમનાષ્યતિ ભારિતા તરી,

નિમજ્જયત્યંગિનમંબુધો દ્રુતમ્ ॥ ૨૫ ॥

: १०६ :

अध्यात्म-

હे भूठ ! धर्मना साधनो, उपकरण आहि नामथी,  
तुं हर्षवेलो थाय छे, साधन मणेव तमामथी;  
जाणे नहि के वडाणुमां, अले १हेम भार वधु भरे,  
कुणाडे ऐसनारने जहाज, रभाराकांत नहि तरे. २४

“ हे भूठ ! धर्मनां साधनने उपकरणाहिं नाम भाव आपाने  
स्वीकारेला परिग्रहये तुं केम हर्ष पामे छे ? शुं जाणुतो नथी के  
वडाणुमां ने सोनानो पणु अति भार अर्थी होय तो ते पणु ऐसनार  
प्राणीने तुरत ज समुद्रमां झुडाडे छे.” २५

वंशस्थव्रतम्

धर्मपकरण पर भूच्छी-अे पणु परिग्रह.

येऽहःकषायकलिकर्मनिबंधभाजनं,

स्युः पुस्तकादिभिरपीहितधर्मसाधनैः ।

तेषां रसायनवैरपि सर्पदामयै-

रात्तीत्मनां गदहृतेः सुखकृतु किं भवेत् ? ॥२६॥

धर्म साधननी वांछा होय, आवा पुस्तकादि वडे,  
पाप कषाय कंकास करता, कर्मना बांधन नडे;  
आ दीते प्राणीने सुखना, साधनो पणु शुं करे ?  
उत्तम रसायणे व्याधि वधे, शांति साधन शुं ठरे ? २६

“ जेना वडेधर्म साधननी वांछा गर्खी होय अनेवा पुस्तकादि  
वडे पणु ने प्राणीच्यो पाप, कषाय, कंकास अने कर्मांध करे त्यारे  
तेच्याने सुखतुं साधन शुं थाय ? ने प्राणीना व्याधिच्यो उत्तम प्रकारनां  
रसायणाची पणु जिलटा वधारे प्रसरता जय तेने व्याधिनी शांति भाटे  
साधन शुं थध शके ? ” २६.

मृहंग.

१. हेम=सेनुं. २. भाराकांत=वधारे भार अरवाची वडाणु तरे नहि.

-५६५ हु अ

: १०७ :

धर्मोपकरणे परं भूच्छी-तेथी हाय.

रक्षार्थं खलु संयमस्य गदिता येऽर्था यतिनां जिनै-  
र्वासः पुस्तकपात्रकप्रभृतयो धर्मोपकृत्यात्मकाः ।

मूर्च्छन्मोहवशात् एव कुथियां संसारपाताय धिक्,  
स्वं स्वस्थैव वधाय शस्त्रमधियां यदुष्प्रयुक्तं भवेत् ॥२७॥

वस्त्रं पुस्तकं पात्रा, धर्मोपकरणे श्रीतीर्थं करे,  
संयमनी रक्षा निभिते, अतावता यतिने अरे;  
ते छतां भूढुषुद्धि मेहुथी, संसारनी वृद्धि करे,  
धिक्कारं जिम भूर्भु अद्युशण, हथीआर वापरता भरे. २७

“ वस्त्रं पुस्तकं अने पात्रा वजेरे धर्मोपकरणुना पदार्थी श्री तीर्थं कर  
बगवाने संयमनी रक्षा भाटे यतिश्चाने अताव्या छे ते छतां भूढुषुद्धि-  
वाणा भूढुल्लवे वधारे मेहुमां पडीने तेने संसारमां पाडवाना साधनभूत  
बनावे छे तेणाने अरेभर धिक्कार छे ! मूर्खं भाषुस वडे अद्युशणताथी  
वपरायलुं शस्त्रं (हथियार) तेना पोताना ज नाशनुं निभित थाय छे.” २७  
शाहूलविकीडितम्.

“ धर्मोपकरणे उपडाववाथी हाय ”

संयमोपकरणच्छलात्परान्भारयन्, यदसि पुस्तकादिभिः ।

गोखरोष्टमहिषादिरूपभृतच्चिरं, त्वमपि भारयिष्यसे ॥२८॥

संयमं उपकरणुना, अहानाथी वधारे राखता,  
पुस्तकं आहि वस्तुओनो, भेजे अति उपडावता;  
गाय, गधेडा, उट, पाडा-इप तुज लेवरावता,  
धण्डा काण पर्यंत तने च्यै ज, भार वडेन करावता. २८

“ संयमं उपकरणुना अहानाथी पुस्तक विगेरे वस्तुओनो भाज  
उपर तुं भार भूडे छे, पण्डे ते गाय, गधेडा, उट, पाडा विगेरेनां इप

: १०८ :

अध्यातम-

तारी पासे लेवरावीने धखुा क्षण पर्यंत तो भार वहन करावशे.” २८  
शेषांक्षता.

“ संयम अने उपकरणानी शोभानी स्पर्शी ”

वस्त्रपात्रतनुपुस्तकादिनः, शोभया न खलु संयमस्य सा ।  
आदिमा च ददते भवं परा, मुक्तिमाश्रय तदिच्छयैकिकाम् ॥२९॥

वस्त्र पात्र शरीर पुस्तक, शोभा वृद्धि ए शुं सरे,  
संयम-शोभा विषु प्रथम, शोभा संसारवृद्धि करे;  
णीज्ञ प्रकारनी संयम, शोभा वडे मुक्ति वरे,  
ए ऐड प्रकारे जाण्ही, यति यत्न संयम आदरे. २८

“ वस्त्र, पात्र, शरीर के पुस्तक विग्रेनी शोभा करवाथी कांध  
संयमनी शोभा थती नथी. प्रथम प्रकारनी शोभा (भव) वृद्धि आपे छे  
अने णीज्ञ प्रकारनी शोभा भेष्ट आपे छे, मारे आ अनेमांथी तारी  
मरण आवे ते एक शोभानो आश्रय कर. अथवा ते मारे वस्त्र पुस्तक  
विग्रे शोभानो लाग करीने हे यति ! भेष्ट भेष्टवानी धृच्छावानो  
पण तुं संयमनी शोभामां डेम यत्न करतो नथी ? ” २८

“ परिषष्ठ सहन-संवर ”

शीतातपाद्यान्न मनागर्णीह, परीषहांश्चेत्क्षमसे विसोहुम् ।  
कथं ततो नारकगर्भवास-दुःखानि सोढासि भवांतरे त्वम् ? ॥३०॥

आ भवमां जरा ठंडी ताप, परिषष्ठा थातां ठरे,  
भवांतरे नरक गतिमां, लांण्हो वर्खत ज्यारे ठरे;  
गर्भावासना पणु भडान्, हुःण्हो जगतमां उतरे,  
ए हुःभ सहन शी रीते थशे, विचारता हिलमां ठरे, ३०

“ आ भवमां जरापणु ठंडी, ताप विग्रे परिषष्ठा सहन करवाने  
शक्तिमान् थतो नथी तो पधी भवांतरमां नारकीनां तेमज गर्भावासनां  
दुःण्हो डेवी रीते सहन करीश ? ” ३०

उपलति.

—ੴ ਦਿਵ ਦੁਆਰਾ

• १०८ •

“ਵਿਨਾਈ ਫੇਹੁ-੯੪ ਤਪ ਕਰਵਾਂ”

मुने ! न किं नश्वरमस्वदेह-मृत्तिष्ठमेन सुतपोवताद्यैः ।  
निपीड्य भीतिर्भवदुःखराशे—हित्वात्मसाच्छैवसुखं करोषि ? ॥३१॥

હે મુનિ ! આ એંગ રૂપ, માર્ટીના પિડ નાશવંતથી,  
પોતાને ન જાણી તપ વ્રતો, આદરે એ હેઠથી;  
તપ વ્રતો ઉત્તમ પ્રકારે, પીડા આપી જો કરે,  
આત્મ સંસુખ ન થાય શાને, અનંત ભવ હુંણો હદે. ૩૧

“હે મુનિ ! આ શરીરડૂપી મારીનો પિંડ નાશવંત છે અને પોતાનો નથી, તેને ઉત્તમ અકારના તપ અને વર્તો કરીને પોડા આપી અનંત ભવમાં પ્રાપેત થનારાં દુઃખો ફૂર કરી નાખીને મોક્ષસુખને આત્મ સન્મુખ ડેમ કર્તો નથી ? ” ૩૧ ઉપજાતિ.

“ याहिनां कष्ट विसर्जनारकी तिथ्याचना कष्ट ”

यदत्र कष्टं चरणस्य पालने, परत्र तिर्यङ्गनरकेषु यत्पुनः ।  
तयोर्मिथः सप्रतिपक्षता स्थिता, विशेषदृष्ट्यान्यतरज्जहीहि तत् ।३२।

ચારિત્ર શુદ્ધ પાલન નિમિત્ત, કષે અદ્વય જે થાય છે,  
પરલબ નારકી તિર્યંચ ગતિ, :હીર્દ્ય સમય હુઃખાય છે;  
પ્રતિપક્ષીપાણું એ બેઉઠું, જગતમાં જોવાય છે,  
સમજણુપૂર્વક તનો એક, કરે। અહણુ જે ક્રણાય છે. ૩૨

“ચારિત્ર પાળવામાં આ લવમાં ને કષ્ટ પડે છે અને પરલવમાં નારકા અને તિથ્યાંગતિમાં ને કષ્ટ પડે છે તે બંનેને અરસપરસ પ્રતિ-પક્ષીપણું છે, માટે સમજણું વાપરિને બેમાંથી એકને તળ હે.” ઉર

वृश्चिकाम्.

१ अंग-शरीर.

: ११० :

અધ્યાત્મ-

“પ્રમાદજન્ય સુખ વિસ્ક્ર સુક્તિનું સુખ”

શમત્ર યદ્વિદુરિવ પ્રમાદજં, પરત્ર યજ્ઞાબિધરિવ ચુમુક્તિજમ્ ।  
તયોર્મિથઃ સપ્રતિપક્ષતા સ્થિતા, વિજોષવૃષ્ટચાન્યતરદ્રહાણ તત્ ॥૩૩॥

પ્રમાદવશો સંસારમાં, બિન્હમાત્ર સુખ જણ્યાય છે,  
૧(૭)દ્વિધિ સમા દેવલોક મોક્ષ, પરભવના સુખ ગણ્યાય છે;  
પ્રતિપક્ષીપણે એ છેઉ, સંસારમાં તેઓ ઠરે,  
માટે વિવેક તળ એકને, એક હેતુ આદરે. ૩૩

“આ ભવમાં પ્રમાદથી જે સુખ થાય છે તે શિંદુ જેટલું છે અને  
પરભવમાં દેવલોક અને મોક્ષસંભંધી જે સુખ થાય છે તે સમુદ્ર જેટલું  
છે; આ બન્ને સુખને પરસ્પર પ્રતિપક્ષીપણું છે, માટે વિવેક વાપરને  
એમાંથી એકને તું અહીંથી કર.” ૩૩  
વંશસ્થવૃત્તતમ.

“ચારિત્ર નિયંત્રણાનું દુઃખ વિસ્ક્ર ગલાર્વાસ વિગેરેનું દુઃખ”  
નિયંત્રણા યા ચરણેત્ત્ર તર્યકુ-સ્વીગર્ભકુંભીનરકેષુ યા ચ ।  
તયોર્મિથઃ સપ્રતિપક્ષભાવા-દ્વિજોષવૃષ્ટચાન્યતરાં ગૃહાણ ॥૩૪॥

રનિયંત્રણા આ ભવ વિષે, ચારિત્રના પાલન વડે,  
નારકી ગતિ સ્વી ગર્ભમાં, એ રીત નિયંત્રણા નડે;  
પરસ્પર વિરોધે બેઉ જે, સંસારમાં એમ સાંપડે,  
એમાંથી અહીંએ એક જે, લાભદ્વારક નિવડે. ૩૪

“ચારિત્ર પાળવામાં આ ભવમાં તારા પર. \*નિયંત્રણા થાય છે,  
અને પરભવે તિર્યાંચગતિમાં, સ્વીના ગર્ભમાં અથવા નારકીના કુંભી-

૧ ઉદ્ધિ-સમુદ્ર. ૨ નિયંત્રણા-કષ્ટ.

\* પ્રત વિગેરે લીધે સહન કરવું પડતું કષ્ટ તથા તીર્થાંકરમહારાજ  
અને ગુરુમહારાજની આચાનું પરાધીનપણું.

-५६५ हु अ

: १११ :

पाकमां नियंत्रणा (कष्टपराधीनपण) थाय छे. आ वन्ने नियंत्रणाने परव्यपर विरोध छे, माटे विवेक वापरीने ऐमांथी एक अल्लु कर.” ३४ उपज्ञाति.

“ परिषिख सहन करवाने। उपदेश, (स्ववशतामां सुभ ”)

सह तपोयमसंयमयंत्रणां, स्ववशतासहने हि गुणो महान् ।

परवशस्त्वति भूरि सहिष्यसे, न च गुणं बहुमाप्स्यसि कंचन । ३५।

तप यम संयम नियंत्रणा, सावधान थृष्ठ आढैरे,  
सहन कर पौताने वश रही, गुण भोटो ते करे;  
परवश थृष्ठ अहु हुःभ लोगवे, अद्यप इण तेनुं ठरे,  
माटे परिसङ्गे हुःभ सङ्गेता, आत्महित वाधे भरे. ३५

“ तुं तप, यम अने संयमनी नियंत्रणा सहन कर. पौताने वश रहीने (परिषिखाद्विनुं हुःभ) सहन करवामां भोटो गुण छे. परवश पडीश त्यारे तो हुःभ अहु अमवुं पडें अने तेनुं इण कांध पण थशे नहीं.” ३५

“ परिषिख सहन करवामां शुभ इण ”

अणीयसा साम्यनियंत्रणाभुवा,

मुनेऽत्र कष्टेन चरित्रजेन च ।

यदि क्षयो दुर्गतिगर्भवासगा-

सुखावलेस्तत्किमवापि नार्थितम् ॥ ३६ ॥

समता नियंत्रणात्थां, चारित्र कष्ट थेडावडे,  
दुर्गति गरभावासना, परभवे नहि हुःभे नडे;  
तो पठी शुभ ईच्छित वक्तु, ओहथी शुं पाम्हो नहीं,  
हुःभपरंपरा क्षय करे, ते आढैरे आवे रही. ३६

“ समताथी अने नियंत्रणा(परिषिख सहन)थी थयेला थेडा ७  
कष्टवडे तेम ७ चारित्र पाणवाने लीधे थयेला थेडा कष्टवडे जे दुर्गतिमां

: ११२ :

अध्यात्म-

ज्वानी अने गर्भवासमां रहेवानी हुः अपरं परातो क्षय थँ जतो होय  
तो पछी शुं धन्ति तुं पाम्हो नहि ? ” ३६ वंशस्थवृत्तम्.

“ परिषिष्ठी हूर आगवानां भाटां इण ”

त्यज स्पृहां स्वःशिवशर्मलाभे, स्वीकृत्य तिर्थडूनरकादिदुःखम् ।  
सुखाणुभिशेद्विषयादिजातैः, संतोष्यसे संयमकष्टभीरुः ॥३७॥

संयम पाणवाना कष्टथी, शिथिल झीतो भने,  
विषयकषायना अद्य सुखमां, संतोष थातो तने;  
तो नरक तिर्थं चगतिना, आगामी हुः अ स्वीकारवा,  
स्वर्गं अने भोक्षणतिना थतां, महान् सुखो त्यागवा. ३७

“ संयम पाणवानां कष्टथी झी जधने विषय क्षायथी थतां अद्य  
सुखमां जे तुं संतोष पामतो होय तो पछी तिर्थं च नारकानां  
आगामी हुः ऐ स्वीकारने स्वर्गं तेमज भोक्ष भेणवानी धन्ति तल  
हे. ” ३७. उपलति.

“ परिषिष्ठ सहन करवाभां विशेष शुभ इण ”

समग्रचिंताच्चिह्नतेरिहापि, यस्मिन्सुखं स्यात्परमं रतानाम् ।  
परत्र चेन्द्रादिमहोदयश्रीः, प्रमाद्यसीहापि कथं चरित्रे ! ॥३८॥

चारित्रिथी आ ज्वे सर्व, प्रकारनी चिन्ता टणे,  
थर्छ भननी आधि नाश, लय लागतां सुख भोटा भणे;  
परभवमां ईन्द्रासन के, महाभोक्षनी लक्ष्मी रणे,  
सुख एवा पामवा चारित्र, प्रभाद टणे भन-भणे. ३८

“ चारित्रिथो आ भवमां सर्वप्रकारनी चिंता अने भननी आधिनो  
नाश थाय छे तेथी तेमां ज्ञेने लय लागी होय तेजोने भोडुं सुख  
थाय छे अने परभवमां ईन्द्रासन के भोक्षनी महालक्ष्मी भणे छे. आ  
प्रभाणे छे छतां पञ्च आ चारित्रिभां शा भाटे प्रभाद करे छे ? ” ३८.  
उपलति.

-੫੬੫ ਨੂ ਮ

: 113 :

**“ સુખસાધ્ય વર્મ કર્તૌણ્ય-પ્રકારાંતર ”**

महातपोध्यानपरीषहादि, न सत्त्वसाध्यं यदि धर्तुमीशः ।  
तद्भावनाःकिं समितीश्च गुमी-धृत्से शिवार्थिन्!न मनःप्रसाध्याः॥३९॥

ਉਥੇ ਤਪਦਿਆ ਧਾਰਾਨ ਪਰਿਸ਼ਹ, ਸੱਤਵਥੀ ਸਾਧੀ ਸ਼ਕੇ,  
ਤੇ ਸਾਧਵਾਨੇ ਕਹਾਪਿ ਤੁਂ ਸ਼ਕਿਤਹੌਨ ਥਧੇ ਥਕੇ;  
ਤੋ ਭਾਵਨਾ ਸਮਿਤਿ ਗੁਸ਼ਿ, ਮਨਥੀ ਜ ਸਾਧੀ ਸ਼ਕਾਵ ਛੇ,  
ਛੇ ਮੋਕਾਥੀ ! ਏ ਸਾਧਨਥੀ, ਕੇਮ ਕਾਚਰ ਥਾਵ ਛੇ ? ੩੬

“ ઉચ્ચ તપદ્યા, ધ્યાન, પીરખ વિગેરે સત્તવથી સાધી શક્ય તેવા છે તે સાધવાને તું શક્તિવાન ન હો તો પણ ભાવના સમિતિ અને ગુપ્તિ જે મનથી જ સાધી શક્ય તેમ છે તેને હે મોક્ષાર્થી ! તું કેમ ધારણ કરતો નથી ? ” ૩૬. ઉપજાતિ.

“ ભાવના—સંયમરથાન—તેને આપ્યાશ્રય ”

अनिल्यताद्या भज भावनाः सदा,

यतस्व दुःसाध्यगुणेऽपि संयमे ।

जिघत्सया ते त्वरते हृयं यमः,

श्रयन् प्रमादान्न भवाहिभेषि किम् ? ॥४०॥

અનિત્ય વિગેરે ભાવનાએ, નિત્ય મનથી ભાવતા,  
જે સંયમના મૂળ ઉત્તર ગુણુ, કઠિન લાગે સાધતા;  
પણ તુરત યાન કર તેહમાં, કાળ અક્ષી જવા ફેરે,  
સંસારભ્રમણ ડરતો નથી, પ્રમાદ તેમાં શું કરે ? ૪૦

“ અનિત્યપણું વિગેરે સર્વાલાવનાચો નિરંતર ભાવ, જે સંયમના (મૂળ તથા ઉત્તર) ગુણો મુશ્કેલીથી સાધી શક્ષાય છે તેમાં યત્ન કર. આ યમ(કાળ) તને ખાઈ જવા માટે ઉત્તાપણ કરે છે ત્યારે પ્રમાદનો આશ્રય ફરતી વખતે તું શું સંસારભ્રમણુંથી ભીતો નથો?” ૪૦ વંશરસ્થકૃતમ.

: ११४ :

અધ્યાત્મ-

“ થોગડુંબનની આવશ્યકતા ”

હતું મનસ્તે કુવિકલ્પજાલૈ-

વંચોડ્યવદૈશ્ર વણુઃ પ્રમાદૈઃ ।

લબ્ધીશ્ર સિદ્ધીશ્ર તથાપિ વાંછન्,

મનોરથૈરેવ હહા !! હતોડસિ ॥ ૪૧ ॥

તારું હણુચેલું મન, સંકલ્પવિકલ્પ કર્યા કરે,  
તારા વચન અસત્ય કઠોર, ભાષણું ખરડાયા ખરે;  
અગડેલ શરીર પ્રમાદ, લખિધ સિદ્ધિની વાંછા અરે,  
એ રીત મિથ્યા મનોરથે, હણુયદેલ જગમાં ઝરે. ૪૧

“ તારું મન ખરાય સંકલ્પવિકલ્પથી હણુયલું છે, તારાં વચન  
અસત્ય અને કઠોરભાષણુંથી ખરડાયાં છે અને તારું શરીર પ્રમાદથી  
અગડું છે, છતાં પણ તું લખિધ અને સિદ્ધિની વાંછા કરે છે. ખરેખર !  
તું (મિથ્યા) મનોરથથી હણુયો છે.” ૪૧      ઉપનાતિ.

“ મનોયોગ પર અંકુરા—મનાયુભિત ”

મનોવશસ્તે સુખદુઃखસંગમો, મનો મિલેદૈસ્તુ તદાત્મકં ભવેત ।  
પ્રમાદચોરૈરિતિ વાર્યતાં મિલ-ચીલાંગમિત્રૈરનુષ્ઞયાનિશમ્ ॥૪૨॥

સુખ હુઃખની પ્રાપ્તિ થવી એ, સહુ મનને આધોન છે,  
મન મળે એકાકાર જાણુલું, જળ પ્રવાહે મૌન છે;  
માટે પ્રમાદિપ શાર્થી, મનને વારી રાખજે,  
શીલાંગિપ મિત્રો સાથે, નિલ્ય જેડી નાંખજે. ૪૨

“ તને સુખ હુઃખની પ્રાપ્તિ થવી એ તારા મનને વશ છે. મન  
નેની સાથે મળે છે તેની સાથે એકાકાર-એકમેક થઈ જાય છે. તેથી

૧ જળ ને ભાણલાની કેવી પ્રીતિ.

-५६५ द्वु भ

: ११५ :

प्रभाद्वय चोरने भणतां तारा भनते रोकी राख-अटधाय अने शीलांग-  
इप मिनोनी साथे तेने निरंतर जेझा कर.” ४२ वंशस्थ.

“ भत्सर-त्याग ”

**ध्रुवः प्रमादैर्भववारिधौ मुने !,**

तव प्रपातः परमत्सरः पुनः ।

गच्छे निबद्धोरुशिलोपमोऽस्ति चेत्

कथं तदोन्मज्जनमप्यवाप्स्यसि ॥ ४३ ॥

हे मुनि ! चारित्र प्रभादथी, संसारसमुद्र नक्की पडे,  
भत्सर धरी धीज्ञ उपर, अध्याय भोटी शिलावडे;  
अे पथ्यर भारवडे तणे ज्ञता, उच्चे किम आवशे ?  
अे छे होषवडे करी कडे, जनम वृथा गुमावशे. ४३

“ हे मुनि ! तुं प्रभाद करे छे. तेने लीघे संसारसमुद्रमां तारो  
पात तो जाणे नक्की ज छे. पण वणी पाणी धीज्ञ उपर भत्सर करे  
छे ते जेन भाषिकी भोटी शिला जेवो छे. त्यारे पछी तो तुं तेमांथो  
उच्चे पण डेवी रीते आवी शकीश ? ” ४३ वंशस्थ.

“ निर्जरा निभित परिसङ्घसङ्घन ”

**महर्षयः केऽपि सहन्त्युदीर्या-प्युग्रातपादीन्यदि निर्जरार्थम् ।**  
**कष्टं प्रसंगागतमप्यणीयोऽपीच्छन् शिवं किं सहसे न मिक्षो ! ॥ ४४ ॥**

ज्यारे भोटा मुनि ऋषिओ, निर्ज कर्म निर्जरा इरे,  
उद्दीरण्या आतापनाहि, विविध कष्टो जे आदरे;  
तो तुं भोक्षनी धृच्छा करी, अद्य कष्टवडे उरे,  
हे साधु ! शुद्ध चारित्र विषु, संसारमां इरतो इरे. ४४

“ ज्यारे भोटा ऋषिमुनिओ, कर्मनी निर्जरा भाटे उद्दीरण्या करने  
पण आतापनाहि सङ्घन करे छे तो तुं भोक्षनी धृच्छा राखे छे लारे

: १२६ :

અધ્યાત્મ-

પોતાની મેળે પ્રાણ થયેલ અત્યંત અવસ્થ કૃષ્ણને પણ હે સાધુ ! તેમ સહન કરતો નથી ? ” ૪૪

“ યતિસ્વરૂપ—ભાવદર્શિન.”

યો દાનમાનસ્તુતિવંદનામિ-

ને મોદતેઽન્યારેન તુ દુર્મનાયતે ।

અલાભલાભાદિપરીષહાન સહન,

યતિઃ સ તત્ત્વાદપરો વિદ્ધબકઃ ॥ ૪૫ ॥

જે પ્રાણી દાન માન સ્તુતિ, નમસ્કાર આદિવડે,  
ખુશી ન થતો એહથી, વિપરીત થતાં કોઈ નદે;  
અસ્તકાર નિનંદા આહિ અસદ્ય, પરિસહેલ કોઈ કરે,  
યતિ સહેતા પરમાર્થવૃત્તિ, અવર વેશવિડંખક ઠરે. ૪૫

“ જે પ્રાણી દાન, માન (સત્કાર), સ્તુતિ અને નમસ્કારથી ખુશી  
થધ જરૂતો નથી અને તેથી વિપરીતથી (અસ્તકાર, નિનંદા વિગેરથી)  
નાખુશ થતો નથી અને અલાભ વિગેર પરિષહેને સહન કરે છે તે  
પરમાર્થથી યતિ છે, બાઢો બીજાઓ તો નેશવિડંખક છે.” ૪૫ ધર્મવંશા

“ યતિએ ગૃહસ્થની ચિન્તા ન કરવી.”

દધદગ્ધસ્થેષુ મમત્વબુદ્ધિ, તરીયતપ્ત્યા પરિત્પ્યમાનઃ ।

અનિવૃત્તાંતઃકરણઃ સદા સ્વૈસ્તેષાં ચ પાપૈભ્રમિતા મવેઽસિ । ૪૬ ।

મમત્વ બુદ્ધિ ગૃહસ્થ પર, સુખ હુઃખ તેને આવતા,

ચિન્તાવડે તપતા હૃદય પર, વ્યાકૂળતા દિલ લાવતા;

તારા તેઓના પાપથી, એ મોહના સાધનવડે,

અનાદિકાળથી રખડતા, એહિ સંસારે આથડે. ૪૬

“ ગૃહસ્થ ઉપર મમત્વબુદ્ધિ રાખવાથી અને તેઓનાં સુખુઃખની  
ચિન્તાવડે તપવાથી તારં અંતઃકરણ સર્વદા વ્યાકૂળ રહેશે, અને તારં  
અને તેઓનાં પાપથી તું સંસારમાં રખજા કરીશ.” ૪૬ ઉપનાતિ

-५६५ कु अ

: ११७ :

“ गृहस्थचिंतानुं इण् ”

त्यक्तवा गृहं स्वं परगेहचिंता-तस्स्य को नाम गुणस्तवर्षे ! ।  
आजीविकास्ते यतिवेषतोऽत्र, सुदुर्गतिः प्रेत्य तु दुर्निवारा ॥४७॥

पोतानुं धर तल्ल पराया, धरेनी चिन्तावडे,  
डे ऋषि ! परितापवडे ए, लाभ तुझने शुं जडे ?  
यतिवेशथी आलुविका तारी, सुखपूर्वक चालशे,  
परभवमां भडामाडी दुर्गति, ए नहि अटकावशे. ४७

पोतानुं धर त्यज्ञने पारका धरनी चिंताथो परिताप पामता हे  
ऋषि ! तने शो लाभ थवानो छे ? (अहु तो) यतिना वेशथी आ  
जलमां तारी आलुविका (सुषे) चालशे पण् परभवमां भडामाडी  
दुर्गति अटकावी शकाशे नहि. ४७ उपज्ञति.

“ तारी प्रतिज्ञा विठ० तारुं वर्तन ”

कुवेै न सावधमिति प्रतिज्ञां,  
वदन्नकुर्वन्नपि देहमात्रात् ।  
शश्यादिकृत्येषु नुदन् गृहस्थान्,  
हदा गिरा वाऽसि कथं मुमुक्षुः ? ॥ ४८ ॥

हुं सावध करीश नहि ए, प्रतिज्ञा कायम उच्चरे,  
परंतु शरीर भान्नथी ए, होषने तुं परिहूरे;  
शश्या विगेरे काममां, तुं गृहस्थने प्रेरण्णा करे,  
मन वयनथी करतो तुं, त्यारे मुमुक्षु शानो हरे ? ४८

“ हुं सावध करीश नहि’ एवा प्रतिज्ञानुं हररोज उच्चारणु करे छे  
छतां शरीर भान्नथी ज सावध करतो नथो. अने शश्या विगेरे कामोमां तो  
मन अने वयनथी गृहस्थाने प्रेरण्णा कर्या करे छे त्यारे तुं मुमुक्षु  
शानो ? ” ४८ उपज्ञति

: ११८ :

અધ્યાત્મ-

“हृषीता प्रशस्त सावध कर्मनुं इण ”  
 कथं महत्त्वाय ममत्वतो वा,  
 सावधमिच्छस्यपि संघलोके ।  
 न हेममयप्युदरे हि शङ्खी,  
 क्षिप्ता क्षणोति क्षणतोऽप्यसून् किम् ? ॥ ४९ ॥

મહત્વતા અગર મમતવપણે, સાવધના કાર્યો કરે,  
સંઘના સાવધ કાર્યો પણ, એ નિમિત્ત તું આહરે;  
સોનાની છરી છતાં પેટમાં, ભારતાં તુરત ભરે,  
ક્ષણવારમાં પણ એહી છરી, પ્રાણ પોતાના હરે. ૪૬

“મહત્વતા માટે અચવા મમતવપણુથી સંઘલેક્ષામાં પણ સાવધ વાંછે, પણ શું સોનાની છરી હોય તે પેટમાં મારવામાં આવે ત્યારે એક ક્ષણિવારમાં આખુંનો નાશ ફરતી નથી ? ” ૪૬ ઉપનિષાદ.

“ନିଷ୍ପତ୍ତୁଯକ ଚେଷ୍ଟା-ଉଦ୍ଧତ ବର୍ତ୍ତନ-ଅଧିମ କୁଣ୍ଡଳ ”

रंकः कोऽपि जनाभिभूतिपदवीं त्यज्जवा प्रसादादगुरो—  
 वैषं प्राप्य यतेः कथंचन कियच्छास्त्रं पदं कोऽपि च ।  
 मौख्यादिवशीकृतर्जुनता दानार्चनैर्गर्वभा—  
 गात्मानं गणयन्नरेदमिव धिग् गंता द्रुतं दुर्गतौ ॥ ५० ॥

અપમાન ચોગ્ય સ્થાનક તળ, કોઈ રંક દીક્ષા આદરે,  
ગુરુહૃપાચે શાસ્ત્ર ભણુતાં, સારી પહીમાં ધરે;  
વાચાલ અતિ અદ્રિક રાગી, દાન પૂજા તેથી કરે,  
એ ગર્વે ધિક્કાર ભૂપ હું, વિચારતાં ફર્ગતિ ઠરે. ૫૦

“કોઈ ગરીબ-રાંક માણુસ લોકોના અપમાનને ચોથ્ય સ્થાનક તરજુ દર્ખને ગુરુમહારાજની કૃપાથી ભુનિનો વેશ પામે છે. કાંઈક શાલોનો

—કે દ્યે હુ અ

: ૧૧૬ :

અભ્યાસ કરે છે અને ડોઈ પહીને મેળવે છે ત્યારે પોતાના વાચાલ-  
પણાથી ભદ્રીલોડાને વશ કરીને તે શગીલોડા જે હાન અને ખૂંઝ કરે  
છે તેથી પોતે ગર્વ માને છે અને પોતાની જતને રાજ જેવી ગણે છે.  
આવાઓને ખરેખર ધિક્કાર છે ! તેઓ જલ્દી દુર્ગતિમાં જવાના છે.  
(અનંતા દ્રવ્યલિંગ પણું આવી દશામાં વર્તવાથી નિષ્ટળ થયાં છે.) ૫૦  
શાર્દૂલવિકીડિત.

“ ચારિત્ર પ્રાપ્તિ-પ્રમાદત્યાગ ”

પ્રાણ્યાપિ ચારિત્રમિદુદુરાપં,  
સ્વદોષજૈર્યદ્વિષયપ્રમાદૈઃ ।  
મબાંબુધૌ ધિકું પતિતોડસિ મિશ્નો !,

હતોડસિ દુઃખૈસ્તદનન્તકાલમ् ॥ ૫૧ ॥

મહાકષ્ટથી મુશકેલ મળવું, ચારિત્ર એવું પામીને,  
પોતાના કરેલ વિષય, પ્રમાદોવડે, એ વામીને;  
હે બિક્ષુ ! તું સંસારસમુદ્રમાં, એમ પડતો જાય છે,  
અને તેના પરિણામે, અનંતકાળ હુંઘી થાય છે. ૫૧

“ મહાકષ્ટથી પણું મળવું મુશકેલ એવું આ ચારિત્ર પ્રાપ્ત કરીને  
પોતાના દ્વારથી ઉત્પન્ન કરેલા વિષય અને પ્રમાદોવડે હે બિક્ષુ ! તું  
સંસારસમુદ્રમાં પડતો જાય છે અને તેના પરિણામે અનંતકાળ સુધી  
હુંઘી અમીશ.” ૫૧. ઉપનાતિ.

“ બ્યાધિષ્ઠીજ પ્રાપ્તિ-મ્યાત્મહિતસાધન ”

કથમપિ સમવાપ્ય બોધિરતનं,  
યુગસમિલાદિનિર્દર્શનાદુરાપમ् ।  
કુરુ કુરુ રિપુવશ્યતામગચ્છન्,  
કિમપિ હિતં લભસે યતોડર્થિતં શમ્ભુ ॥ ૫૨ ॥

: १२० :

अर्धयात्रा-

युगसमिला सुप्रसिद्ध दृष्टांत, महाभेनते कही भये,  
ऐधिरत्न मनुष्यक्षव अति, कठिन पुण्य रहित यये;  
तो शत्रु ताखे नहि थता, तुं आत्महित ज्ञे आहरे,  
प्रयास कोई ए ज करतां, ईच्छित सुझेने वरे. ५२

“युगसमिला विग्रे सुप्रसिद्ध दृष्टांताथी महाभुशेलीथी भेणवा  
शक्तय तेवुं ऐधिरत्न(समहित) पाभीने शत्रुओने ताखे थांन जतां  
कांध पणु आत्महित कर, जेथी ईरीने ईच्छित सुख प्राप्त थाय.” ५२.  
पुजिताचा.

“शत्रुओना नाभनी टीप”

द्विषस्त्वमे ते विषयप्रमादा,

असंवृता मानसदेहवाचः ।

असंयमाः सप्तदशापि हास्या-

दयश्च विभ्यच्चर नित्यमेभ्यः ॥५३॥

तारा शत्रु विषय प्रभाद, विना अंकुशे झावतां,  
मन वयन शरीर उपर, माठी असर ऐह जमावता;  
सतर असंयम स्थानके, हास्यादि पणु होषषट छे,  
तेओथी कायम डरतो रहे, येतता आधीन छे. ५३

“तारा शत्रुओ—विषय, प्रभाद, विना अंकुशे प्रवर्तविळां मन,  
शरीर अने वयन, सतर असंयमां स्थानक अने हास्यादि छ छे.  
तेओनाथी हुं निरंतर येततो (भीतो) आवजे.” ५३ उपेन्द्रवल्ला.

“सामश्री—तेनो उपयोग”

गुरुनवाप्यप्यपहाय गेह—मधीत्य शास्त्राण्यपि तत्त्ववांचि ।  
निर्वाहचिंतादिभराद्यभावेऽप्यषे ! ने किं प्रेत्य हिताय यत्नः ? ५४।

हे यति ! महान् शुरु भर्या, धरणार पणु छेऊया तमे,  
तत्त्व प्रतिपादन अंथीनो, अळ्यास पणु कीधे कमे;

-६५ कु अ

: १२१ :

आर उतरी गयो। निर्वाहने, चिन्ताथी मुक्त खरे,  
परंतु परब्रह्मना हित भाटे, यत्न केम नहिं करे ? ५४

“ हे यति ! भडान् गुरुती प्राप्ति थई, धरभार छाँझां, तत्त्व प्रति-  
पादन करनारा अथेनो अन्यास कर्यो अने निर्वाह करवानी चिंता  
विगेशनो आर उतरी गयो, अतां पशु परब्रह्मना हित भाटे केम यत्न  
थतो नथी ? ” ५४.

उपज्ञाति.

“ संयमनी विराधना करवी नहि. ”

**विराधितैः संयमसर्वयोगैः,**

**पतिष्यतस्ते भवदुःखराशौ ।**

**शास्त्राणि शिष्योपधिपुस्तकाद्या,**

**भक्ताश्च लोकाः शरणाय नालम् ॥५५॥**

ज्यारे संयमना सर्व योगोनी, विराधना करे,  
भवदुःखना दगला विषे, पडीश ज्यारे आभरे;  
शास्त्रो शिष्यो उपधि, पुस्तकादि भक्त लेडे। हुशे,  
ते शरणु तुज्जने आपवा, शक्तिवान नहिं ज थशे. ५५

“ संयमना सर्व योगोनी विराधना करवायी तुं ज्यारे भवदुःखना  
दगलामां पडीश लारे शास्त्रो, शिष्यो, उपधि, पुस्तक अने भक्तलेडे।  
विगेरे डाढ़ पशु तने शरणु आपवाने शक्तिवान् थवाना नथी.” ५५.  
उपज्ञाति.

“ संयमथी मुख, प्रभाद्धी तेनो नाश ”.

यस्य क्षणोऽपि सुरधामसुखानि पल्य-

कोटीर्नृणां द्विनवतीं हृषिकां ददाति ।

किं हारयस्यधम ! संयमजीवितं तत्,

हा हा प्रमत्त ! पुनरस्य कुतस्तवास्तिः ? ॥५६॥

三二二

અધ્યાત્મ

જે સંયમ એક ક્ષણું પણ, આરાધના કરવાબડે,  
બાણું કોડ પહ્યોપમથી, વધુ દેવગતિ સાંપડે;  
એવું સંયમ જીવન હે અધમ ! તું કેમ હારી જાય છે ?  
હે પ્રમાણી ! વિચાર કર્યાવાર, પ્રાપ્તિ કિમ એ થાય છે ? ૫૬

“ ને સંયમની એક ક્ષાણ(મુહૂર્ત) પણ આણું હોડ પલ્યોપમથી વધારે વખત સુધી દેવલોકનાં સુઝો આપે છે એવા સંયમ જીવનને હે અધમ ! તું કેમ હારી જય છે ? હે પ્રમાણી ! ફરીવાર તને આ સંયમની પ્રાપ્તિ પણ કયાંથી થશે ? ” ૫૬. વસ્તંતતિલકા-

“ સંયમનું કેળી-એહિક આભિવિક-ઉપસંહાર ”

नामूनापि यस्येति जनेऽसि पूज्यः, शुद्धात्ततो नेष्टसुखानि कानि ।  
तत्संयमेऽस्मिन् यतसे प्रमुक्षोऽनभ्युमानोरुपल्लेऽपि किं न ? ।५७।

સંયમના નામ માત્રથી, તું લોકમાં પૂજાય છે,  
તે ખરેખર શુદ્ધ હોય તો, ધીષ કુળ મળી જાય છે;  
જે સંયમના મહાન् ફળો, પ્રયત્ન અનુભવાય છે,  
હેઠતિ ! એ સંયમમાં તં, કેમ પ્રયત્નહૂંન જણાય છે. ૫૭

“ સંયમના નામ માત્રથી પણ જે તું લોકોમાં પૂજાય છે તો જે ખરેખર તે શુદ્ધ હોય તો કયું ધૃત કુળ તને ન મળે ? જે સંયમનાં મહાનું કુળ પ્રત્યક્ષ અનુભવવામાં આવ્યાં છે તે સંયમમાં હે યતિ ! તું કેમ યતન કરતો નથી ? ” ૫૭. ઉપાલતિ.

## ଧର୍ମ ପ୍ରସାଦାଧିକାର: ସଂପୂର୍ଣ୍ଣ.

अथ चतुर्दशो मिथ्यात्वादिनिरोधाधिकारः

## અંવ હેતુનો સંવર કર.

मिथ्यात्वयोगाविरतिप्रमादान्,

आत्मन् ! सदा संवेषु सौख्यमिच्छन् ।

—ੴ ਦੇਵ ਦੂ ਮ

: १२३ :

असंवृता यद्भवतापमेते,  
सुसंवृतां मुक्तिरमां च दद्युः ॥ १ ॥

શાણ ક્ષણું શુભ અશુભ કર્મનો, ચેતો ચેતન બંધ પડે,  
અવિરતિ મિથ્યાત્વ કૃષાય ચોગુ, સહૃકારણું આરવડે;  
સંવર તેના નહિ થાતા, સંસારના તાપે તાવે,  
સારી રીતે સંવર થાતાં, મોક્ષગતિના સુખ પાવે.\* ૧

“હે ચેતન ! ને તું સુખની છંચા રાખતો હોય તો મિથ્યાત્વ, ચોગ, અવિરતિ અને પ્રમાણનો સંવર કર. તેઓનો સંવર કર્યો ન હોય તો તે સંસારનો લાપ આપે છે, પણ જે તેઓનો સારી રીતે સંવર કર્યો હોય તો મોક્ષલક્ષ્મીને આપે છે.” ૧

## મનોનિયત-તંડુલમત્સ્ય.

मनः संवृणु हे विद्वन् !, असंवृतमना यतः ।

याति तंदुलमत्स्यो द्राक्, सप्तमीं नरकावनीम् ॥२॥

મગરમત્સ્ય મુખ જળપ્રવાહે, નાના મોટા મચ્છ આવે,  
જળ વળતા એ છિદ્ર પ્રવાહે, નાના મચ્છ અચી જાવે;  
હે વિદ્ધન! તંહુલમત્સ્ય પાંપણે, આર્ત રૌદ્ર તેથી કણાવે,  
હું તો એકે નહિ છેડું, સાતમી નારકીએ જાવે. ૨

“હે વિદ્યાર્થી! મનનો સંવર્ગ કર, કારણું કે તંડુલમત્તય મનનો સંવર્ગ કરતો નથી તો તુરત જ સાતમી નરકે જાય છે.” ૨. અનુષ્ટુભુ.

મનતો વેગી. વિઠ્ઠ પ્રસંગયંદ્ર.

प्रसन्नचंद्राजर्खेर्मनःप्रसरसंवरौ ।

नरकस्य शिवस्यापि, हेतुभूतौ क्षणादपि ॥ ३ ॥

\* ઇતા આ ચોદમો અધિકાર ઇચ્છિસા છંદ માત્રા ૩૦ તેમજ હરિ ગીત માત્રા ૨૮ બનેમા કાખાગ્રેલ છે, જેથી જ્યાંને કઢીમાં જેટલી માત્રા આવતી હોય તે પ્રમાણે જાણુંને. આ ખુલાસા ખાતરજ આ નોટ મૂહુવામાં આવી છે.

: १२४ :

अर्थात्-

प्रसन्नयं द्व राज्यभिः, आतापना लेता १वटे  
 श्रेणिक भूपति एह समय, जता वीरवं हन माटे;  
 कुमति शण्ड सांखणता, रेसातभीना हणीआं खांधे,  
 उभस्तक हाथ जता शुभध्याने, डेवणज्ञान तुरत साधे. ३

“ क्षेत्रवारमां प्रसन्नयं द्व राज्यभिं ने भननी प्रवृत्ति अने निवृत्ति अनु-  
 झेमे नरक अने भोक्षनुं क्षारण थए. ” ३. अनुष्टुप्.

भननी प्रप्रवृत्ति-स्थिरता

मनोऽप्रवृत्तिमात्रेण, ध्यानं नैकेन्द्रियादिषु ।

धर्म्यशुक्लमनःस्थैर्य-भाजस्तु ध्यायिनः स्तुमः ॥ ४ ॥

भननी प्रवृत्ति नहिं करवा भावथी, ध्यान नहिं थावे,  
 जेम एकेन्द्रिय भन वगरना, भन प्रवृत्ति नहिं लावे;  
 पणु जे ध्यान करनार प्राणी, धर्म शुक्लध्यान ध्यावे,  
 भन स्थिरता भाजनभूत ए, स्तुति करीए तस भावे. ४

“ भननी प्रवृत्ति न करवा भावथी. ४ ध्यान थतुं नथी. जेम ते  
 एकेन्द्रिय विगेरमां ( तेगोने भन न होवाथी भननी प्रवृत्ति नथी. )  
 पणु जे ध्यान करनार प्राणीओ धर्मध्यान अने शुक्लध्यानने लाधे  
 भननी स्थिरताना भाजनभूत थाय छे तेगोनी अमे स्तुति करीए  
 छीए. ” ४ अनुष्टुप्.

सुनियन्त्रित भनवाणा पवित्र भहात्माए।

सार्थ निरर्थकं वा यन्मनः, सुध्यानयन्त्रितम् ।

विरतं दुर्विकलपेभ्यः, पारगांस्तान् स्तुवे यतीन् ॥ ५ ॥

सार्थकता अगर निष्कण, प्रयत्नो परिष्ठुमे आवे,  
 पणु जेतुं भन एह समय, सुध्यानमां रहेतुं भावे;

१. वटे-रस्तामां, २. सातभी नारकी गति, ३. भाथे हाथ जतां  
 लोय भाणी शुभध्याने चञ्चा.

-५६५

: १२५ :

ખરાળ વિકલ્પોથી રહે હૂર, સંસાર તરેલા તે,  
એવા યતિ ! સ્તવીએ અમે, સવથી પાર પડેલા તે. ૫

“ સાર્થકતાથી અથવા નિજ્ઞલ પરિણામવાળા પ્રયત્નોથી પણ  
એઓનું મન સુધ્યાન તરફ લોડાયલું રહે છે અને એઓ ખરાળ  
વિકલ્પોથી દૂર રહે છે તેવા—સંસારનો પાર પામેલા યતિઓને અમે  
સ્તવીએ છીએ.” ૫ અનુષ્ટુભુ.

### વચન અપ્રવૃત્તિ-નિરવદ્ય વચન

વચોઽપ્રવૃત્તિમાત્રેણ, મૌનં કે કે ન વિભ્રતિ ।

નિરવદ્ય વચો યેષામ્, વચોગુપ્તાંસ્તુ તાન् સ્તુવે ॥ ૬ ॥

વચનની અપ્રવૃત્તિ માત્રથી, ધારણુ મૌન ન કોણુ કરે ?  
પણ જે વચન શુસ્તિવાળા, નિરવદ્ય વાક્યો ઉચ્ચરે;  
સ્તુતિ સ્તવના કરીએ તેહની, મધુર વાણી મુખ વહે,  
સ્તવના કરવા લાયક જગમાં, એ જન જાણો અથવા. ૬

“ વચનની અપ્રવૃત્તિ માત્રથી કોણુ મૌન ધારણુ કરતું નથી ? પણ  
અમે તો જે વચનશુસ્તિવાળા પ્રાણીએ નિરવદ્ય વચન બોલે છે  
તેઓની સ્તવના કરીએ છીએ.” ૬ અનુષ્ટુભુ.

### નિરવદ્ય વચન—વસુરાજ.

નિરવદ્ય વચો બ્રૂહિ, સાવદ્યવચનૈર્યતઃ ।

પ્રયાતા નરકં ઘોરં, વસુરાજાદયો દ્રુતમ् ॥ ૭ ॥

તું નિરવદ્ય વચન બોલજે, એ વચને સુખી થાવે,  
કારણુ સાવદ્ય વચન બોલે તો, દુર્ગતિમાંડે જાવે;  
સાવદ્ય વચન બોલવાથી, વસુરાજ નરકે જાતા,  
એહ આદિ સાવદ્ય વચને, ધોર નરકલાજન થાતા. ૭

“ તું નિરવદ્ય (નિષ્પાય) વચન બોલ; કારણુ કે સાવદ્યવચન  
બોલવાથી વસુરાજ વિગેરે એકદમ ધોર નરકમાં ગયા છે.” ૭ અનુષ્ટુભુ.

: १२५ :

અદ્યાત્મ-

દુર્વાચાનાં ભયંકર પરિણામ.

ઇહાઽમુત્ત્ર ચ વैરાય, દુર્વાચો નરકાય ચ ।

અગ્રિદગ્ધાઃ પ્રરોહન્તિ, દુર્વાગ્રિદગ્ધાઃ પુર્નર્ન હિ ॥ ८ ॥

હુષ્ટ વચને આ લોક અને, પરલોકમાં વૈર કરે,  
હુષ્ટ વાક્ય ઉચ્ચારતા જગમાં, નરકગતિ માંહે જ ધરે;  
અભિથી બળેલ હોય તે, ઝરીવાર ઉગી આવે,  
પણ હુષ્ટ વચને બાળેલ મન, સ્નેહાંકુર નહિ લાવે. ८

“ હુષ્ટ વચન આ લોક અને પરલોકમાં અનુકૂમે વૈર કરાવે છે અને  
નરકગતિ પ્રાપ્ત કરાવે છે. અભિથી બળેલું ઝરીવાર ઉગે છે પણ  
હુષ્ટવચનથી બળેલાં હોય તેમાં પછી ઝરીવાર સ્નેહાંકુર કુટો  
નથી. ” ८

તીર્થંકરમહારાજ અને વચનગુપ્તિની આહેયતા

અત એવ જિના દીક્ષા-કાળાદાકેવલોદ્ભવમ् ।

અવદ્યાદિમિયા બ્રૂય-ર્જાનત્રયભેતોડપિ ન ॥ ९ ॥

ત્રણ જ્ઞાન સહિત તીર્થંકર, માતાની ઝૂખમાં આવે,  
જગત જરૂર ઉદ્ઘરચવાકાને, ચારિત્ર વરતા શુભ જાવે;  
પાપ બોકે દીક્ષાધારી ડેવળ, જ્ઞાન સુધી મૌન રહે,  
ડેવળજ્ઞાન થતાં પ્રતિષ્ઠાધી, તૌર્થ સ્થાપવા જેહ ચહે. ९

“ તેટલા માટે જે કે તીર્થંકર મહારાજને ત્રણ જ્ઞાન હોય છે  
તો પણ દીક્ષાધારી માંડીને ડેવળજ્ઞાન થતાં સુધી પાપની બીજથી તેઓ  
કંઈ પણ બોલતા નથી. ” ९

અનુષ્ટુભ.

કાયસંવર-કાયખાતું દૃષ્ટાંત

કૃપયા સંવૃણ સ્વાંગ, કૂર્મજ્ઞાતનિર્દર્શનાત् ।

સંવૃતાસંવૃતાંગ યત્, સુખદુઃखાન્યવાપ્તુયુઃ ॥ १० ॥

-५६५-

: १२७ :

કાયખાના દૃષ્ટાંતથી, શરીર સંવર જેહ કરે,  
જીવો ઉપર બહુ હ્યા લાવતા, તે સંસારસમુર તરે;  
અંગ સંવર નહિ કરનારા, હંસક થાતા હુઃખ વરે,  
એ રીતે સંવર અસંવર જ, સુખ હુઃખ નિમિત ઠરે. ૧૦

( જીવ ઉપર ) હ્યા લાવીને તારા શરીરનો સંવર કર. કાયખાના  
દૃષ્ટાંતથી શરીરનો સંવર કરનાર અને નહિ કરનાર અનુક્રમે સુખ હુઃખ  
પામે છે. ૧૦

કાયાની અપ્રવૃત્તિ વિ. કાયાનો શુલ વ્યાપાર  
કાયસ્તંભાન્ત કે કે સ્યુ-સ્તરસ્તંભાદ્યો યતા:  
શિવહેતુક્રિયો યેણાં, કાયસ્તાંસ્તુ સ્તુતે યતીન् ॥ ૧૧ ॥

માત્ર કાયાના સંવરથી, આડ સ્તંભ અડગ રહે,  
પણ જે શરીર સંવરવણે, મોક્ષ મેળવવા જ ચહે;  
કિયા કરવા ઉદ્ઘત થાય જે, એવા યતિઓનોંજ અમે,  
સ્તુતિ કરીએ અમે શુદ્ધ દિલથી, તાસ પ્રવૃત્તિ દિલ રમે. ૧૧

“ માત્ર કાયાના સંવરથી આડ, સ્તંભ વિગેર ડોણુ ડોણુ સંયમી ન  
થાય ? પણ જેઓનું શરીર મોક્ષ મેળવવા માટે કિયા કરવામાં ઉદ્ઘત  
થાય છે તેવા યતિની અમે સ્તુતિ કરીએ છીએ.” ૧૧ અનુષ્ટુય.

શ્રોત્રેનિદ્રય સંવર

શ્રુતિસંયમમાત્રેણ, શબ્દાન કાન કે ત્યજન્તિ ન ।  
ઇષ્ટાનિષ્ટેષુ ચૈતેષુ, રાગદ્રેષી ત્યજન્મુનિઃ ॥ ૧૨ ॥

કાનના સંયમ માત્રથી, ડોણુ શષ્ઠ્યોને નહિ તણે ?  
પણ ધૃત અનિષ્ટ શષ્ઠ્યો પર, સમલાવે જસ દિલ ભણે;  
રાગ દ્રેષ નહિ લાવે તે પર, તેહ ખરા મુનિ જાણ્યા,  
વંદન સ્તુતિ કરવા લાયક, એહ મુનિ જ્યાં ગીણાણ્યા. ૧૨

: १२८ :

अद्यातम-

“ कानना संयम मात्रथी डोखु शष्ठोने तजतुं नथी ? पथु ईश्वर अने अनिष्ट शष्ठो पर रागद्वेष तज्ज हे तेने मुनि समजवा। ” १२  
अनु४हुय्.

## चक्षुरिन्द्रिय संवर

चक्षुःसंयममात्रात् के, रूपालोकांस्त्यजन्ति न ।  
इष्टानिष्टेषु चैतेषु, रागद्वेषो त्यजन्मुनिः ॥ १३ ॥

मात्र चक्षु ईन्द्रिय संयमथी, डोखु इप्रेक्षणु त्यागे ?  
पथु ईश्वर अनिष्ट इपोमां, जेता रहे जे सम लागे;  
इप कुरुप हेखी दिलमांडे, रागद्वेष नहि लावे,  
तेह अरा मुनिवर जगमां, भाववडे भजुओ भावे. १३

“ मात्र चक्षुना संयमथी डोखु इप्रेक्षणु तजता नथी ? पथु ईश्वर  
अने अनिष्ट इपोमां जेओ रागद्वेष छाडी हे छे तेज अग्र मुनि छे। ” १३  
अनु४हुय्.

## धारेन्द्रिय संवर

ग्राणसंयममात्रेण, गंधान् कान् के त्यजन्ति न ? ।  
इष्टानिष्टेषु चैतेषु, रागद्वेषो त्यजन् मुनिः ॥ १४ ॥

नासिङ्काना संयमथी, डोखु कहो गंधो त्यागे ?  
पथु ईश्वर अनिष्ट गंधोमां, जेता रहे जे समभागे;  
सुगंध झुर्गंधी आवतां, राग देष नहि लावे,  
तेह अरा मुनिवर जगमां, भाववडे भजुओ भावे. १४

“ नासिङ्काना संयममात्रथी डोखु गंधोने तजतुं नथी ? पथु ईश्वर  
अने अनिष्ट गंधोमां जेओ रागद्वेष त्यज्ञ हे छे तेज मुनि कहेवाय्। ” १४  
अनु४हुय्.

## २सेन्द्रिय संवर

जिह्वासंयममात्रेण, रसान् कान् के त्यजन्ति न ।  
मनसा त्यज तानिष्टान्, यदीच्छसि तपःफलम् ॥ १५ ॥

-५६५ कु ॥

: १२८ :

જીવાના સંયમ માત્રથી, કોણું રસો તે તો ત્યાગે,  
પણ ભાઈ ! તપકળ યામવા, ઈચ્છાએ તજવા લાગે;  
સુન્દર લાગતા રસોને, જેહ સાધન છતાંય તજે,  
ખરા તપસ્વી એ જ જગતમાં, પરલવે મહાસુખ જને. १५

“ જીવાના સંયમમાત્રથી કોણું રસોને ત્યજતું નથી ? હે ભાઈ !  
જે તું તપનું ઇણ મેળવવાની ઈચ્છા રાખતો હોય તો સુંદર લાગતા  
રસોને તજ હું.” १५  
અનુષ્ટુકુ.

### સ્પર્શનિદ્રિય સંયમ.

ત્વचઃસંયમમાત્રેણ, સ્પર્શાનું કાનું કે ત્યજન્તિ ન ? ।  
મનસા ત્યજ તાનિષ્ટાન, યદચ્છસિ તપઃફલમ् ॥ १६ ॥

ચામડીનો સ્પર્શ કરવાને, કોણું સ્પર્શનો ત્યાગ કરે,  
પણ જે તપ ઇણ ચાહે તો, ઈષ્ટસ્પર્શનો ત્યાગ ધરે;  
મનની એહ પ્રવૃત્તિ થાતા, છતા સાધને જેહ તજે,  
વિષય વિરક્તા થાતા મુખુક્ષુએઓ, સહેજે મુક્તિસુખ જને. १६

“ ચામડીનો સ્પર્શ ન કરવા માત્રથી કોણું સ્પર્શનો લાગ કરતું  
નથી ? પણ જે તારે તપનું ઇણ મેળવવું હોય તો ઈષ્ટસ્પર્શનો મનથી  
લાગ કર.” १६  
અનુષ્ટુકુ.

### બ્રહ્મિસંયમમાત્રેણ.

ब्रह्मिसंयममात્રेण, ब्रह्म के के न विभ्रते ।  
मनःसंयमतो धेहि, धीर ! चेत्तक्फलार्थ्यसि ॥ १७ ॥

મુન્ત્રાશયના સંયમથી, બ્રહ્મચારી ન કોણું થતા ?  
હે ધૌર ! બ્રહ્મચર્ય ઈચ્છાએ, કર મનની તું સંયમતા;  
બ્રહ્મચર્ય ધારણું કરનારા, સુખી આ જવમાં થાવે,  
એહ તણું શુદ્ધ પાલન મને, પરલવમાં માશે જાવે. १७

: १३० :

अध्यात्म-

“ सुनाशयना संयमभावथी डेणु लेडा अलयर्थं धारणु करता नथी ? हे धीर ! जे तने अलयर्थना इणानी धर्षा होय तो मनने संयम करीने अलयर्थने धारणु कर.” १७. अनुष्टुप्.

समुदायथी पांचे ध्रियोना संवरने उपदेश.

**विषयेद्वियसंयोगा-भावात्के के न संयताः ? ।**

**रागद्वेषमनोयोगा-भावाद्ये तु स्तवीमि तान् ॥ १८ ॥**

विषय धन्दिय संयोग न थता, डेणु नहि संयम पाणे ?

पणु मनथी ते उपरना, राग द्वेषने जे टाणे;

नीराणा मन योगथी, सदा प्रवृत्ति ए नहि जगमे,

तेवा ज्ञोनी जगमाहे, स्तुति करीमे नित्य अमे. १८

“ विषय अने ध्रियोना संयोग न थवाथी डेणु संयम पाणतु नथी ? परंतु रागद्वेषने योग ज्ञेया मननी साथे थवा होता नथी तेयोनी हुं तो स्तवना करुं छुं.” १८. अनुष्टुप्.

क्षाय संवर-करट अने उत्करट

**कषायान् संवृणु प्राज्ञ !, नरकं यदसंवरात् ।**

**महातपस्विनोप्यापुः, करटोत्करटादयः ॥ १९ ॥**

हे विद्वन् ! हुं क्षाय संवर, क्षायम करतो रे हिलमां,

करट उत्करट ज्ञेवा महा, तपस्वी ज्ञेय १अभिलमां;

क्षायनो संवर नहि करता, नरकगति पामेला ते,

ए दृष्टांत विचारी तज्जे, क्षाय रही संवरमें. १९

“ हे विद्वन् ! हुं क्षायनो संवर कर. तेनो संवर नहि करवानी करट अने उत्करट ज्ञेवा महातपस्वीओ पणु नरकने पाम्या छे.” १९.

अनुष्टुप्.

१. अभिलमां-जगतमां.

-५६५

: १३१ :

कियावंतनी शुभ योगमां प्रवृत्ति होवी जेहमे तेनु कारण्।  
 यस्यास्ति किंचिन्त तपोयमादि,  
 ब्रूयात्स यत्तुदतां परान् वा ।  
 यस्यास्ति कषासमिदं तु किं न ?  
 तद्भ्रंशभीः संवृणुते स योगान् ॥ २० ॥

तपस्या आदि कांઈ न कीधुं, ते गमे तेवुं भोले,  
 औजने पौडा उपन्नवे, गणुवा तस डेना तोले ?  
 पणु महाकषे करी, तपस्याद्विं जे प्राप्त करे,  
 नष्ट थवानी औडे, योग् संवर नहिं केम धरे ? २०

“ जेने तपस्या विगेरे कांઈ पणु नथी ते तो गमे तेवुं भोले अथवा  
 औजनेने पौडा उपन्नवे, पणु जेओगे महाकषे करीने आ तपस्या-  
 द्विं प्राप्त कर्युं छे तेओ तेनो नाश थध जवानी अहिं राखीने योगनो  
 संवर केम न करे ? ” २०. ईदवज्ञा.

मनयोगना संवरनी मुख्यता।

भवेत्समग्रेष्वपि संवरेषु, परं निदानं शिवसंपदां यः ।  
 स्यजन् कषायादिजदुर्विकल्पान्, कुर्यान्मनःसंवरमिद्धधीस्तम् ॥ २१ ॥

भोक्ष लक्ष्मीं प्राप्त करवानुं, भोटुं साधन भन जाणो,  
 सर्वं प्रकारना संवरमां, भन उपर संवर आणो;  
 एम जाणी समृद्ध बुद्धिज्ञव, कषायथी उत्पन्न थाता,  
 दुर्विकल्पो तज्ज दृहने, भन संवर करता ज्ञाता। २१

“ भोक्षलक्ष्मी प्राप्त करवानुं भोटामां भोटुं कारण् सर्वं प्रकारना  
 संवरेमां पणु भननो संवर छे एम जाणीने समृद्धबुद्धिज्ञव कषायथी  
 उत्पन्न थगेवा दुर्विकल्पोने तज्ज दृहने भननो संवर करे.” २१. उपनिति.

निःसंगता अने संवर-उपसंहार.

तदेवमात्मा कृतसंवरः स्यात्, निःसंगताभाक् सततं सुखेन ।  
 निःसंगभावादथ संवरस्तद्-द्वयं शिवार्थी युगपद्धजेत ॥ २२ ॥

: १३२ :

અધ્યાત્મ-

ઉપર કહ્યું એહી જ રીતે, સંવર ક્રીધેલો જેણો,  
નિઃસંગતાનો જ ખરો, ભાજન આત્મ કર્યો તેણો;  
નિઃસંગતા ભાવથી સંવર, ભાવવૃદ્ધિ બેઠ કરતા;  
માટે મોક્ષ અભિલાષી જીવ, સાથે બેઠ આદરતા. ૨૨

“ ઉપર કહ્યું તે પ્રમાણે કર્યો છે સંવર જેણો એવો આ આત્મા તરત  
જ વળર ગ્રયાસે નિઃસંગતાનો ભાજન થાય છે. વળી નિઃસંગતાભાવથી  
સંવર થાય છે, માટે મોક્ષનો અભિલાષો જીવ આ અન્તેને સાથે સાથે  
જ જને.” ૨૨.

અથ પંચદશઃ શુભમૃત્તિશિક્ષોપદેશાધિકાર:  
આવશ્યક હિયા કરવી.

આવશ્યકેષ્વાતત્ત્વ યત્નમાપ્તો—દિતેષુ શુદ્ધેષુ તમોડપહેણુ ।  
ન હંત્યભુંક્તં હિ ન ચાષ્યશુદ્ધં, વૈદ્યોક્તમપ્રૌષ્ઠધમામયાન યત્ત ॥૧॥

આપ્ત પુરુષ અતાવેલ શુદ્ધ, આવશ્યકે યત્ન કરો,  
એ સહુ પાપતણું હુણુનારા, એ વિચારી દિલ ધરો;  
વૈદ્યે અતાવેલ ઔપધ, અશુદ્ધ જેએ વાપરતા,  
વ્યાધિ તણો એહ ભૂળથી, નાશ નથી કેમે કરતા. ૧

“ આપ્ત પુરુષોના અતાવેલા શુદ્ધ અને પાપના હરનારા એવા  
આવશ્યકો કરવામાં યત્ન કર; કારણું કે વૈદ્યે અતાવેલું ઔપધ ખાધું ન  
હોય અથવા (ખાધા છતાં પણ ને) અશુદ્ધ હોય તો તે રોગનો નાશ  
કરી શકતું નથી.” ૧.

ઉપરથી કરવી.

તપાંસિ તન્યાદ્વિવિધાનિ નિત્યં, મુખે કદ્બન્યાયતિસુંદરાણિ ।  
નિધનંતિ તાન્યેવ કુકર્મરાણિ, રસાયનાનીવ દુરામયાન યત્ત ॥૨॥

-કે દ્વિ મ

: ૧૩૩ :

શરૂઆતે કડવા લાગે, પણ સુનદરતા પરિણામે,  
અન્ને પ્રકારના તપો કરવામાં, કાયમ હિત રમે;  
વિનાશ કરે કુકર્મ દગલાનો, ભાવવડે આહરે,  
જિમ રસાયણે દુષ્ટ રોગ જઈ, આરોગ્ય શરીર કરે. ૨

“ શરૂઆતમાં કડવાં લાગે તેવાં પણ પરિણામે સુનદર અન્ને પ્રકારના તપો હમેશાં કરવાં, તે કુકર્મના દગલાનો તુરત વિનાશ કરે છે,  
એવી રીતે રસાયણે દુષ્ટ રોગને દૂર કરે છે તેમ.” ૨. ઉપાનિતિ.

શીલાંગ-યોગ-ઉપસર્ગ-સમિતિ-ગુપ્તિ.

**વિશુદ્ધશીલાંગસહસ્રધારી, ભવાનિશં નિર્મિતયોગસિદ્ધિઃ ।**  
**સહોપસર્ગાંસ્તત્ત્રનિર્મમઃ સન्, ભજસ્ત્વ ગુપ્તીઃ સમિતીશ સમ્યક् ॥૩॥**

તું અઢાર હળર શુદ્ધ, શીલાંગ રથ ધારી થાજે,  
યોગ સિદ્ધિ નિર્ણાહિત થા, તજી ભમતા શરીર કાજે;  
ઉપસર્ગો સહુ સહન કરીને, શુભ વૃત્તિએ હિત સજે,  
સમિતિ ગુપ્તિએ આહિ પણ, સારી રીતે સહાય લાજે. ૩

“ તું ( અઢાર ) હળર શુદ્ધ શીલાંગને ધારણુ કરનારો થા, યોગ-  
સિદ્ધિ, નિર્ણાહિત થા, શરીર પરની ભમતા દૂર મૂકીને ઉપસર્ગોને સહન  
કર, સમિતિ અને ગુપ્તિને સારી રીતે ભજ.” ૩. ધંદ્રવજા.

સ્વાર્થ્યાય-આગમાર્થ-બિક્ષા વિગેરે.

**સ્વાર્થ્યાયયોગેષુ દધસ્ત યત્નં, મધ્યસ્થતૃત્યાનુસરાગમાર્થાન् ।**

અગારવો ભૈક્ષમટાડવિષાદી, હેતૌ વિશુદ્ધે વશિતેદ્રિયૌઘઃ ॥૪॥

સજાય ધ્યાન વિષે યત્ન કર, માર્થ્યસ્થ ખુદ્ધિ દિલે ઠરે,  
આગમ અર્થને અનુસરી, ધૂનિદ્રયસમૂહને વશ કરે;  
અહંકારને મૂકી દઈને, બિક્ષા કાજ સહાય ઇને,  
શુદ્ધ હેતુમાં વિષવાદ રહિત થતા આત્મતું હિત કરે. ૪

“ સજાયધ્યાનમાં યત્ન કર, મધ્યસ્થખુદ્ધિથી આગમના અર્થને અનુ-  
સર, અહંકાર મૂકી દઈને બિક્ષા માટે ઇર, તેમજ ધંદ્રવિના સમૂહને વશ  
કરીને શુદ્ધ હેતુમાં વિષવાદ રહિત થા.” ૪. ઉપાનિતિ.

: १३४ :

अध्यात्म-

## उपदेश—विहार.

ददस्व धर्मार्थितयैव धर्म्यान्, सदोपदेशान् स्वपरादिसाम्यान् ।  
जगद्भितैषी नवभिश्च कल्पै—ग्रमे कुले वा विहारप्रमत्तः ॥५॥

हे भुनि ! तुं धर्म प्राप्त करवाना, हेतुथी ज इरे,  
उपदेश आपवा ऐवा, स्व-पर समानपाणुं ज धरे;  
तुं जगतनुं सारुं धर्छितां, प्रभाद सरवे द्वर हुरे,  
गाम अगर कुणमां नवकल्पी, विहारे कायम करे. ५

“ हे भुनि ! तुं धर्म प्राप्त करवाना हेतुथी ऐवा प्रकारना धर्मा-  
तुसार उपदेशी आप के जे स्व अने पर्नी आपतोमां समानपाणुं  
प्रतिपादन करनारा होय. तुं जगतनुं सारुं धर्छिते प्रभाद वरणतो  
थधने, गाम अथवा कुणमां नवकल्पी विहार कर.” ५      उपज्ञाति.

## स्वात्मनिरीक्षण-परिणाम.

कृताकृतं स्वस्य तपोजपादि, शक्तीरशक्तीः सुकृतेतरे च ।

सदा समीक्षस्व हृदाथ साध्ये, यतस्व हेयं त्यज चाव्ययार्थी ॥६॥

तप जप सारा नठारा, कार्य कर्या के कर्या नथी,  
शक्ति अशक्ति डेवी तेहमां, विचारी जेवुं दिलथी;  
तुं शौष्ठुभूषणी धर्छा धरी, तेह साधवा योग्य करे,  
अने त्यागवा योग्य होय, तेवा कार्यथी द्वर इरे. ६

“ तप जप विग्रे ते छ कर्या छे के कर्या नथी ? सारां काम अने  
नठारां कामे करवामां शक्ति अशक्ति डेटली छे ? ते सर्व आपततो  
हुमेशां तारा हृद्य साथे विचार कर. तुं मेक्ष सुख भेगववानी धर्छिता-  
वानो. छे तथी साधवा योग्य ( अनी शक्ति तेवां ) कार्यमां यत्न कर अने  
त्याग करवा योग्य कार्यने छाडी हे.” ६.      उपज्ञाति.

## परपीडावर्जन-योगनिर्भिता.

परस्य पीडापरिवर्जनात्ते, त्रिधा त्रियोग्यप्यमला सदास्तु ।

साम्यैकलीनं गतदुर्विकल्पं, मनो वचश्चाप्यनघप्रवृत्ति ॥७॥

-के द्वय कुम

: १३५ :

थीज ज्ञाने वर्षा प्रकारे, पौड़ाओं जे नहि करे,  
तारा मन वचन १अंगनी, निर्मण थष्टि त्रिपुटी सुधरे;  
मनमात्र समतामां लीन रही, हुविंकिल्पोने तजशे,  
अने वचन वर्षा निरवद्य, व्यापारमां ज प्रवृत्त थशे. ७

“थीज ज्ञाने वर्षा प्रकारे पीड़ान करवाथी तारा मन, वचन, कायाना  
योगेन्ती त्रिपुटी निर्मण थाय, मन मात्र समतामां ज लीन थष्टि जय,  
वर्णा ते तेना हुविंकिल्पो तज्ज हे अने वचन वर्षा निरवद्य व्यापारमां  
ज प्रवृत्त थतुं रहे.” ७.

### आवना-आत्मलय.

मैत्रीं प्रमोदं करुणां च सम्यक्, मध्यस्थतां चानय साम्यमात्मन्! ।  
सद्भावनास्वात्मलयं प्रयत्नात्, कृताविरामं रमयस्व चेतः! ॥८॥

हे आत्मन्! मैत्री प्रमोद, करुणा माध्यस्थ आवे,  
सारी शीते लीन थतां तुं, समता हिलमांडे लावे;  
प्रयत्ने करी सहभावना, भावीने आत्मलयमां,  
विराम पाभी मनने क्षिडा, कराव शुभ आशयमां. ८

“हे आत्मन्! मैत्री, प्रमोद, करुणा अने मध्यस्थताने सारी शीते  
आव, (अने ते वडे) समता भाव प्रगट कर. प्रयत्ने करी सहभावना  
भावीने आत्मलयमां विराम पाभीने (तारा) मनने क्षिडा कराव.” ८. उपनिषति.

### मोहना सुखदोनो पराजय.

कुर्यानि कुत्रापि ममत्व भावं,  
न च प्रभो! रत्यरती कषायान् ।

इहापि सौख्यं लभ्सेऽप्यनीहो,  
ह्यनुचरामार्त्यसुखाभमात्मन्! ॥ ९ ॥

हे समर्थ आत्मन्! कोई वस्तु पर, ममत्वता जीठी जशे,  
रति अरति कषाय त्यागतां, तुं वांछा रहित थाशे;

९. अंग-शरीर.

: १३६ :

अध्यात्म-

तो अनुत्तर विमान रहेल, हेवेा ने जे सुख होशे,  
आँही रह्या पण् तुझने, एह प्रकारनुं सुख थशे. ६

“ हे समर्थ आत्मन् ! आँहि पण् वस्तु उपर भगवत्प्रभाव न कर्वो.  
तेमज्ज रति, अरति अने कथाय पण् न करवा. ज्यारे तुं वांछारहित  
थष्ठि सारे तो अनुत्तर विमानमां रहेनारा हेवताओनुं सुख पण् तने  
अहीं भणशे.”. ६.

धृद्वज्ञा.

उपसंहार-शुद्ध प्रवृत्ति करनारनी गति.

इति यतिवरशिक्षां योऽवधार्य व्रतस्थ-

श्रणकरणयोगानेकचित्तः श्रयेत ।

सपदि भवमहाबिध क्लेशराशि स तीर्त्ता,  
विलसति शिवसौरुद्यानंत्यसायुज्यमाप्य ॥१०॥

यतिवरोना संधंधे उपर, शिक्षाओ जे अतदावी,  
ते व्रतधारी सुनि श्रावक, एक चित्त रहे अपनावी;  
ते संसारदृप क्लेशनो, दगडो तुरत तरी जाता,  
अने भोक्षना अनंत सुख, पाभी आनंहित थाता. १०

यतिवरोना संधंधमां (उपर प्रभाणे) अतावेदी शिक्षा जे व्रतधारी  
(साधु अने उपलक्षणयुक्त श्रावक) एकाच्चित्तथी छुद्यमां इसावे छे अने  
चारित्र अने कियाना योगोने सेवे छे ते संसारसमुद्रदृप क्लेशनो  
दगडो एकदम तरी जाईने भोक्षना अनंत सुख साथे तन्मयपणुं पाभी  
गेते आनंद करे छे.” १०

भाविनी.

पंद्रभो अधिकार समाप्ते.

अथ घोडशः साम्यसर्वस्वाधिकारः

समतानुं इण-भोक्षसंपत्ति.

एवं सदाभ्यासवशेन सात्म्यं, नयस्व साम्यं परमार्थवेदिन् !

यतः करस्थाः शिवसंपदस्ते, भवन्ति सधो भवभीतिभेतुः ॥१॥

-ક દ્વાપ કુ મ

: ૧૩૭ :

હે તત્ત્વિક પદ્ધાર્થના જ્ઞાતા, આત્મિક શુણુ એણખો,  
પંદર દ્વાર કહો શિક્ષાનો, નિરંતર અભ્યાસ હોશો;  
સમતા આત્મ સાથે લેડતા, બાવલય લેદતા કરતા,  
મોક્ષ સંપત્તિ હુસ્ત કરી અટ, શાશ્વતા સુખો વરતા. ૧

“હે તત્ત્વિક પદ્ધાર્થના જાણુનાર! આ પ્રમાણે (ઉપર પંદર  
દ્વારમાં કહેલ) નિરંતર અભ્યાસના એણગથી સમતાને આત્મા સાથે લેડી  
દે, જેથો કરીને બાવના બથને બેદ્વાવાળા મોક્ષ સંપત્તિએ તને એકદમ  
હુસ્તગત થઈ જાય.” ૧

અવિદ્યાત્યાગ એ સમતાભીજ.

ત્વમેવ દુઃખે નરકસ્ત્વમેવ, ત્વમેવ શર્માપિ શિવં ત્વમેવ ।

ત્વમેવ કર્માણિ મનસ્ત્વમેવ, જહીદ્વિદ્યામવધેહિ ચાત્મન્ ! ॥૨॥

હે આત્મન્ ! તું જ હુઃખ તું જ, નરકને તું જ સુખ ખરે,  
મોક્ષ તું જ વળી કર્મ તું જ, અને મન તું જ નહિ પરે;  
અવિદ્યાનો ત્યાગ કરીને, સાવધાન હિલથી થાતા,  
સમતાઝીપી ધીજ હુદ્ધ્યમાં, ટકી રહે કાયમ જ્ઞાતા. ૨

“હે આત્મન્ ! તું જ હુઃખ, તું જ નરક, તું જ સુખ અને મોક્ષ  
પણ તું જ. વળી તું જ કર્મ અને મન પણ તું જ. અવિદ્યાને તળ દે  
અને સાવધાન થા.” ૨

ઇદ્વજા

સુખહુઃખતું મૂળ-સમતા ને ભમતા.

નિઃસંગતામેહિ સદા તદાત્મનર્થેષ્વશોષેષ્વપિ સાન્યભાવાત् ।

અવેહિ વિદ્ધન્ ! મમતૈવ મૂલં, શુચાં સુખાનાં સમતૈવ ચેતિ ॥૩॥

હે આત્મન્ ! સર્વ પદ્ધાર્થ પર, સમતાભાવ સદા લાવે,  
હે વિદ્ધન્ ! નિઃસંગપણું, પ્રાસ કરી લેતા ભાવે;  
હુઃખતું મૂળ જાણી લ્યો, ખરેખરી નડતી ભમતા,  
સુખતું મૂળ આત્મહિતેચ્છુ, આદરવી ભાવે સમતા. ૩

“હે આત્મન્ ! સર્વ પદ્ધાર્થી ઉપર સદા સમતાભાવ લાવીને  
નિઃસંગપણું પ્રાપ્ત કર. હે વિદ્ધન્ ! તું જાણી લેજે કે હુઃખતું મૂળ  
ભમતા જ છે અને સુખતું મૂળ સમતા જ છે.” ૩

ઉપનાતિ.

: १३८ :

अध्यात्म-

## समतानी वानकी इणावापित.

स्त्रीषु धूलिषु निजे च परे वा, संपदि प्रसरदापदि चात्मन् ! ।  
 तच्चमेहि समतां ममतामुग्, येन शाश्वतसुखाद्यमेषि ॥४॥  
 स्त्री उपर के धूल उपरे, पर के पोतानीय सहा,  
 संपत्ति विस्तृत आपत्ति पर पशु, ममता करवी नहिं कहा;  
 हे आत्मन् ! समता हिंद ज्येष्ठ, तो अनुपम सुणो वरशे,  
 अने एड गुणुवडेथी, शाश्वता सुख पशु ऐक्य थशे. ४

“ स्त्री उपरथी अने धूण उपरथी, पोताना उपरथी अने पारका  
 उपरथी, संपत्ति उपरथी अने विस्तृत आपत्ति उपरथी ममता मूळा  
 दृढ़ने हे आत्मन् ! तुं समता राख, जेथी करीने शाश्वतसुख साथे  
 ऐक्य थशे. ” ४

स्वागता.

## समताना कारण्डप पदार्थानुं सेवन कर.

तमेव सेवस्व गुरुं प्रयत्ना-दधीष्व शास्त्राण्यपि तानि विद्वन् ! ।  
 तदेव तच्चं परिभावयात्मन् !, येभ्यो भवेत्साम्यसुधोपभोगः ।५।

ते ज गुरुनी कर सेवा तुं, ते ज शास्त्र-अख्यास करे,  
 हे आत्मन् ! ते ज तत्त्वनुं, चिंतवन कायम हिंद धरे;  
 जेना वडे आत्महित थाय, ते आहरीये आवे,  
 तने जेहुथी समताइप, अभृतनो स्वाह सहा आवे. ५

“ ते ज गुरुनी प्रयत्नयो सेवा कर, ते ज शास्त्रोनो अख्यास कर  
 अने हे आत्मन् ! ते ज तत्त्वनुं तुं चिंतवन कर के जेनाथी तने  
 समताइप अभृतनो स्वाह आवे. ” ५

उपलब्धि.

## आ अंथ समतारसनी वानकी.

समग्रसच्छास्त्रमहार्णवेभ्यः, समुद्रतः साम्यसुधारसोऽयम् ।  
 निपीयतां हे विबुधा ! लभध्व-मिहापि मुक्तेः सुखवर्णिकां यत् ॥६॥  
 आ समता अभृतनो रस, ज्ञानी ज्ञानथी ओणभता,  
 भेटा भेटा समथ शास्त्री, अनुपम रस ए उद्धरता;

-५६५-

: १३८ :

હે પંડિત જનો ! તમે એ રસ, પીઓ અને ડેળવો,  
આ લવમાં રૈતા થકા, મોક્ષસુખ વાતકી મેળવો. ૬

“આ સમતા અમૃતનો રસ મોટા મોટા સમગ્ર શાખસમુદ્રોમાંથી  
ઉદ્ઘર્યો છે. હે પંડિતજનો ! તમે તે રસ પીઓ અને મોક્ષસુખની  
વાનકો અહીં પણ મેળવો.” ૬ દીપ્દવજ્ઞા

કર્તા, નામ, વિષય પ્રયોગન.

**શાંતરસમાવનાત્મા, મુનિસુંદરસુરિમિઃ કૃતો ગ્રંથઃ ।**

**ब્રહ્મસ્પૃહયા ધ્યેયઃ, સ્વપરહિતોऽધ્યાત્મકલ્પતરુરેપઃ ॥૭॥**

શાંત રસ ભાવના ભરપૂર, અધ્યાત્મજ્ઞાનનો અરો,  
કલ્પવૃક્ષ સમાન અંથ, શ્રી મુનિસુન્દરસુરિ ઉદ્ઘરો;  
પોતાના પરના હિત માટે, (તેનું) અધ્યયન કરતા,  
જ્ઞાન લઈ કિયાઓ કરતા, તેઓ શાંખત સુખ વરતા. ૭

“શાંત રસ ભાવનાથી ભરપૂર અધ્યાત્મ જ્ઞાનના કલ્પવૃક્ષ (અધ્યાત્મ-  
કલ્પદુમ) અંથને શ્રીમુનિસુન્દરસુરિએ પોતાના અને પરના હિતને  
માટે રચ્યો તેનું ધ્યાન (જ્ઞાન અને કિયા) પ્રાપ્ત કરવાની ધ્યાણથી  
અધ્યયન કરવું.” ૭ ગીતિ.

ઉપસંહાર.

**ઇમમિતિ મતિમાનધીત્ય, ચિત્તે રમયતિ યો વિરમત્યયં ભવાદ્બાક્.**

**સ ચ નિયતમતો રમેત ચાસ્મિન्, સહ ભવૈરિજયશ્રિયા શિવશ્રીઃ ॥૮॥**

આ અંથનું ઝુદ્ધિમાન પુરુષો, સદ્ગા અધ્યયન કરે,  
તેમાં રહેલા તત્ત્વનું, ચિત્તમાં કાયમ રમણ ધરે;  
અદ્ય સમયમાં સંસારવિરક્તા, થર્ધ શત્રુ દ્વર કરે,  
અને તેણ જ્યની સાથે, જરૂર મોક્ષલક્ષમીને વરે. ૮

“આ અંથનું” જે ઝુદ્ધિમાન પુરુષો અધ્યયન કરીને ચિત્તમાં રમણ  
કરે તે પુરુષ થોડા વખતમાં સંસારથી વિરક્ત થઈ જય અને  
સંસારદ્વારા શત્રુના જ્યની લક્ષમીની સાથે મોક્ષલક્ષમીની જરૂર કોડા  
કરે.” ૮ આર્થિગીતિ.

## “ઉપસંહાર અંતિમ કળશ”

( હિન્ગિત-૪ંદ. )

દુવીર આ સંસારના, અનાહિના હુઃખને હરે,  
લઈ લક્ષ શ્રી મુનિસુનદરસ્કુરિ, ૧અધ્યાત્મની રચના કરે;  
મરપૂર આત્મહિતશિક્ષાએ, રખોડશ દ્વાર વિષે ભરે,  
જિનેંદ્રભાષિત તત્ત્વના, એ આગમોથી ઉદ્ધરે, ૧  
ગુણુ આત્મહિતમાંહે ચેડે, એ બોધ હિલમાં ઉતરે,  
લાલ મેળવે નરજન્મનો, ૩ભવબ્રમણુથી અવિ ઉગરે;  
વહુ શુદ્ધિતાએ સંસ્કૃત ખસેહ, અડોતેર શ્વોકે ધરે,  
ચંચળ મતિ ગુલરાજ ચરણમાં, નમન કરું હું ૪આદરે. ૨  
દક્ષ પુરુષ પુરુષાર્થ મનન, વાંચન નિદ્ધ્યાસન કરે,  
મહારોગ જન્મમરણાદિ વારી, ૫શાખતા સુષો વરે;  
હેતુ સુધારે આત્મનો, ૬ગુર્જર ગિરાએ ખનાવતા,  
તાસ લાલ સહુ મેળવે, શ્રી મહેન્દ્રસ્કુરિ આજા થતાં. ૩  
વખત મખ્યો શુભ પૂન્યથી, અનુવાદ એહ ખનાવવા,  
લાલ શુંત સામાયકતણો, મળે ભાવ હૃદયે લાવવા;  
ગાયો કળશ છે હુનર નવના, વિકમે વલ્લબીપુરે,  
મહાલાલ બોધિણીજ, ૭લંબ માગતો સ્તુતિ આખરે. ૪

અધ્યાત્મ કલ્પદ્રમ સમાપ્ત.

૧ અધ્યાત્મ-કલ્પદ્રમ અંથની રચના શ્રી મુનિસુનદરસ્કુરિણ કરે. ૨  
સોળ દ્વારામાં-અધિકારમાં. ૩ ભવબ્રમણુથી નિરતાર પામી અવિજનો  
ઉગરી જય, શાખત સુખને વરે. ૪ વિનય સહિત આદરથી. ૫ મોક્ષના  
સુષોને પામે. ૬ ગુજરાતી ભાષામાં જનાવતા.

# ગભ્ર બૃહેંતેરીની સજાય

( એચ્છવરંગ વધામણું પ્રલુબ પાસને નામે-એ દેશી.)

ઉત્પત્તિ જે લુલ આપણી, મનમાંહિ વિમાસ;	
ગર્ભવાસે લુલણો, વસ્ત્રિયો નવ માસ.	૧
નારીતણી નાલિ તળે, જિનવ્યાને જેય;	
કુલતણી જિમ નાલિકા, તેમાં નાડી છે દોય.	૨
તસુ તળે યોનિ કહી, વણુકુળ સમાન;	
અંખતણી માંજર લુસો, તિંદાં માંસ પ્રધાન.	૩
રૂધિર સ્વે તિણુ ઠામથી, ઝતુકાળ સહૈવ;	
રૂધિર શુકે યોગે કરી, તિંદાં ઉપજે લુલ.	૪
જે અપાવન પવને કરી, વાસિત હુર્ણિધ;	
તિણુ થાનક તું ઉપન્યો, હવે હુંઓ મહાધ.	૫
નાળી વાંસતણી ધાણું, ભરીયે ઇ ધાલા;	
તાતી દોહ શીલાક તે, જલે તરકાળ.	૬
તિમ મહિલાની યોનિમાં, નવ લાખ લુલ;	
પુરુષપ્રસંગે તે સહુ, મરી જાય સહૈવ.	૭
ઉપજે નર નારી મલે, પંચેન્દ્રિય જેહ;	
તેહતણી સંખ્યા નહિ, તનો કારજ એહ.	૮
નવ લાખ લુલ ટકે તિંદાં, ઉત્કૃષ્ટી વાર;	
લુલ જધન્યપણું ટકે, એક હો ત્રણ આર.	૯

: ૧૪૨ :

ગલો અહેંતેરીની-

- જવ જધન્યપણે તિહાં રહે, સુહૂર્ત્ પરિમાણ;  
ભાર વરસની સ્થિતિ તિહાં, ઉત્કૃષ્ટી જાણ. ૧૦  
તિણે ગલો કોઈ જીવડો, એમ કહે જગદીશ;  
કરી આવે તો તે રહે, સંવત્સર ચોવીશ. ૧૧  
મહિલા વર્ષ્ પંચાવને, કહિયે નિખીંજ;  
પંચોત્તર વર્ષ પછી, થાય પુરુષ અણીંજ. ૧૨  
જમણી ઝૂણે નર વસે, તિમ ડાખે નાર;  
વન્ને નપુંસક જાહ્યારો, જિનવચને વિચાર. ૧૩  
હવે સામાન્યપણે ઈહાં, આઠો ગર્ભવાસ;  
સાત દિવસ ઉપર રહે, નરગતિ નવમાસ. ૧૪  
આઠ વરસ તિર્યાંચ રહે, ઉત્કૃષ્ટો કાળ;  
ગર્ભવાસે લોગંધો, ઈમ ખાડુ જંબાલ. ૧૫  
કાર્માણુ કાયે કરી લિયો, પહિલો તે આહાર;  
શુક અને શોણિતતણો, નહિ જૂડ લગાર. ૧૬  
પર્યાસિ પૂરી નહિ, તિહાં વિસવાવીશ;  
તિણે આહારે એ તતુ થયો, ઓદારિક અરુ મિશ્ર. ૧૭  
પવન આવે ઉદ્દરથકી, ઉપજાવે અંગ;  
અન્ન કરે સ્થિર તેહને, જલ સરસ સુરંગ. ૧૮  
કઠિણુ પણુ પૃથ્વી રચે, અવગાહ આકાશ;  
પાંચે ભૂત શરીરને, એમ કરે પ્રકાશ. ૧૯  
ભાર સુહૂર્ત્ ઋતુ પછે, વિલસે નર નાર;  
ગર્ભતણી ઉત્પત્તિ તિહાં, નહિ અવર પ્રકાશ. ૨૦  
કલિલ હોયે હિન સાતમે, ખુરખુદ હિન સાત;  
ખુરખુદ્ધી પેશી વધે, ધન માંસ કહાત. ૨૧

- સંજાય

: ૧૪૩ :

માંસતણી ગોટી હુવે, અડતાલીશ ટાંક;	
પ્રથમ માસે જિનવર કહે, મન મ ધરે શંક. ૨૨	
રૂધિર માંસ ખીજે હુએ, હવે ત્રીજે માસ;	
કર્મતણે યોગે કરી, માતા મન આશ. ૨૩	
ચોથે માસે માતના, પરિણુમે સહુ અંગ;	
હાથ અને પગ પાંચમે, તિમ ભસ્તક અંગ. ૨૪	
પીત રૂધિર છુટે પડે, સાતમે ઈમ સંચ;	
નવ ધમની નસ સાતમે, પેશી સથ પંચ. ૨૫	
રોમરાઈ પણુ સાતમે, સાડીતીન કોડ;	
ઉપજે બીજ્યા તેટલા, એમ આગમ જોડ. ૨૬	
આઠમે માસે નિપણ્યું, એમ ઓળ શરીર;	
ભિંધે શિર વેદન સહે, જંપે જિન વીર. ૨૭	
શાખિત, શુંક સંદેષમાં, લઘુ ને વડી નીત;	
વાત પિતા કંક ગર્ભમેં, એ થાય ઈણુ રીત. ૨૮	
માતતણી કુંટી લગે, બાલકની નાળ;	
રસ આહારતણ્ણા તિહુંા, આવે તલ્કાળ. ૨૯	
જનની લેવે આહાર, તે જાય નાડોનાડ;	
રોમ ઈન્દ્રિય નખ ચક્ષુ વધે, તિમ મજલાને હાડ. ૩૦	
સવિહુ અંગે ઉદ્વલસે, સર્વાંગે આહાર;	
કવળ આહાર કરે નહિ, ઈસો ગલો વિચાર. ૩૧	
તે ગલો કિણુ જીવને, થાય જ્ઞાન વિભંગ;	
અથવા અવધિ કહી જિને, તિણે જ્ઞાન પ્રસંગ. ૩૨	
કટક કરી વૈક્રિયપણે, ઝૂઝી નરકે જથ્ય;	
કો જિનવચન સુણી કરી, મરી સુર પણ થાય. ૩૩	

: ૧૪૪ :

ગભો બહેંતરી-

જાધે મુખે શુડા હિંદે, સહેતો ણહુ પીડિ;  
દૃષ્ટિ આગળ બિહુ હાથસું, રહે સુહી લીડ. ૩૪

નર વિષુ વસ્ત્ર જલા દિકે, ઉપજે એધાણ;  
અથવા બિહુ નારી મહ્યા, કદ્યા ગર્ભ વિધાન. ૩૫

કોઈ ઉત્તમ ચિત્તવે, દેખી હુઃખ રાશ;  
પુષ્ટય કરું પરો નિકળી, નાવું ગર્ભાવસ. ૩૬

ઉઠ કોડી (સાડાત્રણુ કોડ) સૂર્ય અંગમે, ચાંપે સમકાળ;  
તિણુથી ગર્ભમાં આઠગુણી, સહે વેહના બાલ. ૩૭

માતા ભૂખી ભૂખીયો, સુખીણી સુખ થાય;  
માતા સ્નોતે તે સુવે, પરવશ દિન જાય. ૩૮

ગર્ભથકી હુઃખ લક્ખ ગણું, જનમે જીણી વાર;  
જનમ થયે હુઃખ વિસર્યું, ધિગ મોહ-વિકાર. ૩૯

ઉપન્યો અશુચિપણે તિઢા, મલ મૂત્ર કલેશ;  
ધીનંડ અશુચિ કર્ણી પૂરીયો, નહિ શુચિ નવ લેશ. ૪૦

તુરત રૂઘન કરતો થડો, જનમે જીણી વાર;  
માતા પયોધર સુખ હવે, પીવે ફૂધ તીવાર. ૪૧

દીસે દિન દિન દીપતો, કરે રંગ અપાર;  
લાડ કોડ માતા પિતા, પૂરે સુવિચાર. ૪૨

છિદ્ર બારહ નારીને, નરના નવ જાણુ;  
રાત દિવસ વહેતા રહે, ચેતો ચતુર સુજાણુ. ૪૩

સાત ધાતુ સાતે ત્વચા, છે સાતસે નાડ;  
નવસે નારાં છે પિંડમાં, તિમ ત્રણસે હાડ. ૪૪

સનિધ એકસો સાડ છે, સિસેર સો મર્મ;  
તીન દોષ પેશી પાંચથે, ઢાંકચા છે ચર્મ. ૪૫

-સ જગતા ય

: ૧૪૫ :

રૂધિર શેર દસ દેહમેં, પૈશાળ સરીધ;  
 શેર પાંચ ચરણી તિહુંા, દોય શેર પુરીધ. ૪૬  
 પિત ચોસઠ ટાંક છે, વીરજ ભત્રીશ;  
 ભત્રીશ ટાંક શ્વેષમાં, જાણે જગદીશ. ૪૭  
 ધ્યાનુ પરિમાણુ થકી જદા, એછે અધિકો થાય,  
 વ્યાપે રોગ શરીરમેં, તવ ન ચલે કાય. ૪૮  
 પોણ્યો પહીલે દાયકે, ધૂમ વાધ્યો અંગ;  
 ખાનપાન ભૂષણુ ભલા, કરે નવનવા રંગ. ૪૯  
 હવે બીજે દસકે બણે, વિદ્યા વિવિધ પ્રકાર;  
 ત્રીજે દસકે તેહને, જાગ્યો કામવિકાર. ૫૦  
 જિણુ સ્થાનક તું ઉપન્યો, તિણુમેં મન જાય;  
 ચોથે દશકે ધનતથ્યા, કરે કોડ ઉપાય. ૫૧  
 પહોંચ્યો દશકે પાંચમે, મનમાં સસ્નેહ;  
 બેટા બેટી ને ચોતરા, પરણ્યાવે તેહ. ૫૨  
 છુટે દસકે પ્રાણિયો, વલી પેરવશ થાય;  
 જરા આવી નેવન ગયું, તોય તૃણથ્યા ન જાય. ૫૩  
 આંધ્રો દશકે સાતમે, હવે પ્રાણી તેહ,  
 અળ ભાંગ્યું બુઢ્હો થયો, નારી ન ધરે નેહ. ૫૪  
 આઠમે દશકે ડાસદો, ખુલીયા સહુ દાંત;  
 કર કંપાવે શિર ધૂણે, કરે ઝેણટ વાત. ૫૫  
 નવમે દશકે પ્રાણિયો, તનશક્તિ ન કંચ;  
 આવે વગન સહુ તથ્યા, દીન જૂરંતાં જાય. ૫૬  
 ખાટ પણ્યો ખુંખું કરે, સુગાલી દેહ;  
 હાત હુકમ ચાવે નહિ, દીયે પરિજન છેહ. ૫૭

: १४६ :

ગણભૂષણતેરીની-

આખ ગળે એ પડ મિલે, પડે સુંહકે લાળ;  
 બેટા બેટી ને વહુ, ન કરે સંભાળ. ૫૮  
 દશમે દશકે આવીયો, તવ પૂરી આય;  
 પુણ્ય પાપ કુળ બોગવી, પ્રાણી પરબ્રહ્મ જાય. ૫૯  
 દશ દશાંતે હોહિલો, લહી નરબ્રહ્મ સાર;  
 શ્રી જિન ધર્મ સમાચારે, તે પામે ભવપાર. ૬૦  
 તરણુપણે જે તપ તપે, પાળે નિર્મણ શીલ;  
 તે સંસાર તરી કરી, લહે અવિચલ લીલ. ૬૧  
 કોઈ રતન કવડી સાટે, કાંઈ ગમે રે સંસાર;  
 ધર્મ વિના એ જીવને, નહિ કોઈ આધાર. ૬૨  
 કાયા માયા કારમી, કારમો પરિવાર;  
 તન ધન જોખન કારમા, સાચ્ચા ધર્મ સંસાર. ૬૩  
 ચૌહે રાજ પ્રમાણ એ, છે લોક મહંત;  
 જન્મ મરણ કરી ઝૂરસીએ, જીવ વાર અનંત. ૬૪  
 આપ સવારથીએ સહુ, નહિ કોઈનો કોય;  
 નિજ સવારથ અણુપુગતા, સુત પણ રિપુ હોય. ૬૫  
 જરા ન આવે જીહાં લગે, જીહાં લગે સખળ શરીર;  
 ધર્મ કરો જીવ તિહાં લગે, થઈ સાહસ ધીર. ૬૬  
 આરજ દેશ લદ્યો હવે, લાધ્યો ગુરુસંચીએ;  
 અંગથકી આલસ તજો, કરો સુકૃત સંગ. ૬૭  
 શ્રી નમિરાજતાણી પરે, ચેતો ચિત્તમાંહી;  
 સ્વાર્થના સહુ કો સગા, નહિ કોઈનું કોઈ. ૬૮  
 બોગ સંચીએ તજ થયા, સહુ જે અણુગાર;  
 ધન, ધન, તસુ માતાપિતા, ધન ધન અવતાર. ૬૯

-સ જગ્યા ૪

: ૧૪૭ :

સુરતરુ સુરમણુ સારિએ, સેવો શ્રી જિન ધર્મ;  
 અણુથી સુખ સંપત્તિ વધે, કીજે તેહ જ કર્મ. ૭૦  
 તં હલ વિચાલી મેં છે, એહનો અધિકાર;  
 તિણુથી ઉદ્ધરીને કહ્યો, નહિ જૂઠ લગાર. ૭૧

“ કળશ ”

ઈહ જિનધર્મ વિચાર સાંભળી, લહીએ સંયમ ભારાએ;  
 વળી સિંહની પરે સદ્ગ પાલે, નિયમ નિરતિચાર એ;  
 સંસારના સુખ સકળ લોગવી, તે લહે ભવપાર એ,  
 શ્રી રત્નહર્ષ સુશિષ્ય રંગે, ઈમ કહે શ્રી સાર એ. ૭૨

બાણસુ

## ગર્ભબહેંતરીનો સ્પષ્ટાચ

હે પ્રાણી ! તારી ઉત્પત્તિ કઈ રીતે થઈ ? તેનો તું મનમાં જરૂર વિચાર કર. નવ માસ પર્યાંત તારે ગર્ભવાસમાં રહેવું પણું છે. (૧)

ઓની નાભિ નીચે ફૂલની નાલિકા જેવી નળી છે, કેમાં એ નાડી છે, એમ શ્રી જિનેશ્વર ભગવતે જ્ઞાનદિષ્ટી જોઈને ફરમાવેલ છે. (૨)

તેની નીચે વનના ફૂલ સરખી યોગિ રહેલ છે, અને આંખાની માંજર(મોર) જેવી માંસની અંથી-પેસીએ છે. (૩)

તે માંસની પેશીમાંથી ઝડપુ સમગે રૂધિર સંવે છે અને તે રૂધિર અને મુરૂખના શુફ-વીર્યના યોગથી જીવોટ્પત્તિ થાય છે. (૪)

ફુંદ્ધી પવન-વાયુવાળા સ્થાનમાં તું ઉત્પત્ત થયો છે, પણ હવે તે સ્વભાવ ભૂતી જરૂર મદ્ધથી-અલિમાનથી તું આંધળા બન્યો છે. (૫)

: १४८ :

गर्भभृतेशानी-

वांसनी नणीमां डांसी-डांसीने घण्टु इ भरीयो, पछी तेनी अंदर गदमागरम सण्योयो नांभीयो तो ते इ तत्काळ खण्णा जाय तेवा रीते खीनी चेनिमां नव लाख ज्ञेतपति थाय छे, ते पुरुष साथेना संयोगथी तत्काळ मृत्यु पामी जाय छे. (६-७)

नर-नारी विषयेप्रभोगथी जे पचेदिय ज्ञव उपजे छे तेनी तो संभ्या ज गण्णी शक्षाय नहीं, भाटे तेवा विषय-विलासनो लाग करो. (८)

उत्कृष्ट प्रमाणुथी तो ते सभये नव लाख ज्ञवो गर्भस्थानमां टकी शके, परन्तु जधन्य प्रमाणुथी तो शोक, ऐ, नण्णु के \*व्यार ज ज्ञव टकी शके. (९)

जधन्य स्थितियो ज्ञव गर्भस्थानमां सुर्हाँत ग्रमाणु रहे अने उत्कृष्ट प्रमाणुथी वार वर्ष पर्यन्त रहे. (१०)

जिनेश्वर अगवांत विशेषमां इरमावे छे डे-तेनो ते ज ज्ञव इरीथी ते ज गर्भस्थानमां उत्पन थाय तो चोवीश वर्ष सुधी पण्णु ज्ञव टकी शके. (११)

पंचावन वर्षे खी निर्भिज अनी जाय छे एटले डे गर्भ धारणु करी शक्ती नथो, तेमज पंचोत्तेर वर्षे पुरुष अभीज अनी जाय छे एटले डे तेना वीर्यमां गर्भ-धारणु कराववानी शक्ति रहेती नथो. (१२)

जे खीनी जमणी बाजुयो गर्भ रहे तो पुत्र जन्मे, डाढी बाजु रहे तो पुत्री थाय अने वर्च्यो-मध्य स्थगे रहे तो नपुंसक प्रसवे, यो ग्रमाणु जिनवयन छे. (१३)

सामान्य रीते मनुष्य जनिमां ज्ञव गर्भावासमां नव भास ने सात हिंस रहे छे. उत्कृष्ट प्रमाणुथी तिर्यंचनो ज्ञव गर्भस्थानमां आठ वर्ष सुधी रही शके छे, आ ग्रमाणु गर्भावासमां धण्णी पीडा सहन कर्वी पडे छे. (१४-१५)

\*वर्तमान सभयमां ज्ञेडका के नण्णु-व्यार वस्याने जन्म आप्याना समाचार आपणे वर्तमानपत्रोमां अवारनवार वांचीये छीयो.

—सं ७४॥ ४

: १४६ :

ते गर्भस्थानमां कार्मण्य शरीरद्वारा वीर्य तेमज रुधिरनो आहार करवो पडे छे, तेमां लेश मात्र शंका नथी. (१६)

ते स्थितिमां पूरेपूरी पर्याप्ति नहीं होवाथी अने रुधिर तेमज शुक्रनो आहार करवो पडतो होवाथी औहारिक-मिश्र शरीर अंधाय छे. (१७)

उपर्युक्तमांथो प्रगटेलो वायु अंगेनी रथना करे, असि तेने रिथर करे, जग-पाणी तेने सरस करे, पृथग्नीकायना तरवो तेने मजभूत करे अने आकाश तेने अवकाश आपे-आ प्रमाणे पांच महाभूतो शरीर धडवामां कारणभूत अने छे. (१८-१९)

खीने झडतु प्राप्त थया पछी बार महूर्त पछी जे खी-पुरुष विषयसेवन करे तो गर्भोत्पत्ति थाय छे, तेमां शंका नथी. (२०)

गर्भ रख्या पछी सातमे हिवसे कलिल थाय छे अने बीज सात हिवस व्यतीत थया पछी झुरझुद पाणीना परपेटा जेवो आकार अने छे. झुरझुदमांथी मांसनी ऐसी वृद्धि पामे छे. (२१)

श्री जिनेश्वर अगवर्त छडे छे के-आ प्रमाणे ओळ मास पछी ते मांसनी ऐसीमांथी गोटी-गोण आइति थाय छे, जेतुं वज्जन आशरे अडतालीश टांक जेट्लुं होय छे, तेमां लेशमात्र शंका न करेशा. (२२)

बीजे अने नीजे भिन्ने मांसमांथी रुधिर थाय, चोये भिन्ने माताना अंगा पुष्ट थाय अने पांचमे भिन्ने हाथभग्नो विकास थाय अने भरताह अंधाय. (२३-२४)

छडे भिन्ने पित-रुधिर प्रगटे अने सातमे मासे नव मुख्य नसो। अने मांसनी पांचसो जेटली ऐसीओ ग्रगटे. तेमज साडानेणु कोड रोभराय उपने. केटलाह जुवोने ते रोभराय कांधक ओआ धनु होय तेम आगम-शास्त्रोमां वर्णवेलुं छे. (२५-२६)

आठमे भिन्ने समस्त शरीर अंधाय अने उधे माथे लटकाने अनंती पीडा सहन करे, ओम श्री वार अगवर्त उपदेशेल छे. (२७)

: १५० :

ગભીરહૃતેરીની-

રુધિર અને વીર્યના સંઘટામાં, લધુતીતિ( ચેશાખ ) તેમજ વડી-તીતિ(ાડો) તેમજ વાત, પિત અને કરુ આ સર્વ ગર્ભાવસ્થામાં જ થાય છે. (૨૮)

માતાની નાલિ-કુંઠી સુધી બાળકની નાળ લાંખી હોય છે અને માતા જે આહાર કરે તેનો રસ તે નાળદાર ગર્ભ લે છી. એટલે માતાનો આહાર તે નાડીદાર પ્રસરે છે અને તેને કારણે બાળકના રેખ, ધર્ષિય, નેત્ર, નખ, મજાળ અને હાડકાં વિગેરે વૃદ્ધિ પામે છે. (૨૯-૩૦)

તે સ્થિતિમાં ગર્ભને સર્વાંગે આહાર કરવો પડે, કારણું કે તે સ્થિતિમાં ક્વલાહાર ( ડેણિયો ) તો થઈ શકતો નથી. (૩૧)

શ્રી જિનેશ્વર અગવંત કુરમાવે છે કે-આ જાતની ગર્ભાવસ્થામાં કાઢ જીવને વિભાગ કે અવધિજીબન પણ થાય છે. (૩૨)

વિચિત્રતા એ છે કે-ગર્ભાવસ્થામાં જ આ જાનના કારણે કાઢ કાઢ જીવ પોતાના વૈરને યાદ કરી, વૈક્રિયપણે સૈન્ય વિકુર્ચ, અને યુદ્ધ કરી મૃત્યુ પામી નરકે જય તો કાઢ કાઢ જીવ વળી શ્રી જિનેશ્વર અગવંતના ઉપદેશ-વચનો સાંભળી, પરિણામની ધારા સુધારી દેવલોકમાં જય. (૩૩)

પગને હુદ્ધય આગળ સ્થાપી, તેમજ નેત્રની આગળ બંને હાથની સુહી વાળી જીંધા માથે લટકતો આ જીવ ધર્ણી પીડા ભોગવે છે. (૩૪)

પુરુષના સંચેદન વિના પણ ગર્ભોત્પત્તિ થાય છે; જેમકે-કોઈના વલ્લમાં વીર્યના અણુઓ હોય અને તે વલ્લ નહી કે સરોવરમાં ધોવાતા તે જળમાંહેલા ખીજ-અણુઓ તે તે રથળમાં સ્નાન કરતી કાઢ સ્વીની ચોનિમાં પ્રવેશો તો પણ ગર્ભ ધારણું થાય છે, તેમજ એ ખીજો પરસ્પર મળવાચી પણ ગર્ભ ધારણું થાય છે. (૩૫)\*

\*વર્તેમાન ધનોમાં આપણે કાઢ કાઢ હકીકત વાંચીએ છીએ કે- વિજાન પદ્ધતિથી અમુક પુરુષના વીર્યના પરમાણુ લઈ તેનો ખીજમાં પ્રવેશ કરાવી શકાય છે. પણએમાં તેવી જાતના અખતરા પણ થયા છે.

-સ જ્ઞાય

: ૧૫૧ :

વળી ગર્ભસ્થાનમાં ડોઈ ઉત્તમ જીવ આવી જાતની અસહ્ય પીડા સહન કરીને વિચારે કે-આ ગર્ભસ્થાનમાંથી બહાર નીકળીને હું એવું ધર્માચરણ-પુષ્યકર્મ કરું કે જેથી ફરી મારે અવતાર જ ન દેવો પડે. (૩૬)

ગર્ભાવાસની અસહ્ય અને અકથ્ય પીડા સંખ્યાંધી કણું છે કે-સાડા-નણું કોડ રોમમાં એક્ઝાજ વખતે અત્યંત તપાવેલી સોંય લોકવામાં આવે અને જે પીડા થાય તેના કરતાં આડગુણી પીડા ગર્ભમાં થાય. (૩૭)

માતા જે ભૂખી રહે તો આળફને પણ ભૂખ્યું રહેવું પડે. જે માતા સુખમાં દિવસ વાતાવે તો ગર્ભને પણ સુખ થાય. માતા જૂદે લારે આળક પણ સૂદી જાય. એ પ્રમાણે ગર્ભાવાસમાં પરવશપણું-પરાધીનપણું જ છે. (૩૮)

ગર્ભમાં જે દુઃખ છે તેના કરતાં લાખગણું વિશેષ દુઃખ જ-મતી વખતે થાય છે, પરન્તુ આ પ્રાણીની એવી મુગ્ધાવસ્થા છે કે-જ-મ થતાંની સાથે જ તે બધું દુઃખ ભૂલી જાય છે. ખરેખર માહાવસ્થાને વિકાર છે ! (૩૯)

મળ-મૂત્રકૃપી અશુચિમાં ઉપનયો, અને અશુચિદ્વારા જ પિંડનું પોણણું કર્યું. ખરેખર ગર્ભાવસ્થામાં શુચિ-પવિત્રતાનો અંશ પણ રહેતો નથી. (૪૦)

જન્મયો ત્યારે રૂદ્ધ કરતો કરતો જન્મયો. એટલે માતા તેને સ્તન-પાન કરાવે છે અને ધાવણું મળતાં જ શાંત થઈ જાય છે. (૪૧)

પછી તો દિવસે-દિવસે વૃદ્ધિ પામતો જાય છે, કઈ કઈ જાતની ચેષ્ટા કરે છે, માતા પિતા પણ તેના લાડ-કોડ પૂર્ણ કરે છે. (૪૨)

સ્વીને બાર છિદ્રદ્વારા અને પુરુષને નવ છિદ્રદ્વારા દંમેશાં મળ-દુર્ગંધ જર્ણી કરે છે. (૪૩)

ચામડીથી દંકાયેલા આપણા આ દેહમાં જાત પ્રકારની ધાતુ છે, જાતસો નાડીઓ છે, નવસો નારી છે, નણુસો અસ્થિ-ઢાડકાં છે,

: १५२ :

ગર્ભખણ્ડાંતેરીની-

એકસો ને આઠ સાંધા છે, સાત હજાર મર્મસ્થાન છે. વાત, પીત અને કહું ત્રણું દોષ છે અને પાંચસો માંસપેસીઓ છે. (૪૪-૪૫)

એક મનુષ્યના દેહમાં દ્વારા લોહી, પાંચ શેર ચરણી, બશેર, પુરીષ, ચોસઢ ટાંક પીતા, બત્રોશ ટાંક વીર્ય અને બત્રોશ ટાંક શ્રેષ્ઠમ રહેલું હોય છે. (૪૬-૪૭)

આ ગ્રમાણેનું જે માપ છે તે વળજનમાં કંઈપણ ફેરફાર થાય ત્યારે શરીરમાં રોગ પ્રગતે છે અને શરીર ચાલી શકતું નથી. (૪૮)

પહેલા દ્વારા દ્વારા વર્ષમાં શરીરનું પોષણ કર્યું અને અંગ-દેહનો વિકાસ થયો, સારાં સારાં ખાનપાન કર્યોં, સારાં વસ્ત્રો પહેલ્યોં અને દિવસે દિવસે વિવિધ ચેષ્ટાઓ કરો. (૪૯)

બીજા દ્વારા વિવિધ વિદ્યા પ્રાપ્ત કરી અને ત્રીજા દ્વારા દ્વારા કામાલિલાપ પ્રગણ્યો. અને એ રીતે કામવિકાર થવાથી, જે સ્થાનકર્મા પોતે જ ઉત્પત્ત થયો તે સ્થાનને જ સેવવાની અભિલાષા કરી. ચોચા દ્વારા દ્વારા ધનોપાર્જનમાં મન ગયું અને તે પ્રાપ્ત કરવા માટે કોડો ઉપાયો કર્યાં. (૫૦-૫૧)

પાંચમા દ્વારા પુત્ર-પુત્રીઓને રનેહથી પગણુાયા પણ છિદ્રો દ્વારો આવતાં-વૃક્ષાવસ્થા આવતાં પ્રાણી પગવણ બનો જય છે. જરા આવતાં યુવાનીનો થનગનાટ નાશ પામે છે, પણ વિચિત્ર હકીકત તો એ છે કે-તેવી અવસ્થામાં પણ તૃષ્ણુનો અંત આવતો નથી. (૫૨-૫૩)

સાતમા દ્વારા તો રહ્યુંસહ્યું બળ પણ ચાલ્યું જય છે અને લાદડી લઈ શુદ્ધાની માઝે ચાલવું પડે છે અને પોતાની રીતી પણ સ્નેહ લાળ હે છે. (૫૪)

આઠમા દ્વારા તો “તોસો” બની જય છે. મોટામાં એક પણ હાત હોતો નથી. હાથ કંપવા લાગે, માથું ધુલ્ખલવા લાગે અને જે કંઈ વાત કરે તેની કંઈ પણ અસર ન થાય. (૫૫)

**—સુજાતા ય****: ૧૫૩ :**

નવમા દશકામાં તો શરીરમાં પાઠભાર પણ શક્તિ ન રહે અને ભીજાઓ પણ હુઃખ ઉપજાવે તેવા વચ્ચેનો બોલવા લાગે, અને એ રીતે જિંદગીના છેલ્ખાં દ્વિસો ઝૂરતાં-જૂરતાં વીતાવવા પડે. (૫૬)

ખાટલામાં પણો પણો ઝો-ઝો કરે, શરીર પર માપીઓ બણ-બણતી હોય, પોતાનો હુકમ ડોષ માને નહિ અને પોતાનો પરિજન-વર્ગ પણ બેદરકાર બની જાય. (૫૭)

અને આંખમાંથી પાણી જરવા માંડે, ડાચા મળા જાય, મોઢામાંથી લાળ જરવા માંડે અને પોતાના દીકરા, દીકરો કે વહુઓ સામું પણ ન જુઓ. (૫૮)

આવી સ્થિતિમાં જેમ તેમ કરી દશમા દશકામાં આવતાં આચુષ્ય પૂણું થતાં પુણ્ય તથા પાપનાં ઝળ બોળવી પરલવમાં ચાલ્યો જાય. (૫૯)

ફરિદાંતે દુર્લભ માનવભવ મળ્યા પણી, જે સમજુ ને વિચારણ પ્રાણી કૈન ધર્મનું આચરણ કરે છે તે આ બવસાગરનો પાર પામી શકે છે. (૬૦)

યૌવનાવસ્થામાં જે તપતું આચરણ કરે તેમજ નિર્મણ શરીરનું પાલન કરે તે પ્રાણી આ દુસ્તર સંસાર-સમુદ્ર તરી જઈ શાશ્વત સ્થાન-મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. (૬૧)

એક ડાડોને માટે કોડો રતનને શા માટે ગુમાવે છે ? આ સંસારમાં જીવને ધર્મ વિના બીજું કાંઈ પણ શરણભૂત નથી. (૬૨)

શરીરની માયા દુઃખદાયી છે, તેમજ કુદુંખ-કખીલો વિગેર પરિવાર પણ દુઃખકર છે. તન, ધન અને યૌવન એ પણ વિનાશી જ છે, માટે સાચા એક ધર્મનું અવલભન દે. (૬૩)

આ લોક ચૌદશજ પ્રમાણું છે, ત્યાં આ જીવ અનંતી વાર ઉત્પજ બચ્ચને મૃત્યુ પણ પામ્યો છે. (૬૪)

આ સમર્ત સંસાર સ્વાર્થીલો છે. કોઈનું કાંઈ નથો. જે પોતાના

ફરિદાંતની દુર્લભતાના દશ દશાંતો સંક્ષિપ્તમાં આ અર્થ પૂણું થયા પણી આપવામાં આવેલ છે, જે વાંચીને વિચારવા યોગ્ય છે.

૧૫૪ :

## ગલ્ફ બહેંતેરીની સજાય

સ્વાર્થનો નાશ થતો હોય તો પોતાનો\* પુત્ર પણ દુષ્મન થાય છે. (૧૫)

જ્યાં સુધી વૃક્ષાવસ્થા આવી નથી, શરીર સશક્ત છે, ત્યાં સુધીમાં હીમત કરીને કરાય તેટલું ધર્મસાધન કરી દ્યો. (૧૬)

આર્થિક મળ્યો છે, કંચન ને કામનીના લાગી જૈન સાધુ જેવા સદ્ગુરુનો યોગ મળ્યો છે તો શરીરમાંથી આળસનો ત્યાગ કરી પુણ્યચરણ કરવા માંડા. (૧૭)

સ્વજન-સંબંધી સગાંવહાલાંએ સહુ રવાર્થી જ છે. ડોછ ડોધતું સગું નથી; માટે અનભિગારિની પેઢ વિચારણા કરી અસારથી જ ચેતી જાવ. (૧૮)

આ અસાર સંસારને સમજી, બોગ તેમજ સંપત્તિ-સમૃદ્ધ ત્યજીને જેણો અણગાર.—મુનિ થયા છે તેણોનો અવતાર ધન્ય છે, તેમજ તેવા સંતપુરુષના માતા-પિતા પણ ધન્ય-ધન્ય છે! (૧૯)

કલપવૃક્ષ તેમ જ ચિત્તામણિ રત્ન સરખા શ્રી જૈન ધર્મતું હર-હર્મેશ માટે સેવન કરો, જેથી સુખ તેમ જ સંપત્તિની વૃદ્ધિ થાય અને તે વધે તેવું જ પુણ્યચરણ કરો. (૭૦)

આ ગર્ભાવસનો અધિકાર “તંહુલ વૈયાદીય” નામના અંથમાં છે, તેમાંથી ઉક્ષરીને અહીં તો સંક્ષિપ્તમાં જ વર્ણન કરેલ છે. અહીં જણાવેલી હકીકતમાં અંશમાત્ર પણ સંશેષ રાંકા ન કરશો. (૭૧)

શ્રી રત્નહર્ષ નામના મુનિવર કહે છે કે—આ પ્રમાણે જિનધર્મ સંબંધી હકીકત સાંભળી, જે સંયમ સ્વીકારે છે અને તે સ્વીકારીને પણ જે સિહની માઝું નિરતિચારપણે પાળે છે તે સંસાર સંબંધી સક્ષત મુખો ભોગવીને છેવટે ભવસમુદ્રનો પાર પામે છે. (૭૨)

### ધર્તિ શ્રી ગલ્ફ બહેંતેરી અર્થવિચાર

\* ગન્ધયની છંચાથી ડોછ ડોછ રાજકુંવરે પિતાનો ધાત કરવાના ઉપાયો કર્યાનું ચરિત્રથામાં આપણે વાંચીએ છીએ. ચાલુ યુગમાં પણ ધનાદિકને કાગળે બાપ સામે ડોર્ટ ચડેલા ઘણા કુદીન (!) પુત્રોના દાખલા વાંચવામાં આવે છે.

× આ કથા પાછળ આપવામાં આવી છે.

## મનુષ્યભવની દુર્લભતાના દર્શા દણાંત

(૧) ચોદલક (લોજન)-ચક્રવર્તી ખલદાસે એક ખાલણું પ્રસંગ અછિને કહ્યું કે-તારે નોદાયે તે માગો લે. ખાલણે સ્વોની સલાહથી જણ્ણાબ્યું કે-“તમારા રાજ્યનું દરેક ધર મને વારાફરતી બોજન કરાવે.”

પહેલે દિવસે ચક્રવર્તીને ત્યાં જ ખાલણે બોજન કર્યું. ચક્રવર્તીના સ્વાધિષ્ટ ને પરમોત્તમ બોજન માટે શું કહેવાનું હોય? લાર પછી તે પ્રતિદિન જૂદે જૂદે રથળે બોજન કરવા લાગ્યો, પણ ચક્રવર્તીના બોજન જેવો સ્વાદ ક્યાંય પણ પ્રાપ્ત ન થયો, તેથી તે વિચારવા લાગ્યો કે-કૃતારે ફરીવાર ચક્રવર્તીને ત્યાં જમવાનો પ્રસંગ પ્રાપ્ત થાય?

જ ખંડ ધરતીમાં શહેરો કેટલા? ગામ કેટલા? તેમાં પણ ધર-સંખ્યા કેટલી? દરેક ધરે બોજન કર્યા પછી કૃતારે તેને ચક્રવર્તીના ધરે જમવાનો પુનઃ પ્રસંગ મળે? આ બનતું જેમ દુર્લભ છે તેમ ભાનવ-જીવન મળવું પણ અતિ દુર્લભ છે.

(૨) પાસા-ચંદ્રગુપ્ત મૌર્ય ગાદીએ આવતાં તેનો ખજનો ખાતી થઈ ગયો. બુદ્ધિનિધાન ચાણુાકયે યુક્તિ અજમાવી. તેણે કળવાળા પાસા તૈયાર કરાબ્યા જેથી તેને ભરજી મુજબ રમતમાં નાખી શકાય. પછી શહેરમાં ધોષણા:કરાવી કે-ને કાઈ પાસાની રમતમાં મને જીતી જરો તેને સોનામહેરાથી ભરેલો થાગ આપવામાં આવશે. જે હારી જરો તો તેણે ફક્ત એક સોનામહેર જ આપવી પડશે. આવી આર્થર્ક જહેરાતથી ઘણ્ણા લોકો પાસાની રમત રમ્યા અને હારી ગયા.

હારી ગયેલા માણુસો પાસાની રમતથી કહી પણ પોતાની મૂડી મેળવી શકે અરા? તેવી રીતે આ ભાનવજીવ મળવો ઘણ્ણા જ દુર્લભ જાણુવો.

: १५६ :

## મનુષ્યભવની હુર્દાભતાના-

(૩) વાન્યનો હગલો-વિશ્વભરનો અનાજનો જથ્યો એકત્ર કરવામાં આવે અને તેમાં થોડા સરસવના દાણા ભેળવી, એક અશક્તા અને વૃદ્ધ ડોસીને તે સરસવના દાણા જૂદા પાડવાનું કહેવામાં આવે તો તે કરી શકે ?

તેવી જ રીતે અનંતા ભવોમાં માનવભવ તો સરસવના દાણા જેવો છે, તો તે પ્રમાદ કે આગસ્થા નિરર્થક ગુમાવી દીધે તો પુનઃ માનવભવ ભળવો અતિ સુશકેલ છે.

(૪) જુગાર-એક રાજ વૃદ્ધ થયો એટલે પુત્રે તેને મારી નાખીને ગાઢી હસ્તગત કરવાનું વિચાર્યું. આ વાત રાજના જાણવામાં આવી ગઈ એટલે તેણે યુક્તિપૂર્વક કામ લીધું. તેણે યુવરાજને બોલાવી ક્ષયું કે-આપણા કુળની એવી રીત છે કે-જુગારમાં પુત્ર જીતી જાય કે તરત જ તેને ગાઢીએ બેસાડવો; માટે આપણે જુગાર રમીએ. રાજસભાને એક હંજર આઠ સ્થાંભો છે. તે દરેક સ્થાંભને એકસો આઠ હાંસ છે. રમતમાં એક વાર જીતતાં એક હાંસ જીતી ગણ્યાય, એવી રીતે અખંડપણે અધી હાંસો જીતાઈ જતાં તને તરત જ ગાઢી ભળશે. જે વર્ચ્યે એક વાર પણ હાર થઈ તો બધું જીતેલું વૃદ્ધા થઈ જશે.

વિચારે કે-આવી રીતે જીતતાં રાજકુમાર ડોધ દ્વિવસ પણ ગાંને જીતી શકે ભરો ? સરલતાથી રાજપુત્ર પિતાને જીતી શકે નહિ તેમ એક વાર ગુમાવેલું મનુષ્યપણું સરલતાથી કદી પણ પ્રાપ્ત થતું નથી.

(૫) રત્નો-એક સાહસિક વ્યાપારી સમુદ્રમાર્ગે વ્યાપારથે ગયો અને દૈશ-પરદૈશ ફરતાં તેણે ધણું રત્નો પ્રાપ્ત કર્યાં. પાછા વળતાં સમુદ્રમાં તેનું વહાણ ભાંગ્યું અને બધાય રત્નો સમુદ્રમાં પડી ગયા. તે તરીને કિનારે આવ્યો. થોડા દ્વિવસે ઔષધીપચારથી સાનો થતાં તેણે પોતાના રત્નો મેળવવા વિચાર કર્યો, પણ તે બધાં રત્નો કંઈ રીતે પાછા મેળવી શકે ? તેવી રીતે પ્રાપ્ત થયેલ માનવજીવન ધર્મ-પાલનના અભાવે ગુમાવી દીધું તો રત્નની માઝક પુનઃ પ્રાપ્તિ સુશકેલ છે.

x

x

x

-६८ दक्षिण

: १५७ :

આ હકીકત ખીલ રીતે પણ ઘટાવાય છે. એક શેડને રત્નાનો સંઅહ કરવાનો અજ્ઞાય શોખ હતો. તેના પુત્રને આ વાત પસંદ પડતી નહિ. એકદા કામ પ્રસંગે શેડ બહારગામ ગયા તે તફનો લાભ લઈ પુત્રે, દેશ-દેશાવરથી આવેલા વ્યાપારીઓને તે રત્ના વેચી નગદ નાણું કરી લાધા. થોડા દિવસો બાદ શેડ ઘરે આવતાં તેને આ હકીકતની ખરાર પડી. પુત્રને ઘણો ઉપાલંબ આપ્યો અને તે બધાં રત્નો પાછા લઈ આવવાની આસ્તા કરી. હવે દેશ-દેશાવરના વ્યાપારીઓ પાસેથી તે રત્નો જેમ મેળવવા મુશ્કેલ છે તેમ ગુમાવી દીધેલો માનવભવ ભળવો હુર્લાં ભ.

(૬) સ્વખેન-એક રાજકુમાર રીસાધને પરદેશ ચાલ્યો ગયો. રાન્નિ-સમયે ડોધ ધર્મશાળામાં સૂર્ય રહ્યો. તેવામાં પ્રભાત સમયે તેને એવું સ્વખેન આયું કે—“પૂનમના ચંદ્ર મારા સુખમાં પ્રવેશ કર્યો.” બરાબર તે જ સસ્યે બાજુમાં સૂતેલા ડોધ બિક્ષુઙ્ને પણ તેવું જ સ્વખેન આયું.

પ્રભાતકણે બંને જગ્યા, યાચકે ડોધ બાવાળને પોતાના સ્વખેનનું ફળ પૂછ્યું. બાવાળને જણાયું કે—તેને આજે મોદ્દક મળશે અને ખરે-ખર બિક્ષામાં તેને ડોધણે ચૂર્માનો લાડવો આપ્યો. રાજકુમારે કુઠળ સ્વખેનપાઠકને પોતાના સ્વખેનનો અર્થ પૂછ્યો. તેણે જણાયું કે—“સાત દિવસની અંદર તેને રાજ્યપ્રાપ્તિ થશે.” અને સાથોસાથ સ્વખેનપાઠકે પોતાની પુત્રી પણ તેને પરણ્યાંથી દીધી.

રાજપુત્રને ફરતાં ફરતાં સાતમા દિવસે, અપુત્રિયો રાજ મૃત્યુ પામતાં, રાજ્યપ્રાપ્તિ થઈ. આ વાત તે બિખારીના જાણવામાં આવી એઠલે તે પોતાના ભાગ્યની નિંદા કરવા લાગ્યો. આવું સ્વખેન ફરી આવે અને રાજ્ય મળે તેવી આશાથી તે ધર્મશાળામાં સૂવા લાગ્યો, પણ આવું સ્વખેન ને રાજ્ય મળવું જેમ હુર્લાં છે તેમ મલુષ્યજન્મની પ્રાપ્તિ હુર્લાં છે.

(૭) ચક્ર-રાખાવેદ્ય-એક સ્થાનની ટોચે યાંત્રિક પ્રયોગથી ખૂતળા ચક્ર-ચક્ર ફરતી હોય. તે રાખા-પૂતળીની નીચે ચાર છાણી બાજુથી

: ૧૫૮ :

## મનુષ્યભસવની દુર્લભતાના-

આને ચાર જમણી બાળુથી ગોમ આડ ચઢો ફરતાં હોય છે. નીચે તેલની કડાઈ હોય તેમાં આડે ચક ને પૂતળાનું પ્રતિભિંબ પડતું હોય. સ્થાલના મધ્ય લાગમાં એક નાજવું હોય તેના એ પલલામાં એ પગ રાપ્ણાને ઉભા રહેવું અને નાચેના પ્રતિભિંબમાં જેંટ એવી રીતે ધનુષ્યમાંથી ખાણું છોડવું કે જેથી પૂતળાની ડાણી આંખ વીધાઈ જાય.

આ કાર્ય અતિ દુર્લભ છે તેમ માનવભસવ મળવો પણ અતિ દુર્લભ છે.

(૮) ફૂર્ભી-ચંદ્રશર્ણિન-આડ જગલમાં પાણીનો ઊડો ધરો હતો અને તેમાં અનેક જાતના જળચરો વસતા હતા. ધરો વહેતો ન હોવાથી તેના મથાળે જાડી સેવાળ જામી ગઈ હતી. પવનના યોગે સેવાળ આમતેમ થઈ જતાં એક છિદ્ર પણું અને તે સમયે અચાનક એક કાચયણો આવી ચઢ્યો. તેણે તે છિદ્રમાંથી કાકશમાં પૂર્ણિમાનો ચંદ્ર જેણો. સંપૂર્ણ થાળી જેવો જોળ ચંદ્ર તેણે જિંઘળીમાં કદાપિ જેણો ન હતો. એટલે તે અલાંટ આનંદિત થયો અને આવું અફલુત દસ્ય પોતાના કુદુર્ણીએ જોવે તો સારું એમ વિચારી પોતાના કુદુર્ણીને ખોલાવવો તળિયે ગણો, તેવામાં પવનના ફરી આવેલા જપાટાથી તે છિદ્ર પૂરાઈ ગયું. કાચયણો ઉપર આવ્યો ને પેલું છિદ્ર શોધવા લાગ્યો, પણ નિરાશ, ઘની ગયો.

વિચારવાનું એટલું કે-કદાપિ કાળે પવનના યોગે છિદ્ર પડે તો રાત્રિ અંજવાળી ન હોય, રાત્રિ અંજવાળી હોય તો પૂર્ણિમાનો યોગ ન હોય, કદાચ પૂર્ણિમા હોય તો વાણાથી રહિત ન હોય. આ પ્રમાણે આ ચંદ્રશર્ણિન દુર્લભ છે તેમ માનવભસવ મળવો અરેખર દુર્લભ છે.

(૯) યુગ (સમોલ)- બળદાની ખાંધે જે ધોંસરી મુઠવામાં આવે છે તેને યુગ કહેવામાં આવે છે. આ યુગમાં એક છિદ્ર હોય છે અને બળદ આધો-પાછો જન થઈ જાય તે માટે તેમાં એક નાતો લાકડાનો દંડિડો ભગવવામાં આવે છે જેને “સમોલ” કહેવામાં આવે છે.

-૬૨ દષ્ટાંત

: ૧૫૯ :

સમજે કે—ધોંસરીને સમુદ્રના એક છેઠેથી પાણીમાં નાંખવામાં આવે અને સમોલને ભીજા છેઠેથી વહેતી મૂક્યવામાં આવે તો સમુદ્રના ઉછળતાં પાણીનાં મોઝાંથી તે ધોંસરી ને સમોલ બેગાં થશે ખરા ? કદાચ ચાય તો સમોલ આપોઆપ ધોંસરીના છિદ્રમાં પ્રવેશ કરશે ખરા ? મનુષ્યની જન્મની પ્રાપ્તિ આ હુકીકત કેવી જ દુર્લભ છે.

(૧૦) પરમાણુ—એક વિશાળ થાંબલાના ખડક-ખડક કરીને ટૂકડા કરવામાં આવે અને તેનું એવું બારીક ચૂંચું કરવામાં આવે કે જેથી તેના પરમાણુને પરમાણુ છુટ્યા પડી જાય. તે ચૂંચુને એક નળીમાં ભરી તેને હિમાલયના શિખર પરથી ઝૂંક મારી ચારે દ્વિશામાં ઊડાડી મૂક્યવામાં આવે. પછી એવો વિચાર કરવામાં આવે કે તે બધા પરમાણુને એકન કરીને પુનઃ પેલા રથંઅનું નિર્માણ કરીએ, તો તે બની શકતું જેમ અસંભવિત છે તેમ મનુષ્યપણુને પ્રાપ્ત કરવું દુર્લભ ગણવામાં આવ્યો છે.

આ દ્વારા દષ્ટાંતોની માદ્રાક મનુષ્યસવ દુર્લભ ગણવામાં આવ્યો છે.

## નમિ રાજર્ષિનું સંક્ષિપ્ત વૃત્તાંત

અદ્દાક લક્ષ્મીને સ્વામી, મહાસાંનયનો ધર્ણી નમિ રાજવી જ્યાલિથા ધેરાયો. દાહેનવરને કારણે આખા શરીરમાં અંગારા ઊઢા હોય તેમ અળું અળું થવા લાગ્યો. ધડીકમાં જમણું પડ્યે તો ધડીકમાં ડાઢે પડ્યે—કોઈ રીતે શાંતિ ન વળે.

રાજવીને પાંચસો ક્રીએઓ હતો. રાજની શાંતિ માટે સર્વ કામે લાગી ગઈ, કારણું કે તે સર્વનીં જીવનાધાર રાજવી હતો. બાવના ચંદ્રના ક્રોણા ભરી—ભરીને રાજવીના શરીર પર ચોપડવા લાગી પણ અગતરા વટવાને બદલે ઉલ્લિ વધવા જ માંડી.

: ૧૬૦ :

## નમિ રાજર્ષિનું સંક્ષિપ્ત વૃત્તાંત

જ્યારે માણસ માંદો હોય લારે જરા પણ અવાજ તેને અપ્રિયી લાગે છે. પાંચસેં સ્વીએઓ સુખડ ધસતી હોવાથી અને દરેક રાણીના હરતમાં કંકણ-ભલોયા હોવાથી તેનો ખૂબ જ અવાજ થવા લાગ્યો. દાહની અળતરામાં આ અવાજે વધારો કર્યો. રાજથી ન રહેવાયું-તેણે આદેશ કર્યો આ શેનો ધોંઘાટ છે? બંધ કરો, મારું માયું ફરી જય છે.

સ્વીએઓ અતુર હતી. તેણે વધારાના ચૂડા ડિતારી નાખી કુઝા સૌભાગ્યનું ચિહ્ન એક એક વલય રાખ્યું અને ચંદ્ન ધસવા લાગ્યી. અવાજ બંધ થઈ જતાં રાજને પૂછ્યું-અવાજ કેમ બંધ થઈ ગ્યો? વૈદ્ધરાજે ખૂલાસો કર્યો-

“આપની પાંચસેં સ્વીએઓ ચંદ્ન ધસતી હતી તેનો એ અવાજ હતો.”

“શું સ્વીએઓ ચંદ્ન ધસતી બંધ થઈ ગઈ?” રાજને ફરી પૂછ્યું

વૈદ્ધરાજે કહ્યું—“ના, ચંદ્ન તો ધસે છે, પણ સર્વ ચૂડા કાઢી નાખી કુઝા એક સૌભાગ્ય કંકણ જ રાખ્યું છે, જેથી અવાજ આવતો નથી.”

આ ખૂલાસાથી નમિ રાજર્ષીના મનમાં વિચારેનું ધર્ષણ જગ્યું. ખરો શાંતિ એકમાં જ છે તેની પ્રતીતિ થઈ. અનેક છે ત્યાં ખડુખડાટ છે; એક છે ત્યાં આતાંદ છે. આમ એકત્વની વિચારણા કરતાં કરતાં દાહનો વ્યાધિ ભૂલી જવાયો અને આત્મ-ચિંતનમાં ગરૂ થઈ ગયા. એ વિચારમાં ને વિચારમાં તેમને કયારે ઊંઘ આવી ગઈ તેનો પણ જ્યાલ ન રહ્યો.

સવારે જાગતાં જ એકત્વનો અમલ કર્યો. સર્વ રાજપાઠ, વૈભવ, સ્વીએઓ, કુદુર્ય-કણીલો વિગેર અનેકને છાડી એક આત્માની સાધનમાં જ લયલીન બની જઈ, સંયમ સ્વીકારો, પ્રત્યેકખુદ થઈ મોક્ષલક્ષ્મીને આપ્ત કરી શક્યા.



**श्री वर्षभान-सत्य-नीति-हृष्टसूरि जैन अंथभासा  
तरहथी प्रकाशित थयेना थयेण।**

- \* १ संवभमधेगिगिर्वित श्री भग्नानेन स्तवन अंदितश्री जिनविज्ञप्तिकृत साथः
- \* २ का खुल्लैना सनासभूत-जिनारथा तिविरचित,
- \* ३ का निधि धनाकारि
- \* ४ के न्ययागामवस्त्रहृष्टसूरिका अवश्युदि-हेमचंद्रसूरीवृक्षहृष्ट
- \* ५ यां बनिव महादाव्य-शुभमधी गा हृष्ट
- \* ६ वलिशारक प्रकृत्य सटिक-नेमिमांडलादी ई. गुण्डाना उभान्याथः
- ७ जिना नस्तवनानवी अने गतुलीस अह-अ. इपिच. अल्कृत
- \* ८ चेष्टाविधि
- \* ९ कृपदेशस्त आहि भूल ३ अथ
- \* १० अंभहयनिव ख्याइसक्त-मुनिरत्नसूरिकृत
- \* ११ सत्य हुनिथंद्रप्रभवं राजयंद्रसूरीविनकृत
- \* १२ आठनानुसारन-पार्वि अहृष्टा,
- \* १३ युक्तात्वसिद्धि-पूर्वोचाम हृष्टा,
- १४ प्राह्लादक्षय-यंद्रिकृत
- १५ वाहृप्रकाश सटिक-अ. द्युष्मभिगिरिहृष्ट,
- \* १६ कृपदेशसत्त्वकैष हिन्दी,
- \* १७ व्यालात्यनीतिसूत्र भूत.
- \* १८ अन्यात्मकपृष्ठुम हिन्दी विवेचन भुक्ता,
- \* १९ कृपदेशसत्त्वमाता अने प्रकार्ष्णु कृपदेश,
- \* २० जैन गत्वसार सटिक-अ. सूर्यंद्रविहि
- \* २१ प्रदोनसत्त्वमाता गुरुराती अने हिन्दी,
- \* २२ साथ-चावीशी-लाली ५. जिनविज्ञप्तिकृत,
- \* २३ जैन दर्शि. गुरुराती अल्लान साथे-हनिभृतसूरि
- \* २४ पर्युष्मात्व-हिन्दी व्यालात्यन विजयवहीसूरि,
- \* २५ व्याहृति-ज्ञप्रबाश-सत्त्वसूरि,
- \* २६ प्रमोन-सत्त्वमाता सटिक-चिह्नान इल्कृत,
- \* २७ चेहरे प्रकृत्यसीका
- \* २८ राम वर्णनयनिव
- \* २९ उत्तम-प्रत्ययनिव
- \* ३० अद्या-न-पृष्ठपृष्ठुम
- \* ३१ हृष्ट-प्रभवं पद्म

Serving JainShasan



082368

प्रालिङ्ग्य  
gyanmandir@kobatirth.org

३० छुडालापा पाण जैन विपालय-अभद्रानां  
\* वा निर्दानेनाजा थयेण शीक्षनां नयी भाटे नजावता नहीं.

साथ-भूला लय, दाला भीत-पालनगर,